

PARTICIPUM.

Pluralis.

Dualis.

Singularis.

مُسْبِرَاتٌ مُسْبِرَانَ مُسْبِرٌ وَ مُسْبِرٌ | مُسْبِرٌ مُسْبِرٌ مُسْبِرَاتٌ

De Præterito.

KESRA mediæ radicalis rejicitur ad primam, cuius vocalis perit; ut pro سِبَر sit سِبَر, & pro قُول قِبَل, قُول Waw in Ie mutato, juxta Can. 2. generalem. Secundæ & primæ personæ Concavorum Ie coincidunt cum Activo, sed sensu orationis facile distinguntur.

De Futuro.

FATHA mediæ radicalis ad primam retrocedente, وَ & يَ mutantur in يَ quiescens, juxta Can. 2. gen. quo يَ regulariter in Plur. Fœm. excidit: est itaque يَسَارٌ يَقُولٌ يَسَارٌ يَقُولٌ pro يَسَارٌ يَقُولٌ

De Participio.

DAMMA secundæ radicalis ad primam rejecto, participiale (etsi quidam malunt radicale) excidit; quia duæ literæ simul in una vocali nequeunt quiescere: estque يَقُولٌ يَقُولٌ pro يَقُولٌ & يَقُولٌ N quies-

quiescens non accommodat se more solito vocali præcedenti damma; sed contra, discriminis ergo, eam sibi accommodat, vertitque in kesra, ut dicitur **مَسْتَوْنَ**, non **مَسْتَوْنَ**, pro **مَسْتَوْنَ**.

Reperies tamen etiam apud Auctores probatos, maxime apud Poëtas, participia hæc regulariter formata, potissimum in Concavis ي; ut **مَصْرُونَ** custoditus, **مَكْبُرَةَ** consutus, **مَكْبُرَةَ** mensuratus.

Similis est ratio Conjugationum quartæ, septimæ, octavæ, & decimæ: in his enim ي & ي moveri quoque nolunt, sed abjecta vocali sua, vel ad præcedentem rejecta, quiescunt, expressæ ante vocalēm, abjectæ ante gjezma, hoc modo:

A C T I V A.

Infin. Part. Imp. Fut. Præt.

أَفْسَارٌ	يَغْبَلُ	أَفْسَلُ	مُقْبَلٌ	إِقْسَائِ	4
	يَسْبِرُ	أَسْبَرُ	مُسْبَرٌ	إِسْبَائِ	
إِنْقَالٌ	يَنْقَلُ	إِنْقَلُ	مُنْقَالٌ	إِنْقَبَالٌ	7
	يَنْسَارٌ	يَنْسَارٌ	إِنْسَرٌ	مُنْسَارٌ	

إِقْسَائِ

إِقْتَشَالٌ يَقْتَشِلُ مُقْتَشَالٌ إِفْتَبَالٌ
 إِسْتَقَالٌ يَسْتَقِلُ مُسْتَقَالٌ إِسْتَهْلَكَةٌ
 إِسْتَقْبَالٌ يَسْتَقْبِلُ مُسْتَقْبَالٌ إِسْتَقْبَالَةٌ
 إِسْتَسَارَةٌ يَسْتَسِيرُ مُسْتَسِيرٌ مُسْتَسِيرٌ إِسْتَسَارَةٌ

P. A. S. S. I. V. A.

٤ أَقْبَلَ يَقْبَالُ مُقْبَالٌ أَسْبَرَ يَسْبَارُ مُسْبَارٌ
 ٧ أَنْغَبَلَ يَنْجَبَالُ مُنْجَبَالٌ أَنْسَبَرَ يَنْسَبَارُ مُنْسَبَارٌ
 ٨ أَقْتَبَلَ يَقْتَبَالُ مُقْتَبَالٌ أَسْتَبَرَ يَسْتَبَارُ مُسْتَبَارٌ
 ١٠ أَسْتَغْبَلَ يَسْتَغَبَالُ مُسْتَغَبَالٌ أَسْتَسْبَرَ يَسْتَسَبَارُ مُسْتَسَبَارٌ

Vides hic non differre Concava. ي a Concavis
 & Participia quoque Passiva septimæ & octa-
 væ Conjugat. coincidere cum Activis: sed usus &
 circumstantia textus ea discernunt. In Infinitivis
 quartæ & decimæ Conjugationis & ي fatha suo
 ad præcedentem gjæzmatam rejecto in Elif quiescens
 mutantur; post quod illud quiescens quod ad for-
 mationem Infinitivi ultimæ præponitur in إِضَارَةٍ
 & إِسْتِنْصَارَةٍ excidit, ob causam in Participio

allatam; sed ad compensationem ejus & in fine accedit, diciturque إِسْتَقَالَةً، إِفْرَالًا pro إِسْتَقَالَةً، إِفْرَالًا pro إِسْتَقْوَالَةً، Septimæ & octavæ Conjugationis Infinitivi medium regulariter movent; sed Concava & eam insuper in يَ mutant, ut patet in Paradigmate.

Reliquæ Conjugationes perfecte inflectuntur; ut

قَوْلٌ يَقُولُ قَوْلٌ مُّقَوْلٌ تَقْوِيَّلًا
 قَوْلٌ يَقَاوْلُ قَاوْلٌ مُّقَاوْلٌ مُّقَاوْلَةً
 سَبَرٌ يَسَبِّرُ سَبِّرٌ مُّسَبِّرٌ مُّسَبِّرَةً
 سَابِرٌ يَسَابِرُ سَابِرٌ مُّسَابِرٌ مُّسَابِرَةً
 & sic quoque، إِبْيَاضٌ، إِسْوَدٌ، تَقاوْلٌ، تَقْوَلٌ، &cæt.

Quin & verba quædam medium vel يَ habentia, in primis illis Conjugationibus regulariter etiam inflecti reperies: ut

عَوْرٌ يَعْوِرُ إِنْعَوْرٌ، وَرَنْعَوْرٌ، عَارِفٌ
 monoculus fuit.
 صَبَدٌ يَصْبِدُ أَصْبَدٌ صَابِدٌ
 venatus est.
 أَغْنَوْرٌ إِنْغَنَوْرٌ إِسْتَغْنَوْرٌ، & sic quoque
 أَصْكَبَهٌ إِنْصَبَدٌ إِصْطَبَدٌ إِسْتَصَبَدٌ

quæ-

quædam etiam in prima conjugatione imperfecta esse; in quarta vero, modo perfecta, modo imperfecta: ut,

جَاهَ quievit. } in افْعَل $\left\{ \begin{array}{l} \text{أَمْلَاحُ} & \text{أَمْلَاحُ} \\ \text{exhalavit.} & \text{أَغَامُ} & \text{أَغَامُ} \end{array} \right.$

Sic concava & in decima Conjug. sæpiissime perfecte etiam conjugantur: ut إِسْتَجَابَ & إِسْتَجَابَ، إِسْتَصَوَبَ & إِسْتَصَوَبَ، إِسْتَجَوبَ approbavit, quin non nemo Grammaticorum id perpetuo ait liberum esse; quod non probo.

C A P U T N O N U M.

De verbo Quiescente J.

QUIESCENTIA ج, hoc est, quæ ultimam radicalem habent & vel ي, defectivâ propriæ vocantur ab Arabum Grammaticis; & hoc modo flectuntur in prima Conjugatione.

Activum Defectivi 6.

P R A E T E R I T U M.

Pluralis.

Dualis.

Singularis.

كَرِزَوْنَ	كَرِزَتْ	كَرِزَّا
كَرِزَوْتْ	كَرِزَّوْتْ	كَرِزَّوْتْ
كَرِزَّوْتْ	كَرِزَّوْتْ	كَرِزَّوْتْ

F U T U R U M.

Pluralis.

Dualis.

Singularis.

يَغْرِزُ	تَغْرِزُ	يَغْرِزَوْنَ
تَغْرِزُ	تَغْرِزَوْنَ	تَغْرِزَوْنَ
أَغْرِزُ	أَغْرِزَ	أَغْرِزَ

I M P E R A T I V U S.

Pluralis.

Dualis.

Singularis.

أَغْرِزْ	أَغْرِزَ	أَغْرِزَوْنَ
----------	----------	--------------

P A R T I C I P I U M.

Pluralis.

Dualis.

Singularis.

غَانِرِيَةٌ	غَانِرِيَانِ	غَانِرِيَانِ
-------------	--------------	--------------

IN

INFINITIVUS.

غَزَّوا

Actuum defectivi

P R E T E R I T U M.

Pluralis.

Dualis.

Singularis.

رَهَبْتُمْ	رَهَبْتُمَا	رَهَبْتَ
رَهَبْتُمْ	رَهَبْتُمَا	رَهَبْتُمْ
رَهَبْتُمْ	رَهَبْتُمَا	رَهَبْتُمْ

F U R U T U M.

Pluralis.

Dualis.

Singularis.

يَرْمِي تَرْمِيَان	يَرْمِيَان تَرْمِيَان	يَرْمِيَون تَرْمِيَن
يَرْمِي تَرْمِيَان	يَرْمِيَان تَرْمِيَان	يَرْمِيَون تَرْمِيَن
يَرْمِي	يَرْمِي	يَرْمِي

I M P E R A T I V U S.

Pluralis.

Dualis.

Singularis.

أَنْزِلْنَاهُ	أَنْزِلْنَا	أَنْزَلْنَا
---------------	-------------	-------------

PAR-

PARTICIPIUM.

Pluralis.

Dualis.

Singularis.

مَرِامِبَاتٌ مَرِامِبَاتٍ مَرِامِبَاتٌ | مَرِامِبَاتٌ مَرِامِبَاتٌ مَرِامِبَاتٌ

INFINITIVUS.

De Præterito.

عَزَّزَ oppugnavit est pro عَزَّرَ in Elif quiescens converso, juxta Canonem tertium ُ; & يَرْمَي projecit, pro يَرْمَي, abjecta vocali ُ, quod quiescit instar Elif, juxta Canonem tertium يَ: & excidit utraque cum vocali sua in tertia persona fœmin. singularis ac dualis, & masc. pluralis. Dicitur enim

عَزَّرُوا عَزَّرُوتَا عَزَّرُوتَنَا عَزَّرُوتَنَتَا
عَزَّرُونَ pro عَزَّرُونَ مَرِامِبَاتَنَا مَرِامِبَاتَنَتَا

Cum media radicis habet damma, non mutatur ُ radicale, ut شَرْقَ potitus fuit: cum vero kesra possidet, convertitur ubique in يَ, ut يَرْخَسِي, pro يَرْخَسِي مَرِضَبَتَنَا مَرِضَبَتَنَتَا juxta Canon. quintum ُ; ut يَرْخَسِي, pro يَرْخَسِي

pro مَرْضُوتْ رَضْوَتْ juxta Can. 2. gen. At tunc etiam in tertia fœm. sing. & dualis non excidit; ut مَرْضِبْتْ مَرْضِبْتَا سَرْوَتْ سَرْوَتَا in Plurali masculino, ubi dicitur مَرْضُوا سَرْوَا juxta Canon. 1. 6 & ي.

De Futuro.

U L T I M A radicalis, abjecto damma suo, quiescit. Penultima, si in Præt. fatha habet, id hic (ut in Concavis) quiescentia و in damma, quiescentia ي in kesra mutant: ut يَرْمِي يَغْزِي يَرْعِي; sed & ob gutturalem manet, sicut in perfectis, ut يَرْعَى pavit pascet. Si damma, id regulatiter manet, ut يَسْرِي noctu ibit. quod flectitur ut يَغْزِي si kesra, id in fatha mutatur, ut يَرْضِي gratum habebit: ubi & pro و est ي in star Elif quiescens, juxta posterius membrum Canonis tertii و; ponitur enim pro يَرْضِي: flectiturque hoc modo,

يَرْضِي تَرْضِي	يَرْضِيَان قَرْضِيَان	يَرْضِيَان قَرْضِيَان
تَرْضِي قَرْضِيَان	تَرْضِيَان قَرْضِيَان	تَرْضِيَان قَرْضِيَان
ذَرْضِي		أَرْضِي

In plurali masculino, & singulari secundæ personæ fœminino, juxta Canonem primum ۶ & ۷, fit contractio, quæ aufert differentiam pluralis mascul. a plur. fœm. cum penultima Futuri habet damma, ut patet in يَغْزُون & تَغْزُون; & singulare fœm. secundæ personæ, a plur. fœm. secundæ personæ, cum penultima possidet kesra vel fatha; ut in تَرْضِيَان & تَرْضِيَن.

Præpositis particulis giezmantibus, ultima radicalis non recipit giezma, sed excidit, & ۸ regulariter abjicitur hoc modo,

Pluralis.	Dualis.	Singularis.
يَغْزُون	يَغْزُوا تَغْزُون	يَغْزُون
تَغْزُون	تَغْزُروا تَغْزُون	تَغْزُري
ذَرْضِي		أَرْضِي

Et sic quoque كَمْ يَرْض & كَمْ يَرْض: sed interdum licet rariissime, manere ultimam reperies, dici-

كَمْ يَرْضِي, لَمْ يَرْمِي, لَمْ يَغْزِي.

At cum particulæ fathantes præmittuntur, ultima regulariter recipit fatha; ut

يَرْضِي تَرْمِي	يَغْزِي تَغْزِي
يَرْمِي تَرْمِي	}
لَنْ تَغْزِي تَغْزِي	
&c.	أَنْ تَغْزِي

Nisi penultima habeat fatha; tunc enim obstat Canon tertius ي &c. ut لَنْ يَرْضِي تَرْمِي Sic & و interdum manet quiescens post damma, sed rarissime; ut لَنْ نَغْفِي neutiquam condonabimus.

De Imperativo.

Imperativus, ut in perfectis, fit a futuro giez-mato, præfixo ل imperativo, ut أَرْض, أَنْتَ, أَنْتُ: redditque cum Nun paragogico tertia radicalis abjecta in singulari masc. ut أَرْضَسْن, أَنْتَسْن, أَنْتُونَ In singul. fœminino & plur. masculino adhibetur contractio, eo prorsus modo quo in Futuro.

De Participio.

In singulari masc. & finale post kesra mutatur in ي, juxta Canonem quintum و, fitque غَانِيٌّ pro غَانِيٍ: & quia Ie finale post kesra nequit habere damma, juxta quartum Canonem ي, id abjicit, ejusque Nun ad præcedentem rejecto, ipsa etiam excidit, ut غَانِيٌّ pro غَانِيٍ; sicut eo amissio redit, ut الْغَانِيٌّ pro الْغَانِيٍ (nam articulum tolle-re Nun ultimæ vocalis post disces:) Eadem est ra-tio defectivi ي, ut مَلِمٌ pro مَلِمٍ pro الْمَلِمِيٌّ: & quia ي finale post kesra etiam respuit kesra, juxta eundem Canonem quartum, dicitur etiam in genitivo غَانِيٌّ & مَلِمٌ & غَانِيٌّ & مَلِمٌ. At accusativus est regularis, غَانِيٌّ pug-nantem, & غَانِيٌّ مَلِمٌ projicientem. In مَلِمٌ redit ي abjectum; quia extra finem dictio-nis col-lo-catur. & in غَانِيٌّ fit contractio, ut in Fu-turo.

De infinitivo.

Infinitivus est regularis.

De

De Passivo.

Passivi similis est ratio: ut,

P R A E T E R I T U M.

Defectivum.

يَرْبَتْ	مُرْبَتْ
مُرْبَتْ	مُرْبَتْ
مُرْبَتْ	مُرْبَتْ
&c.	

Defectivum.

عَزِيزٌ	عَزِيزٌ
عَزِيزٌ	عَزِيزٌ
عَزِيزٌ	عَزِيزٌ
&c.	

F U T U R U M.

يَرْمَيْ	تَرْمَيْ
تَرْمَيْ	تَرْمَيْ
تَرْمَيْ	تَرْمَيْ
&c.	

يَغْزِي	تَغْزِي
تَغْزِي	تَغْزِي
أَغْزِي	أَغْزِي
&c.	

P A R T I C I P I U M.

مَرْتَمِي	مَرْتَمِي
&c.	

مَغْزِي	مَغْزِي
&c.	

عَزِيزٌ est pro **عَزِيزٍ** juxta Canonem quintum ۶.
 in يُعْزِيزَ mutatur ۷ in يُعْزِيزَ quiscens instar Elif,
 juxta tertium Canonem ۸ يُعْزِيزَ autem est pro
 مَعْزِيزٌ ۹ secundum tertium Canonem يُعْزِيزَ ۱۰
 est pro مَعْزِيزٍ per contractionem: & مَعْزِيزٌ ۱۱
 pro مَعْزِيزَ ۱۲ juxta quintum Canonem يُعْزِيزَ ۱۳.

Atque hujus Conjugationis normam derivati-
 vae omnes sequuntur, ut:

P A S S I V U M.

Futurum. Præter.

عَزِيزٌ يُعْزِيزَ
 عَزِيزٍ يُعْزِيزَ
 أَعْزِيزٌ يُعْزِيزَ
 تَعْزِيزٌ يُعْزِيزَ
 إِعْتَزِيزٌ يُعْزِيزَ
 اسْتَعْزِيزٌ يُعْزِيزَ

A C T I V U M.

Futurum. Præter.

عَزِيزٌ دَعَّعَزَّي
 عَزِيزٍ دَعَّعَزَّي
 أَعْزِيزٌ دَعَّعَزَّي
 تَعْزِيزٌ دَعَّعَزَّي
 إِعْتَزِيزٌ دَعَّعَزَّي
 اسْتَعْزِيزٌ دَعَّعَزَّي

P A S S I V U M.		A C T I V U M.	
F u t u r u m.	P r æ t e r .	F u t u r u m.	P r æ t e r .
مُهْرَّبٌ يُهْرَّبَ	يُهْرَّبِي	مُهْرَّبٌ يُهْرَّبَ	يُهْرَّبِي
مُرَوْمَيٌ يُرَأَمَيٌ	يُرَأَمِي	مُرَأَمٌ يُرَأَمَ	يُرَأَمِي
أَزْرَمٌ يُرَأَمَ	يُرَأَمِي	أَزْرَمٌ يُرَأَمَ	يُرَأَمِي
قَسْرَمٌ يُسَتَّرَمَ	يُسَتَّرَمِي	قَسْرَمٌ يُسَتَّرَمَ	يُسَتَّرَمِي
أَرْتَمٌ يُرَثَمَ	يُرَثَمِي	أَرْتَمٌ يُرَثَمَ	يُرَثَمِي
أَسْتَرَمٌ يُسَتَّرَمَ	يُسَتَّرَمِي	أَسْتَرَمٌ يُسَتَّرَمَ	يُسَتَّرَمِي

Et sic in cæteris Conjugationibus & temporibus primæ Conjugationis regulæ obſervantur: ſolumque notandum eſt, ḥ illud quod in præteritis Defectivi & ponitur loco & juxta posterius membrum Canonis tertii & in primis & ſecundis personis manere, & diphthongescere cum fatha, dicique, أَكْرَمَتْ أَكْرَمَتْ &c. ſecus atque in prima Conjugatione, ubi redit ḥ.

أَكْرَمَتْ أَكْرَمَتْ أَكْرَمَتْ أَكْرَمَتْ

CAPUT DECIMUM.

De Verbo dupliciter imperfecto.

VERBA dupliciter imperfecta, simpliciter imperfecta per omnia sequuntur. Classes autem eorum duæ sunt; quarum prima continet ea quæ hamzata sunt & simul quiescentia: quorum quatuor sunt species.

1. Hamzatum Fe & quiescens Ain: ut آبَ re-
versus est; quod conjugatur sicuti قَالَ & أَكَرَ: ut

<i>Infin.</i>	<i>Part.</i>	<i>Imp.</i>	<i>Fut.</i>	<i>Præt.</i>
آبَ	يَوْبُ	أَبْ	أَبَّ	أَبَّا

2. Hamzatum Lam & quiescens Ain: ut سَاءَ
contristavit, جَاءَ *venit*. quorum illud conjuga-
tur ut سَامَ & سَامَّا & قَالَ: هَنَّاً & هَنَّاً: *exempli gratia*,

<i>Infin.</i>	<i>Part.</i>	<i>Imp.</i>	<i>Fut.</i>	<i>Præt.</i>
سَاءَ	يَسِّعُ	سَيِّءٌ	سَيِّءٌ	سَيِّءٌ
جَاءَ	يَجِيِّهُ	جَاهٌ	جَاهَةٌ	جَاهَةٌ

3. Ham-

3. Hamzatum Fe & quiescens Lam: ut أَتَيْ
venit; quod conjugatur sicut أَتَرْ يَ & أَتَرْ يَهُ, ut

<i>Infin.</i>	<i>Part.</i>	<i>Imp.</i>	<i>Fut.</i>	<i>Præt.</i>
أَتَيْ	يَأْتِي	أَتَيْ	أَتَيْ	أَتَيْ

Dicitur tamen & تَهْ in Imperativi sing. masculino.

4. Hamzatum Ain & quiescens Lam: ut فَأَيْ
recessit; quod conjugatur sicut سَأَلْ يَ & سَأَلْ يَهُ, ut

<i>Part.</i>	<i>Imp.</i>	<i>Fut.</i>	<i>Præt.</i>
فَأَيْ	يَأْنَجَيْ	فَأَيْ	يَأْنَجَيْ

Fatha penultimæ manet in Futuro & Imperativo, quia elif est litera gutturalis. Et sic quoque regulariter conjugaretur رَأَيْ vidit: sed ob frequentem usum hamza abjicit, vocali ejus ad præcedentem rejecta, quoties giezma habet; ideoque in Futuro & Imperativo primæ Conjugationis sic habet:

F U T U R U M.

<i>Pluralis.</i>	<i>Dualis.</i>	<i>Singularis.</i>
يَسْرِي تَسْرِي يَسْرِي سَانِ يَسْرِي وَنِ	يَسْرِي سَانِ قَسْرِي سَانِ يَسْرِي سَنِ	يَسْرِي تَسْرِي قَسْرِي سَانِ قَسْرِي وَنِ
قَسْرِي سَانِ قَسْرِي سَنِ قَسْرِي وَنِ	قَسْرِي سَانِ قَسْرِي سَنِ قَسْرِي وَنِ	قَسْرِي سَانِ قَسْرِي سَنِ قَسْرِي وَنِ
	ذَسْرِي	ذَسْرِي

pro ، يَسْرَأَي تَسْرَأَي ، &c; sicuti & apud Poëtas interdum , versu id exigente , occurrit.

I M P E R A T I V U S.

<i>Pluralis.</i>	<i>Dualis.</i>	<i>Singularis.</i>
مَرْيَةٌ مَرْيَةٌ مَرْيَةٌ مَرْيَةٌ	مَرْيَةٌ مَرْيَةٌ مَرْيَةٌ مَرْيَةٌ	مَرْيَةٌ مَرْيَةٌ
vel مَرْيَةٌ مَرْيَةٌ مَرْيَةٌ مَرْيَةٌ	vel مَرْيَةٌ مَرْيَةٌ مَرْيَةٌ مَرْيَةٌ	vel مَرْيَةٌ مَرْيَةٌ

Invenitur tamen etiam non raro regulariter formatus , ut لَهُمْ إِنْ إِي وَ &c.

Et in tota Conjugatione quarta لَفْسَعْلَ .

P R A E T E R I T U M.

أَرَى أَرَتْ أَرْيَتْ أَرْيَتْ أَرْيَتْ

F U T U R U M.

يُرِي تُرِي تُرِي تُرِي &c. أُرِي

I M P E R A T I V U S.

Pluralis.

Dualis.

Singularis.

أُنِي أُرِي | أُنِي وَأُنِي

& cum Nun paragogico,

أُرِيَّنَ لُرِيَّنَ | أُرِيَّنَ لُرِيَّنَ

P A R T I C I P I U M.

مُسْرِي مُسْرِيَةً | مُسْرِيَانِ مُسْرِيَتَانِ | مُسْرِونَ مُسْرِيَانِ

I N F I N I T I V U S.

إِرِيَّةٌ لِإِرِيَّةٍ vel إِرِيَّةٌ لِإِرِيَّةٍ aut

Quin reliqua etiam verba omnia hujus ordinis, in Conjugatione hac quarta, hamza etiam posse abjicere doctissimi tradunt Grammatici; ac proinde dici non solum يَنْبَيِي مَنْبَيِي, sed &

أَنْبَيِي دَنْبَيِي مَنْبَيِي.

Cum ۷ giezma non habet, regulariter conjugatur مَرَأَيْبُ، nec amittit hamza; ut

P R A E T E R I T U M.

مَرَأَيْتُ مَرَأَيْتَ مَرَأَيْتِ مَرَأَيْتُنْ

P A R T I C I P I U M.

مَرَاعِيَانْ | مَرَاعِيَةً &c.

I N F I N I T I V U S.

مَرَأَيْ

Et sic quoque in Participio Passivi est مَرَاعِيٌّ
ut مَرْمَسِيٌّ; licet ۷ habeat giezma.

Secunda verborum dupliciter imperfectorum clas-
sis continet dupliciter quiescentia , quæ ab Arabi-
bus vocantur Involuta ; suntque duum generum ,
Separata & Conjuncta. Involutum separatum est
quod quiescit prima & ultima, ut وَقْيَ custodi-
vit , وَجْيَ ungulam attritam habuit (equus sci-
licet) quorum illud flectitur, ut وَعَدَ & وَهَبَيٌّ
hoc

hoc vero ut وَجْهٌ & مَرْضٍ يَ & وَجْهٌ يَ; exempli gratia,

Part.	Imp.	Fut.	Præt.	Part.	Imp.	Fut.	Præt.
وَقِيٌّ							

Imperativus ق in reliquis personis resumit ي, adhibita tamen contractione in singul. & plural. mascul. ut

Pluralis.

Dualis.

Singularis.

ق	وَقِيٌّ	وَقِيٌّ	وَقِيٌّ
---	---------	---------	---------

Sic cum و paragogico in singul. mascul. قٰنٰ dicitur.

Involutum coniunctum, quod quiescit media & ultima, ut قَوَىٰ *assavit*, شَوَىٰ *valuit*, حَبَّىٰ *vixit*: quæ perfecte conjugantur quoad medium, at imperfecte quoad ultimam; شَوَىٰ quidem sicut قَوَىٰ vero & حَبَّىٰ sicut مَرْضَىٰ, ut

Infin.

Part.

Imp.

Fut.

Præt.

شَوَىٰ	يَشَوَىٰ	إِشَّـ	شَـ	شَـ	قَوَىٰ
--------	----------	--------	-----	-----	--------

<i>Infin.</i>	<i>Part.</i>	<i>Imp.</i>	<i>Fut.</i>	<i>Præt.</i>
قُوَيْ يَقْتَوَيْ إِقْنَقْ قَنَقْ	قُوَيْ	قَنَقْ	قَنَقْ	قَنَقْ
حَبَّيْ يَخْبَأْ إِحْبَأْ حَبَّيْ	حَبَّيْ	حَبَّيْ	حَبَّيْ	حَبَّيْ

Infinitivus شَبَّا est pro شَقْبَا secundum Canonem tertium و & ي pro قَنَقْ juxta Canonem de secunda syllabæ mixtæ litera: est autem pro قَوَفْ قَوَفْ ultimo juxta Canonem quintum و ob kesra præcedens in ي converso; unde desinit ultimam penultimæ similem habere, & Surdum esse. Sicuti contra, حَبَّيْ convertens و finale in ي juxta eundem Canonem, accipit ultimam penultimæ similem, unde & more Surdi contractionem non raro patitur: dicitur enim in Præterito حَبَّيْ & حَبَّيْ; quanquam nonnulli kesra penultimo ad primam rejecto malunt حَبَّيْ dicere: & in Futuro يَخْبَأْ (ubi ي instar Elif quiescens, in quod و conversum erat juxta Canonem tertium و, in ي quiescens mutatur ob ي præcedens, juxta Canonem tertium ي & يَخْبَأْ. Pro Participio حَبَّيْ usitatius est adjectivum حَبَّيْ vivus. In Infinitivo و radicale sua vocali abjecta quies-

quiescit instar Elif: quod particulare est, & de eo
Can. secun. ۶ & ۷ vide.

Sic in reliquis quoque Conjugationibus hæc verba analogiam quiescentium ultima sequuntur. Sed حبی in decima Conjugat. ۷ prius interdum abjicit, vocali ejus ad præcedentem rejecta: dicitur enim,

إِسْتَحْبَاتٌ يَسْتَحْبِي إِسْتَحْبَاتٌ مُسْتَحْبِي إِسْتَحْبَاتٌ
إِسْتَحْبَاتٌ يَسْتَحْبِي إِسْتَحْبَاتٌ مُسْتَحْبِي إِسْتَحْبَاتٌ &

Verba tripliciter imperfecta paucissima reperiuntur: suntque hamzata Fe & Involuta conjuncta: ut أَوْي recepit; vel hamzata Ain & Involuta separata, ut وَأَيْ stetit promissus; quorum illud conjugatur ut شَوْيٰ & أَشْرَقٰ، hoc ut وَقَيٰ & سَلَّا: ut

<i>Inf.</i>	<i>Part.</i>	<i>Imp.</i>	<i>Fut.</i>	<i>Præt.</i>
أَيّا	أَيٰ	أَيْ—يٰ	يَأْوِي	أَوْي
وَأَيّا	وَأَيٰ	إِ & إِهٰ	يَأْيٰ	وَأَيٰ

Verba tribus radicalibus aut primis duabus quiescentia nulla dantur. Itaque hæc de Imperfectis, & de verbis in universum sufficient.

FINIS LIBRI SECUNDI.



أَنْتَ مَنْ يَعْلَمُ
بِيَقْنَةِ الْمُؤْمِنِينَ
أَنْتَ مَنْ يَعْلَمُ
بِيَقْنَةِ الْمُؤْمِنِينَ

THO-

THOMÆ ERPENII
 GRAMMATICÆ
 ARABICÆ
 LIBER TERTIUS,
 DE
 NOMINE.

In Nomine consideranda sunt Qualitas,
 Species, Forma, Genus, Motio; Nu-
 merus, Casus, Declinatio, & Comparatio.

CAPUT PRIMUM.

De Qualitate.

UALITATE Nomen aliud est Substantivum, idque Proprium, ut ^{مُحَمَّدٌ} Muhammed, ^{مَكَّةٌ} Mecca, ^{جَبَرِيلٌ} Jibril, ^{نَهْرٌ} Oxus fluv. aut Appellativum; ut ^{پَرَسِي} pro-

Q phe-

pheta, مَدِينَةٌ *civitas*, نَهْرٌ *fluvius*: vel Adjectivum, ut صَغِيرٌ *parvus*, أَبْيَضٌ *albus*.

Quorum Proprium natura sua restrictum & determinatum est: Appellativum vero & Adjectiva late patentia & vaga; sed restringuntur praefixo Articu-

لُو، ut الْمَدِينَةُ، وَالْمَوْفِرُونُ، الْأَنْبَيْهُ، الْأَلْبَيْضُ

وَالْمَلَوُسُ، الْمَصْغِيرُ، الْمَلْعُوسُ.

Cujus Articuli literam J ante Solarem inter pronunciandum perire, Solari in compensationem ejus duplicata, dictum est Cap. 4. libri primi: autem ejus unionis esse, vocalemque suam fatha in fluxu sententiæ abjicere, & consonam sequentem cum præcedentis dictionis aut literæ servilis vocali unire, constat ex ejusdem libri Capite quinto.

Appellativum autem restringitur quoque constructione, seu regimine genitivi; separati quidem, ut in عَبْدُ اللَّهِ *servus Dei*; conjuncti vero, ut عَبْدُهُ *servus ejus*, unde Articulum tunc non admittit: sicuti nec unquam Proprium, quippe natura sua determinatum. Multa tamen virorum nomina ex appellativis facta possident Articulum, sed ut effentiale, non ut accessorium; ex. gr. الْخَلِيلُ، الْقَاسِمُ: quæ tamen & brevitatis causa interdum eum amittunt. Sic & Par-

ti-

ticularum quarundam compositionem Articulus post dicetur ingredi.

C A P U T S E C U N D U M.

De specie.

SPECIES duplex est, Primitiva & Derivativa: Nomen Primitivum est quod non derivatur a liunde; ut *كَوْكَبٌ caput*, *لَحْمٌ caro*: Derivativum vero quod ab alio derivatur; estque Verbale vel Nominale. Verbale est quod derivatur a Verbo: qualia fere sunt Adjectiva, ut *كَبِيرٌ magnus*, ab *كَبِيرٌ magnus fuit*, *صَغِيرٌ parvus*, a *صَغِيرٌ parvus fuit*; *أَصْفَرٌ flavus*, a *أَصْفَرٌ flavus fuit*; *طَيِّبٌ bonus*, a *طَيِّبٌ bonus fuit*; *نَاصِرٌ adjuvans*, a *نَاصِرٌ adjuvit*, atque sic reliqua Participia adjective accepta: & substantiva significantia Actorem, Locum vel Tempus actionis, Instrumentum actionis, aut denique Actionem ipsam.

Nomen Actoris.

ACTOREM significant Participia activa, substantive accepta: ut **نَاصِرٌ** *adjutor*, **رَّجُلٌ** *rex*, **مُسَالِكٌ** *dominator*, **قَاعِدٌ** *seffor*, &c.

Nomen Loci & Temporis.

LOCUS & TEMPUS actionis eadem nominis voce significantur: ut **مَكْتَبٌ** *locus* & **تِيمَسٌ** *tempus scriptionis*, **مَجْلِسٌ** *locus* & **تِيمَسٌ** *tempus sessionis*: fiuntque in prima trilateri Conjugatione a Futuro activo, & pro **أَتْبِعٍ** posito, & vocali penultima manente, cum est fatha, ut **لَوْقُ** *locus* & **تِيمَسٌ** *tempus laboris*, a **يَشْغُلٍ**; vel kesra, ut **مَضْرِبٌ** *locus* & **تِيمَسٌ** *tempus verberationis*, a **يَضْرِبٍ**; **مَبْرُوعٌ** *locus* & **تِيمَسٌ** *tempus emptionis*, a **يَبْرُوعٍ**: at in fatha converso, cum est damma, ut **ذَخْلٌ** *locus* & **تِيمَسٌ** *tempus introitus*, a **يَذْخُلُ**; **مَقْلُومٌ** *locus* & **تِيمَسٌ** *tempus stationis*, a **يَقْلُومُ**. Duodecim tamen hæc nomina damma in kesra mutant,

مُشْرِقٌ

مَشْرِقٌ	<i>locus ortus, Oriens.</i>	مَنْخَرٌ	<i>locus spirationis, id est, nares.</i>
مَغْرِبٌ	<i>locus occasus, Occidens.</i>	مَنْسُكٌ	<i>locus sacrificandi.</i>
مَرْفَقٌ	<i>locus innitendi cubito.</i>	مَطْلَعٌ	<i>locus ascensus.</i>
مَنْبَثٌ	<i>locus cretionis berbarum.</i>	مَفْرِقٌ	<i>locus separatio- nis capillorum.</i>
مَسْقَطٌ	<i>locus casus.</i>	مَسْكَنٌ	<i>locus habitatio- nis.</i>
مَجْرِيٌّ	<i>locus jugulandi camelum.</i>	مَسْجِدٌ	<i>locus adoratio- nis.</i>

Quorum postrema quinque etiam regulariter cum fatha scribuntur: quod &, ex sententia quorundam, primis etiam sex accidere potest. Septimum quoque interdum irregulariter kesra sub ۚ habet, & مَنْخَرٌ effertur.

Si autem verbum est simile ۖ, penultima perpetuo kesra habet, & ۖ si abjectum est, redit: ut مَوْعِدٌ; يَضْعَفُ locus & tempus positionis, a مَوْجَةٌ; يَعْدُ locus, & tempus promissionis, a بِيَوْخَةٍ, si vero est Defectivum, penultima perpetuo habet fatha: ut مَرْتَبَةٌ (pro مَرْتَبَةٍ) secundum Canon. tertium

مَدْعَى ي (ي) locus & tempus projectionis, a بِسْرِمِي مَدْعَى ي (ي) locus & tempus vocationis, a بِسْرِضِي مَدْعَى lo-
cūs & tempus complacentiæ, a بِسْرِضِي a بِسَاوِي مَسَاوِي tamen reperitur مَسَاوِي, & cum kesra pro
مَسَاوِي (juxta Canonem quintum ي (ي)) locus & tem-
pus mansionis.

Assumitur interdum in Locorum nominibus s in
fine; ut مَقْبَرَة locus sepelitionis, cœmiterium,
ا مَشْرَقَة locus ortus, Oriens, a بِشَرَقٍ, ac tum penultima radicalis subinde damma habet;
ut مَقْبَرَة، مَشْرَقَة، مَظَانَّ، a بِظَانَّ autem,
existimat, fit مَظَانَّ cum kesra, locus existi-
mationis.

In Verbis autem quadrilateris & Conjugationi-
bus omnibus derivativis, formatur Nomen Loci &
Temporis a Futur. passivo, posito ḡ pro ا-
ita ut omnino conveniat cum Participio passivo:
ut مَخْرَجَنَّ locus & tempus contristationis, a بِخَرَجَنَّ مَقْلَمَ locus & tempus constitutionis, a بِخَرَجَنَّ مَنْقَطَعَ locus & tempus abscissionis,
مَخْرَجَنَّ locus & tempus volutationis, مَخْرَجَنَّ locus & tempus tumultuationis.

Nomen Instrumenti.

NOmen Instrumenti sit præposito μεντρα; estque formæ مِنْصَارٌ vel مِنْصَرٌ aut مِنْصَرٌ: ut مِفْتَاحٌ quo quid aperitur, clavis, a فَتَحَ aperuit; مُخْلِبٌ mulcitra, ab حَلْبٍ mulxit; مُخْلَقٌ verriculum, a حَلْقٍ verrit. Sed مُنْخَلٌ cribrum, a نَخْلٌ cribravit, habet damma super μ & media radicali; ut & مَدْقَقٌ (contracte pro مَدْقَقٌ) instrumentum quo contunduntur veste, a دَقَّ contudit. Dicitur tamen etiam regulariter مَدْقَقٌ & مَدْقَقٌ. His adjungunt etiam مَدْهُونٌ vasculum in quo affervatur unguentum, مَسْعُطٌ vasculum in quo affervatur medicina caput purgans, مَكْعَلٌ vasculum in quo affervatur stibium, & nonnulli etiam مَكْرَضَةٌ (pro quo tamen doctissimi Grammatici مَكْرَضَةٌ scribunt) clavae theca. Sed hæc mihi non videntur actionum significare instrumenta: nulla certe ratione hoc postremum, quod ne verbale quidem est.

Nomen actionis.

ACCTIONEM ipsam significat Infinitivus, relatum quorum Nominum more Casibus variabilis: ut **قَصْرَبْ** verberatio, **إِحْرَانْ** contristatio, **قَصْلَعْ** colluctatio, **إِسْتَخْرَاجْ** eductio, &c. quin propri nihil aliud est Infinitivus quam Nomen verbale adverbiascens, quod elegantiae, & significationis intendendæ causa Verbo apponitur.

Nomen Vici.

AB Infinitivo autem non terminato & formatur etiam Nomen & terminatum significans actionem unam & solitariam, ac repudians proinde Adjectivum **وَاحِدَةً** una; vocaturque ab Arabibus Nomen Vici. Et est a triliteris primæ Conjug. perpetuo formæ **نَصْرَبَةً**: ut **ضَرْبَةً** una sola verberatio, **قَفْدَةً** una sola sessio, **قَوْمَةً** una sola statio; **قَوْمًا**, **قَعْدُوا**, **ضَرْبَا**, **نَصْرَبَا**: quorum Infinitivi sunt a quadrilateris vero & Conjugationibus derivatiyis, ejusdem formæ cum Infinitivo apposito solum &, ut **إِحْرَانْ** una sola volutatio, **إِحْرَانْ** una sola contristatio; **إِسْتَخْرَاجْ** una sola eductio,

atio, ab Infinitivis إِسْتِخْرَاجًا , دِحْرَاجًا , & sic quoque a duobus hisce Infinitivis primæ Conjugationis triliteræ لِقَاءٌ & إِثْبَانًا fiunt لِتْبَانَةٌ unus solus accessus , unus solus occursus ; non ضَرْبَتْهُ ضَرْبَةٌ Ex. gr. verberavi eum verberatione una , seu verberando semel , vel semel eum verberavi : قَعَدْتُ قَعْدَةً sedi sessione una , semel sedi : at ضَرْبَتْهُ ضَرْبًا est verberavi eum verberando , قَعَدْتُ قَعْدَةً sedi sedendo , indeterminate. Cum autem Infinitivus terminatur ئ، non formatur ab eo Nomen vicis ; sed ut unitas actionis significetur , adjicitur ei Adjectivum ئ، ut وَاحِدَةٌ ئ، وَاحِدَةٌ una sola miserescentia , إِفَامَةٌ ئ، وَاحِدَةٌ una sola constitutio.

Simili prorsus modo formatur Nomen Specificationis , ut ajunt Arabes , id est , quo specificatur seu determinatur actio generalis ; (ut cum dicimus , Hic excellit scriptio , seu in scriptura , vel cum scribit , ubi excellere determinatur & specificatur vocabulo actionis , scriptio scilicet) fit enim additione literæ ئ ad Infinitivum destitutum ئ , nec in quadrilateris & Conjugationibus derivativis differt a nomi-

ne vicis; ut هُنَّ إِسْتَخْرَاجَةٌ ipse bonus est eductione, seu in eductione: sed in triliteris primæ Conjugationis prima radicalis perpetuo habet kesra, & est formæ نَصْرَةٍ, ut هُنَّ حَسَنٌ ضَرْبَةٌ ipse bonus est verberatione seu in verberatione; هُنَّ حَسَنٌ قَفْدَةٌ ipse bonus est sessione, seu in sessione. Apud Poëtas tamen hanc formam interdum cum præcedente نَضْرَةٍ confundi videoas, ut مَنْضُرٌ formam instrumenti cum مَنْضُرٌ forma Loci & Temporis.

Derativum Nominale est quod derivatur ab aliо nomine: estque possessivum, Diminutivum, Augmentativum, & Locale.

Possessivum.

POSSESSIVUM est Nomen Adjectivum significans possessionem & formatur a quovis Substantivo adjectione يٰ; ut إِنْسَانٌ homo, بَشَرٌ humanus; أَرْضٌ terra, تَرَنْسٌ terrenus: sed si terminata id abjiciunt, ut مَائِدَةٌ mensa, مَهْلِكَةٌ mensalis: حَبْلَيْ gravida mulier, حَبْلَيْ ad gra-

gravidam pertinens; ي tamen interdum in م mutatur, ut dicatur حبْكَوْي. A propriis regionum Nominibus formata s̄epe sunt substantiva, & Gentilia vocantur, ut الْشَّام Syria, الْشَّامِيْ Syria & Syrus; مصر Egyptus, اَمْصَرِيْ Egyptiacus & Egyptius: اَفْرِيْقِيْ Africa, اَفْرِيْقِيْ Africanus & Afer, ubi & ي cum ي perit, quod in terminatis per ي perpetuum est.

Diminutivum.

DIMINUTIVUM significat diminutionem sui primitivi; estque in triliteris formae, in quadrilateris قَمْبَطْ: ut عَبْدَه servulus, ab عَبْدْ servus; قَمْبَسْ junula, a قَمْرْ luna; ضَرْبَتْ lente & perfuctorie verberans, a ضَرْبَتْ verberans; جَغْنَفْ rivulus; a جَغْنَفْ rivus, عَصْنِفْ passer, ab عَصْنِفْ passer.

Augmentativum.

Augmentativum intendit significationem sui pri-

mitivi; estque participiale ut plurimum, formæque variæ, scilicet **فَصَلَّى**, **فَصَوْرَ**, **مِنْصَارَ**, & **فَصِبَرَ**; quæ si immediate a verbis derivari dicantur, verbalia erunt actorem significantia: ut **ضَرِبَ** & **ضَرَوبَ**, **ضَرِيَّ**, **مِضَرَابَ**, **ضَرَابَ** bene & diligenter seu vehementer verberans, vel vehementer verberator. De **فَصِبَرَ** vide ad Partic. passivum primæ Conjug. ubi videbis id interdum passivum esse; quod & **فَصَوْرَ** interdum accidit, sed in Fœminino tantum.

Locale.

LOCALE denotat locum sui primitivi: estque Collectivum vel Singulare. Collectivum significat locum in quo res copiosæ sunt & abundantes, estque formæ **مَنْصَرَةَ**; ut **مَاسِدَةَ** locus leonibus refertus, ab **أَسَدَ** leo; **مَبَطَّخَةَ** locus melonibus refertus, a **بَطَّاخَ** melo. Nec formari potest a nominibus quatuor literas radicales habentibus, ut sunt **ضِنْدَعَ** *rana*, **غَلَبَ** *vulpes*. Singulare significat locum seu instrumentum in quo quid reponitur, aut asservatur vel asservari solet; est-

estque ejusdem formæ cum verbali significante instrumentum actionis, id est منْصَرٌ vel منْصَرٌ، aut منْصَرٌ: ut مُقْلِمٌ calamarium, a قَلْمَنْ calamus; بُولٌ وَالْ & مُبَوْلٌ urinarium, a بُولٌ urina; مُشْكُلٌ vasculum in quo ponitur cera, a شَكْلٌ cera; مُبَسَّرٌ & مُبَسَّرٌ theca in qua asservantur acus, ab إِبْرَةٌ acus. Huc enim referenda sunt hæc & similia, non ad verbalia significantia instrumentum actionis, ut supra monui: ubi quatuor attuli per duplex damma scripta, huc quoque transferenda.

CAPUT TERTIUM.

De forma Nominum.

FORMA Nominum duplex est, Nuda & Augusta. Nuda est quæ solis radicalibus literis constat, ut كَنَابٌ servus, مَرْجُلٌ vir, عَبْدٌ liber, بَطْوَلٌ inanitas, otium; مَظْبُونٌ magnus; صَرَافٌ belleborus, خَزْرَنْقٌ aranea, خَرْبَقٌ nummularius: Augusta, quæ præter radicales habet

unam aut plures ex literis servilibus ^{يَسْمَنْ}, quæ formationi nominum inserviunt.

ب quidem in fine; ut فَرْسَيْ Persa & Persicus, سَمَاوِي celestis; دَكْرَي recordatio: vel in medio; ut حَجَبْ lapillus: aut in principio; ut يَسْنَبْ fons.

ت in principio; ut تَطْوِيل prolongatio, كَبْرَى superbia: vel in medio; ut in Octava Conjugatione, ut إِفْتَرَاف confessio: aut in fine, sed per s scriptum; ut خَمْدَة misericordia.

س solum hic non servit, sed cum aliis duabus, sicut in decima Conjugatione; ut يَسْتَفْعَلْ petitio veniae, مُشَتَّخْرِج eductor.

م initio; ut مِضْرَبْ fustis, مِنْقَالْ pondus, مِنْكَكَةْ locus, مُنْكَكَةْ regnum: raro in fine; ut إِبْنَهْ filius, دَرْدَمْ camela edentula.

و in principio; sicuti in septima Conjugatione; ut إِنْقَطَاعْ abstinentia, finis: & in fine; ut غَفَرَانْ remissio.

in principio; ut أَسْوَةٌ *niger*, إِغْفَالٌ *negligentia*, أَلْكُزْمٌ *breves habens digitos*: & in fine; quo casu Elif aliud, sed quiescens, ante se habet, ut كَبْرِيَّةٌ *superbia*, عَاشُورَةٌ *dies decimus mensis Ramadán*.

CAPUT QUARTUM.

De Genere Nominum.

GENUS duplex est, Masculinum & Fœminum.

Fœminina sunt ex significatione,

1. Nomina mulierum, & quæ mulieribus tantum conveniunt; ut هِنْدٌ *Hinda*, مَرْيَمٌ *Maria*; أم *mater*, عَرْوَةٌ *mulier amans maritum suum*.

2. Nomina Regionum & Urbium; ut مصر *Egyptus*, قَبْرِش *Cyprus*; مَكَّةٌ *Mecca*, عَدَن *Aden*.

3. Nomina geminorum membrorum; ut يَدٌ *manus*, كَتْفٌ *brumerus*, عَيْنٌ *oculus*.

Ex terminatione vero,

i. Ter-

1. Terminata ۷; ut قصْعَةٌ scutella, خَلَائِقٌ خَلَائِقٌ amicitia, جَنَاحٌ hortus, ظُلْمَةٌ tenebrae, صَفَرٌ parva, طَيْبَةٌ bona.

2. Terminata ۱ servili; ut مُشَكَّةٌ وَخَلَائِقٌ multitudine senum, senes, كِبْرِيَاتٌ superbia, حَمْرَةٌ rubra.

3. Terminata ۲ servili quiescente instar Elif, ut أُوكَرِيَّ recordatio, ذَكْرِي prior, prima, طَوَّيَّ longissima.

His addenda أَرْضِيَّ terra, خَمْرٌ vinum, بَيْسِرٌ puteus, نَارٌ ignis, رِيحٌ ventus, نَفْسٌ anima, شَفَقٌ sol; & alia quædam usu discenda.

Reliqua Masculina sunt; ut مُحَمَّدٌ Maboh med, رَجُلٌ vir, أَبٌ pater, دُوْمَسٌ domus, فَلَوْنٌ fluvius, صَغِيرٌ parvus, طَيْبٌ bonus, & sic paucissima in ۷ terminata; ut خَلِيلٌ summus Imperator, عَلَامٌ vir valde doctus.

Sed utrumque genus habent, & Dubia sunt litterarum nomina: ut لَفْ بَتْ, عَوْهٰ, quæ saepius tamen fœminina sunt: Communia vero, Adjectiva quædam sunt in sequentibus indicanda.

CAPUT QUINTUM.

De Motione Nominum.

MOTIO est Nominis Masculini in Fœmininum conversio: fitque additione terminationis fœmininæ; ut **بَرِّ** *patrius*, **عَمِّةٌ** *amita*; **كَرِيمٌ** *honorandus*, *لِيبرَالِيزْ* *liberalis*, **كَرِيمَةٌ** *honoranda*, *لِيبرَالِيزْ* *liberalis*.

Accidit autem Motio Substantivis quibusdam ^{Ad Act. in fœminin} Masculinis res potissimum sexum habentes significantibus; ut **فَتَيْ** *vir*, **مُرْجَلٌ** *mulier*; **مَالِكٌ** *puellus*, **مَالِكَةٌ** *Rex*, **خَاتِمَةٌ** *Regina*; **جَدٌ** *avus*, **جَادَةٌ** *avia* &c. & Adjectivis, ut **كَبِيرٌ** *magnus*, **كَبِيرَةٌ** *magna*, **فَرِحٌ** *latus*, **فَرِحةٌ** *lata*; **فَرِحَةٌ** *verberans* mascul. **فَسَارِبَةٌ** *verberans* fœmin. Assumitur que ut plurimum prima terminatio fœminina **كَ**, absque ulteriori mutatione; ut appareat in exemplis allatis. Excipiuntur Adjectiva formæ **أَفْعَلٌ**; quæ cum sunt Positiva, secundam assumere solent termina-

nationem, nempe Elif servile, & Fœmininum habere فَعْلَاءُ أَصْفَرْ : ut صَفَرَ flavius, فَلَا flava; أَهْدَبْ longa habens cilia, هَذِبَةً fœmin. Cum vero Comparativa sunt aut Superlativa, tertiam adsciscunt terminationem, يَ scilicet servile quiescens post fatha, habentque Fœmininum ut قَفْلَى: sic طَوْلَى longior vel longissimus, طَوْلَى longior f. vel longissima; أَكْبَرْ major vel maximus, كَبْرَى major f. vel maxima.

Hanc quoque terminationem tertiam assumunt Adjectiva non pauca formæ نَصِيرٌ; ut كَبِيرٌ ebrius, شَرِي ebria. quo pertinent أَقْلَى primus, أَوْيَ prima. & sic أَخْرَى aliis, habet أَخْرَى.

Eandem terminationem adsciscunt, sed forma يَنصَرَى, Adjectiva quædam formæ يَنصَرَى; ut أَحْمَدَ iratus; غَضَبَانٍ irata. autem unus habet إِحْدَى cum kesra.

Quinque tamen Adjectivi formæ Communis ferre sunt generis, & sub eadem terminatione nunc masculine nunc fœminine usurpantur: suntque 1. يَنصَرَى active sumpta, ut صَبُورٌ hic & hæc pa-

patiens. 2. مُنْصَارٌ, ut مُنْظَمٌ hic & hæc condiens aromatibus. 3. مُنْصَبٌ, ut مُسْكِنٌ hic & hæc pauper. 4. مُنْفَشٌ, ut مُنْفَشٌ temerarius, temeraria. 5. مُنْصَبٌ passive sumpta, ut قَتْبَلْ bio occisus, & hæc occisa. Invenies tamen etiam has formas in fœminino interdum assumere s, ut عَدِي inimicus, عَدِي inimica; مُسْكِنٌ pauper mascul. مُسْكِنَةٌ fœmin. & sic perpetuo ultima, cum substantive usurpatur: ut وَاحِدَةٌ ea quæ occisa est.

Neutrum genus Árabes non agnoscunt: unde Adjectiva neutra substantive usurpata exprimunt per fœminina, ut وَاحِدَةٌ تَغْوِيرٌ unum deest tibi.

Cæterum observatu quoque dignum est, a Nominibus Substantivis Masculinis significantibus res habentes partes homogeneas, formari sæpe fœminina primæ terminationis significantia partem aliquam illarum: ut تَبْرِي stramen, تَبْرِي particula straminis: هَرْبَةٌ aurum, هَرْبَةٌ particula auri, massa auri.

CAPUT SEXTUM.

De Numero.

NUMERI Nominum tres sunt: Singularis, ut سَارِقٌ *fur*, مُجَاهِلٌ *vir*; Dualis, ut مَجْهَالَانِ *duo fures*, سَارِقَانِ *duo viri*; & Pluralis, ut شَارِقَوْنَ *complures fures*, مِجَاهَلَ *complures viri*.

Formatur autem Dualis a Singulari, adjecto الـ absque ulla mutatione, ut patet in exemplis allatis. & tamen foemininum in ئـ mutatur, ut مَدِينَتَانِ *civitas*, مَدِينَتَيْنِ *due civitates*, كَبِيرَتَانِ *magna*, كَبِيرَتَيْنِ *duae magna*, & يـ autem finales in singulari post fatha quiescentes, juxta Canonem suum tertium, hic fiunt mobiles: ut فَتَّيْنِ *puer*, فَتَّيْنِ *duo pueri*; ذَكْرَيَانِ *commemoratio*, ذَكْرَيَانِ *duae commemorationes*; نَمِينَيْنِ *nominatus*, نَمِينَيْنِ *duo nominati*; عَصْرَوْنَ *fustes*, عَصْرَوْنَ *duo fustes*.

Elif

Elif servili terminata mutant id in و, ut صَفْرَاءُ صَفْرَاوَانِ flava, صَفْرَاءُ duæ flavæ. at radicale ي manet, ut جَزْأٌ جَزْأَنِ pars, جَزْأٌ جَزْأَنِ duæ partes: nisi ponatur pro و vel ي, juxta ultimum Canonem و & ي; tunc enim libere manet, vel mutatur in و, ut وَدَّي vestis, وَدَّاونِ وَدَّاونِ & وَدَّاونِ duæ vestes.

Pluralis fit a Singulare dupliciter, perfecte scilicet aut imperfecte: unde Plurale aliud est perfectum, quod Sanum vocant Arabes, aliud imperfectum, quod Fractum appellant. Sanum formant potissimum nomina propria rationalium, & Adjectiva formantia foemininum adjecto ة, cum de rationalibus prædicantur: Masculina quidem adjecto مَكْمَدُونَ ut مَكْمَدُونَ Mahomed, مَهْمَدُونَ وَنَ مَهْمَدُونَ adjuvans, نَاصِرُونَ adjuvantes; فَرِحَّوْنَ latus, فَرِحَّوْنَ Propheta, فَرِحَّوْنَ Prophetæ: Foeminina vero adjecto مَرْيَمَاتَ ut مَرْيَمَاتَ Maria, مَرْيَمَاتَ مَرْيَمَاتَ adjuvans foemin. فَرِحَّةَ نَاصِرَاتَ adjuvantes; فَرِحَّةَ lata, فَرِحَّةَ Prophetissa, فَرِحَّةَ Prophetissæ. Nulla quoque adhibita fin-

gularis mutatione, nisi quod & foemininum excidit; ut manifestum est in exemplis allatis. Sed Masculina terminata ي quiescente post kesra, id una cum kesra abjiciunt: ut أَلْقَاضِي *judex*, judges, non أَلْقَاضِيُونَ; juxta Can. primum ي & ي, at finita ي post fatha, solum ي amittunt manente in ejus indicium fatha, cum quo ي plurale diphthongescit: ut مُوسِي *Moses*, in plural. habet مُوسِيُونَ, non مُوسِيَونَ; & ي مُصْطَفَى فَوْنَ *Mustapha*, ي non مُصْطَفَى فَوْنَ, juxta eundem Canonem. Substantiva autem foeminina perfecta (id est, non derivata a verbis imperfectis) nuda, vel sola & aucta; quorum media radicalis habet giezma, illud in pluri mutant in vocalem talem, qualem possidet prima radicalis: ut دَعْدَةٌ *Daado*, nomen mulieris, جَمْرٌ *Gjumra*, nomen mulieris quoque, هَنْدَهٌ *Hinda*, nomen mulieris, سَنْدَهٌ *Sentella*, قَصْبَاتٌ *Cschibat*; هَنْدَاتٌ *lotus arbor*, جَلْبَاتٌ *Jelbat*; سِدَّهَاتٌ *ventus*, حَلْبَاتٌ *ventus*, ea tamen quorum prima habet damma vel kesra, giezma etiam retinere possunt, vel in fatha mutare: ut,

جَسْمَرٌ

جُمِرَاتْ جُمِرَاتْ جُمِرَاتْ *Gjumrāt*, جُمِرَاتْ جُمِرَاتْ جُمِرَاتْ *Gjumrāt*,
 هِنْدَاتْ هِنْدَاتْ هِنْدَاتْ *Hinda*, هِنْدَاتْ هِنْدَاتْ هِنْدَاتْ *Hinda*,
 جَلْبَاتْ جَلْبَاتْ جَلْبَاتْ *ventus*, جَلْبَاتْ جَلْبَاتْ جَلْبَاتْ *ventus*,
 سِدَرَاتْ سِدَرَاتْ سِدَرَاتْ *lot. arb.* سِدَرَاتْ سِدَرَاتْ سِدَرَاتْ *lot. arb.*

Plurale fractum est quod formatur imperfecte, seu non adjectis وَ & اَتْ, fitque a plerisque singularibus tam rationalibus, quam irrationalibus. Formæ autem ejus præcipuæ, a Nudis triliteris & femininis eorum potissimum ortæ, sunt xxii: videlicet,

- | | | | |
|---------------|------------------|--------------|---------------|
| ١٩ نَصَرَةٌ | ١٣ أَنْصَارٌ | ٧ نَصَرٌ | ١ نَصَرٌ |
| ٢٠ أَنْصَرٌ | ١٤ أَنْصَرَةٌ | ٨ نَصَرَةٌ | ٢ نَصَرٌ |
| ٢١ ذَصَرَيٌ | ١٥ نَوَاصِرٌ | ٩ نَصَرَةٌ | ٣ نَصَرٌ |
| ٢٢ نَصَارَيٌ | ١٦ نَصَارَايِينْ | ١٠ نَصَرَةٌ | ٤ نَصَرٌ |
| ٥ نِصَارَى | ١١ نِصَارَةٌ | ١٧ نِصَارَةٌ | ٥ نِصَارَى |
| ٦ نِصَارَوْنْ | ١٢ أَنْصَارَاتْ | ١٨ أَنْصَارٌ | ٧ نِصَارَوْنْ |

Quarum rationem analytice, evidentioris do-
ctri-

Etrinæ ergo, visum est proponere, in hunc modum.


نَصْرٌ Prima

عُرْفٌ fit a singularibus نَصْرَيِ & نَصْرَةٌ ut كَبْرَى cœnaculum, فُرْفَى maxima, كَبْرَى نَصْرَةٌ & نَصْرَةٌ raro a كَبْرَى كَبْرَى ut فَرِيزَةٌ pagi, بَرْبَةٌ barba, كَبْرَى بَرْبَةٌ barbae, maxilla, بَرْبَةٌ barbæ, maxillæ.


نَصْرٌ Secunda

fit a substantivis quatuor literarum, quarum ultima non est ي vél ي, penultima autem quiescens: ut حَدَائِي paries, حَدَائِي parietes, حَمْدَى columnæ, حَمْدَى virga, حَلْوَى حَجَّاجَ os superciliæ, حَجَّاجَ قَضْبَى subsequens jumentum, حَلْلَى lectica, حَلْلَى solum, sed duplicitia secundam interposito quiescente, ut حَجَّاجَ, saepius decimam quartam formam obtinent.


Ter-

Tertia 

fit ab Adjectivis masculinis formæ **أَنْصَرٌ**, & fœmininis eorum **أَنْصَرَةٌ**: ut **أَحْمَرٌ ruber**, & **أَحْمَرَةٌ rubra**, **أَحْمَرٌ rubri**, & **أَحْمَرَةٌ rubre**.

Quarta 

fit a Singulari **نِصْرَةٌ uter**, **utris**, **نِسْكَةٌ annus**, **جِبَاجَةٌ moneta**, **سِكْكَةٌ**.

Quinta 

fit i. a. **قِدْحٌ**: ut **نِصْرٌ & نِصْرَةٌ** **نِصْرٌ**
telum absque cuspide, **قِدَاحٌ basta**,
بِرْجَالٌ vir ḡall; **بِرْمَاحٌ**

2. a. **كِفْبَعٌ**: ut **نِصْرَةٌ & نِصْرٌ** **نِصْرٌ**
calceus; **قِصَاعٌ scutella**, **قِصَعَةٌ**; **كِعَابٌ**;

T dif-

difficilis, ثَبَابٌ vestis: صِنْعَابٌ mutato,

وَ فَيْلَافَ post kesra in قَبْفَ: يِ

3. a Substantivis نَصْرَةُ & نَصْرٌ non habentibus tertiam radicalem secundæ similem, aut وَ vel يِ ut جَبَلٌ mons; مُرَقَّبَةٌ رَقَابٌ collum,

4. ab Adjectivis نَصِبَرَةُ & نَصِبَرٌ: ut شِرَافٌ شَرِيفَةٌ & شَرِيفٌ nobilis, non tamen a Particiiis formæ نَصِبَرٌ passive sumptis, ut قَتْبَلٌ occisus.

5. ab Adjectivis نَضْرَانَةُ & نَضْرَانٌ: ut بِسَدَامٌ بَذْمَانَةُ & بَذْمَانٌ pænitens,

6. ab Adjectivis نَضْرَانَةُ & نَضْرَانٌ: ut خَمْضَانَةُ & خَمْضَانٌ esuriens, خِمَاصٌ

نُصُورٌ

نَصَرٌ نِصَرٌ نَصَرٌ نَصَرٌ fit a Substantivis نَصَرٌ، نَصَرٌ، نَصَرٌ، نَصَرٌ، حَنْسَدٌ؛ بَزْوَرٌ بَزْرَنٌ: نَصِيرٌ &

exer-

exercitus, ضَرْوَسْ *dens*; جَنْوَدْ جُنْوَدْ; أَسَدْ أَسَدْ; كَبْوَدْ كَبْوَدْ; أَسْوَدْ أَسْوَدْ. Et interdum quoque اَنْصَارْ شَاهِدْ *testis*, شَهِيدْ.

نَصْمٌ Septima

fit ab Adjectivo نَاصِرٌ & نَاصِرَةٌ, cuius ultima radicalis non est و vel ي: ut ضَارِبٌ ضَارِبَةٌ *verberans*, ضَرِبٌ ضَرِبَةٌ *verberantes*, mascul. & fœmin. Sed differentia causa Masculinum interdum assumit ante ultimam radicalem, hoc modo; ضَرَابٌ ضَرَابٌ *verberantes*, mascul.

نَصْرٌ Octava

fit ab Adjectivo rationali (seu quod de re rationali prædicatur,) formæ نَاصِرٌ non habentis ultimam و vel ي; ut كَامِلٌ perfectus, قَائِمٌ قَائِمَةٌ; وَرَثَةٌ وَرَثَةٌ; كَمَكَةٌ *stans*, بَرْزَةٌ بَرْزَةٌ; قَوْمَةٌ *justus*.

Nona نَصْرٌ

fit ab Adjectivo rationali formæ نَاصِرٌ quiescentis ultima: ut مُهَاجِرٌ projiciens, مُهَاجِرٌ op-pugnans, مُهَاجِرٌ: in quibus ultima radicalis in نَاصِرٌ quiescens convertitur juxta secundum Can. و & ي.

Decima نَصْرٌ

fit a Substantivo نَصْرٌ: ut كَوْفَرٌ urceus, دِبَّةٌ ursus, دِبَّةٌ & a paucis formæ قِرَدٌ; مِرْجَةٌ maritus, نَصْرٌ & نَصْرٌ simia, قِرَدٌ.

Undecima نَصْرٌ

fit a Nominibus نَصْرٌ, نَصْرٌ, نَصْرٌ, نَصْرٌ, نَصْرٌ, نَصْرٌ, فَتَّيٌ puer, فَتَّيٌ senex, شَبَّحٌ شَبَّحٌ; ubi in singul. abjectum reddit, est enim أَخْرَى pro أَخْرَى ramus,

mus: غَرْزَةً **غَرَّالٌ**, *dorcas*, غَرْزَةً **صَبِيٌّ**, *puer*, غَلْمَةً **صَبِيٌّ**, *infans*.

اَنْصَرٌ

fit a Substantivo فَضْرٌ non habente medium و
vel ي: ut دُلْقَةً وَجْهَةً: *facies*, item دُلْقَةً situ-
la, اَنْدَى mamma mulieris, اَنْدَى; ubi و
& ي excidunt, Nun vocali eorum retrocedente:
sic اَيْدٍ pro يَدِي manus, اَيْدٍ يَدِي.

& a Substantivis fœmininis quæ non terminan-
tur s fœminino, & quatuor constant literis quarum
penultima est اوي quiescens: ut ذِرَاعٌ brachium,
اَيْمَنٌ juramentum, بِيمِيَّنٌ ذِرَاعٌ.

اَنْصَارٌ

fit a Substantivis trium literarum, cujusvis formæ
(præter فَضْرٌ, non habentis medium و vel ي
aut ultimam penultimæ similem): ut مَطَرٌ plu-
via, اَمْرَاضٌ morbus, اَمْطَارٌ كَتْفٌ;

bumerus, أَبْلَأْ ^{أَكْتَافٌ}; *camelus*, أَبْلَأْ; ubi ¹ radicale excidit, juxta Canon. quintum Elif: أَيْمَمْ *oculus*, أَكْبَانْ ^{يَقْوِمْ} *dies*, أَكْبَانْ ^{عَبْنَ} pro طَرَبْ ^{أَيْ-وَامْ}; ي & و *gau-dium*, أَطْرَابْ, ab hac tamen forma نَصْرَ ^{فَسْرَانْ} sæpius venit plurale decimum septimum رَحَا; بِسْرَانْ *mola*, أَرْخَاءْ ^{خَشْيَةً} *simus bovis*, أَخْشَاءْ: in quibus ultima radicalis mutatur in hamza, secundum Canon. quartum ي & و ^{إِسْمُ}: ي & و *nomen*, أَسْمَاءْ ^{أَبْنَ}; أَسْمَاءْ ^{أَبْنَاءْ} *filius*, أَبْنَاءْ: ubi redit ultima radicalis quæ in singulari exciderat, mutaturque in hamza, juxta eundem Canonem.

Decima quarta آنحضرة amicunseq.

fit a multis Substantivis Masculinis quatuor constantibus literis, quarum penultima est اوی quiescens: ut قَلَادَه ^{أَقْلَادَه} *torques*, إِلَهَه ^{أَلَهَه}; Deus (quod compendii causa sic scribitur pro إِلَهَه ^{أَلَهَه}) *Deus*; ubi ¹ radicale excidit, juxta Canonem quintum Elif: لَغْبَه ^{أَمْدَه} *columna*, لَغْبَه ^{أَمْدَه} *libum*, لَغْبَه ^{أَمْدَه}, & sic fere perpetuo surda, & quiescentia

ل;

بَنَتْتَ ut: بِصَارَ & مَصَارَ formarum
 supellex, لَيْمَةٌ antistes; إِسَامٌ; أَبِيشَةٌ, Elif ra-
 dic. in mutato juxta primum Canon. Elif; قَبَاءُ
 tunica, فَنَاءٌ; أَفْقَبَةٌ aula,

ذو اصْسَرُ

طَابِقٌ نَاصِرٌ fit a singulari *sartago*, & ab Adjectivo نَاصِرٌ ac Fœminino ejus ضَارِبٌ نَاصِرٌ ut ضَارِبٌ verberans mascul. ضَارِبٌ verberans fœmin. ضَارِبٌ verberantes mascul. & fœmin. a Masculino tamen rationali نَاصِرٌ rarius hæc forma venit.

-Decima sexta نَصْلَى يَسْرَى.

fit a Fœmininis harum decem formarum:

فَصَارَ فَصَارَ فَصَارَ فَصَارَ فَصَارَ فَصَارَ

ut

سَحَابَةٌ سَحَابَةٌ شَمَائِلُ شَمَائِلُ ut nubes,
 دَوَابَةٌ دَوَابَةٌ عَقَابٌ عَقَابٌ دَوَابَةٌ antiæ, aquila,
 مَسَائِلُ مَسَائِلُ شَمَائِلُ شَمَائِلُ epistola, sinistra,
 حَمَائِلُ حَمَائِلُ حَمَوَةٌ حَمَوَةٌ jumentum o-
 حَجَافَنْ حَجَافَنْ حَجَافَنْ nerarium,
 صَحَافَنْ صَحَافَنْ أَصْبَانُ Tempus ante
 لَامِنَا لَامِنَا vesperam, lamina,
 كَرِيمَةٌ سَعَيْدَةٌ سَعَيْدَةٌ felix fœm. nobilis fœm.

ذِي ضَرَّانَ

Decima septima

غُلَامٌ puer: نَصَرٌ & نَصَارٌ fit a singulare
 صِرْدَانَ asalo, & sape etiam a
 حَوْتٌ ut نَصَرٌ & نَصَرٌ صِرْدَانَ: غُلْمَانٌ
 concavis & formarum قَاعٌ; عِبْدَانَ lignum, عَوْدٌ; حِبْنَتَانَ, piscis,
 اَجَرٌ, قِبْجَانَ corona, تَاجٌ, قِبْغَانَ ager, & a
 ظَلِيلَبِمٌ struthiocamelus mas,
 صِبَانَ infans صَبِيٌّ ظَلِيلَمَانَ

-Decima octava نَصْرَانِيَّةٌ

fit a Substantivis نَصْرٌ، نَصْرٌ، & نَصْرٌ،
quorum media radicalis non est و vel ي: ut سَقْفٌ tectum, بَلْدٌ سُقْفَانٌ regio, provin-
cias, بَلْدَانٌ libum, بَلْدَانٌ رَغْبَفٌ libum, بَلْدَانٌ.

Decima nona نَصْرَاءُ

fit ab Adjektivo rationali نَصْرٌ، cujus tertia
radicalis non est secundæ similis, aut و vel ي: ut كَرِيمٌ nobilis, شَرِيفٌ bonabilis,
بَخْلَاءُ avarus, بَخْلَاءُ كَرِيمٌ.

Vigesima آنَصِيرَةٌ

fit ab Adjektivo rationali formæ نَصِيرٌ، cu-
jus tertia radicalis est secundæ similis, aut و vel ي: ut

أَحْبَبَ *dilectus*, حَبِّبَ } أَحْبَبَ
أَشْدَدَ *vehemens*, شَدِيدٌ } أَشْدَدَ
contracte pro

أَوْلَبَاءُ *amicus*, وَلِيٌ; أَقْنَبَاءُ *غُنْيٰ* *dives*, & in paucissimis perfectis: ut صَدِيقٌ *verax*,
أَصْدَقَاءُ, sicut contra imperfecta quædam habent
تَقْوَاءُ, تَقِيٌّ *pious*, ut تَصَرِّفٌ.

نَضَارِي

Vigesima prima نَصَارِي
fit ab Adjectivis formæ نَصَارِي, & interdum quo-
que نَصَارِي significantibus dolorem
aut destructionem: ut جَرْحِي *vulneratus*,
هَالِكٌ: قَتْلَى *occisus*, قَتِيلٌ
riens, قُتْلَى *occidens*.

نَصَارِي

Vigesima secunda نَصَارِي
fit a singulare نَصَارِي: ut صَنْخَرٌ *ager*,

عَمَدَانِي virgo, صَخْلَارِي.

Si quæ autem harum formarum ab aliis etiam singularibus triliteris & Nudis aut Foemininis eorum veniunt, id speciale est & notandum, scuti & observanda sunt illiusmodi singularia, quorum Pluralia diversas habent formas a nominatis: qualia non usque adeo multa occurrent.

Ea autem singularia quarum formæ in diversis hic comparent classibus, diversa quoque ut plurimum habent Pluralia: sic a نَفْسٌ anima, fit نَفْسٌ & عَنْتَمَةٌ animæ & لَامٌ puer, & عَبُونَ & أَعْبَسَانَ pueri; عَلْمَانَ oculus & أَعْبَسَانَ عَيْنَ & أَعْبَسَانَ oculi; لِبَّا libum, لِبَّا & مُرْغَفَانَ libum; مُرْغَفَانَ & سَوَّى murus; سَوَّى & جَنْنَنْ palpebra, جَنْنَنْ & جَقْوَنْ palpebrae; جَقْوَنْ & عَبْدَانَ servus, عَبْدَانَ & عَبْدَوَهُ & عَبْدَادَ quoque عَبْدَهُ servi: عَبْدَهُ mare, بِخَارَ عَبْدَهُ & شَاهِدُونَ maria; شَاهِدُونَ & شَهْوَهُ testes, شَهْوَهُ & شَوَاهِدَ testes. Non tamen perpetuo omnia illa quæ a talibus formis derivari possunt: sic

اَنْفَسْ non dicitur نَفْسٌ،
 اَنْفَسْانْ nec ab اَنْبَدْ dicitur نَفْسَةٌ؛
 اَنْبَدْ & اَنْبَدْهُ، اَنْبَدْهُهُ، &c. interdum vero u-
 num tantum; ut a رَجُلٌ vir, solum fit رِجَالٌ؛
 ab اَمْرٌ negotium, solum اَمْرٌ وَرْهٌ؛ quod usus do-
 cebit.

Observandum autem est formas undecimam , duodecimam , decimam tertiam & decimam quartam , Pluralia paucitatis vocari & usurpari cum numeralibus tantum , si videlicet aliud ejusdem singularis plurale extet ; si minus , etiam has generaliter usurpari , ut solent reliquæ.

Atque hæc quidem de nudis triliteris dicta sunt : quadrilatera autem nuda omnia , & aucta pleraque , cum Fœmininis suis formant plurale fractum assumpto ١ quiescente post secundam literam , quæ , ut & prima , fatha possidet , sicut tertia kesra ; ut sit formæ قَمَاطِرٌ ضَفْدَعٌ rana , ut مَدَخَلٌ مَدَخَلٌ vestibulum , & autem finale excidit : ut مَزَبَلٌ مَزَبَلٌ finetum , & ultimam radicalem si præcedat aliqua literarum اوی quies-

quiescens, ea manet; ut قَنْدِيلٌ *lampas*,
 قَنَادِيلٌ: sed ob præcedens kesra in ي muta-
 ta, si sit ا vel و; ut سُلْطَانٌ *princeps*, سَلَاطِينٌ;
 عَرَاقِبٌ *calcaneus*, عَرْقُوبٌ: interdum tamen
 ea excidit, & in fine accidente ad ejus compensatio-
 nem; ut دَيَّابُلُسٌ *diabolus*, & دَيَّالِبُسٌ
 أَسَاكِبُفٌ *calcearius*, إِسْكَافٌ; دَيَّالِسَةٌ
 & أَسَاكِفَةٌ: sicuti & alias interdum accedit
 ة; ut أَسَافِةٌ & أَسَاقِفَهٌ *Episcopus*,
 تَلَامِيدٌ & تَلَامِيذٌ *discipulus*.
 Hanc etiam pluralis formam adsciscunt adjectiva
 formæ, أَنْصَرٌ, نَصْرٌ de quibus supra in نَصْرٌ dictum
 est; ut أَسْوَدٌ *niger*, أَسْاوَدٌ, & comparativa, ut
 أَكْبَرٌ أَضْعَفٌ *minor*, minimus, أَكْبَرٌ *ma-
 jor*, maximus, أَكْبَرٌ, & Pluralia quædam au-
 cta triliterorum (formatur enim interdum ab uno
 Plurali aliud ad copiam sermonis;) ut ظُفَرٌ un-
 quis,

guis, in Plural. habet أَظْفَارٌ, unde formatur secundum plurale أَظْلَافٌ: sic ab عَرْقٍ *vena*, fit عَرْقٌ & ab hoc سِوَاءٌ *armilla*, أَسْوَاءٌ & ab hoc أَسْوَاءٌ.

Ad hanc quoque pluralis formam reduci commode possunt formæ نَصَابٌ & فَوَاصٌ supra positæ, ut inspicienti satis fit manifestum.

Cæterum quædam ultimam literam habentia quiescentem, kesra penultimum in fatha mutant: ut عَذَارِي pro عَذَارِي *virgo*.

Quæ autem quinque vel pluribus constant literis (non annumeratis وَ & اُوی quiescentibus) eandem quidem formam assument, sed abjecta tamen litera una aut pluribus: Nuda enim pentagramma abjiciunt ultimam radicalem; ut سَفَرْجَلٌ *cydonium malum*, سَفَرْجَبُوتٌ *aranea*, عَنْكَبُوتٌ: & interdum quoque penultimam, manente ultima; ut خَزَارِنٌ *aranea*, وَ خَزَارِنَقٌ *frustum libi deciduum*, فَرَازِنَقٌ Collect. *mica*, فَرَازِنَقٌ & فَرَازِنَقٌ. Si tamen penultima est

و vel ي diphthongescens post fatha, utraque manet, ultima scilicet & penultima, sed و in ي mutatur ob kesra præcedens; ut فِرْعَوْنُ crocodilus, قَرْاعِبَنْ. Aucta vero abjiciunt serviles; ut دَحَارِجُ locus volutationis, مُنْطَلِقٌ solutus, مَطَالِفُ: vel cum و; ut سَتْ مُشَتَّخِرَجُ euctor مَكَارِجُ.

Observatio de Pluralibns Anomalis.

NOTANDUM est Singularia quædam, Pluralia sua aliunde mutuari: ut مَهَانْ ^{سَهَّل} mater habet مَهَانْ, tanquam ab عَنَانْ; فَوَاهْ a فَوَاهْ os, امَّةْ قَمْ fumus, عَائِنْ مَاءْ; عَائِنْ مَاءْ, ut ab عَوَانْ ^{سَهَّل} aqua, إِنْسَانْ مَاهْ mulier, habet إِنْسَانْ نِسْوانْ ^{سَهَّل} & نِسْوَةْ, نِسْانْ ho-mo, إِنْسِيَّا ^{سَهَّل}, ab إِنْسَاسْ, ponitur enim pro قَيْسِيَّا; sed ob frequentem usum يَ excidit: qui-

quidam tamen putant poni pro Plurali regulariter
formato ab إِنْسَانٍ, nempe أَنْسَابُونَ, abjecto
يَسِّينٍ: & sic pauca alia, de quibus alias. Atque
hæc de Pluralibus nunc sufficient.

C A P U T S E P T I M U M.

De Casu.

In Numero tres sunt Casus, Nominativus, Genitivus (sub quo Dativus etiam noster & Ablativus continetur) & Accusativus. Horum ratione nomina alia sunt Triptota; alia Diptota. Triptota sunt, in quibus casus isti tres tribus distinctis terminationibus discernuntur. Diptota, in quibus Casus obliqui una terminatione continentur, atque adeo quæ duas tantum terminations agnoscent.

Triptota autem sunt,

*Ultima illa vocali
licentia poetica ali
quando tollitur ad
Egolim addi soleat
S. Ch. ad H. c. 1. p. 62 in
voca "عَنْتَ"*

Omnia fere singularia, & pluralia fracta, terminantque Nominativum per "on", Genitivum per "in", Accusativum per "an": ut Nominat. رَجُلٌ
vir, Genit. رَجُلٍ viri vel viro, Accus. رَجُلًا
virum; رَجُلٌ viri, رَجُلٌ virorum, وَّ vi-
ris; رَجُلًا viros.

Di-

Diptota sunt,

1. Dualia omnia, habentque Nominativum in
اَنْ, Genitivum & Accusat. in فِيْنْ: ut مَرْجَلَانْ
duo viri, مَرْجَلَيْنْ duorum virorum, duobus vi-
ris, duos viros: مَدِينَتَانْ duæ urbes,
مَدِينَتَيْنْ duarum urbium, duabus urbibus,
duas urbes.

2. Pluralia sana Masculina, habentque Nomina-
tivum in وَ, Genitivum & Accusat. in يِنْ: ut
مَوْمِنَبَنْ credentes, مَوْمِنَتَوْنْ credentium,
credentibus, credentes.

3. Pluralia sana Fœminina, habentque Nomina-
tivum in كَاتْ, Genitivum & Accusativum in اَتْ:
ut مَأْمَهَاتْ matres, مَأْمَهَاتْ matrum, ma-
tribus, matres.

4. Nomina Invariabilia quæ vocant Arabes, seu
quorum ultima vocalis non admittit Nunnationem:
habetque Nominativum in اَنْ, Genitivum & Accu-
sativum in اَنْ, ut عَثْمَانْ Othmanus, عَثْمَانْ
Othmani, Othmano, Othmanum: مَسَاجِدْ tem-
pla, مَسَاجِدْ templorum, templis, templo;
أَنْسُودْ niger, أَنْسُودْ nigri, nigro, nigrum.

Sunt autem Nomina invariabilia,

1. Adjectiva Positiva & Comparativa formæ
أَفْعَلٌ: ut أَحْمَرٌ *ruber*, أَكْبَرٌ *major*, māximus, nisi, quod rarius accidit, fœmininum per
s forment; sicuti أَرْبَلٌ *viduus*, أَرْبَلٌ *vidua*.

2. Adjectiva terminata أَنْ servili, quæ non for-
mant fœmin. addito s ut أَخْضَبَانْ *iratus*, cu-
jus fœmin. est أَخْضَبَيْ; sic enim etiam hujus for-
mæ quædam Adjectiva moventur.

3. Terminata Elif servili; ut صَفَرَاءُ *flava*: vel
ي servili quiescente instar Elif; ut ذَكْرَي *re-
cordatio*, pro ذَكْرَي *juxta Canon. tertium* ي;
sic etiam غَضْبَيْ *irata*. قَشْلَي *occisi*.

4. Pluralia fracta formæ نَوَاصِرٌ & فَمَاطِرٌ
vel ضَوَالِرٌ: ut قَمَاطِرِي *verberantes*,
مَدَاخِلٌ *ranae*, قَنَادِيلٌ *lucernæ*, ضَفَادِعٌ
vestibula; vel خَرَلِقٌ *araneæ*. Sed ex
quarum ultima radicalis est litera quiescens, triptota
sunt, ut reliqua Pluralia fracta: quædam tamen kes-
ra penultimam in fatha mutant, & ea hujus quo-
que loci sunt: ut حَذَارِي *virgines*, pro حَذَارِي
in

in Nominativo, عَذَلَنِي in Genitiv. & Accusati-
fis نَصَارَى Christiani, pro نَصَارَى &
نَصَارَى. Cæterum vox سَرَافِيل femoralia,
aliis est Plural. a سِرَافِيل, & regulariter diptoton;
ob similitudinem quam habet cum plurali formæ
نَصَارَى.

5. Regionum, Insularum, Urbium, Pagorum,
Artium, Montium, Fluviorum, & Locorum quæ-
libet nomina; ut مُضْرِق *Ægyptus*, قَبْرُس *Cy-
prus*, مَكَّة Mecca, جِبَرَة Gjiza,
أَكَارَا Acara, دَرَنْ Atlas mons, تِجْرِيَة Tygris,
غَوْطَة Gouta.

6. Pleraque hominum propria, & inter cætera
Masculina omnia terminata ئ: ut عِمَرَانْ *Im-
ran*, عَبْرَمَانْ Othman, & Barbara pluribus
quam tribus literis constantia; ut إِبْرَاهِيمْ *Abra-
ham*, إِسْحَاقْ Isaac, يَعْقُوبْ Jacob, آدَمْ
Adam, فَرَدْوَنْ Gebenna, جَهَنَّمْ *Paradisus*,
&c. nec non fœminina terminata s. fœminino, ut

عِصْمَةُ Aisja; & constantia literis quatuor,
 زَيْنَبُ زَيْنَبُ Zainab; vel tribus quarum media move-
 tur, ut سَقْرَ Sakar, aut damma ante se habet,
 ut جُوَرْ Gjero, quæ autem tribus constant lite-
 ris nec terminantur s, nisi Barbara sint, (nam hæc
 sunt diptota) modo triptota sunt, modo diptota,
 ut Nominat. سَقْرَ Genitiv. سَقْرَ Accusat.

سَقْرَ, & Nominat. سَقْرَ Genit. & Accusat.
 سَقْرَ, sic Nominat. دَعْدَى, Genitiv. دَعْدَى Ac-
 cusat. دَعْدَى; & Nominat. دَعْدَى Genitiv. & Ac-
 cusat. دَعْدَى, quod & reliquis nominibus invariabi-
 libus (in poësi potissimum) interdum contingit; si-
 cut contra, variabilia seu triptota quædam, invariabilia seu diptota subinde fiunt; sed utrumque ra-
 rum est.

Bene autem hic meminisse oportet Canonis ter-
 tii وَ, nec non tertii & quarti يِ: nam juxta Ca-
 nonem tertium وَ dicitur, عَصْمَةً pro عَصْمَةٍ,
 عَصْمَةً, عَصْمَةً, baculum, baculi vel baculo,
 baculum: & juxta tertium Canon. يِ pro رَحْيِي, رَحْيِي pro
 رَحْبَةً, رَحْبَةً, mola, molæ, molam;
 jux-

juxta quartum vero ejusdem Canōnem مِنْأَمْ , pro جَوَافِي projiciens , projicientis ; مِنْأَمْ & مِنْأَمْ
pro جَوَافِي & جَوَافِي puellæ , puellarum.

Consideranda autem in hisce casibus sunt Apocope & Permutatio.

Apocope est τῆς Nun Casualis : Vocalis quidem , ^{ellige in Nominis.}
in nominibus triptotis , & diptotis pluralibus fœmininis perfectis : Consoni vero in diptotis dualibus ,
& pluralibus masculinis perfectis : amittunt enim
hæc omnia Nun ob Constructionem , tum I. Regiminis , seu cum sequitur Genitivus : ut كِتَابٌ
كِتَابٌ مُوسَى liber Mosis , كِتَابٌ مُوسَى libri vel libro Mosis , مُوسَى
كتاباً مُوسَى libri duo , كِتابَانِ libri duo مُوسَى
كتابي مُوسَى libri duo Mosis , librorum duorum , libris duobus , vel libros duos Mosis : كِتبَ مُوسَى libri
كتب مُوسَى libri Mosis , كِتبَ مُوسَى librorum , vel libris Mosis ,
كتب مُوسَى libros Mosis : بَنْوَةَ filii , بَنْوا

بَنْيَةٌ filii Dei, بَنْوَاتُ الْلَّهِ filiorum,
 بَنْيَةٌ vel filios Dei, tum II. Affixi, seu cum annexetur
 Pronomen Possessivum: ut كِتَابَةُ liber ejus,
 كِتَابَةُ libri vel libro ejus, كِتَابَةُ librum
 ejus; كِتَابَةُ libri duo ejus; كِتَابَةُ librorum duorum, libris duobus, vel libros duos e-
 jus; كِتَابَةُ, كِتَابَةُ, كِتَابَةُ, libri, li-
 brorum, & libros ejus. Et Nun vocale III. etiam ex-
 cedit ob articulum الـ tum 1. præcedentem, ut
 الـ كِتَابُ liber, الـ كِتَابُ libri, الـ كِتَابُ
 librum; tum 2. sequentem, ut كِتَابُ الـ ذِي li-
 ber qui, كِتَابُ الـ ذِي librum qui, &c. مِنْ
 sagittarius, مِنْ مِنْيَ الـ مَلِكُ sagittarius regis:
 excidente enim Nun redit ي abjectum.

Sed أَبُ pater, أَخُ frater, حُمُّ socer, & inter-
 dum quoque هُنَّ res, muliebria, Nun ob construc-
 tionem abjicientes (nisi accedat ي affixum,) as-
 sumunt ejus loco literam quiescentem; in Nomina-
 tivo ي, in Genitiv. ي, in Accusativ. ي: ut هُنَّ

مِنْ أَبِي دَاوُدْ is est pater Davidis, هُنَّ أَبْنَى دَاوُدْ
 a patre Davidis, مَرِيَّتْ أَبَا دَاوُدْ vidi patrem
 Davidis; أَبْوَكَ pater tuus, أَبْبِكَ patris tui,
 أَبْاكَ patrem tuum. Sic دُهْ possessor, in regimi-
 ne (nec aliter usurpat) habet Genitivum دِي,
 Accusativum دَا, & قُسْ os, oris, in Genitiv. con-
 structo فِي habet, (etiam cum affixo ي) & in
 Accusativo فَا.

Permutatio est Nominativi cum Accusativo: ac-
 cipit enim ille hujus terminationem in subjecto e-
 nuntiationis, cum præcedunt particulæ subjecti,
 quæ sunt

إِنْ etenim, utique: أَنْ quod: كَانَ sicuti, ac si:
 لَعْلَّ: كَيْفَ sed: لَا كَنْ & لَا كَنْ
 fortassis.

Ut إِنْ مُحَمَّداً يَقُولُ utique Mahomed stat;
 إِنْ اللَّهُ عَزَّ وَجَلَّ etenim Deus est clemens;
 عَبْدٌ وَلَا إِلَهَ إِلَّا كَفِيلٌ sciunt quod rex
 est potens; ubi مُحَمَّداً est pro اللَّهِ، مُحَمَّداً est pro
 الْمَلِكِ pro الْمَلِكِ، اللَّهُ pro الْمَلِكِ.

Sed necesse est ut nihil intercedat; nisi forte
 Pra-

فِي الْدَّارِ رَجُلًا
Præpositio cum suo casu: ut أَنْ فِي الْدَّارِ رَجُلًا
utique in domo est homo, أَنْ quoque &
assumunt interdum مَا in fine; & tunc أَنْ sem-
per, كُبْتَ ut plurimum, virtutem illam amittit.

Sic لَا non est, immediate præpositum appellati-
 tivo, ei influxu suo pro Nominativi dat Accus-
 ativi terminationem, sed sine Nun vocali; ut
 لَا مَيْسَرٌ فِي لَا non est dubium in eo, sed itera-
 tum libere influit in alterutrum, & utrumque; ut

لَا حَوْلٌ وَلَا قُوَّةٌ
 لَا حَوْلٌ وَلَا قُوَّةٌ
 لَا حَوْلٌ وَلَا قُوَّةٌ
 لَا حَوْلٌ وَلَا قُوَّةٌ

non est virtus nec po-
tentia nisi in Deo.

De Vocativo.

VOCATIVUS per Accusativum concipitur: ut
 يَا عَبْدَ اللَّهِ o vir, يَا رَجُلًا

Dei: nisi sit nominis Proprii, aut Appellativi possi-
dentis Articulum: vel absolute positi, quod signi-
ficat rem quam vocans intuetur; tum enim conci-
pitur per Nominativ. sed absque Nun vocali: ut

يَا

يَا مُحَمَّدٌ o Adam, يَا مُحَمَّدٌ o Mahomed,
 يَا رَجُلٌ o homines, يَا إِنْسَانٌ o tu
 vir, (quem scilicet aspicio) يَا رَجُلَيْنِ o vos duo
 viri, يَا نَبِيُّونَ o vos prophetæ. Si quis ad o-
 pem invocetur, adhibetur non raro Genitivus præ-
 fixo لـ: ut يَا كَرِيْدَ o Zeide, (adjuva scilicet)
 vel Accusativ. cum لـ, ut يَا نَرِيْدَةَ. Adjecti-
 vum Vocativo appositum, aut Substantivum per co-
 pulativam Conjunctionem ei adjunctum, indifferen-
 ter Nominativi terminationem habet vel Accusativi;
 nisi adsit Affixum, tunc enim Accusativi tantum.
 Cum autem Vocativo addendum est *mi* vel *mei*, id
 regulariter fit per affixum يـ: ut يَا غُلَامِي puer *mi*; & fathato يـ, يـ vel eo
 omisso, ut يـلـامـ: raro per اـ, ut يـلـامـاـ; يـ
 rarissime per simplex damma, ut يـلـامـ: pro
 اـبـي autem *pater mi*, & اـمـيـي *mater mea*, in-
 terdum dicitur، اـمـتـ & اـبـتـ vel اـبـتـ vel
 اـمـتـ: quod speciale est.

C A P U T O C T A V U M.

De Declinatione.

Ex Numerorum & Casuum supra memoratorum varietate Declinationes exsurgunt quatuor.

Prima triptota est in Singulari & Plurali, (nam Dualis ubique eadem est ratio:) ut

Sing. Nom. بَيْتٌ, Gen. بَيْتٍ, Accus. بَيْتًا.

Plur. Nom. بَيْتُونَ, Gen. بَيْتُونٍ, Accus. بَيْتُونًا.

Secunda triptota in Singulari & diptota in Plurali: ut

Sing. Nom. نَاصِرٌ, Gen. نَاصِيرٍ, Acc. نَاصِرًا.

Plur. Nom. نَاصِرُونَ, Gen. & Acc. نَاصِرِينَ.

Sing. Nom. نَاصِرٌ, Gen. نَاصِرٍ, Acc. نَاصِرًا.

Plur. Nom. نَاصِرَاتٌ, Gen. & Acc. نَاصِرَاتٍ.

Sing. Nom. مَسْجِدٌ, Gen. مَسْجِدٍ, Acc. مَسْجِدًا.

Plur. Nom. مَسَاجِدٌ, Gen. & Acc. مَسَاجِدٍ.

Ter-

Tertia diptota in Singular. & triptota in Plurali, ut

Sing. Nom. أَخْمَرٌ, Gen. & Acc. أَخْمَرٌ.

Plur. Nom. أَخْمَرُ, Gen. أَخْمَرُ, Acc. أَخْمَرُ.

Quarta diptota in Singular. & Plurali, ut

Sing. Nom. أَصْفَرٌ, Gen. & Acc. أَصْفَرٌ.

Plur. Nom. أَصْفَارٌ, Gen. & Acc. أَصْفَارٌ.

C A P U T N O N U M.

De Comparatione.

COMPARATIVUS fit a positivo præfixo أَنْ-; et pro adjectivi formam intensior. estque formæ أَفْقَلٌ: ut حَسَنٌ bonus, v. Schrad. s. 13. in voice حَسَنٌ in exempla reperi- melior; صَغِيرٌ parvus, hunc in exempla reperi- mi-
nor; أَحَبٌ charus, in exempla reperi- أَحَبٌ (pro أَحَبَتْ)
charior, habetque post se مِنْ, ut مِنْ كَمْ in exempla reperi-
كَمْ major rege, si absolute ponatur aut
in regimine, Superlativus est; ut إِلَّا كَمْ
Y 2 Deus

أَخْسَنُ الْتَّنَاسِ
Deus est scientissimus; optimus hominum.

C A P U T D E C I M U M.

De Numeralibus.

NO MINUM Numeralium, quia peculiaria quædam habent, tractatum hic lubet adjicere: sunt autem duplia: Cardinalia, & Ordinalia. Cardinalia sunt

Fœm.	Masc.	Fœm.	Masc.
٦	وَاحِدَةٌ وَحِيدَةٌ	٦	وَاحِدَةٌ وَحِيدَةٌ
٧	إِحْدَى سَبْعَ	٧	إِحْدَى سَبْعَ
٨	إِثْنَانِ إِثْنَانِ	٨	إِثْنَانِ إِثْنَانِ
٩	ثَلَاثَةٌ كَلَاثَ	٩	ثَلَاثَةٌ كَلَاثَ
١٠	أَلْبَعَةٌ أَلْبَعَةٌ	١٠	أَلْبَعَةٌ أَلْبَعَةٌ
	خَمْسَةٌ كَمْسَ		خَمْسَةٌ كَمْسَ
	عَشْرُونَ		عَشْرُونَ

Fœm.	Masc.	Fœm.	Masc.
عِشْرُونَ ٥٠	خَمْسُونَ ٢٠	تَمَائِلَانَ ٨٠	مَائِيَّةٌ ٢٠٠
ثَلَاثُونَ ٦٠	سِتُّونَ ٩٠	تِسْعُونَ ١٠٠٠	أَلْفٌ ٣٠
أَلْبَعُونَ ٧٠	سَبْعُونَ ١٠٠	مِائَةٌ ٢٠٠٠	أَلْفَانٌ ٤٠

Quorum prima duo regulariter formant fœmininum: sequentia octo masculina sunt sub terminacione fœminina, & vice versa: reliqua communia. Ea autem quæ terminantur ء, diptota sunt, ut reliqua Dualia, & Pluralia perfecta; cætera vero triptota.

Reliqua ex his componuntur, minori numero perpetuo præmisso: idque sine Conjunctione copulativa usque ad viginti: ut

Fœm.	Masc.	Fœm.	Masc.
أَحَدُ عَشَرَ إِحْدَى عَشَرَةَ ١٣	ثَلَاثَةَ عَشَرَ ثَلَاثَ عَشَرَةَ ١١		
إِنْتَانَا عَشَرَ إِنْسَنَةَ عَشَرَةَ ١٤	أَرْبَعَةَ عَشَرَ أَرْبَعَ عَشَرَةَ ١٢		

& sic de cæteris: ita ut in hac compositione regulariter ءـ sit masculinum, & ةـ fœmininum, & utrumque terminetur nuda vocali fatha, idque in omni casu; præterquam in quorum casus obliquus est

إِنْتَانَا عَشَرَةَ & إِنْسَنَةَ عَشَرَةَ،
إِنْسَنَةَنِي عَشَرَةَ & إِنْتَانِي عَشَرَةَ.

In reliquis accedit Conjunctio absque ulla mutatione: ut أَحَدٌ قِعْشَرِيَّسْ, أَحَدٌ قِعْشَرُونْ ut أَحَدٌ قِعْشَرِيَّسْ, & sic de cæteris.

Ordinalia sunt,

Fœm.	Masc.	Fœm.	Masc.
سَادِسَةٌ	6 ^{us} .	أَوَّلٌ	أَوَّلٌ
سَابِعَةٌ	7 ^{us} .	ثَانِيَةٌ	ثَانِيَةٌ
ثَامِنَةٌ	8 ^{us} .	ثَالِثَةٌ	ثَالِثَةٌ
تَاسِفَةٌ	9 ^{us} .	رَابِعَةٌ	رَابِعَةٌ
خَامِسَةٌ	10 ^{us} .	عَاشرَةٌ	عَاشرَةٌ

vigesimus, ma; trigesimus, ma:
& sic de cæteris denariis: nam in his non differunt Ordinalia a Cardinalibus.

Reliqua ex his componuntur eodem fere modo, quo Cardinalia: ut

Fœm.	Masc.
حَادِيَةٌ عَشَرَةٌ	حَادِيَ عَشَرَ Unde-
ثَانِيَةٌ عَشَرَةٌ	ثَانِيَ عَشَرَ cimus.
ثَالِثَةٌ عَشَرَةٌ	ثَالِثٌ عَشَرَ

&

& sic cætera, ut aptota quoque sint per fatha:

٢١ حَادِي وَعِشْرُونَ حَادِي وَعِشْرُونَ

& ita reliqua.

Usurpatur autem pro Ordinali numerus Cardinalis, cum numeratum non est restrictum.

C A P U T U N D E C I M U M.

De Pronomine.

NO MINIS vicem subeunt Pronomina; quæ sunt Separata, vel aliis vocibus Affixa. Separata sunt triplicia, Personalia, Demonstrativa, & Relativa: quæ Generibus & Numeris variantur ut Nomina: sed Casus non agnoscant; nisi dualia Demonstrativa & Relativa, quæ more Nominum diptota sint.

Personalia autem sunt hæc:

Pluralia.	Duala.	Singularia.
illi vos nos أَنْتُمْ هُنْ	illi duo vos duo أَنْتُمَا هُنَّا فَهُنْ	ille tu ego أَنْتَ هُنِي
illæ أَنْتُنَّ هُنَّ		Mase. Com. illa أَنْتِنِ هِيَ
		Fœm. Quo-

Quorum ea quæ tertiae personæ sunt pro verbo substantivo cuiusvis personæ sœpissime usurpantur.

Demonstrativum autem propinqui est لَهُ hic; quod sic flectitur:

<i>Pluralia.</i>	<i>Duala.</i>	<i>Singularia.</i>
أُولَاءِ	ذَانِينِ	ذَا Masc.
أُولَاءِ	ذَاهِي ذَي	ذَاهِي Com.
	تَانِينِ	تَاهِي Fœm.

fitque demonstrativum remoti addito كَ, in hunc modum;

<i>Pluralia.</i>	<i>Duala.</i>	<i>Singular.</i>
أُولَاءِكَ	ذَانِكَ ذَيْنِكَ	ذَاكَ ille
أُولَاءِكَ	تَانِكَ تَبِنِكَ	تَاكَ illa

ante quod كَ in Singular. & Plural. non raro assumitur لَ, ut dicatur ذَالِكَ, & cum مَ paragogico مَلَكَ, قَلَكَ: ذَالِكَ, قَلَكَ, utriusque autem, nisi illud assumatur, crebro præfigitur هَ:

هـ : cujus tamen compendii causa non solet pingi; sed per fatha perpendicularē aut medda representari, (quod & **رـ** دا ante **J**, & aliis vocibus quiescens habentibus creberrime accidit) hoc modo:

هـ دـا	هـ دـان	هـ دـيـن
هـ دـهـ	هـ دـتـهـان	هـ دـتـهـيـن

Relativum est **الـذـي** qui, compositum ex articulo لـذـي & الـ لـذـي & الـ؛ flectiturque hoc modo:

أـلـذـي	أـلـذـدان	أـلـذـيـن
أـلـذـيـ	أـلـذـتـهـان	أـلـذـتـهـيـن

Nun duale hic & in Demonstrativis interdum habet tesdid, in compensationem ultimae singularis excidentis.

Cæterum relativum hoc non patitur ante se literas serviles præter **فـكـلـوـ**, ac rarissime usurpatur in Casu obliquo, sed defectus hi supplementur per Affixa vocum sequentium: sic pro **بـالـذـي** in

Z quo,

مِنْ الَّذِي dicitur & pro ; الَّذِي بِهِ a quo عَلَى الَّذِي مَرَأَتِي pro ; الَّذِي مَنْهُ quem vidi , عَلَى الَّذِي مَرَأَيْتُهُ .

Relativa quoque sunt , sed antecedens includentia مَنْ is qui , & ii qui , quicunque ; مَا id quod , quocunque , ea quae , quaecunque : illud de personis , hoc de rebus dicitur : & utrumque non raro interrogat.

أَيْ autem quis , qualis , Nomen est interrogativum & substantivum ; unde aliud substantivum regit in Genitivo : ut أَيْ كِتَابٌ qualis liber , مَنْ أَيْ كِتَابٌ ex quo vel quali libro ?

Affixa cum Nominibus significant possessionem , referuntque Pronomina nostra possessiva : cum Verbis ut plurimum Casum patientem ; non raro tamen Dativum , maxime cum Accusativus aliis sequitur : suntque

Pluralia. Dualia. Singularia.

3	2	1	3	2	1	Perf.
كُمْ فَهْ			كَمْ	فَهْ	يَ	Masc.
كُنْ هَنْ			كَنْ	هَنْ	هَا	Com.
						Fœm.

Pro ي, cum Verbis & Particulis terminatis ۚ, est نسي.

Nunquam autem mutantur: nisi quod حُمَّا هَنْ damma in kesra mutant, i. cum immedia-
te præcedit kesra, ut مِنْ مِرِّيٍّ; vel 2. vocali
destitutum, ut فَبَهْ in eo, & عَلَبْيَةْ super eo:
& 3. quod ي loco kesra ante se, habet fatha super
se, cum annexitur dictioni terminatae aliqua lite-
rarum اوي vocali destituta: ut خَطَابْيَةْ pec-
cata, عَلَامَانْ خَطَابْيَانْيَيْ peccata mea, duo
pueri, عَلَامَبْنْ خَطَابْيَانْيَيْ duo pueri mei; duo-
rum puerorum, عَلَامَبْنْ خَطَابْيَانْيَيْ duorum puerorum meo-

rum, مُسْلِمٍ بِنْ fidelium, مُسْلِمٍ بِنْ fideliūm meorum; sic & a مُسْلِمٍ وَنْ est مُسْلِمٍ حَصَابِيٌّ juxta Canon. 5. Ie: عَصَابَيْ baculus, عَصَابَيْ baculus meus; حَامِي sagittarius, حَامِي sagittarius meus, & quod 4. post kesra interdum excidit, quod frequens est in Vocativo: ut مُبِتْ domine mi: & fe-re perpetuum, cum præcedit aliud ي descendens ex hamza; ut أَحِبَّاً amici mei, أَبَاءُ patres mei. Sic pro ذَبِي occurrit ـ؛ ut أَنْصَرُونَ adjuva te me.

Et vocibus nullam inducunt mutationem: nisi quod 1. in Nominibus Nun casuale tollunt, ut supra dictum est: & 2. ad ي insuper ultimam vocalem; ut كِتابِي liber, كِتابِي liber meus: ac ـ 3. fœmininum in ة mutant; ut عَمَّةُ amita, عَمَّةُ amita tua: nec non hamza ultimum 4. in ئ vel ي, juxta Canonem primum Elif. In verbis autem 5. pellunt ـ otiosum post ئ servile; ut نَصَرُوا adjuverunt, نَصَرُوا adjuverunt nos: & 6. termina-tio-

tioni نَصْرَتْمْ adjiciunt و, ut نَصْرَتْمْ adjuvistis,
نَصْرَتْمُوْه adjuvistis eum.

In utrisque autem, tum Nominibus tum Verbis, ie finale post fatha quiescens instar Elif, libere in Elif quiescens mutant vel relinquunt: ut مَرْسِي jecit, فَتَّيْ مَرْسِي & مَرْسِي jecit eum; & فَتَّيْ مَرْسِي & فَتَّيْ مَرْسِي puer, فَتَّيْ مَرْسِي & فَتَّيْ مَرْسِي puer ejus. Nam in Particulis يَابْرِي hoc diphthongescit; ut إِلَيْي ad, إِلَيْي ad eum.

Uni autem Verbo duo interdum annexuntur affixa: ut أَعْطَيْتَنْبَه dedit mibi eum, يَكْفِيْكَنْبَه sufficere fecit tibi illos.

Possunt quoque Affixa separatis verbis apponi, sed præfixo إِيْسَاك ut إِيْسَاي te, إِيْسَاي me, &c. ضَرَبَكَ، atque etiam ضَرَبَكَ verberavit te.

Actiones autem reciprocæ per nomen نَفْسَه cum affixis exprimuntur: ut أَخْبَبْتَ ذَفْسِي dilexi me (quasi dicas, animam meam) أَخْبَبْتَنْمَه Z 3 آنْفَسَكَم

دَلِيْخِسْتِis vos ipso^s, &c. rarissime
per nudum affixum, ut أَحَبُّنِي diligo me.

FINIS LIBRI TERTII.



THO-

THOMÆ ERPENII
GRAMMATICÆ
A R A B I C Æ
LIBER QUARTUS,
 D E
P A R T I C U L I S.

C A P U T P R I M U M.

De Particulis conjunctis.

BARTICULARUM orationis indeclinabiliūm aliæ sunt conjunctæ , quæ perpetuo aliis vocibus præfiguntur ; aliæ separatae : conjunctæ sunt octo literæ

وَ لَمْ وَ مَنْ وَ شَنْ وَ بَنْ

habit fatha, estque nota interrogationis: ut أَمَّاتْ
an obiit? أَنْتَ an tu? أَفِي an in? & vocan-
di articulus; ut أَيْ-وْسَفْ o Joseph, vocat-
que propinquum.

ب

semper possidet kesra, &

1. significat *in*: ut بِالْمَسْجِدِ in templo.
2. notat *instrumentum*: ut كِتْبَةِ بِقَلْمَى scripsi calamo.

3. valet *cum*; quando videlicet subjungitur ver-
bis adventus & discessus, quæ tum per *adduce-
re*, *afferre*, *abducere*, *auferre*, exponuntur: ut
ذَهَبُوا بِالْقَنْتَنِي attulerunt librum; أَتَوْا بِكِتَابٍ
abduxerunt puerum vel juvenem.

4. significat *per*: ut بِأَبِي per patrem meum.
5. valet *propter*: ut بِمَدْخَلِكَ propter introitum tuum.

6. est

6. est jurandi particula: ut بِاللَّهِ per Deum,
بِالْأَرْضِ per terram.

7. Nominativo præfigitur pleonastice: ut أَنْتَ
Deus est in potente, id est, potens; تَعَالَى
ego sum in credente, id est, credens.

8. constructioni verborum peculiariter inservit:
ut مَرَّ بِي præteriit me.

præfigitur nomini أَنْتَ cum fatha, estque jurandi particula: ut بِاللَّهِ per Deum.

eum fatha Futuro præfigitur, & valet post. vi-
de pag. 52.

habet fatha, & significat ac, dein; subjungitque præcedenti id quod re ipsa posterius est, & sequitur, sed sine mora; quo differt a نَمَّ. Initio ta-
Aa men

Tum interiorem re-
adferit conditionem
quemvis præteriit datur
in S. I. t. 1. Ludi de Dieo
in obs. ad V. pp. itaq.
deg. e. in e. g. o. o. ut est
deg. et. exc. v. Sch.
Har. c. 4 p. 40 ut & sch.

men sententiæ , & post dictiones completivas sæpe redundat, & completiva est. Emphasim egregiam importat, & per igitur commode sæpe redatur, cum Imperativo præfigitur. Exempla pañim sunt obvia.

ك

fatha quoque possidet, & significat *sicut*, *in star*, regitque Genitivum, nec admittit affixa: ut كَرْجِين *sicut vir.*

ل

1. est Dativi nostri nota, regitque Genitivum, ac obtinet kesra; ut لِسَرِيْد *domino*: cum affixis tamen habet fatha, ut لَكَ *tibi.*

2. significat *ob*, *propter*, cum kesra: ut ضَرَبْتُ لِكَ ذَبَابَ *verberavi eum ob mendacium ejus.*

3. denotat *ad*: ut ضَرَبْتُ لِإِلَّا تَأْبِيْبَ *verberavi eum ad erudiendum.*

4. juramenti cum admiratione particula: ut لِإِلَّهِ *per Deum!*

5. cum fatha, est vocationis ad opem nota: ut يَا لَزَيْدَه *o Zeide adjuva.*

6. per

6. per pleonasmum eleganter vocibus præfigitur cum fatha, nec mutationem ullam inducit; cum aliibi, tum maxime initio prædicati, cuius subjectum ante se habet إِنَّ اللَّهَ لَغَدِيرٌ ut etenim seu utique Deus est potens إِنَّ اللَّهَ لَغِيَ السَّمَاءُ etenim Deus est in cœlo إِنَّ اللَّهَ لَبِحْتَ وَمِنْ بَنْ namque, eisdem, Deus amat fideles.

7. præfigitur Præterito cum fatha, vertitque id in Optativum. vide Pag. 46. 50.

8. præfigitur Futuro cum kesra, & tunc aut format ex eo Imperativum, inducitque apocopen; aut significat ut, inducitque antithesin. vide pag. 58. & 60.

9. peculiariter inservit Verbis: ut مَرْدَفْ كَتَمْ pro مَرْدَفْ كَتَمْ ejicit vos.

habet fatha, estque

1. Coniunctio copulativa, وَ, etiam; sed non includit ordinem, ut فَ; de quo supra vide sis:

2. jurandi particula, regit Genitivum: ut وَنْ per Dominum.

3. Præpositio æquivalens *cum*, & regit Accusativum: ut جَاءَ الْإِمَّارُ وَالْجَنْدُونُ *venit* Imperator *cum exercitu.*

Appendix.

وَمَ & وَعَ videntur quoque serviles esse in مَنْ
وَمَنْ pro مَنْ & مَنْ مَنْ عَنْ مَنْ.

C A P U T S E C U N D U M.

De Particulis separatis.

PARTICULAS separatas more nostro visim est distingue in Adverbia, Conjunctiones, Präpositiones, & Interjectiones: quæ omnes immutabiles sunt.

Adverbia Loci.

مَنْ حَبْتُ, مَنْ أَيْنَ ubi; & hinc حَبْتُ, أَيْنَ
أَنِي, حَبْتُمَا: quo: إِلَيْ حَبْتُ, إِلَيْ أَيْنَ;
ubicunque: فَاهْنَا & فَهْنَا, هَنْنَا hic;
هَنْتَلِكَ

مِنْ هَنَاءٍ illic; هَنَاءُكَ binc,
إِلَيْ هَنَاءِكَ , إِلَيْ هَنَاءٍ illinc; هَنَاءُكَ مِنْ هَنَاءِكَ
illuc, &c.

Temporis..

قَدْ quando, cum: قَدْ jam, ante; cum
Præterito; interdum cum Futuro, saepe etiam cum
Præter. vacat, aut indicat Præteritum non venire
loco Futuri vel Præsentis, aut emphasin solum ali-
quam importat; ut & فَقَدْ & فَقَدْ un-
quam: إِذَا, إِذْ & تَمَّتْ & تَمْ deinde: حِينَئِذْ, يَوْمَئِذْ & حِبْنَ, يَقْمَ quum: آیَانَ
tunc: مِنْ بَعْدَ مَا, بَعْدَ, إِذْ, لَمَّا
quam: سَيْفَ, سَيْفَ, سَيْفَ post:
بَعْدَ هَذَا antea, قَبْلَ هَذَا posthac,
إِلَيْ أَنْ & حَتَّى أَنْ, حَتَّى إِذَا, حَتَّى nec
nec antea: مِنْ قَبْلَ & قَبْلَ: &
منْ قَبْلَ أَنْ postea; & منْ بَعْدَ antequam.

Vocandi.

propinquum vocat, de quo supra; أَنْ medio-
cri-

criter distans; يَا & مُبَارَّا remotum; يَا آيَهَا & مُبَارَّا omnia: & sequente Articulo, يَا آيَهَا & مُبَارَّا & fœmin. يَا آيَتَهَا & مُبَارَّا.

Demonstrandi.

هَاتِنْدَا, هَافَرْوَدَا, هَرْوَدَا, هَادَا, إِذَا, هَانِدَا, هَانِدَةَ, ecce. fœmin.

Interrogandi.

أَفَلَا, أَلَا, أَمْسَا an, nunquid? دَهْلَى, دَهْلَى, أَوْلَمْ, أَوْلَمْ, أَفْلَمْ, أَفْلَمْ, أَوْلَمْ, أَوْلَمْ an non?

Affirmandi.

إِنْ, أَجْلَى, جَبْرِ, بَأْكِي, دَعْمَهْ, إِي etiam: أَهْبَسْ amen.

Negandi.

لَا non & nè prohibitivum. كَلَّا nequaquam, mini-
me gentium, مَا كَبْسَ, كَمْ non (sed hoc ulti-
mum modo præteriti quoque conjugatur, venitque
pro

pro verbo substantivo negante: ut **لَبْسٌ** *non est*,
كَسْنَتْنِمْ *non estis*, &c.) **إِنْ** idem, sed non nisi
 sequente **إِلَّا** *nisi*; **لَمْ** idem, & *nondum*; **لَنْ**
nequaquam.

Alia.

كَبْنَمَا *quomodo*, **أَنَّيْ**, **كَبْنَفْ**
 cunque, **لَمْ**, & **لِمْ**, *quare*, **فَقْطُ** *solum*,
 semper postponitur, **إِنَّمَا** *solummodo*, *tantum*:
لَعْلَّ *utinam*, o *utinam*: **لَعْلَّ**
 fortasse: **رُبْ** idem, & *interdum*; sed regit Geniti-
 vum, seu Nominativo dat Genitivi terminationem:
إِذْن *age*: **إِذَا** idem, & *utique*: **كَلَّ** *sicuti*:
كَمَا *ac si*: **كَلَّمَا** *quotiescunque.*

Reliqua.

Reliqua Adverbia sere exprimuntur per Accusa-
 tivos Nominum: ut **حَسْنَتْ** *bene*, **شَرًّا** *male*,
جَدَّا *sapienter*, **كَثِيرًا** *multum*, **كَبِيرًا**
vehementer, **خَارِجًا** *foris*, **فَقْيَا** *simul*,
يَعْبُدُ

أَمْسِتَهِ بَعْدًا *eminus*, أَوْلًا *primum*, *bodi*,
أَلَآنَ *cras*; & cum Articulo, أَلْبَقْمَ *bodie*,
nunc. Vel per Genitivum cum præpositione: ut
إِلَيْيِ دَاخِلٍ *desuper*, مِنْ فَوْقٍ *intro*,
مِنْ أَلَآنَ *hactenus*, إِلَيْيِ أَلَآنَ *posthac*, &c.

Conjunctiones.

Copulativæ, sub quibus & disjunctivæ & adver-
sativæ continentur: قَوْنَمْ *deinde*, idem:
كَنْ, بَلْ *vel*, *aut*; أَمْ *an*, *vel*, *أَمْ*
& كَنْ *sed*: لَا non autem.

Causales.

إِنْ *nam*, etenim, utique; أَنْ & أَنَّهُ *quod*;
كَبِمَا, كَبِمَا, كِيْ, كِيْ, حَتَّى, أَنْ *لَآنَ* *quia*;
بِمَا *ne*: كَبِلَا, كَبِلَا, كَبِلَا, أَلَا: *ut*:
كَبِنْ *eo quod*, إِنْ *si*, de Præterito; كَفْ *idem*,
وَيَانْ *nisi*: هَلَا & إِلَا, كَفْ لَا, كَوْمَا, وَكْ،
وَكْ،

وَلْفَنْ مِنْ شَمْ وَبَمَا et si, quamvis, propterea.

Completivæ.

أَمَّا، قَاتَّا، وَأَمَّا، إِنَّا، أَنَّ، إِنَّ، أَمَّا &c. autem.

Præpositiones.

مِنْ *a*, *ab*, *ex*, *de*, & sœpè pleonastice nominis apponitur. حَتَّى *ad*, *cum*: حَتَّى *usque ad*, *donec*; *cum*, فِي *in*, *super*, *de*, مِنْ *a*, *de*: عَلَى *super*, *de*, لَدَيْ *أَنْدَنْ*, & interdum لَدْ *أَنْدَنْ*, لَدْ *أَنْدَنْ*, كَدْ *أَنْدَنْ*, كَدْ *أَنْدَنْ*, apud; مِنْ *a*: مِنْ *أَنْدَنْ* & مِنْ *أَنْدَنْ* *inde a*, de tempore, حَاسَّا, عَدَا, خَلَا, *præter*. Quæ omnia admittunt affixa, præter حَتَّى, مِنْ & مِنْ.

Reliquæ autem Præpositiones, exprimuntur per nomina substantiva adverbialiter posita, id est, in casu Accusativo, sed abjiciente Nun vocale ob regimen, ut فَوْقَ supra *تَحْتَ* *infra*, قَبْلَ ante, قَدَمْ ante, أَمَّامْ coram, عَنْ apud, مَعْ cum; & دُونْ *præter*, & *infra* de numero, & non autem subintellecta simul præpositione, si qua præ-

cessit, بَدَلَ *trans*, حَوْلَ *circa*, بَيْنَ *inter*, خَلْفَ *versus*; & si quæ similia: quo pertinent غَيْرَ & سَوَاءٌ سُوَيْ *præter*: quæ tamen interdum variant terminationem; ut dicetur libro sequente, vel per Genitivum præcedente Præpositione: ut مِنْ فَوْقِ *superne*, مِنْ أَجْلِ *post*, مِنْ دُونِ *præter*, مِنْ بَغْدَادِ *propter*, لِأَجْلِ, idem, &c.

Interjectiones.

Has docebit facile usus, قَيْلٌ autem *væ* Nomen est; & cum Articulo الْقَيْلُ dicitur: regitque Genitivum cum لـ.

Appendix.

كَذَا & كَائِنْ كَمْ ac كَائِنْ quot, & نَسَالٌ هَاتْ غَاقْ crocitatio: da, offer; هَاتْ descendere. tot, Nomina quidem videntur potius esse quam Particulæ: sed tamen Particularum more immutabilia sunt, quod & Nominibus, sonitus animaliumque voces significantibus, & paucis etiam aliis Præteriti aut Imperativi valorem obtinentibus contingit: ut

F I N I S L I B R I Q U A R T I .

THO.

THOMÆ ERPENII
GRAMMATICÆ
ARABICÆ
LIBER QUINTUS.
 DE
SYNTAXI.

CAPUT PRIMUM.

De Syntaxi Nominum.

 **O**NCORDIA Substantivi cum Adjectivo, Relativi cum Antecedente, ac Nomina-
tivi cum Verbo eadem hic quæ in aliis linguis. Solum observandum est.

I. Plurale inhumanum (sic voco quod non significat homines) eleganter construi modo singularis

Bb 2

fœ-

Sube hunc glosseum
Ellipsis, & ea non
facile indicari potest
v. Schr. ad Tab. p 76n

جَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتَهَا أَلَانَهَامُ
 Itaee phrasis spig. fœminini: ut تَجْرِي مِنْ تَحْتَهَا أَلَانَهَامُ
 occidit in descriptione Pro descrittione
 horti sub quibus currunt fluvii: ubi singularia fœ-
 malium etiam se
 minina هَا & جَنَّاتٌ تَجْرِي
 eunt variis flue
 ruz irrigari, regna & جَنَّاتٌ أَلَانَهَامُ pluralibus inhumanis.
 et Qamolnifring.

2. Plurali humano eleganter quoque præponi
 Verbum singulare, eodem fere genere in Præte-
 rito, sed non raro discrepante in Futuro: ut
 يَعْوَلُ الْكَمَاءَ dixerunt homines, قَالَ الْنَّاسُ
 & تَقُولُ dicunt sapientes, si Verbum postponatur,
 omnia sunt regularia: ut الْنَّاسُ قَالُوا وَيَقُولُونَ
 homines dixerunt & dicent.

Idem de Duali habendum.

3. Adjectivum appositum Vocativo vel Nomi-
 ni affecto a vocula يُ cum Substantivo suo, inter-
 dum non convenire casu.

Cæterum Adjectivum & Substantivum eandem
 partem enuntiationis constituentia hic etiam in re-
 strictione & absentia ejus convenient, id est, si ut-
 rumque pertinet ad subjectum, aut ad prædicatum,
 ac unum restrictum est, necesse est etiam alterum
 restringi: ut كِتَابُ الْعَظِيمُ & كِتَابُ عَظِيمٍ

liber magnus, إِبْرَاهِيمُ الْأَمِينُ, Abraham fidelis,

أَبْرَاهِيمُ

أَبْيَ الْكَوْكَرْمُ أَنْسَلْ إِلَيْهِ هَذِهِ الْرِسْالَةُ

Pater meus reverendus misit ad me hanc epistolam.
Si vero non constituant illa eandem partem enun-
tiationis, id non obtinet: ut **اللهُ قَدِيرٌ** Deus
est potens, **فَهَذَا كِتَابٌ** bic est liber.

At Substantivum Appellativum cum adjuncto Ad-
jectivo nomen Proprium constituens Articulum ab-
jicit: ut **بَيْتُ الْمَقْدَسِ** *domus sanctificata*,
id est, *Hierosolyma*; **بَابُ الْمَصْفَرِ** *por-
ta parva*, Nomen portæ Damascenæ.

Substantivum cum Substantivo genitivo casu jun-
gitur: ut **يَدُ الْأَذْنَانِ** *manus hominis*:
بْنُ مَرْيَمٍ *filius Mariæ*. Sic quoque
كَاسَهُ بِهِ *cyathus auri*, id est, *aureus*.

Item **كُلُّ إِنْسَانٍ** *universitas hominis*, id
est, *omnis homo*, vel *omnes homines*, nam **كُلُّ**
est Substantivum.

Exceptio.

Sed nomen mensuræ & ponderis regit mensura-
tum & ponderatum in Accusativo: ut **فَبِزْ**
شَعِيرًا *Bb 3*

مُدْيُسْ modius, vel potius *bemimedimnus hor-*
dei; طَنْطَلْ libra olivarum.

O B S E R V A T I O I.

Quædam Substantiva assumpto affixo cum præcedente Substantivo congruente adjectiva quodammodo fiunt, & constructionem eorum imitantur:

عَنْفَسْ anima, cum affixo alii Substantivo appositum valeat idem quod *ipse*, *ipsa*, *ipsum*; &
كُلْ univeritas, idem quod *totus*, *tota*, *totum*:
conveniuntque cum præcedente Substantivo, ut
خَبِيبَ نَفْسَهُ amicus *ipse*, quasi dicas, a-
amicus *anima ejus*, خَبِيبَ نَفْسَهُ a-
amicum *ipsum*, خَبِيزَ كُلِّ panis *totus*,
خَبِيزَ كُلِّ panis *totius*, &c.

O B S E R V A T I O II.

Numeri cardinales ratione regiminis substantiva sunt, unde a tribus ad decem, & qui supra 99 sunt, regunt numeratum in genitivo, more reliquorum Substantivorum; sed minor denario Plurale cupit, centenarius & major eo, Singulare:

re: ut **تَّلَاتْ جَمِيلَاتْ** *tres puellæ*;
 مِائَةُ رَجُلٍ **أَلْبَعَةُ رِجَالٍ** *quatuor viri*;
أَلْفُ دِينَارٍ *centum denarii*, reli-
 qui a decem ad centum, ut Substantiva ponderis
 & mensuræ, regunt numeratum in Accusativo sin-
 gulari: **حَمْسَةُ عَشَرَ دِرْهَمًا** *quindecim*
دِرَّا *drachmæ*, **عَشْرُونَ دِيَنْبَارًا** *viginti lupi*, &c.
 Quam constructionem sequuntur, **كَمْ كَأْيِنْ**,
 & **كَذَا**: ut **كَمْ دِرْهَمًا** *quot drachmæ?*
كَأْيِنْ رَجُلًا *quot viri?* quæ cum Præposi-
 tione regunt genitivum: ut **كَمْ دِرْهَمٌ** *quot*
دِرَّا *drachmis?* **كَأْيِنْ مِنْ رَجُلٍ** *quot viri?* At
 ratione convenientiæ Adjectiva sunt, & Masculina
 Masculinis, Fœminina Fœmininis, Communia
 utrisque apponuntur, ut patet in exemplis alla-
 tis. Interdum etiam Substantivis postponuntur
 more reliquorum Adjectivorum.

C A P U T S E C U N D U M.

De Syntaxi Verborum.

VERBA Substantiva & Nuncupandi, ut كَانَ
fuit, صَانِعٌ factus est, كَبِيسْ non est,
مَادِيَّا quamdiu fuit vel mansit, & alia similia,
quæ esse vel fieri significant aut includunt, quæque
apud Latinos ante & post se Nominativum adsciscen-
tunt, hic pro secundo Nominativo, qui scilicet
exprimit prædicatum, assumunt Accusativum: ut
الْكَلَّةُ كَانَ قَدِيرًا Deus est potens;
الْزَيْدُ صَانِعٌ كَنْبِيسْ Zeydus factus est dives;
ابْنُ مُحَمَّدٍ يُسَمَّى مَكْمَدًا filius ejus vocatur
Muhammed, &c. quod & interdum accidit omisso
illo Verbo Substantivo; cum subjectum habet an-
te se مَا vel لَا non.

Verba Activa pleraque Accusativum regunt: plu-
rima Genitivum, mediante Præpositione بِ, لِ,
إِلَيْ, مِنْ, فِي, عَلَيْ, عَنْ: quod usu dis-
cendum, & ex Dictionariis.

Verba quædam usque adeo tenacia sunt Præposi-
tio-

tionum, ut eas etiam non sequente Nomine exigant; ut آنْ أَفَدِي عَلَيْ لَا أَفَدِي آنْ أَفَوْلَ non possum super ut dicam, id est, nequeo dicere.

Instrumentum per Genitiv. præfixo ب effertur. Motus ad rem, cum إِلَيْ & فِي; a re, cum مَنْ & عَنْ. Sed nota, Verba veniendi etiam per ellipsis Præpositionis إِلَيْ cum Accusativo eleganter construi: ut جَاءَنِي أَتَبْتَكَ venit ad me, جَاءَكَ أَتَبْتَ أَنِي veni ad te; pro جَاءَ إِلَيْ.

Ad quando & quamdiu respondetur per Accusativum; ad quanto tempore, per Genitivum, præmisso فِي.

Gerundium in *do*, seu Participium quomodo res geratur explicans, per Accusativ. Participii Activi effertur: ut جَاءَ رَاكِبًا venit equitans, seu equitando, يَكُلُّ وَاقْفًا edit stans, صَرَخَ نَائِمًا vociferatur dormiens.

Gerundium in *dum*, vel, ut verbo dicam, finis, per Accusativ. Nominis verbalis exprimitur: ut ضَرَبَنَتْ تَأْدِي سَبَقًا verberavi

*Conscriptio haec ost
er ellipsis verbis bsto
tivi, q. cum locut. pre
dicatis glosatis p. 208 v.
Sch. ad Tab. 4 locum p. 5
in fine x 94 in initio
notata Statuta habi
rei Sch. F. 6 p. 103.*

eum ad erudiendum, id est, ut erudirem eum.

Quod Latini ponunt post quoad vel ratione, respectu, id per nudum Accusativ. hic effertur: ut

طَسَابُ إِسْكَافٍ نَفْسًا
bonus est Isaac quoad animam; لا مَا تَيْسِعُ إِلَاهِيَّةً بِلْ مَا تَاسِوْتَا

Non mortuus est Jesus ratione naturæ divinæ, sed mortuus est ratione naturæ humanae.

Infinitivus Verbo suo, aut alii ejusdem notionis, significationis augendæ causa appositus, est casus Accusativi; ut صَرْبَتَهُ صَرْبَةً verberavi eum verberando; قَمْتُ وَقْوَفًا steti stando.

Atque in his omnibus Accusativi terminatio adverbiale significationem nomini videtur inducere.

Pro Infinitivo autem nostro adhibetur verbale: ut أَقْدِمْ عَكَيْ الْخَرْبَ cupio verberationem, id est, verberare, vel cum Præposit. أَنْ non possum verberare: aut Futurum præposito أَنْ, ut أَرِيدْ أَنْ أَسْمَعْ cupio audire.

Sed verba Notitiae & Opinionis eleganter adsciscant duplē Accusativum: ut ظَنَنْتُ أَبَاكَ حَنْبَلَ opinor patrem tuum esse divitem, عَلِمْتُ زَيْدًا بَخْبِلًا scio Zeydum avarum esse.

CAPUT TERTIUM.

De Syntaxi Particularum.

CONJUNCTIONES copulativæ similes casus con-jungunt: secus tamen interdum accidit, cum Nomen præcedens est Vocativus; aut Nominativus cum Accusativi terminatione: qua de re alias.

Præpositiones omnes tum conjunctæ tum separatae regunt Genitivum: *بِبَنْتٍ in domo*, *فِي بَنْتٍ* Rābīq revera et una Etantra, q̄tūq̄ aliter genitivo casu jungit, v. Schol. à vīce عَلَى; *بِالْمَائِدَةِ sub mensa*, *بِاللَّهِ idem: تَحْتَ مَائِدَةً Deo*, *بِاللهِ* &c. Sed exceptivæ, *عَدَا*, *حَلَا*, *حَاشَا*, sæpe quoque Accusat. regunt; ut *قَامَ الْقَوْمُ حَلَا نَرِيدَ* & *نَرِيدَ stat populus præter Zeydum*, *لَا* autem, cum oratio est affirmans, regit Accusativum, ut *غُرْفَةُ النَّاسِ إِلَّا نَوْحَةً* *submersi sunt homines præter Noachum*, si negans, & nomen unde fit exceptio subtileatur, exceptum Nominis sub intellecti casum accipit: ut *مَا قَامَ إِلَّا نَرِيدَ non stat* (scilicet, *quisquam nisi Zeidus*, *مَا رَأَيْتُ إِلَّا نَوْحَةً* *nisi Noachum*, si vero exprimatur illud nomen, exceptum indifferenter aut ejusdem cum illo

casus est, aut Accusativi: ut **مَا قَامَ أَحَدٌ إِلَّا نُفِخَ**
 & **لَا وَحْدَةٌ** non stat quisquam præter Noachum,
أَوْ بَرْ autem سَوْيٌ & سَوْرًا, regulari-
 ter perpetuo regunt Genitivum; sed ipſæ termina-
 tionem mutant eo modo quo exceptum per **لَا**: nam
 in affirmatione terminantur fatha; in negatione, ea
 vocali qua nomen præcedens, aut fatha, si nomen
 illud exprimatur: ut **خَرَجَ الْقَوْمُ غَيْرَ زَيْدٍ**
مَا خَرَجَ egressus est populus præter Zeidum, **مَا خَرَجَ**
غَيْرَ زَيْدٍ non est egressus nisi Zeidus; & in nega-
 tione, **لَا ضَرَبَتْ** **غَيْرَ زَيْدٍ** non verberavi
نِسْلَانَ **غَيْرَ زَيْدٍ** nisi Zeidum, **مَا خَرَجَ**
 & **غَيْرَ زَيْدٍ** non est egressus quisquam præter
 Zeydum, &c. Observa autem per hanc voculam
غَيْرَ solere exprimi nostra composita per *in*: ut
غَيْرَ مُكَمَّلٌ *imperfectus*, **غَيْرَ مُكَمِّلٌ**
imperfecta.

F I N I S

GRAMMATICÆ ARABICÆ.

olli illi cum debet cum debet cum debet

-80

امثال

امان

وَبِعُضِ افْوَالِ الْعَرَبِ

F A B U L A
LOKMANI SAPIENTIS.

E T Q U A E D A M D I C T A

A R A B U M.

CUM INTERPRETATIONE LATINA

THOMÆ ERPENII,

EJUSDEMQUE NOTULIS ET STRICTURIS

J A C O B I G O L I I.

أَمْ بَلْ أَنَّ

لَقُولَةٌ مَّا لَكَ لِتَرَى

فَلَمَّا دَعَاهُمْ بِهِمْ بِرَبِّهِمْ

أَسْدٌ وَّفِرَانٌ هـ

مَرَّةٌ خَرَجَ عَلَيَّ نَوْرَيْنِ فَاتَّجَتْمَعَا
 جَمِيعًا وَكَانَا يَنْسَطُحَانِ بِعَرْوَذِهِمَا
 وَلَا يُمْكِنُهُ مِنَ الْبَدْخُولِ بَيْنَهُمَا
 فَانْفَرَدَ يَأْخُذُهُمَا وَيَخْدُعُهُمَا وَأَوْعَدُهُمَا إِلَّا يُعَارِضُهُمَا
 فَإِنْ يَتَّخَلِي أَحَدُهُمَا عَنْ صَاحِبِهِ فَتَخَلَّي
 أَحَدُهُمَا وَاقْتَرَسَهُمَا جَمِيعًا هـ

أَسْدٌ

هَذَا مَغْنَاهُ هـ

أَنَّ مَدِينَتَيْنِ إِذَا لَتَّفَقُوا عَلَيْ رَاعِي وَاحِدٍ أَهْلُهُمَا فَإِنَّهُ
 لَا تُمْكِنُ مِنْهُمَا عَدْوَاتٌ فَإِذَا آفَنَرَقَا هَذِكَا جَمِيعًا هـ

كُنْزَالٌ هـ

F A B U L A E

LOKMANI SAPIENTIS.

LOKMANI SAPIENTIS.

I.

LEO ET DUO TAURI.

LE O aliquando egressus est contra duos Tauros , qui simul congregati cornibus suis feriebant , ita ut ingredi inter eos non posset : unde desiit eos invadere & petere , promisit que eis se non adversaturum eis , etiam si recederet alter a socio suo. Recessitque alter: atque ille simul dilaceravit utrumque.

Significat hoc,

Duabus civitatibus , cum cives earum consilio convenient , prævalere non posse inimicitias ; at discordes si sint , simul eas perire.

CER-

غَرَّالٌ هـ

إِبْلٌ يُعْنِي غَرَّالٌ مَرَّةً حَطَّاشٌ فَسَاتِي إِلَيْيِ عَجْمَنِ مَاءٌ
يَشَرِّبُ فَنَظَرَ خَبَالَهُ فِي الْأَمَاءِ فَحَسِنَ لِدَقَّةٍ قَوَابِدِهِ
وَسَرَّ وَأَبْتَهَ حَجَّ لِعَظِيمٍ قُرْوِينَ وَكَبِيرَهَا وَفِي الْحَالِ
خَرَجَ عَلَيْهِ الْصَّبَادُونَ فَمَاهِزَمَ مِنْهُمْ فَامَّا هُنَّ فِي
السَّهْلِ فَلَمْ يَدْرِكُوهُ فَلَمَّا دَخَلُوا فِي الْجَبَلِ وَعَبَرُ
بَيْنَ الشَّجَرِ فَدَكَّتْهُو الْصَّبَادُونَ وَقَنَاسُوْهُ فَقَالَ
عِنْدَ مَوْتِهِ الْوَيْلُ لِي أَنَا الْمَسْكِنُ الَّذِي لَنْدَرَيْتُ
فِيهِ هُوَ خَلَصَنِي وَالَّذِي رَجَوْتُهُ أَهْلَكَنِي هـ

غَرَّالٌ هـ

N O T A E A D F A B . I .

Aliquando] Arabice semel, una vice: *ut nos dimus eens, een reise, une fois.*

Petere] *Verbum non solum fallere significat; sed etiam insistere, rei alicui incumbere, & operam dare, quæ notio hujus loci esse videtur.* * *Malim legere, فانغرد يياخذ بخدعهمـا recessit abstititque, & eos petere cœpit fraude.*

Cer-

II.

C E R V U S.

CERVUS cum aliquando sitiret, ad aquæ venit fontem ut biberet, vidiisque imaginem sui in aqua, ac tristatus est ob pendulum suorum gracilitatem. Gavisus vero est & superbivit cornuum magnitudine & excellentia. Ac statim egressi contra eum sunt Venatores, a quibus fugit: cum autem in planicie esset, non assequuti sunt eum: at cum montem deinde ingressus esset, & inter arbores transiret, ceperunt eum venatores, atque occiderunt. Dixitque moritus: Væ mihi misero, quod me servavit, id vilipendi; in eo confisus sum quod me perdidit.

III.

N O T A E A D F A B . II.

Cervus] *Textus habet*, ajul, (*potius ijjel & ojjel*) *id est*, Cervus. *Explicatur vox obscurior*, & a. pud Hebraeos quam Arabes usitatio[n] يَلْبَسُ per notiorem يَرْبَلْ: sic fabella XIII. Bauda, *id est*, culex.

Ut biberet] يَلْبَسُ, *id est*, ut, hic & frequenter alibi in hac constructione omittitur.

Dd

كَرَالٌ هـ

كَرَالٌ مَرْأَةٌ مَرِضَ فَكَانَ أَصْحَابُهُ مِنَ الْوَحْشِ
يُتَّقِي إِلَيْهِ وَيُوَدِّعُهُ (وَيَغُودُهُ) فَيَرْعَي مَا حَوْكَهُ مِنْ
الْحَشَبِشِ وَالْعَشَبِ فَلَمَّا فَاقَ مِنْ مَرْضِهِ أَتَاهُمْ شَبَّاً
لِبَكَلَةٍ فَلَمْ يَجِدْ فِهْلَكَ جَوْعًا فـ

هَذَا مَعْنَى سَاهٌ هـ

مِنْ كَثْرَ الْهَلَكَةِ كَثُرَتْ أَحْرَافُهُ فـ

أَسَدٌ وَمَغَابَةٌ

أَسَدٌ مَرْأَةٌ أَشْتَوَّ عَلَيْهِ حَرُّ الْشَّمْسِ فَدَخَلَ إِلَيْيِ
بَعْضِ الْمَغَابِيرِ يَتَظَلَّلُ بِهَا فَلَمَّا رَدَضَ أَنْتِي إِلَيْهِ
حِرَادُونَ يَمْشِي عَلَيِ ظَهِيرَةٍ فَوَتَّبَ قَبَائِيمًا فَنَظَرَ
يَمْبِنَا

N O T A E A D F A B . III.

Convaluisse] *Arabice est: cum a morbo suo sur-*
re-

III.

C E R V U S.

CERVUS aliquando cum ægrotaret, ad eum
venerunt socii ejus de feris, & custodi-
verunt eum, (*& visitarunt eum,*) graminaque &
herbas quæ circum eum erant absumpserunt: is
autem cum convalescet, quæsivit quod ederet,
nec invenit quicquam; unde periit fame.

Hoc significat,

Multiplicari dolores ejus, cuius familia
multiplicatur,

IV.

L E O E T V U L P E S.

LEO aliquando cum molestus ei esset ca-
lor solis, ingressus est speluncam quan-
dam, umbram in ea captans. Postquam
autem procubuit, venit ad eum stellio,
ambulans super dorso ejus: unde subsiliit
sur-

N O T A E A D F A B . III.

rexisset. Qui modus loquendi & Belgis est familiaris.

D d 2

يَمِنْنَا وَيَسَارُهُ وَهُوَ خَائِفٌ مَرْعُوبٌ فَمُتَظَرَّهُ الْمُتَعَابُ
 فَتَضَحَّكُ عَلَيْهِ فَقَالَ لَهُ أَلَّا سَدَ لَبِسَ مِنَ الْجِرَدَوْنِ
 خَوْفِي إِنَّمَا أَكِبَرُ عَلَيَّ أَحْتِقَامِي هَذَا مَغْنَأَهُ
 أَنَّ اللَّهَ وَأَنَّ عَلَيَّ الْعَاقِلُ أَشَدُ مِنَ الْمُؤْتَهِ

أَشَدُ وَذَوْرُهُ هَذِهِ
 أَشَدُ مَرَّةً لَمَرَادِ يَقْتَرِسَ ثُورًا فَلَمْ يَجْسُرْ عَلَيْهِ لِشَدَّتِهِ
 فَمَضَى إِلَيْهِ لِيَحْتَالَ عَلَيْهِ قَابِلًا إِعْلَمُ أَنَّنِي قَدْ دَبَحْتَ
 حَرْقًا فَا سَمِنْنَا أَشْنَهِي أَنَّ تَأْكُلَ عِنْدِي فِي هَذِهِ الْلَّيْلَةِ
 كُبِرًا

NOTÆ AD FAB. IV.

In speluncam quandam] *Arabice in quandam speluncarum. Observent autem studiosi, vocem بعض, que collective passim accipitur, & quosdam, non-nulos, partem significat, etiam singulariter interdum sumi pro نوع احادي, sine ullo tamen generis respectu; ut hic في locis aliquot aliis in hoc opusculo.*

*أكبَرُ

surgendo, & prospexit dextrorum, ac sinistrorum, timens & perterritus: viditque eum & irrisit Vulpes, cui dixit Leo: Non metuo a stellione, sed graviter fero contemni me.

Hoc significat,

Despectionem sapienti ipsa morte graviorem esse.

v.

LEO ET TAURUS.

LEO aliquando cum vellet dilacerare Taurum, nihil contra eum est ausus, ob robur ejus; abiitque ut deciperet eum, dicens: Scito me agnum pinguem maestavisse: cupio ut hac nocte cibum apud me su-

NOTÆ AD FAB. IV.

* اَكْبَرْ [graviter fero] seu indignor. *Est autem proprieٰتِ اَكْبَرْ، dicere، اَكْبَرْ اَللّٰهُ اَكْبَرْ،* Allaho Acbar: quam formulam in الصلاة preicatione sacra usurpare solent; nec non extra Dei cultum, in percussi animi admiratione, indignatione, & metu.

خَبِيرًا فَأَجَابَهُ إِلَيْهِ ذَلِكَ فَلَمَّا وَصَلَ إِلَيْهِ الْمَوْضِعُ وَنَظَرَ إِلَيْهِ أَذَا
قَدْ لَسْتَعَدْ أَلْأَسْدَ حَطَبًا حَكِيرًا وَخَلَاقِينَ كَبَارًا فَوَلَيَ
الْتَّوْرُ هَارِبًا فَلَمَّا عَانَ ذَلِكَ قَالَ لَهُ الْأَسْدُ لِمَادَا
وَلَبَثَ بَعْدَ مَحِبِّكَ إِلَيْهَا هَاهُنَا قَالَ لَهُ التَّوْرُ لَأَنِي حَلَمْتُ
أَنَّ هَذَا الْأَسْتِغْدَادَ لِمَا هُوَ أَكْبَرُ مِنْ الْحَرْفِ فَفَجَّ

هَذَا مَفْنَاهُ

أَنَّ مَا سَبَبَلْ الْعَاقِلُ أَنَّ يَصِدِّقَ عَدُوَّهُ
وَلَا يَسْأَسَ إِلَيْهِ

أَسْدٌ

NOTÆ AD FAB. V.

Cibum] *Arabice est panem: sed edere panem Arabibus est cibum sumere.*

Promisit] *Arabice, respondit ei ad hoc, id est annuit, non recusavit. Phrasis elegans, & passim obvia.*

Ollas] *Arabibus خلاقين quam ego vocem alibi non memini me legere, unde nec satis certo scio quid significet: sed suspicor id esse quod dixi.**

Uti-

sumas. Quod is facturum se promisit. Ut autem ad locum pervenit, eumque vidit, ecce, præparaverat Leo ligna multa, & ollas magnas: abiitque Taurus fugiens: quod ut vidit Leo, dixit ei: Cur abis postquam huc advenisti? Respondit Taurus. Quia scio hunc apparatum esse rei alicui majori agno.

Hoc significat,

Non oportere sapientem credere inimico suo, aut associari (seu potius familiarem esse) illi.

VI.

NOTE A D F A B . V.

Utique singulare ejus est خلقیں Chalkinon, *nempe Græcum* χαλκεῖον, ahenum.

Oportere] *Arabice*, non esse semitam sapientis.

Associetur] انس est socium esse, associari, unde انسان inson, انسانان insanon, و انسی انسی insion, hominem significant, quod animal sit sociabile. * *Hic potius familiarem esse reddi posset.*

أَسْدٌ وَمَغَابِبُه

أَسْدٌ مَرَّةٌ شَاحِنٌ وَضَعِيفٌ وَلَمْ يَقْدِمْ عَلَيْيَ شَيْءٍ
 مِنْ الْوَحْوشِ فَلَمَرَادٌ أَنْ يَحْتَالَ لِنَفْسِهِ فِي
 الْمَعِيشَةِ فَنَتَمَارِضُ وَالْقَيْ نَفْسَهُ فِي بَعْضِ
 الْمَغَابِرِ وَكَانَ كَلَّا أَثَاءَ شَيْءٍ مِنْ الْوَحْوشِ
 لِبُودَعَةِ (بِعُودَةِ) أَفْتَرَسَهُ دَاخِلَ الْمَعَانِي وَأَكَلَهُ فَاتَّيَ
 الْتَّعَلَّبَ إِلَيْهِ فَوَقَفَ عَلَيْيَ بَابَ الْمَعَانِي مُسْلِمًا
 عَلَيْهِ قَائِلًا لَهُ كَبِفَ حَالَكَ يَا سَيِّدَ
 الْوَحْوشِ

N O T A E A D F A B . VI.

* *Hoc in Conjug. II. notat valedicere, et in Conjug. IV. depositum relinquere custodiendum: quorum neutrum hic quadrat. Itaque levi facta metathesi legendum puto, يَعُودُ، vilifat ret ægrotantem.*

Pater bonitatis vel pulchritudinis.] *Arabismus, in quo بَ يenit pro ذَي.*

Omnino legendum حَصَبِين munitiunculae. Dimin.

ab

VI.

LEO ET VULPES.

LEO aliquando cum senuisset & debilis factus esset, nec prævalerer ulli fera-^{Ad verbis non rei exter-}rum, voluit sibi dolo acquirere victimum, & morbum simulans, se in speluncam quandam abjecit. Accidit autem ut quotiescumque ac-^{pp. abjectus est. Spelunca in-}cederet ad eum ferarum aliqua ipsum cu-^{sectionem. Spelunca non}stoditura, (*visitatura*,) eam in specu dilacera-^{pp. oī via quā reddipōe.}ret, & devoraret. Venitque ad eum Vul-^{P. oppositōe vix pp. utt.}pes, & substitit ad ostium speluncæ, ac sa-^{complēxū eīg quod.}lutavit eum, dicens: Qualis est status tuus o princeps ferarum ? Dixitque ~~ein~~ Leo :

Quam-

NOTÆ AD FAB. VI.

ابن المصطفى حضن ab mumentum: Ita Gjeub. ^{ابن المصطفى} كثرة عن التعلب pater munitiunculae est periphrasis vulpecula. Utitur Hariri Conf. 49. مكـر ابـي حـصـبـن Astutia patris munitiunculae. Nempe latibula sua callidissime communire solet.

Considerem ego in hoc] id est, crederem bonis verbis tuis, nisi, &c. est enim تـعـقـيـل inniti, confidere. * vel minime veritus eram id facere.

E e

الْوَحْشَ فَقَالَ لَهُ أَلْأَسَدُ لِمَاذَا لَا تَدْخُلُ يَأْبَى
أَبْنَى الْحُسْنَ (الْحَصَبِينَ) فَقَالَ لَهُ التَّعْلِبُ يَا سَيِّدَ قَدْ
كَنْتَ حَوَّلْتَ عَلَيَّ ذَلِكَ غَيْرَ لَفْظِي أَمْ رَا عِنْدَكَ آثَارَ أَقْدَامِ
كَنْبِرَةٍ قَدْ دَخَلُوا وَلَا أَمْرًا أَنْ خَرَجَ مِنْهُمْ وَلَا وَاحِدٌ

هَذَا مَعْنَىٰ ۖ

أَنَّ مَا سَبَيلَ الْإِنْسَانِ أَنْ يَهْجُمَ عَلَيَّ أَمْرٌ إِلَّا حَتَّىٰ يَهْزِئَهُ بِهِ
أَسَدٌ فِي إِنْسَانٍ ۖ

أَسَدٌ مُّرَّةٌ وَجَدَ إِنْسَانًا عَلَيَّ الْطَّرِيقِ فَجَعَلَاهُ يَتَشَاجِرُونَ
بِالْكَلَامِ عَلَيَّ الْقَوْقَةِ وَشِدَّةِ الْبَأْسِ أَلْأَسَدُ يَطْبَبُ فِي
شَدَّدَةِ وَبَأْسِهِ فَنَظَرَ إِلَيْهِ عَلَيَّ حَائِطٌ صُورَةُ رَجُلٍ
وَهُوَ يَحْنَقُ أَلْأَسَدَ فَصَحَّكَ إِلَيْهِ أَنْسَانٌ فَقَالَ لَهُ أَلْأَسَدُ
لَقْ

NOTÆ AD FAB. VII.

Cœperunt] *Verbum* جَعَلَ *bic* في linea sequenti
servile est, ut *verbum* كَانَ *sic* passim alibi.

Fi-

Quamobrem non ingrederis o Pater pulchritudinis (*munitiuncula?*) Respondit Vulpes: Considerem ego in hoc, domine, nisi viderem apud te vestigia multorum pedum, qui ingressi sunt, quorum ne unum quidem video egressum esse.

Hoc significat,

Non oportere hominem rem aliquam aggredi, antequam probe eam perpenderit.

VII.

L E O E T H O M O.

LEO aliquando invenit hominem in via, cœperuntque velitari inter se sermone de virtute & roboris vehementia. Leo quidem suam laudabat virtutem & robur. At homo vidit in pariete figuram hominis strangulantis leonem, ac risit. Leo vero ei dixit:

N O T A E A D F A B . VII.

Filii hominis] seu filii Adami, id est homines, phrasis est Arabibus etiam valde usitata.

أَلْيُوكَانَ السِّبَاعُ مُصَوِّرٌ بَيْنَ مِثْلِ دَنِيِّ آدَمَ لَمْ يَعْدِمْ الْإِنْسَانَ
يَخْتَنِفُ سَبْعًا بَلْ كَانَ السِّبَاعُ يَخْتَنِفُ الْإِنْسَانَ هَذَا
هَذَا مَقْنَاهُ هَذَا مَقْنَاهُ هَذَا مَقْنَاهُ هَذَا مَقْنَاهُ هَذَا مَقْنَاهُ
أَنَّ مَا يُرَكِّي الْإِنْسَانَ بِشَهَادَةِ أَهْلِ بَيْتِهِ هَذَا مَقْنَاهُ

غَرَّالْ وَأَسَدٌ هَذَا مَقْنَاهُ

غَرَّالْ مَرَّةٌ مِنْ خَوْفِهِ مِنْ الصَّبَادِيْنَ أَنْهَ زَمَّ إِنْيِي
مَعَارِةٌ قَدْ خَلَ إِلَيْهِ أَلَّا سَدَ فَاقْتَرَسَهُ فَقَالَ فِي نَفْسِهِ
الْأَوَّلِيْلِ لِي أَنَا أَشْقِي لَأَنِّي هَرَبْتُ مِنْ النَّاسِ
وَقَعْدَتُ فِي يَدِ مَنْ هُوَ أَشَدُ مِنْهُمْ بَاسِا هَذَا مَقْنَاهُ هَذَا مَقْنَاهُ
مَنْ يَغْرِي مِنْ خَوْفِ كِيسِيْرِيْ يَقْعُ فِي بَلَاءِ عَظِيْبِيْمِ هَذَا مَقْنَاهُ
غَرَّالْ

NOTÆ AD FAB. VIII.

Secum] Arabice in anima sua, id est, apud se.

xit: Si leones pictores essent, ut filii hominis, non posset homo strangulare leonem, sed leo strangularet hominem.

Hoc significat,

Non justificari quemquam testimonio domesticorum suorum.

VIII.

CERVUS ET LEO.

CERVUS (vel dorcus) aliquando timens sibi a venatoribus fugit in antrum, ingressusque ad eum est Leo, ac dilaceravit eum, dixitque secum: Væ mihi miserō, qui ab hominibus fugi, & incidi in manum ejus qui vehementior illis est robore.

Hoc significat,

Eum, qui fugit præ timore parvo, incidere in infortunium magnum.

IX.

NOTÆ AD FAB VIII.

Manum] *id est*, potestatem: *ut in aliis linguis.*

خَرَالْ وَنَفَلَبْ ه

عَزَالْ مَرَّةً عَطَشَ فِي جَاهَ إِلَيْهِ عَبْسِنْ مَاءَ يَشَرِبُ
 وَكَانَ الْمَاءُ فِي حَبْتِ عَمْبَقِ قُمَّ إِنَّهُ كَمَا هَرَام
 عَدَيْ الْطَّلَعِ لَمْ يَقْدِرْ فَنَظَرَ الْشَّغَلَبَ فَقَالَ
 لَهُ يَا أَخِي أَسْبَتَ فِي فِعْلِكَ إِذْ لَمْ تَمِيزْ
 طَلَوعَكَ قَبْلَ تُرْزوِلَكَ ه

هَذَا مَفْلَهَ ه

الَّذِي يَسْرِلَ إِلَيْهِ أَسْفَلَ الْبَحْرِ وَلَا يَعْرِفُ
 يُعْنِمُ حَتَّى إِلَيْهِ فَوْقَ وَجْهِهِ الْمَاءُ ه

أَنْبَتَ

N O T A E A D F A B . I X .

Fecisti male] *ad verbum*, deliquisti in actione tua. * *Estque أَسْبَتَ pro أَسْبَتَ*: *nam thema est*, سَبَقَ *pro سَبَقَ*, *idem quod in Conjug.*

IX.

CERVUS ET VULPES.

CERVUS aliquando cum sitiret, venit ad fontem aquæ, ut biberet: erat autem aqua in puteo profundo, unde cum ille deinde conaretur ascendere, non potuit. Veditque eum Vulpes, & dixit ei: O frater mi, fecisti male quod non perpenderis ascensum tuum ante descensum tuum.

Hoc significat,

Hominem, qui descendit in imum maris, neque scit natare, donec super facie ejus sit aqua.

X.

NOTE AD FAB. IX.

jug. IV. scil. male fecit; & opponitur ταῦτα.
Significat hominem] id est, fabula est in hominem: & sic post aliquoties, cum videlicet Accusati-
vum non sequitur Infinitivus.

أَرْنِبٌ وَشَعَالِبٌ *

الْنَّسُورُ مَرَّةً وَقَعَ بَيْنَهُمْ فَبَيْنَ الْأَرْنِبِ
حَرَبَ قَمَضُوا الْأَرْنِبَ إِلَيْيَ الشَّعَالِبِ يَسُومُونَ
مِنْهُمُ الْخَلْفَ وَالْمُعَاصِدَةَ عَلَيَ الْنَّسُورِ
فَقَاتَلُوا كُلَّهُمْ لَمْ لَا عَرَفُنَا كُمْ وَنَعْلَمُ لِمَنْ
تَحَارِبُونَ لَفَعَلَنَا ذَلِكَ

هَذَا مَغَنَّاءٌ

أَنَّ سَبِيلَ الْإِنْسَانِ أَلَا يَحْارِبَ لِمَنْ هُوَ أَشَدُ بَأْسًا مِنْهُ

أَرْنِبٌ وَكَبِيْرٌ *

أَرْنِبٌ مَرَّةً عَمَّرَ عَلَيْهِ كَبِيْرٌ قَائِلًا أَنِّي
أَنْتَجُ فِي كُلِّ سَنَةٍ أَوْلَادًا كَثِيرَةً وَأَنْتِ إِنَّمَا
تَلْدِينَ

N O T A E A D F A B . X .

* الحلف *malim legere* [الخلف والمعاصدة] *bilfa*,
تع

X.

LEPORES ET VULPES.

OR T U M aliquando inter Aquilas & Lepores est bellum: abieruntque Lepores ad Vulpes, petentes ab iis contrarietatem & resistentiam contra Aquilas. At dixerunt eis: Nisi nossemus vos, & sciremus quibuscum bellum geritis, utique faceremus illud.

Hoc significat,

Non decere hominem ut cum eo belligeret, qui plus ipso virtute pollet.

XI.

LEPUS ET LEÆNA.

LEPU S quidam aliquando adortus est, *vel proprie* præteriit, transiit juxta *vel ad*) leænam, dicens: Pario ego

NOTÆ AD FAB. X.

& vertere, ut in fœdus coirent opemque ferrent.

Ff

تَلْدِيَسْ فِي كُلِّ عَمْرِكِ وَاحِدًا أَوْ اثْنَيْسْ
 فَقَالَتْ لَهُ الْلَّبُوَةُ صَدَقْتُ غَبْرَ إِنَّا فِي إِنْ كَانَ أَقْتُونْ
 وَاحِدًا فَهُنَّ سَبْعَةٌ

فَهِذَا مَغْنَاهُ
 أَنْ وَلَدًا وَاحِدًا مَبَارِكًا خَبْرٌ مِنْ أَوْلَادِ كَنْبِرَةِ عَاجِزِينَ

إِمْرَأَةُ وَدَجَاجَةُ هُ

إِمْرَأَةُ كَانَ لَهَا دَجَاجَةٌ تَبَيْضُ فِي كُلِّ كَانَتْ
 يَوْمٌ بَيْضَةٌ فَضَّةٌ فَقَالَتْ لِلْإِمْرَأَةِ فِي نَفْسِهَا إِنْ
 أَنَا كَثِيرٌ عَلَيْهَا تَبَيْضُ بَيْضَتِيْسْ فَلَمَّا
 كَثُرَ عَلَيْهَا قَشْقَنْ حَوْصَلَتِهَا فَمَاتَتْ
 هَذَا

NOTE A D FAB. XI.

Septem valet] Arabice est septem. * Potius
 legendum, reddendumque, est leæna.
 Probus] Proprie benedictus.

go singulis annis complures filios (*seu*
fœtus); tu autem tota tua ætate solum-
modo unum aut duos. **Dixit** ei Leæ-
na: Credo: sed ille, licet unus sit, sep-
tem valet.

Hoc significat,

Quod filius unus probus pœstat pluri-
bus ignavis.

XII.

MULIER ET GALLINA.

MULIERI cuidam erat Gallina fin-
gulis diebus ovum pariens argen-
teum. **Dixitque** Mulier secum: Si multi-
plicavero cibum ejus, pariet ova bina. Ut
autem cibus ejus fuit auctus, rupta est in-
gluvies ejus, & mortua est.

Hoc

NOTE A D F A B. XII.

Caput opum, *id est*, quod *Arabes* uno verbo di-
cunt بفماعة *id est*, *summa principalis* quæ *sœno-*
ri exponitur, *hoofst-somme nostratibus*.

هَذَا مَقْتَنَاهُ هُ
أَنْ دَانَاهَا كَبِيرًا بِسَبَبِ مِرْبُوحٍ كَبِيرٍ يَهْلِكُونَا رَأْسَ مَالِهِمْ هُ
بَعْوَضَةً وَكَفَرَ هُ

بَعْوَضَةً يَعْدِي فَاسِمَوْسَةً وَقَغْنَتْ عَلَيْيِ قَرْنِ تَقْوِينِ
فَظَّنَتْ أَنَّهَا تَقْلَتْ عَلَيْهِ فَقَائِنْ لَهُ إِنْ كَنْتْ
فَدْ تَقْلَتْ عَلَيْكَ أَغْلِمِنِي حَتَّىٰ أَطْبَرَ عَنْكَ
فَقَالَ اللَّهُوْرِ يَا هَذَا مَا شَعَرْتُ لِمَنْ نَزَّلْتُ
وَلَا أَدْرِي لِمَنْ صَرَرْتُ هُ
هَذَا مَقْتَنَاهُ هُ
مَنْ يَطْلُبُ أَنْ يَجْعَلَ لَهُ ذِكْرًا وَمَجْدًا
وَقَوْقَعْبَقْ حَقِيرُ هُ

إِنْسَانٌ فِي الْمَوْتِ هُ

إِنْسَانٌ مِنْهُ حَمَلَ جُرْزَةً حَطَبٍ فَتَقْلَتْ عَلَيْهِ
فَلَمَّا

Hoc significat,

Multos homines quæstus multi causa perdere caput opum suarum.

XIII.

CULEX ET TAURUS.

CULEX, quæ & BAUDA (*Arabice*) dicitur, constitit super cornu Tauri, ac arbitratus est se oneri ei esse, dixitque ei: Si oneri tibi sum, dic id mihi; ut a te avolem. Respondit ei Taurus: O tu, non animadverti in quem descenderis, neque scio cui noceas.

Hoc significat,

Hominem, qui quærit sibi ponere famam & gloriam, cum debilis sit & contemptibilis.

XIV.

HOMO ET MORS.

HOMO aliquando ferebat fascem lignorum, qui gravabat eum: cumque

فَلَمَّا أَعْبَأَ وَضَجَّرَ مِنْ حَمْلِهَا رَمَيَ بِهَا عَنْ
 كَتْفِهِ وَدَعَا عَلَيْهِ مُرْوَحَةً بِالْمَوْتِ فَشَخَّصَ
 لَهُ قَائِلًا هَوْدًا أَنَّا لِمَادًا دَعَوْتَنِي فَقَالَ لَهُ الْأَنْسَانُ
 دَعَوْتَكَ لِتَرْفَعَ هَذِهِ جُرْزَةَ الْحَاطِبِ عَلَيَّ كَتْنِي بِهَا
 هَذِهِ مَعْنَاهُ
 أَنَّ الْعَالَمَ بِاسْرِي يَحْبَثُ الْحَكِيمَةَ الْمُدَّبِّرَةَ
 وَمَا يَمْلِّ مِنْ الْضَّعْفِ فَالشَّقَاءُ
 بِسْتَانِي
 كَانَ يَنْقِي الْبَقْلَ فَقَبِيلَ
 لَهُ لِمَادًا الْبَقْلَ الْبَرِّي بِهِيَ الْمَنْظَرُ وَهُنَّ
 خَبَرُ مُحْدِهِمْ قَالَ الْبَسْتَانِي تَسْرِيبَهُ أَمَّهُ
 وَهَذَا تَسْرِيبُهُ آمِرَةُ أَبْبَهُ بِهَا

هَذَا

СЯМОМ ТА ОМОН
НОТАЕ АД ФАВ. XV.

Noverca] ad verbum, Uxor patris, phrasij Hebraica: nam uno alioqui vocabulo Noverca Arabibus

lassus factus esset, tædioque afficeretur gestationis ejus, abjecit eum ab humero suo, vocavitque ad se Mortem; quæ se coram eo sttit, diceñs: Ecce me: cur me vocavisti? Respondit ei Homo: Vocavi te ut fascem hunc lignorum superimponeres humero meo.

Hoc significat,

Quod universus mundus vitam diligit mundanam, neque lassatur infirmitate & miseria.

XV.

HORTULANUS.

HORTULANUS aliquando, cum herbas purgaret (a zizaniis), dictum ei fuit: Cur herba silvestris aspectu est speciosa, cum non colatur? Respondit Hortulanus: Educat eam mater ejus; at hæc a noverca sua educatur.

Hoc

NOTÆ A.D. F.A.B. XV.

*bus dicitur رابط، * sc. Rabbaton, fæm. رابطة، quod proprie est educator.*

هَذَا مَفْنَاهُ هُ

أَنْ قَرِبَيْ أَلَمْ لِلَّا لَوْلَادْ أَفَصَلْ مِنْ قَرِبَيْ أَمْرَأَةَ الْأَبْ هُ

إِنْسَانٌ وَصَنْمٌ هُ

كَانَ لَهُ صَنْمٌ فِي بَيْتِهِ يَعْبُدُهُ وَكَانَ يَدْبَحُ
لَهُ فِي كُلِّ يَوْمٍ دَبَابِحَةً فَأَقْبَلَ جَمِيعُ مَا يَمْلَكُهُ
عَلَيْهِ ذَلِكَ الْأَصْنَمُ فَشَخَصَ لَهُ قَابِلًا لَا تَفْنِ مَالَكَ
عَاسِيَ نَسْمَةَ تَلَوْمِنِي لِلَّهِ آخِرَ هُ

هَذَا مَفْنَاهُ هُ

مَنْ نَفَقَ مَالَهُ فِي الْحَطَبِ بَلْ نَفَقَ ۖ أَفَنَفَقَ
يَخْتَاجُ أَنَّ اللَّهَ أَفْقَرَهُ هُ

إِنْسَانٌ أَسْوَدُ هُ

إِنْسَانٌ مَرْأَةٌ مَرْأَيٌ مَرْجَلٌ أَسْوَدٌ وَهُنَّ وَاقُفٌ فِي الْمَاءِ
يَسْتَحِمُ هُ

Hoc significat,

Præstantiorem esse educationem matris,
quam novercæ.

pp. q. dedicatio matris
filii melior (sic) pro
educatione uxoris
patris. (noverca.)

XVI.

HOMO ET IDOLUM.

ERAT homini cuidam Idolum domi suæ, quod colebat, & cui quotidie sacrificabat sacrificium, consumpsitque omne id quod possidebat propter Idolum illud: quod se coram eo sistens, dixit: Ne consume opes tuas propter me, & me deinde culpa apud Deum alium.

Hoc significat,

Eum, qui facultates suas erogat in peccato (*seu* peccatum), & deinde queritur (causatur) quod Deus ipsum pauperem fecerit.

XVII.

HOMONIGER.

VIDIT quidam aliquando hominem nigrum, qui in aqua stabat sese lavans;

يَسْتَحِمُ فَقَالَ لَهُ يَا أَخِي لَا تَعَكِرْ آللَّهِ فَإِنَّكَ لَا
تَسْتَطِعُ آللَّبَّاضَ وَلَا تَسْعِدُ عَلَيْهِ أَبَدَ آللَّهُفْرِ

هَذَا مَغْنَاهُ

أَنَّ آللَّمَطْبُوعَ لَا يُغَيِّرُ طَبْعَهُ
إِنْسَانٌ وَفَرْسٌ

إِنْسَانٌ كَانَ يَرْكَبُ فَرْسًا وَكَانَ حَامِلاً وَفِيمَا
هُنَّ

NOTÆ AD FAB. XVII. XVIII.

Non enim potes] *Arabismum hunc Latinus sermo non admittit: sic sonat ad verbum;* Non potes albescientiam, neque valebis super ea in æternitatem seculi. * *وَpotius legendum الابضاضن, Ad. a Conj. IX.*

Equa] *Miror hic فَرْسٌ fæminine usurpari; aliqui رامتون propriæ equam significat.* * *فَرْسٌ est comm. gen. وَ pecul. fæmin. licet pro eo quoque فَرَسَة Ferefaton dicatur, وَ كُلُّ autem, cuius plur. fract. وَ مُكَلِّفٌ, est equa vilioris generis. Camus. in*

vans; dixitque ei: O Frater mi, ne turba
(iniquina) fluvium: non enim potes albesce-
re, nec albitudinem acquirere in æternum.

Hoc significat,

Quod a natura quid habens, non mutat
naturam suam.



XVIII.

HOMO ET EQUULEUS.

HOMO quidam vehebatur equa, quæ
gravida erat: cumque in via quadam
es-

NOTÆ AD FAB. XVIII.

*in inscriptione pro HINNULUS, quod aliæ editiones
habent, reposui EQUULEUS; quanquam non pro-
prie ipsa vox*  *, sed vox*  *Muhron, e-
quuleum notet.*

Gravida]  *in fœminino ponitur ge-
nere; ita ut*  *sterilis, passim in Alko-
rano.*

Via quadam] *ut supra spelunca quadam: vel, in
partem aliquam viæ, id est, cum aliquousque pro-
gressus esset.*

هُنَّ فِي بَعْضِ الظَّرِيفِ أَنْتَ بَحْتَ آبَانَا فَتَنَبَّعَ أَمَّهُ غَبَسَ
 بَعْدُ نَمَّ وَقَفَ وَقَالَ لِصَاحِبِهِ يَا سَيِّدِي تَرَانِي صَغِيرًا
 وَلَا أَسْتَطِعُ لِلْمَشَيِّ وَمَضَبْتَنَ وَتَرَكْتَنِي هَاهَنَا
 فَهَلْكَتْ فَإِنْ أَنْتَ أَخْذَتْنِي مَعَكَ وَرَبَّتْنِي
 إِلَيْ أَنْ أَقْوِيَ فَحَمَلْتَكَ عَلَيَ ظَهْرِي وَأَوْصَلْتَكَ
 سَرِيعًا إِلَيْ حَبْتَ تَشَاءُ

هَذَا مَفْنَاهُ

أَنْتَ يَاجْبَرْ بْ أَنْ يَشَاءُ
 إِلَهٌ مَعْرُوفٌ لِأَهْلِهِ وَمَنْتَهٌ كَفِيلٌ
 وَلَا يَمْطَرْ رَحْمَةً

إِنْسَانٌ

NOTÆ AD FAB. XVIII.

Et si abieris] *Arabice abieris, per ellipsin voculae si: quæ Turcis est usitatissima.*

Res nobilis] *معروف est notus, cognitus, item, justus, æquus. Hic rem præstantia celebrem, et omnibus notam significat, quam eorum nos nobilem*

di-

esset, peperit filium, (pullum) qui sequutus est Matrem suam non longe: deinde substituit, dixitque Domino suo: O Domine mi, vides me parvum esse, neque posse incedere, si itaque abieris & reliqueris me hic, peribo: at si acceperis me tecum, & educaveris me, donec robustus fiam, feram ego te super dorso meo, & perducam te celeriter, quounque voles.

Hoc significat,

Oportere, ut res quælibet nobilis populum suum, & qui ea digni sunt, molestia afficiat, neque abjiciant eam. (Ut observeatur benignitas erga idoneos, & Dignos ea, neque deferatur.)

XIX.

NOTÆ AD FAB. XVIII.

dicimus. * *quin ε& bic* *المسنون* fuerit: Id quod æquum & justum est, τὸ ἀριθμός; *contrarium τῷ* *المتن* *Almunkero*: ita uti etiam Græcis usurpantur τὸ γνώμων & τὸ ἀγνώμον. *دش* cordi & curæ sit verti possit.

إِنْسَانٌ وَخَنْزِيرٌ

إِنْسَانٌ مَرَّةٌ حَمَلَ عَلَيْهِ بَهْمَةً كَبِشًا وَعَنْزًا وَخَنْزِيرًا
وَتَوَجَّهَ إِلَيْهِ الْمَدِينَةَ لِبَيْعِ الْجَمِيعِ فَأَلْكَبَشَ فِي الْعَنْزِ فَلَمْ
يَكُونُوا يَضْرِبُانِ عَلَيْهِ بَهْمَةً وَلَمْ يَأْخُذْهُمْ فَادَهُ كَانَ

يَعْرِضُ دَائِمًا وَلَا يَهْدِي فَقَالَ لَهُ الْإِنْسَانُ يَا أَشْرَقُ الْوَحْشَيَّ^{الْوَحْشَيَّ}
لَهَا دَائِمًا الْكَبِشُ وَالْتَّبَقُسُ سَكُوتٌ لَا يَضْرِبُانِ وَأَنَّ لَهُ
تَهْدِي وَلَا تَسْتَغْرِفُ قَالَ كَهْلُ الْخَنْزِيرِ كُلُّ وَاحِدٍ يَعْلَمُ نَفْسَهُ
أَنَا أَعْلَمُ أَنَّ الْكَبِشَ لِصُوفَهِ وَالْعَنْزَ يُطَلَّبُ لِلْكَبِشِهَا
وَأَنَا الشَّغِيْرُ لَا صُوفَ لِي وَلَا لَئِنْ أَنَا عِنْدَ وَصْوَلِي
إِلَيْهِ الْمَدِينَةِ لَمْ يَسْأَلْ إِلَيْهِ الْمَسْلَخِ لَا مَحَالةَ بَعْدَ
هَذَا

NOTÆ AD FAB. XIX.

Animalium] *propriæ significat feras.**
leg. يَهْدِي Lahdoo, Hamzat. ultim. vel
Lahdeno, مَسْلَخ est laniena, *propriæ loci* ubi excoriatur quid, aut exuitur.

XIX.

HOMO ET PORCUS.

HOMO aliquando portabat super iumento Agnum, Capram, & Porcum, abiitque in civitatem, ut ea omnia venderet. Agnus autem & Capra non percutiebant jumentum: at Porcus continue repugnabat, neque quiescebat: dixitque ei homo: O pessimum animalium, quare Agnus & Capra silent, nec percutiunt; tu autem non quiescis, nec tranquillus es? Dixit ei Porcus: Unusquisque novit se ipsum: ego scio quod Agnus ob lanam, Capra autem ob lac queratur. At ego miser, non est lana mihi, neque lac; cum in urbem ^{penes introit me, pp} venero, mittar procul dubio in carnificinam.

Hoc

NOTÆ A D F A B. XIX.

* سوئة قلبيهم من [lege متنقلا بهم و verte; qui noti sunt per delicta & peccata a se commissa, cognoscere ex pravitate conversationis suæ, quinam futurus sit finis suus.

هَذَا مَفْنَاهُ

أَنَّ الَّذِينَ يُعْرِفُونَ فِي الْخَطَابِيَا وَالْدَّوْبِ
 الَّتِي قَدَّمْتُ أَيْدِيهِمْ يَعْلَمُونَ سُوءً مُتَقْلِبِهِمْ
 مَاذَا تَكُونُ آخِرُهُمْ ؟
 سَلَحْفَاهُ وَأَرْبَبُ مَرَّةٍ تَسَابَقَا وَجَعَلَا الْكَدَ بَيْنَهُمَا
 الْجَبَلَ يَسْتَبَقَانِ إِلَيْهِ أَمَّا الْأَرْبَبُ فَلَأْجَلِ
دَقْتَبَهُ وَخِفْتَهُ وَجَرْبَهُ تَوَانَى فِي الظَّرِيفِ
 وَنَامَ وَأَمَّا السَّلَحْفَاهُ فَلَعْلَاهُ مَا ذَقَلَ
 طَبِيعَتِهَا لَمْ تَكُنْ تَسْتَقِيرَ وَلَا تَنْتَوَانِي فِي
 الْجَرَبِ

NOTÆ A D F A B. XX.

* ضَوِي ^{قُوَّى} *per* *دل a* [دلته] *exponitur*,
 gracilis corpore fuit: *at pro illa voce forte legendum*.

* *جَرَب non تجربة* [وجربة] *est experien-tia.*

Hoc significat,

Eos, qui ^{nobilitatis per} noverunt peccata & delicta, quæ manus eorum commiserunt, agnoscerre pravitatem conversationis suæ cum finis eorum instat.

XX.

TESTUDO ET LEPUS.

TESTUDO & Lepus certarunt aliquando uter alterum anteverteret, & posuerunt inter se terminum montem, ad quem certatim contenderent. Lepus autem ob subtilitatem, (gracilitatem) levitatem, & experientiam tardavit in via, & dormivit: sed Testudo, quod nosset gravitatem naturæ suæ, non quievit, nec tardavit.

NOTÆ AD FAB. XX.

tia. Ideoque legendum puto ^{وَجْهِيَّةٍ}, vel ^{فِي جَرِيَّةٍ}, & cursum, vel in cursu suo.

* Invenit] vel ita transferendum, qui comperit Testudinem antevertisse.

Hh

الْجَهْرِيُّ فَوَصَلَ إِلَيْيَ الْجَبَلِ عِنْدَ مَا تَسْتَبْغَظُ
الْأَرْبَبُ مِنْ نَوْمِهِ فَوَحَدَ الْشَّلْخَفَاءَ قَدْ
سَبَقْتُ فَلَدَمْ حَبَّتْ لَا تَنْقَعُ الْسَّدَامَةَ

هَذَا مَعْنَاهُ

أَنَّ إِذَا كَانَا أَنْتَانَ فِي حَرْبٍ فَكَانَ الْوَاحِدُ
صَعِيقًا وَالْآخَرُ قَوِيًّا فَالصَّعِيفُ لَمْ يُنْمِ مِنْ خَوْفِهِ
عَلَى نَفْسِهِ فَرِبِّمَا أَنَّ الصَّعِيفَ ظَفِيرٌ بِالْقَوِيِّ لِحَسْبِ
تَوَابِهِ وَيَعُودُ يَنْدَمْ حَبَّتْ لَا تَنْقَعُ الْسَّدَامَةَ

ذِيَّبُ ه

NOTÆ AD FAB. XXI.

Auferenti illud] *ad verbum*, cum abiret cum
co. vide Grammat. p. 184. يَسْتَأْتِي

bic

vit in cursu ; venitque ad montem , cum expergiseretur Lepus a somno suo : inventusque Testudinem quæ anteve terat eum. Pœnituitque eum , ubi non prodesset pœnitentia.

Hoc significat,

Quod cum duo sunt in certamine , quorum alter est debilis , alter fortis ; debilis vero non dormit , quod timeat sibi : ^{opp. itaque t. sp. ludo ejus quo} sæpe contingit , ut debilis fortem vincat , propter negligentiam hujus , abeatque pœnitens , ubi non prodit ei pœnitentia.

XXI.

L U P U S.

LUPUS aliquando porcellum rapuit parvum , & auferenti illud occurrit Leo , qui id ei eripuit : dixitque Lopus apud se ; Mi-

NOTÆ AD FAB. XXI.

bic est pro ~~L~~ — — — — — , Hamzat. ultima.

أَعْتَجِبْ كُبَّ شَيْءٌ أَخْنَصْتُ لَا يَنْبَتْ مَعِي ۝
فَذَا مَغْنَاه ۝

أَنَّ مَا يُكَسِّبَ مِنْ الظُّلْمِ لَا يُقْبِسْ مَعَ
صَاحِبِهِ إِنْ هُوَ قَامَ مَعَهُ فَلَا يَنْهَى بِهِ ۝

الْعَوْسَاجُ ۝

الْعَوْسَاجُ قَالَ مَرْأَةُ الْبَسْتَانِ لَقَنْ إِنْ لَيْ مَنْ يَهْمِ
بِي وَيَنْصِبِي فِي وَسْطِ الْبَسْتَانِ وَيَسْقِبِي وَيَحْدِهِنِي
كَانُوا الْمَلُوكَ يَشْتَهِوْنِي وَيَنْتَهِرُونَ نَهْرِي
وَنَمِي فَأَخَدَهُ وَنَصَبَهُ فِي وَسْطِ الْبَسْتَانِ فِي أَجْوَدِ
الْأَرْضِ وَكَانَ يَسْقِبِهِ فِي كُلِّ يَقْمِ دَوْعَتْبَنِ
وَمَقْشَشِي

NOTE AD FAB. XXII.

* Rubus.] *proprie Rhamnus. At Rubus Olleikon dicitur.*

* germina ejus.] *vel legge*

Miror ego quomodo res quam rapui non
maneat mecum.

Hoc significat,

Id, quod per nefas acquiritur, non per-
manere cum domino suo: &, si maneat,
illum non beari eo.

XXII.

R U B U S.

RUBUS dixit aliquando Hortulano: Si
mihi esset quispiam qui curam mei
gereret, meque plantaret in medio horti,
& irrigaret me, & coleret me; utique re-
ges desiderarent me, & aspicerent (con-
templarentur) florem meum, & fructum
meum. Unde accepit eum, plantavitque
in medio horti, in optimo terræ, irrigavit-

que

NOTÆ A D F A B. XXII.

وَقْرَعَتْ اغْصَانَهُ ge, & propagati sunt rami ejus.
فَاصْلَانَ lege * & operuerunt folia ejus terram.] فَاصْلَانَ Feasolet, firmiterque fixæ sunt radices ejus in terra.

فَعْشِي وَقُوَّى شَوْكَهُ وَأَفْرَعُهُ وَأَعْصَانُهُ عَلَيْ جَمِيعِ
 الْشَّجَرِ الَّتِي حَوْكَهُ فَأَمْكَنْتُ عَرْوَقَهُ فِي الْأَرْضِ عَلَيْهِ حَاطِلَتْ مَوْلَاهُ
 فَأَمْتَلَّا الْبَسْنَانَ مَنْهُ وَمَنْ كَثْرَةً شَوْكَهُ وَلَمْ
 يَكُنْ أَحَدٌ أَنْ يَسْتَطِعْ أَنْ يَتَقدَّمَ إِلَيْهِ فَإِذَا دَعَاهُ إِلَيْهِ

هَذَا مَؤْتَمَةٌ

مَنْ يَجْهَاؤْنِي إِنْسَانٌ سُوفَ قَاتَهُ طَكَلَمًا أَكْرَمَنَتَهُ
 كَثْرَتْ شَرْوِيَهُ وَتَمَرِهُ وَكَلَمًا أَحْسَنَتْ إِلَيْهِ
 أَسْاءَ الْغَفَلَ مَغَكَى أَسْأَءَ الْغَفَلَ مَغَكَى
 أَسْوَدَ فِي يَعْمَ نَرَعَ ثَيَابَهُ وَأَثْبَلَ يَأْخُذَ الْثَّلْجَ
 فَيَعْرُكَ بِهِ جِسْمَهُ فَقَبِيلَ كَهُ مَادَانَا تَغْرِيَ جِسْمَكَ
 بِالْثَّلْجِ فَقَسَارَ لَعْلَيَ أَبْيَضَ فَسَاتِي رَجْلَيَ
 حَكِيمَ

que eum quotidie bis : ac invaluerunt spinae ejus , & germina ac rami ejus , supra omnes arbores quæ circum ipsum erant ; & operuerunt folia ejus terram , & impletus est hortus ab eo ac multitudine spinarum ejus ; neque potuit quisquam accedere ad eum.

Hoc significat,

Eum , qui conversatur cum homine malo : hunc enim quotiescumque honoras , multiplicantur malitiæ ejus , & rebellis est , & quotiescumque bene facis ei , male facit tibi.

XXIII.

N I G E R.

NIGER die quodam exuit vestes suas , incepitque accipere nivem , eaque corpus suum fricare. Dictum autem ei fuit : Quare fricas corpus tuum nive ? Ait ille : Fortassis albescam . Venitque vir quidam ^{ppane lactet}
_{pes, ut albescam.} fa-

حَكِيمٌ قَالَ لَهُ يَا هَذَا لَا تَشْعُبْ نَفْسَكَ
 فَقَدْ يَمْكُنُ أَنْ جَسْمَكَ يَسْوَدَ الشَّمْجَ
 وَقُلْقَنْ لَا يَرْتَدَ السَّوَادَ هَذَا مَغْنَاهَ هَذَا
 أَنَّ الشَّرِيرَ يَقْدِرُ أَنْ يُغْسِدَ الْخَبِيرَ وَأَمَا لَا
 يَقْدِرُ أَحَدٌ حَدِي إِصْلَاحَ الشَّرِيرَ هَذَا
 خَنْفَقَةَ وَنَحْلَةَ هَذَا
 خَنْفَقَةَ مَرَّةٌ قَالَتْ لَنَحْلَةَ الْعَسْلُ لَنْ أَخْذُنِي مَعَكَ
 لَعْمَلْتَ عَسْلًا مِنْ لِكَ وَأَكْثَرَ فَاجَابَتْهَا الْنَّحْلَةُ
 إِيْ دِلِكَ فَلَمَّا لَمْ يَقْدِرْ عَلَيْ مِثْلِ دِلِكَ ضَرَبَتْهَا
 الْنَّحْلَةُ

NOTE A D F A B. XXIII. XXIV.

O tu.] *Ad verbum*, O hic. *Græci*, ὁ Ὀὐρανός.
 * خَنْفَقَةَ] *vox Arabibus non cognita; quod*
sciam. Itaque vel *خَنْفَقَةَ seu خَنْفَقَةَ Cha-*
zarnakon legendum est; vel خَنْفَسَةَ Chon-
fa-

sapiens, qui dixit ei: o tu, ne afflige te ipsum: fieri enim potest, ut corpus tuum nigram faciat nivem; ipsum autem non amittet nigredinem.

Hoc significat,

Quod malus potest corrumpere bonum: sed nemo potest emendare malum.

XXIV.

A R A N E A E T A P E S.

ARANEA aliquando dixit Apis melliferae: Si me tecum sumeres, facerem ego mel sicuti tu, & plus eo. Auscultavit ei Apes. Cum autem non posset simile quid facere feriit eam Apes aculeo suo:

N O T A E A D F A B. XXIV.

fafaton; at quod non Aranea est, verum Scara**bæus.**

* Auscultavit ei Apes,] id est, annuit hoc illi Apes.

Ii * بالهـ

النَّحْلَةُ بِحِمَالَهَا فِيمَا هِيَ تَمُوتُ قَائِمٌ فِي نَفْسِهَا
لَقِدْ أَسْتَوْجَبْتُ مَا نَالَنِي مِنْ الْسَّوَاءِ وَلَا يُمْكِنُ
إِلَى حَمْلِ الْأَرْقَبِ لِمَا دَانَهُ اَللَّهُمَّ عَمَلَ الْعَسْلِ

هَذَا مَغَنَّةٌ هُ

أَنَّ نَاسًا كَثِيرًا يَحْطُونَ أَنفُسَهُمْ بِأَشْبَاءِ كَثِيرٍ
فَيَدْعُونَ اللَّهَ أَنْهُمْ بِهَا خَبِيرُونَ فَعِنْدَ مَا كَشَفُوا عَلَيْهَا
وَلَهُمْ كَذِبٌ فَبُكَّا فَوْا عَلَيْيِ قَدْرٍ فِي غَلِيلِهِمْ هُ

صَبَّارٌ هُ

صَبَّيْ هَرَّةً رَّمَيْ نَفْسَهُ فِي نَهْرٍ مَّاءٍ وَلَمْ يَكُنْ يَعْرِفُ
يَسْبَحُ

N O T A E A D F A B . X X I V .

* بِحِمَالَهَا [Aculeo suo.] Arabicum sonat, im-
petu suo, quare potius legendum furcit
Bihomatihi, a Radic. حـمـةـ: quod virus scorpio-
nis, &c. atque aculeum notat: nempe a fervore,
qui pungendo infligi videtur.

* كَشَفُوا [potius in Passiv. Cusjifou efferendum,
cum manifesti fiunt res eas efficiendo: nisi quis prio-
ri

suo: unde mortua est, dicens apud se:
Digna certe ego sum malo hoc, quod ^{m certe digna ego sum}
mihi evenit, cum non possim facere pi- ^{de}
cem, cur volui mel facere? ^{calamitate.}

Hoc significat,

Homines multos immiscere se rebus
 multis, quarum se existimant esse peri-
 tos, cumque eas aggrediuntur, sermo
 eorum est mendax, & accipiunt præmia
 digna opere suo.

XXV.

P U E R.

PUER aliquando conjectit se in fluvium
 aquæ, neque natare sciebat, parum-
 que

N O T A E A D F A B. XXIV.

ri servata lectione, in Accusatiw. ponat قوله *Kau-*
lahum, reddatque, cum iis rebus conficiendis mani-
 festant seu cognoscendum præbent sermonem suum:
atque etiam كذب, in Passiv. *Conjug. II.* Cuddiba
rectius efferatur, mendacii coarguitur, potest و
pro كلفوا legi Cullifou vel تكلفوا
id est, cum adiguntur ad eas res efficiendas.

يُسْبِحُ فَالشَّرَفَ عَلَى الْغُرْفِ فَاسْتَعَانَ بِرَجُلٍ حَابِبٍ
فِي الْطَّرِيقِ فَأَقْبَلَ إِلَيْهِ وَجَعَلَ يَكْوُمَهُ عَلَيْهِ
فَزُولَةٌ إِلَيْهِ فَعَالَ لَهُ الصَّبِيُّ يَا هَذَا خَلِيلِنِي
أَوْلَادٌ مِنَ الْمَوْتِ وَبَعْدَ ذَلِكَ لَوْمَنِي

هَذَا مَغْنَاهُ

إِنْ إِذَا وَقَعَ صَدِيقُكَ فِي شَدَّةٍ نَجِهُ
وَخَلِصْهُ وَفِيمَا بَعْدَ لَوْمَهُ فَبَكُوكَ وَنَ
أَحْسَنَ جَهْمَبِيلَ

صَبِيُّ وَعَثْرَيُ

صَبِيٌّ فِي مَرَّةٍ كَانَ يَصِيدُ الْجَرَادَ فَمَظَرَّ
عَقْرَبًا فَظَنَّ أَنَّهَا جَرَادَةٌ كَبِيرَةٌ فَمَدَ يَدَهُ
لِيَأْخُذُهَا

NOTÆ AD FAB. XXV.

Liberare debes, &c.] ad verbum, Libera eum, &c.
Longe melior.] Arabice optimus honesti, seu de-

co-

quæ aberat quin suffocaretur , & opem im-
ploravit viri cuiusdam in via transeuntis :
qui accedens ad eum , cœpit eum objurga-
re , quod in fluvium descendisset. Dixit-
que ei puer : O tu , libera me primum a
morte , & deinde reprehende me.

Hoc significat,

Quod , cum amicus tuus incidit in ca-
lamitatem aliquam , liberare eum primum
debes & salvare , deinde vero reprehende-
re : eritque longe melior.

XXVI.

P U E R E T S C O R P I O.

PUER aliquando venabatur locustas :
viditque Scorpionem , quem putavit
locustam esse magnam : extenditque ma-
num

N O T A E A D F A B . X X V .

cori ; vel neutraliter , optimum decori ; id est , lon-
ge convenientius.

لِبَأْخَذَهَا ثُمَّ تَبَعَّدَ عَنْهَا فَقَاتَتْ لَهُ أَنْ
إِنَّكَ قَبَضْتَنِي فِي يَدِكَ فَخَلَبْتَ عَنِ
صَبَدِ الْجَرَادِ

فَذَا مَفْنَاهُ ه

أَنْ سَبِيلَ الْأَنْسَانِ أَنْ يَمْسِرَ الْحَبْسَرَ مِنَ الشَّرِّ
فَيَدِسِرَ لِكُلِّ شَيْءٍ تَدْبِرَ عَلَيْهِ حَدَّهُ

حَدَّهُ ه

حَمَامَةٌ مَرَّةً عَطَشَتْ فَاقْبَلَتْ تَحْقِمُ عَلَيْهِ حَائِطَ
فِي طَلْبِ الْمَاءِ فَنَظَرَتْ عَلَى حَائِطٍ صَحْفَةَ
مَمْلُوَّةً مَاءً فَطَارَتْ بِسُرْعَةٍ وَضَرَبَتْ نَفْسَهَا
إِلَيْهِ

NOTÆ AD FAB. XXVI.

* Abstinuisse, &c. vertendum potius, equidem
desiisse venari locustas.

Convenienter naturæ suæ.] ad verbum, secundum

num suam, ut eum caperet; at deinde recessit ab eo, qui dixit illi: Si prehendisses me manu tua, abstinuisses a veneratione locustarum.

Hoc significat,

Quod oportet hominem distinguere bonum a malo, & rem omnem tractare convenienter naturæ suæ. app. secundum unitatem. scilicet i.e. seorsim.

XXVII.

C O L U M B A.

COLOMBA aliquando sitiens, cœpit vagari (circumvolitare) circa parietem, quærens aquam, viditque in pariete scutellam aqua plenam, & volavit celeriter allisitque se ad illam picturam, (formam, rem

NOTÆ AD FAB. XXVI.

terminum, normam aut definitionem suam.* aut pro ~~est~~ non alienum fuerit legere ~~est~~ Hidatin, a ~~est~~ id est seorsim, separatim, vel singulare quodam modo.

إِلَيْ تُلْكَ الْصَّدْوَرَةِ فَمَا نَشَقْتُنْ حَوْصَلَتْهَا
فَعَالَتْ الْقَيْلُ لَيْ أَنَا الْشَّقَبَةُ لِأَنِي أَسْرَعْتُ
فِي طَلْبِ الْمَاءِ وَاهْلَكْتُ مُرْوِحِي

هَذَا مَفْنَاهٌ

أَنَّ الْتَّبَدَدَ وَالْتَّوَانِي عَلَيَ الْأَشْبَاءِ أَخْبَرَ
مِنْ الْمُبَادَرَةِ وَالْمُسَارَعَةِ إِلَيْهَا

قِطْطٌ

قِطْطٌ مَرَّةً دَخَلَ إِلَيْ دَكَانَ حَدَّادَ فَأَصَابَ
الْمِبْرَدَ الْمَرْمِيَّ فَلَاقَبَ يَلْحَسْهَ بِالسَّانَةِ
وَالسَّانَةِ يَسْبِلَ مِنْهُ الْدَمُ وَهُوَ يَبْلَغُهُ وَيَظْلِمُ
أَنَّهُ مِنْ الْمِبْرَدِ إِلَيْ أَنَّ فَنِي لِسَانَهُ وَمَاتَ

هَذَا مَفْنَاهٌ

مَنْ يُنْفِقْ مَالَهُ بِعَيْرِ الْوَاجِبِ ثُمَّ لَمْ يَحْسُنْ حَتَّى
يَقْلِصَ

rem extantem) ita ut ingluvies ejus rumperetur. Dixitque; Væ mihi miseræ, quæ festinavi in aquæ petitione, & me ipsam perdidì.

Hoc significat,

Quod tarditas & mora in rebus præstat festinationi & celeritati.

XXVIII.

F E L I S.

FE LIS aliquando ingressa est officinam fabri ferrarii, invenitque limam projectam, eamque cœpit lingere lingua sua, ita ut a lingua ejus manaret sanguis, quem ipsa deglutiens putavit a lima esse; donec lingua ejus deficeret, & ipsa extingueretur.

Hoc significat,

Eum, qui erogat facultates suas sine necessitate, neque se se emendat, donec

Kk ex-

يَقْلَسُ وَهُنَّ لَا يَعْلَمُ وَأَيْضًا مُّكْتَبَةٌ حَلْوَةٌ وَصَاحِبَةٌ
يَنْلَدَدُ فِيهَا وَهُنَّ لَا يَعْلَمُ أَنَّهَا نَقْصٌ فِي عَمْرِهِ
وَذِلِكَ مِنْ جَمِيلَةِ الْجَهَنَّمِ الْأَكْبَرِ

حَدَادٌ وَكَلْبٌ هـ

حَدَادٌ كَانَ لَهُ كَلْبٌ وَكَانَ لَا يَرَأْلُ نَائِمًا
مَا دَامَ الْحَدَادُ يَعْمَلُ شَغْلًا فَإِذَا رَفَعَ الْعَمَلَ
وَجَاسَ هُنَّ وَاصْحَابَهُ لِبَّا كَلْوَا خَبِيرًا سَتَبْقَطَ
الْكَلْبِ فَقَالَ الْحَدَادُ يَا كَلْبَ السَّوْءِ لَيْ
سَبِبِ صَوْتِ الْمِرَبَاتِ الَّذِي يُزَعِّزُ الْأَرْضَ
لَا يَبْقِيْظُكَ وَصَوْتُ الْمَضْغِيْخِ الْخَفِيْيِ إِذَا أَنْتَ
سَمِعْتَهُ وَسَتَبْقَطَ هـ

هـذا

NOTÆ AD FAB. XXVIII.

Exhaustus] فـلـس est non habere pecuniam, non Arabibus tantum; sed et Belgis; nam et bi dicunt blus zyn. * in Conjugat. quarta tantum,

exhaustus sit, neque id animadvertisit. Est autem peccatum hoc dulce, (*Itemque; quod peccatum dulce*) & auctor ejus delectatur eo, ignorans ipsum detrahere vitæ suæ, quæ certe stultitia maxima est.

XXIX.

F A B E R E T C A N I S.

FABRO cuidam erat Canis, qui non desinebat dormire quamdiu faber laborabat, cumque opus intermitteret & se deret ipse cum sociis suis, ut cibum sumerent, evigilabat canis. Unde dixit ei Faber: O pessime Canis, quam ob causam sonitus malleorum, qui terram concutit, non excitat te? sonum autem mastificationis obscurum ecce audivisti & evigilasti.

Hoc

N O T A A D F A B. XXVIII.

*tum, stulti, ea usurpatur significatione.
Stultitia maxima] ad verbum, e summa maxima stultitiae (pro summa reputandum est stultitia.)*

هُدَا مَفْنَاهُ ه

أَنَّ الْإِنْسَانَ إِذَا سَمِعَ الصَّلَاةَ وَالْأَوْعَدَ يَنْسَمُ، وَمَنْ يُسِمِّعُ الْطَّبِيلَ وَالزَّمَرَ وَالْعَنَاءَ يَجْرِي كَلْفَةً، فَذَلِكَ مَنْ جَمَّلَ الْجَهْلَ أَلَّا كُبَرَ ه وَإِيْضًا مَنْ يَسْمَعُ مَا لَا يُصْلَحُ بِهِ شَانَهُ وَيَتَعَاوَلُ عَنْهَا فِيهِ مَهْفَعَةٌ

كَلَابٌ وَنَفَّاكَبٌ ه

كَلَابٌ مَرَّةً أَصَابُوا جِلْدَ سَبْعٍ، فَأَقْبَلُوا عَلَيْنِهِ فَبَنَهْشُوَهُ، فَنَظَرُهُمُ الْتَّغْلِبُ فَقَالَ لَهُمْ أَمَّا لَنْيَ إِنَّهُ كَانَ حَبَّا لِرَأْيِتُمْ مَخَالِبَهُ كَأَحَدٍ مِنْ أَنْبَابِكُمْ وَأَطْوَلَ ه

هُدَا

NOTÆ AD FAB. XXIX.

Profert يسمع est audiri facit.* زمر cum cantum omnem, tum proprie fistulæ tibiæque denotat.

* وعد institutionem] verbum notat prædicere boni quid, etiam mali; promittere, quoque min-

na-

Hoc significat,

Dormire hominem, cum audit precatio-
nem & institutionem ; post eum autem
currere, qui tympanum, cantum, & va-
nitatem profert : quæ certe stultitia maxima
est. Item eum, qui auscultat id quo non
corrigitur indoles (status, conditio) ejus;
negligit vero id quod utile est.

XXX.

C A N E S E T V U L P E S .

C A N E S aliquando invenerunt pellem
Leonis, eamque arrodere cœperunt,
quod videns Vulpes, dixit eis : At si il-
le vivus esset, videretis ungulas ejus, si-
cuti unum ex dentibus vestris, & longio-
res.

Hoc

N O T A E A D F A B . XXIX .

nari. *Itaque hic exhortationem, vel concionem sa-*
cram significet, quæ proprie ~~L~~^E, dicitur; quin ita
potius hic legendum fuerit.

Item] *supple*, significat hæc fabula.

هُدَا مَفْنَأَةٌ

الَّذِينَ يَشْتَهِي وَنْ بِقُوْمٍ قَدْ مَائَوْا وَلَا
 يَفْدِرُونَ الْجَوَابَ عَلَيْ أَنْفُسِهِمْ فَ
 كَلْبٌ وَلَبَّ وَلَبَّ هُ
 كَلْبٌ مَرَّةً طَرَدَ أَنْبَابًا، فَلَمَّا أَنْرَكَهُ
 قَبَضَ عَلَيْهِ وَأَقْبَلَ يَعْصِي دَائِبَابَهِ
 فَلِإِذَا الَّذِمْ قَدْ جَرَى لَحْسَةً بِلَسَانِهِ فَقَالَ
 الْأَنْبَابُ لَمَّا كَتَعْصَمْنِي كَأَنِّي عَدُوُّكُمْ هُمْ
 تُبُوسُنِي كَمَّا كَ صَدِيقِي هُ

هُدَا مَفْنَأَةٌ هُ

مَنْ يَكُونَ فِي قَلْبِهِ نَسْشٌ وَدَغْشٌ
 وَيُظْهِرُ إِشْفَاقًا وَمَحْبَبَةً فَ

الْبَطْنُ

K. 3

Hoc significat,

Eos, qui detrahunt ei qui jam vita excessit, neque se potest defendere.

XXXI.

CANIS ET LEPUS.

CANIS aliquando insequutus est Leporem, quem ut est assequutus, prehendit eum, & mordere coepit dentibus suis; cumque sanguis emanaret, lambit eum lingua sua: dixitque Lepus; Video te mordentem me, ac si ego hostis tuus essem: deinde oscularis me, ac si tu amicus meus essem.

Hoc significat,

Eum, in cuius corde est dolus & fraus, ostenditque benevolentiam & amorem.

XXXII.

الْبَطْنُ وَالرِّجْلُانِ

الْبَطْنُ وَالرِّجْلُانِ تَخَاصِمُوا فِيمَا بَيْنَهُمْ أَيُّهُمْ يَحْمِلُ
 الْجِسْمَ قَالَتِ الرِّجْلُانِ ذَخْنُنْ بِعْوَنَّا ذَخْمِلُ الْجِسْمَ
 قَالَ الْجَحْوَفُ إِنْ أَنَا لَمْ أَعْدِ مِنْ الْطَّعَامِ شَبَّاً فَلَا
 كُنْتُمَا تَسْتَطِعَانِ الْمُشَيِّ فَصَلَّا تَخْمِلَانِ شَبَّاً
هَذَا مَغْنَثَةٌ
 مَنْ يَتَوَسَّيْ أَمْرًا فَإِنْ لَمْ يَعْضُدْهُ الَّذِي هُوَ
 لَرْفَعَ مِنْهُ وَأَشَدَّ مِنْهُ فَمَا لَهُ قُدْرَةٌ عَلَيْ خِدْمَتِهِ
وَلَا مَنْفَعَةٌ لِمُرْوِحَةٍ

الذِئْمُوسُ

NOTE A D F A B. XXXII.

Contenderunt inter se] *Arabice*, Contenderunt de eo quod inter se erat: *phrasū usitata* **وَ** elegantius.

* **أَغْدَنْ** alerem.] legendum forte **أَعْدَنْ** id-

XXXII.

VENTER ET PEDES.

VENTER & Pedes contenderunt inter se quis ferret corpus. Dixerunt Pedes: Nos robore nostro ferimus corpus. At venter ait: Si nihil ego cibo alerem; non possetis vos ire, nedum ferre quidquam.

Hoc significat,

Eum, qui négotium aliquod suscipit, nisi adjuvetur ab eo, qui ipso major & potentior est, non posse perficere (obire) ministerium suum, & frustra esse.

XXXIII.

NOTE AD FAB. XXXII.

iddo, si ego non præparem cibi quicquam.
Frustra esse] *ad verbum*, Non esse utilitatem spiritui (*seu animæ*) ejus.

النَّمُوسُ وَ الدَّجَاجُ

يَأْتِيَ النَّمُوسُ عَنِ الدَّجَاجِ فَدْ مَرِضُوا فَلَبَسُوا جَلَوْدَ
الْطَّاوِسِ وَأَتَوْا تَهْرُورُهُمْ فَقَالُوا لَهُمْ السَّلَامُ حَلَبْكُمْ أَيْهَا
الدَّجَاجُ كَبْنَ أَنْتُمْ وَكَبْنَ أَخْوَالِكُمْ فَأَجَابُوا
مَذْنَحُنْ إِلَّا بَخْبِرِ يَسِيمَ لَا نَرِي وَجْوَهَكُمْ

هَذَا مَعْنَاهُ

مَنْ يُظْهِرُ الْمَحَبَّةَ مِنْهُ وَفِي قَنْبِهِ
الدَّغْمُلُ

NOTÆ AD FAB. XXXIII.

نَمُوس Furones] plurale est, a singulari (nimson.) quod significat animal quoddam Gallinis inimicum, in Oriente frequens, Auctori Glossarii Raphelengiani Furo, quod mibi nomen visum fuit retinere. Musta Ben Achmed in Lexico suo ait دلق سارى Arabic vocari, و Turcice سکانى capiteque و ore canino esse, crine caprino, oculis ful-

XXXIII.

FURONES ET GALLINÆ.

Intellexerunt FURONES ægrotare GAL-
LINAS; indutaque pelle pavonis ve-
nernnt eas visitatum; dixeruntque iis: Pax
vobis sit o Gallinæ: quomodo valetis?
Responderunt: Bene nobis est, cum non
videmus facies vestras.

Hoc significat,

Eum, qui per hypocrisim ostendit a-
morem, in corde autem suo (gerit) do-
lum & odium.

XXXIV.

NOTE AD FAB. XXXIII.

fulvis, corpore cæruleo, (mustelino) &c. * نمس
propre mustela est vulgaris, que alias metonymice
نمس عربی Ibn Irsin dicitur.

Quomodo valetis] ad verbum quomodo vos &
status vestri.

Bene nobis est.] *Arabice.* Nos non nisi in bo-
no sumus.

الشمس في الريح

الشمس في الريح تحاصن فيما بينهما من منها يغدر
 أن يجرد الإنسان التباد فأشننَّ الريح بالهوب وعصفة
 جداً فكان الإنسان إذا اشتدت هبوب الريح ضم
 ثبابة إليه في النف بها من كل جانب فترتفع
 النهر وأشتد الريح فخلع الإنسان ثبابة
 وحملها على كتفه من شدة الريح
 هذا مفناه

من كان معه الاتضاع وحسن الخلق
 يسأل من صاحبه مما ي يريد
 ديكان

NOTÆ AD FAB. XXXIV.

* باليهوب *lege* [بالهوب] Bilhuboubi.
 uti ^ق linea sequenti, flatu, flando: nam
 est formidolosus, Act. ^ق Pass.

عصفة *

XXXIV.

S O L E T V E N T U S .

SO L & V E N T U S contulerunt inter se, uter eorum posset efficere ut homo exueret vestes suas. Intenditque se vehementer Ventus impetu & tempestate. Homo autem, cum intenderetur vis Venti, collegit ad se vestes suas, involvitque se iis ab omni latere. Cumque ortus esset dies, & intenderetur calor, exuit homo vestes suas, tulitque eas super humero suo præ vehementia caloris.

Hoc significat,

Eum, quicum est humilitas & naturæ bonitas, consequi a socio suo quod vult.

XXXV.

N O T A E A D F A B . XXXIV.

* [عاصفة] lege ~~عاصفة~~ Asfhi, vehementi spiratione sua, vel ~~عاصفة~~ Asifatin, procella quadam ac tempestate.

دِيْكَانْ كَانْ ه

دِيْكَانْ يَقَاتِلُانْ فِي قَارُونَةِ فَغَلَبَ الْوَاحِدُ بِالْأَخْرَى
 مُضِيَّ مِنْ وَقْتِهِ فِي بَعْضِ الْأَمَاسِكِنْ فَأَمَّا الْدِيْكَانْ
 الَّذِي عَلَبَ صَدَدَ فَفَوْقَ سَطْحِ عَالِيٍّ وَجَعَلَ يَسْقُفَ
 بِجَنَاحَبَةِ فَيُصْبِحُ فَيَقْتَلُ خَرْ فَنَظَرَةً يَعْبُطُ
 الْجَوَارِحَ فَأَنْقَضَ عَالِبَهُ فَأَخْتَطَفَهُ لِوقْتِهِ
 هَذَا

N O T A E A D F A B . X X X V .

* قَارُونَةِ] *tantum ampullam vitream, aut ocu-
 li pupillam designat, quæ hic locum non habent.* Ne-
 que enim in *vel* sub ampulla pugnare possint gallina-
 cei duo. Itaque reddendum potius foret, ob ampul-
 lam, scil. pabulum ea contentum, *vel* legendum
 قَهْقُورِي] Kahkourin, quod longiorem ex lapidibus
 structuram notat, quam parare pueri solent: ita uti
 tradit Camus fortean sepimento similem, intra
 quod tale certamen fiebat.

- Vultur] *hoc certe animal puto significari duabus
 vocibus*, يَعْبُطُ الْجَوَارِحَ *quoniam de scriptu-*
ra

XXXV.

DUO GALLI.

DUOBUS GALLIS in vase pugnantibus alter vicit; & alter illico in locum quendam secessit: at Gallus, qui vicit, ascendit supra tectum altum, cœpitque complodere alas suas, & clamare ac gloriari; vidiisque eum vultur, qui celerrime in eum irruit, eumque statim rapuit.

Hoc

NOTÆ AD FAB. XXXV.

*ra nonnihil dubito, forte legendum
eminus: ut solum جواح sit animalis nomen. * Cum
vox proprio quidem signet vulnificas, id
est, rapaces aves, utique طالع—وأوح،
quasi clamosus accipiter, (nam à initio nonnunquam
servit) non inconvenienti metonymia vulturem de-
notarit, alias una voce هداون Hidaon appel-
latum: quod vix alia ejus generis avis voce ma-
gis strepera sit. Festo jugere vultur, aliis lippire
dicitur: unde forsitan recentioribus Græcis ipse لامـون
vocatur.*

هَذَا مَعْنَاهُ هـ

أَن لَا يَجِدُ الْإِنْسَانُ أَن يَفْتَدِي مِنْ بِعْدِ مَوْتِهِ فـ

ذِيَابٌ هـ

ذِيَابٌ أَصَابُوا جُلُودَ بَعْرٍ فِي جَوَارِ مَاءٍ قَسِيلٍ وَبَسَّ
خَنَدَهُمْ أَحَدٌ فَاتَّقَعُوا عَلَى أَكْلِهِمْ جَمِيعَ وَقَوَامَهُوا
لَنْهُمْ يَشْرِبُونَ الْمَاءَ كُلَّهُ حَتَّى يَصِلُوا إِلَيْهِمْ
فَيَأْكُلُوهُمْ قَمْنٌ كِنْزٌ مَا شَرَبُوا مُنْفَلَقُوا أَكْلَهُمْ
وَمَائِنُوا وَكُمْ يَصِلُوا إِلَيْهِمْ إِلَيْهِمْ

هَذَا مَعْنَاهُ هـ

مَنْ هُنَّ قِلْبَلَ الرَّأْيِ يَعْمَلُ مَا لَا يَجِدُ عَمَلَهُ فـ
أَكْلَوْنَ

NOTÆ AD FAB. XXXVI.

Crepuit venter eorum] *Arabice*, Rupti sunt
stomachum, seu quoad stomachum: *puto enim*,
اَكْل stomachum *significare hoc loco:* * *Ve-*
rum

Hoc significat,

Quod non oportet hominem gloriari virtute sua & roboris vehementia.

XXXVI.

L U P I


LUPI invenerunt pelles boum in fo-
vea aquæ fluentis, nec quisquam iis
aderat, & unanimiter statuerunt eas edere:
decreveruntque omnem aquam eibere, ut
attingerent pelles, easque devorarent. Præ
multitudine autem ejus quod biberunt (hau-
sti potus), crepuit venter eorum, & mortui
sunt, neque pervenerunt ad pelles.

Hoc significat,

Eum, qui consilio non valet, face-
re id quod fieri non oportet.

XXXVII.

N O T A E A D F A B . XXXVI.

*rum id ab usu abborret: quare vix dubito quin
I redundet, legendumque sit*  *, cre-
puerunt omnes.*

Mm

الْوَرْ وَالْحُطَّافُ اشْتَرَكُوا فِي الْمَعْبُشَةِ فَكَانَ
مَرْعِي الْجَمِيعِ فِي مَكَانٍ وَاحِدٍ وَرَأَيَا يَوْمًا تَوْهِيمَ
الصَّبَادِينَ فَأَمَّا الْحُطَّافُ فَلَأَجْلٍ خَفَّتْهُ طَامِ وَسَلِيمَ
وَأَمَّا الْوَرْ فَأَدَرَ كَوْهَ الْصَّبَادِينَ فَذَبَحَوْهُ
هُدَى مَفْنَاهُ
مَنْ يَعَاشُ مَنْ لَا يَشَاكِلُهُ وَلَبَسَ
هُوَ أَبْنُ جَنْسِهِ

NOTÆ AD F.A.B. XXXVII.

Utriusque] *proprie*, universitatis *seu omnium*:
frequenter enim vox etiam de duobus usurpatur.

Ejus-

XXXVII.

ANSER ET HIRUNDO.

ANSER & HIRUNDO sociata-
tem inierunt vitæ, erantque pascua
utriusque in loco uno. Visis autem ali-
quando insidiis venatorum, Hirundo prop-
ter levitatem suam avolavit, & evasit:
at Anserem ceperunt venatores, & occi-
derunt.

Hoc significat,

Eum, qui amicitiam init cum eo cum
quo non convenit, nec qui ejusdem est
generis.

NOTÆ A D F A B. XXXVII.

Ejusdem generis] *Arabice*, qui non est filius ge-
neris ejus.

FINIS FABULARUM.

SEN T E N T I A
QUÆDAM
A R A B I C Æ.

I.

Initium sapientiæ
est timor D E I.

رَأْسُ الْحِكْمَةِ مَخَافَةٌ
اللَّهٌ

II.

Eruditus in patria
sua est ut aurum in
fodina sua.

الْعَالَمُ بِإِرْضِ مِبْلَادِهِ
كَالْذَّهَبِ فِي مَعْدُنِهِ

III.

Qui se ipsum ha-
bet pro sapiente, ha-
bent eum Deus &
homines pro igna-
ro.

مَنْ تَرَكَ نَفْسَهُ بِمَنْزِلَةِ
الْعَاقِلِ تَرَكَهُ اللَّهُ
وَالنَّاسُ بِمَنْزِلَةِ الْجَاهِلِ

N O T A E A D S E N T . III.

* Pro قرکه ^ع paulo post قرکه ^ع malim le-
gere nezzela ^ع nezzelaho; vel جعل

Pro sapiente] ad verbum : Qui se constituit ad
modum sapientis, constituunt eum, &c.

مَنْ أَحَبَّ أَنْ يَقُولَ
عَلَيْهِ الْحَكْمَةَ فَلَا
تَمْلِكُ نَفْسَهُ الْبِنْسَاءُ

I V.

Qui cupid polle-
re sapientia, in a-
nimam ejus potesta-
tem ne habeant mu-
lieres.

نَقْلُ الْبَشَرِ عَنْ
شَرِفِهِ لَيْسَرُ مِنْ
نَقْلِ الْمُخْزُونِ عَنْ حَزْدَةِ

V.

Abducere malum
a malitia sua (male-
factis suis) facilius
est, quam tristem a
trifitia.

فَكُنْ مِمَّنْ لَا تَغْرِي
عَلَيْهِ حَلْقَةٌ

V I.

Cave ab eo, quem

مَنْ كَانَ الظَّمْعَ
لَهُ مَرْكَبًا كَانَ الْفَقْرُ
لَهُ صَاحِبًا

V II.

Qui vehitur curru
Spei; sociam habet
Paupertatem.

N O T A E A D S E N T . VII.

*Bonum nimirum exspectat, non possidet, qui id
sperat: unde indigens ejus & pauper non immerito
dicitur. Affine huic est illud Italicum, La speran-
za e il pane de miseri.*

VIII.

Qui tegit secretum
suum, quod cupid,
consequitur.

IX.

In capite orphani
discit chirurgus.

فِي رَأْسِ الْبَرْتَبَةِ
يَتَعَلَّمُ الْجَحَّامُ

X.

In hac stra e Rytberg, ieddens ornatus quatuor in permultis horum locis tentias reprehendit, at in 2, 8. ex.
Quidquid planta-
veris in horto, uti-
litatem tibi afferet:
at hominem si plan-
tes, is eradicabit te.

كُلُّمَا تَعْرِسُ فِي
الْفَدَانِ يَنْفَعُكَ
تَعْرِسُ أَوْنَادَمَ يَقْلَعُكَ

XI.

Præstat te secre-
tum tuum custodire,
quam alium a te.

حَفْظُكَ لِسِرِّكَ أَوْجَبٌ
وَهُوَ مِنْ حَفْظِ غَيْرِكَ لَهُ

NOTÆ AD SENT. IX.

Affine huic est ^{et} sensu ^{et} verbis illud Hispa-
nicum: A barua de necio aprenden todos a rapar.

X. [الغدان] sunt Arab. uti ^{et} Hebr. ^{et} Chald. Ara-
ratorii boves, pec. juges, eorumve par. etiam aran-
trum. At hinc agrum, aut quod longius abest, hor-
tum notare, nusquam reperi. Nec ^{في} الغدان aran-
do, vel inter arandum, quis recte verterit. Itaque
legendum videtur ^{في} الجنهان Filzjinani, in hortis.

Hominem si plantes, &c.] id est, si hominem ad

X I I.

مَنْ أَوْجَهَكَ فَقُدْمُ
شَتَّمَكَ | Qui adulatur ti-
bi , etiam detesta-
tur te.

X I I I.

مَنْ نَقَلَ إِلَيْكَ فَقُدْمُ
نَقَلَ عَنْكَ | Qui affert ad te ,
aufert & a te.

X I V.

الْعَالَمُ عَرَفَ الْجَاهِلَ
لَاذَةُ كَانَ جَاهِلًا
وَالْجَاهِلُ لَا يَعْرِفُ الْعَالَمَ
لَاذَةُ لَا كَانَ عَالَمًا | Doctus novit Indo-
ctum , quia indo-
ctus fuit : sed Indo-
ctus non novit Do-
ctum , quia doctus
non fuit.

N O T A D S E N T . X I I .

*dignitatem promoveas, is de tua te dignitate detur-
babit. Non minus verum, quam elegans adagium,
cui simillimum circumfertur apud Gallos.*

* [اوجـهـكـ] *id est* شـرفـكـ, Sjerrafaca, Qui extollit te ac laudat, etiam maledicit tibi.

XIII. *Elegans Adagium in garrulos: qui si alio-
rum se creta tibi aperiant, nec tua alios celant.
Belgæ iisdem fere & totidem verbis dicunt: Die
veel in brengt, brengt veel uyt.*

Stultus, seu indotus, sibi ipsi inimicus est, quomodo sit amicus alii?

X V.

أَلْجَاهِلُ عَدُوٌ لِّنَفْسِهِ
فَكَيْفَ يَكُونُ صَدِيقًا
لِّغَبْرِةِ ؟

Non egreditur anima e spe, donec ingrediatur mortis momentum.

X VI.

لَا تَخْرُجْ النَّفْسُ مِنْ
الْأَمْلِ حَتَّى تَذْخُلَ فِي
الْأَجْلِ ؟

Qui minuit negotia, equitat maria.

X VII.

مَنْ مَارِسَ الْأَمْوَارَ
مُكَبِّلًا بَخْوَرَ ؟

NOTÆ AD SENT. XVI.

Ajl generaliter finem seu terminum notat: sed hic & alibi passim vitæ terminum & mortis ipsius instans. Unde Latini: Ægroto dum anima est, spes est. Et Itali: La morte sola puo occider la speranza.* Quin saep cum maxima sperant homines, inopinantibus proxime adest ut exspirent; juxta simile eodem rhythmō dictum:

مَنْ جَرَى فِي عِنَانِ أَمْلَهُ قَدْ عَثَرَ فِي أَجْلَهِ ؟

Dum quis forte spei laxatis currit habenis,

Ad fati metam cæspitat ille sui.

XVII. Elegansissimum rhythmō adagium; sed cuius

X V I I I .

طُولُ التَّجَارِبِ نَرِيَادَةٌ

فِي الْعُقْدِ بَلْ

كَانَ النَّاسُ كَافِرُهُمْ

عَنَّا خَرَبَتْ الْأَذْنَابُ

أَعْسَانُ مُرِيبِنْ كَبِيرًا

مَنْ الْأَمَالِ

الْكَسْلُ وَكَثْرَةُ

النَّقْمِ يَبْعَدُهُمْ مِنْ

Longitudo experi-
entiæ augmentum est
intelligentia.

Si omnes homines
saperent, desereretur
mundus.

Nequitia (impro-
bitas) multas aufert
opes.

Pigritia & mul-
titudo somni abdu-
cunt a Deo, & ad-

N O T A E A D S E N T . X I X .

*ego acumen non satis capio, مارس aut aliud hic for-
tassis significat, aut aliter scribendum est. ** مارس
*per عالج exponit Gieuharis, & sic erit, qui tractat,
administrat, obitve negotia. Et Persice Marufides
interpretatur: منج بردن بکاري في کوشبد atque ita sonabit: qui se intendit negotiis, atque
molestiam suscipit, navigat maria, sic e contrario
dixit Cicero: magnum negotium est navigare.*

Saperent] *id est, sapientiae piisque meditationibus
toti dediti, a licitis etiam voluptatibus & conjugio
abstinerent.*

Nn

Nisi

ducunt paupertatem.

الله وَيُورِثَانَ الْفَقْرَ

X X I I .

Quære vicinum ante domum, & socium ante viam.

أَطْلَبْ الْجَارَ قَبْلَ الدَّارِ
فِي الْرَّفِيقِ قَبْلَ الْطَّرِيقِ

X X I I I .

Benefac, si vis ut benefiat tibi.

أَخْسِنْ إِنْ أَرْدَتْ أَنْ
يَخْسِنَ إِلَيْكَ

X X I V .

Vitupera te ipsum, ut vituperas alium.

إِسْتَقْبِحْ لِنَفِيسِكَ كَمَا
تَسْتَقْبِحْ لِغَيْرِكَ

X X V .

Initium iræ furor est, finis vero pœnitentia.

أَوَّلَ الْغَضَبِ جُنُونٌ
وَآخِرَةُ نَدَمٌ

X X VI .

Deficiente potestate, frustra est conatus.

إِنْ كَانَ الْمُقْدَرْ

* potius hoc sonat: Si quod a Deo destina-

يَسْتَمِعْ فَاتَّسْخِرْصَ

N O T A E A D S E N T . X X .

Nisi malis وَ *quod alias* per-
versitatem وَ naturæ pravitatem & corruptelam
vel seditionem etiam significat, hic prodigalita-
tem,

فَلَكَ طَلْبُ

tum sit, explebitur; uil
tique vana est ayiditas.

مَنْ غَلَبَ هَوَّةَ لِعَقْلِهِ

Cujus concupiscentia
vincit intellectum;
(seu rationem) is perit.

فَلَكَ

Religio (cultus Dei)
occidit concupiscentiam.

أَلْعَبَادَةُ تَمْبَثُ

Inimicus sapiens
præstat amico stu-

الشَّهْوَةُ

to: l' esgnil fte roil
x x i x .

عَدُوٌ عَاقِلٌ أَخْيَرُ مِنْ

Abstinere a con-
cupiscentiis est divi-

صَدِيقٌ جَاهِلٌ

tem esse.

x x

أَلْكَبِقْ عَنْ

Nullus intellectus

الشَّهْوَاتِ غَنِّيٌّ

similis est prudentiae:
nulla abstinentia simi-

x x

لَا عَقْلٌ كَحَانَدَبِسٌ وَلَا

NOTÆ AD SENT. XXII.

وَمَنْعَ كَالْكَفْ عَنْ

proprie est corrumpere.
Gemino rhytmio, & sensu elegans prover-

N O T E A D S E N T . X X I I .

tem, denotare. Radix

biuum : intricatae sententiae sicut

Gemino rhytmio, & sensu elegans prover-

bium.

N n 2 Suf-

lis ei, qua abstinetur
a vetito : neque bo-
nitas , bonitati natu-
ræ (indolis:) nec ullæ
divitiæ, sufficientiæ.

آلْحَرَمُ وَلَا حَسْنَ
كَحْسَنٍ آلْخَلْقُ وَلَا
غُنَيٌ كَالْقَنْوِعِ

X X X I .
Paupertas præstat
divitiis illicitis , &
lucro injusto.

آلْفَقْرُ آلْخَبِيرُ مِنْ آلْغَنِيِ
آلْحَرَمُ وَآلْأَكْتَسِابُ
مِنْ آلْظُلْمِ

X X X I I .
Lingua muti me-
lior est lingua lo-
quentis mendacium
(i.e. mendacis.)

لَسَانٌ آلْحَرِسُ آلْخَبِيرُ مِنْ
لَسَانٌ نَاطِقٌ فِي
آلْكَذْبِ

X X X I V .
Pessimus hominum
est Eruditus , qui non
prodest eruditione sua.

أَشَرُّ الْتَّنَاسُ آلْعَالَمُ
لَا يَنْفَعُ بِعِلْمِهِ

X X X V .
Duo non saturan-

إِثْنَانٌ لَا يَشْبَعانِ

N O T A E A D S E N T . XXXI .
Sufficientiæ] vis vocis قَوْفَنْ non satis
commodo hic Latine potest exprimi : quippe quæ
s u M n o -

طَالِبٌ عِلْمٍ وَ طَالِبٌ
⊗ مَالٌ

tur, Quærens scien-
tiam, & Quærens o-
pes.

X X X VI.

شَخْصٌ بِلَا أَدَبٍ
كَجَسَدٌ بِلَا رُوحٍ

Persona sine eru-
ditione, est ut cor-
pus sine spiritu.

X X X VII.

الْغَلَبِيلُ مِنْ الظَّاهِرِيِّ أَخْبَرَ
مِنْ الْكَثِيرِ مِنْ الْنَّافِعِ

Paucum noxii præ-
stat nimio ejus, quod
utile est.

X X X VIII.

الْجَاهِلُ يَرْضِي عَنْ
نَفْسِهِ

Ignarus seu stultus
placet sibi.

X X X IX.

مَنْ كَثَرَ كَلَامُهُ
⊗ نَلَّ

Qui multiplicat ser-
monem, errat. * pro-
prie cæspitat.

X L.

الْقَنْتَغُ مِنْ الْغَلَبِيلِ
⊗ غَنِيٌّ

Paucis contentum
esse, divitiae sunt.

N O T A A D S E N T. XXXI.

*nomen est significans contentum esse eo quod ha-
bes.*

Nn 3 * مَحْسُون

Doctus exul melior
est indocto qui susten-
tatur.

X L I.

الْعَاقِلُ الْمَحْسُوفُ أَخْبَرَ
مِنْ الْجَاهِلِ الْمَرْفُوفِ

Audi, & disce: si-
le, & pacem habe.

X L I I.

إِسْمَاعِيلْ قَاتِلُهُ فَأَسْكَنَ
فَاسْلَمَ

In festinatione est
poenitentia, & in mo-
ra prosperitas (*vel fa-
lus.*)

X L I I I.

فِي الْعَجَلَةِ تَكُونُ
الْتَّدَامَةُ وَفِي التَّوْانِي
السَّلَامَةُ

Homines, duos sunt:
consequens nec con-
tentus, & querens nec
inveniens.

X L I V.

الْأَنْسَانُ أَثْنَيْانٌ بَالِعُ
لَا يَكْتَنِي وَطَالِبٌ
لَا يَجِدُ

Propitios habere

X L I . V.

إِصْلَاحٌ الْرَّعْبَةُ

N O T A E A D S E N T . X L I .
* مَرْفُوفٌ مَحْسُوفٌ sunt duo contraria: hic,
cui de vita adminiculis & bona forte prospectum est;
ille, qui illis destitutus est, & exclusus, itaque sententia hæc est: Vir intelligens qui bonis caret, insipienti præstat qui illis gaudet.

* Dis-

أَنْفَعُ مِنْ كِنْسَةِ
الْجَهَّادِ وَهُوَ

(bene regere) subdi-
tos, utilius est mul-
titudine militum.

X L V I .
الصَّبَرُ مُفْتَاحُ
الْفَرَحِ وَالْعَجَلَةُ
مُفْتَاحُ الْتَّدَامَةِ

Patientia est clavis
gaudii, festinatio au-
tem clavis pœnitentiæ.

X L V I I .
كَبْسُ لَمْكُوكِيٍّ
أَخْ وَلَا لَكْشُودِ
لَرَاهَةُ وَلَا لَكْ دُوبِ
هُرْقَةُ

Non est regibus fra-
ter, nec invidis quies,
neque mendacibus fa-
vor, * *potius*, neque
mendaci ulla virilis
virtus, aut decus vi-
ro dignum.

X L V I I I .
الْمَعْتَدُلُ بَعْرِدَنْبُ يَوْجَبُ
الْذَّنْبُ عَلَيْ نَفْسِهِ

Qui justificat se si-
ne culpa, culpam sibi
efficit.

N O T A E A D S E N T . X L I I .

* *Disce] proprie*, scito; *id est*, sciveris, *vel ut* scias.

* *Pacem habe] proprie*, salvus esto; *id est*, sal-
vus fueris, *vel ut* salvus sis.

X L I V . *Hominum alii quæ querunt inveniunt, nec
inventis sunt contenti: alii querunt, nec inveniunt.*

* *المُعْتَدُلُ*

X L I X.

Cave tibi a viro honорато, (generoso,) cum vilipenderis eum, & a stulto cum luseris cum eo; & a Sapiente, cum offendaris (ad iram provocaveris) eum; & ab Improbo, cum amicitia ei junctus fueris.

كُنْ عَلَيْ حَذْرٍ مِنْ
الْكَرِيمِ إِذَا هَوَّتْهُ وَمِنْ
الْحَمَقِ إِذَا مَأْرِجْتَهُ
وَمِنْ الْعَاقِلِ إِذَا غَصَبْتَهُ
وَمِنْ الْفَاجِرِ إِذَا
عَاهَرْتَهُ

Tres utilitatem non capiunt a tribus: Nobilis a Vili; Probus ab Improbo; Sapiens a Stulto.

ثَلَاثَةٌ لَا يُنْفَعُونَ مِنْ ثَلَاثَةٍ
شَرِيفٌ مِنْ دَنِيٍّ فَبَارٌ مِنْ
فَاجِرٍ وَحَكِيمٌ مِنْ جَاهِلٍ

Non est scientia, nisi quae in pectore est abs-

لَا عِلْمٌ إِلَّا مَا
كَانَ مَنْ تَقْرَبَ

N O T A E A D S E N T. X L V I I I .

* [المنتذر] *est temperatus, mediocris: quare legendum* [المنتذر] *vel* [المنتذر] *qui reprehensionem admittit.*

Sine culpa] *id est sine accusatione: qui enim purgare se, antequam accusatur, nititur, is a conscientia*

فِي الْأَشْدَدِ
مَتَّيْ شِبَابَتِ
أَظْهَرْتُمْ فِي

أَوْهُمُ النَّاسُ مَنْ يَنْظُرُ
الْعَوْاقِبَ فِي

ثَلَاثَةٌ لَا يُعْرَفُونَ إِلَّا فِي
ثَلَاثَةٌ مَوَاضِعٌ لَا يُعْرِفُ
الشَّجَاعَ إِلَّا عِنْدَ الْحَرْبِ وَلَا
يُعْرِفُ الْحَكِيمُ إِلَّا عِنْدَ
الْغَصَبِ وَلَا يُعْرِفُ الْصَّدِيقُ
إِلَّا عِنْدَ الْحَاجَةِ إِلَيْهِ

condita, cum lubet,
producis eam: * vel nisi
pro libitu proferre pos-
sis, seu manifestum fa-
cere, quod in pectore
est absconditum.

L II. Sapientissimus ho-
minum est qui fines
respicit.

L III. Tria non cognos-
cuntur, nisi in tribus
locis. Non cognos-
citur audacia nisi in
bello. Non cognos-
citur sapiens nisi in i-
ra. Neque cognos-
citur amicus nisi in
necessitate.

N O T A E A D S E N T I A
tia sua accusari, culpamque sustinere, non immerti-
to creditur.

Amicitia] est quoque Affinitate cum ali-
quo jungi. Sed amicitiae notio huic loco melius mihi
videtur congruere.

Oo Ami-

Qui non discernit
bonum a malo, adjun-
ge eum bestiis.

L V.

مَنْ لَا يَعْرِفُ الْخَيْرَ مَنْ
الشَّرِّ الْحِقْةُ بِالْهَمَيمِ ﴿٤﴾

Optimus amicorum
est, qui amicos suos
jubet cavere sibi a ma-
lo, dirigitque eos ad
bonum.

L V.

خَيْرُ الْأَخْوَانِ مَنْ
خَيْرٌ إِخْرَقَةٌ مَنْ الشَّرِّ
وَهَدَاهُمْ إِلَى الْخَيْرِ ﴿٥﴾

Non est sapiens fa-
piens, donec cupidi-
tates suas omnes vin-
cat.

L VI.

لَا يَكُونُ الْحَكِيمُ
حَكِيمًا حَتَّى يَغْلِبَ
جَمِيعَ شَهْوَاتِهِ ﴿٦﴾

Qui experitur, au-
get scientiam; qui vero
credit, auget errorem.

L VII.

مَنْ يَجْرِيَ بِرِزْ عَلِيًّا
مَنْ يَوْمَنْ يَرِزْ غَلَطًا ﴿٧﴾

NOTÆ AD SENT. LV.

Amicorum] خ propriæ fratrem significat: sed u-
surpatur non raro pro amico; quæ significatio haud
dubie est hujus loci: sic in Adagio 56. alibi legi

لَا يَغْرِفُ الْأَخْ إِلَّا عِنْدَ الْحَاجَةِ إِلَيْهِ ﴿٨﴾

Non cognoscitur frater nisi in necessitate.

imA

○ ○

Si-

L V I I I .

أَخْرِسْ عَاقِلْ أَخْبَرْ
مِنْ جَاهِلْ نَاطِيفْ

Mutus sapiens præ-
stat stulto loquenti.

L I X .

إِذَا تَكَلَّمَتْ كَلْمَةً
مَكَنْكَهْ فَإِذَا كُمْ تَكَلَّمَ
بَهَا مَكَنْكَهَا

Cum verbum ali-
quod es proloquutus,
dominatur id tibi: cum
vero id proloquutus
non es, tu ei dominaris.

L X .

أَنْ لَا جَهَلْ الْجَاهِلْ
لَمْ يَعْرِفْ الْلَّبِيبْ
الْعَاقِلْ

Nisi desiperet stu-
lus, non cognoscere-
tur prudentia Sapien-
tis.

L X I .

أَطْلَبْتْ عِلْمًا مِنْ الْمَهْدِ
الَّهِيَ الْهَدِي

Quære scientiam
a cunis ad sepul-
chrum.

N O T A E A D S E N T . L I X .

Simillimum huic est proverbium xlv. Centuria prioris duarum illarum, quas jam pridem evulgavimus. Arcanum tuum est captivus tuus, si custodieris illud: tu autem es captivus ejus, si manifestetur.

LX.* *الْبَبْ notat tantum cordatus, prudens: ac sic legendum esset الْبَبْ الْعَاقِلْ in casu recto,*

LXIII.

Difficillima homini est sui ipsius cognitionis.

أَصْعَبَ عَلَيْيَ الْإِنْسَانُ
مَغْرِفَةً نَفْسِهِ

LXIII.

Homines regum suorum sequuntur religionem.

الْإِنْسَانُ عَلَيْ دِينِ
مَلَوكِهِمْ

LXIV.

Qui laudat obscœnum, is perpetrat illud.

مَنْ أَسْتَحْسَنَ قَبْلًا
فَقَدْ عَمِلَهُ

LXV.

Accipe ab RID.

خُذْ مِنْ الْرِّضْوَةِ

NOTÆ AD SENT. LXI.

prudens & intelligens, vel pro Lubbo, ingenium, intelligentia.

LXI.* est duntaxat via recta, & dies, itaque pro sepulchri notione, & servando rhythmo, legendum l'wahdi: proprio vero hac vox terram depressam notat.

LXII. Unde merito, tanquam divinum, celebratur aureum illud veterum sapientum apophthegma, Nosce te ipsum.

LXIII. Sequuntur vel sequi oportet: hoc certe sensu memini id a docto quodam Arabe me praesente usurpatum.

200

Non

فَمَا عَلِمْتُهَا فَإِنْ كُلَّا مَالَ إِنْ كُلَّا مَالَ
F A quod super ea
est.

L X V I .

حَبَّ الْدَّنَبَةِ فِي الْمَالِ

Amor mundi & di-
vitiarum omnis pec-
cati est origo,

رَأْسُ كُلِّ حَطَبَةِ

Verecundia impe-
dit largitionem.

L X V .

الْحَبَّةُ يَمْنَعُ الْزِّرْقَ

Optimum supœni-
tentiæ bestiæ paucitas
delicti.

L X V .

خَبَرُ الْمُنَادَةِ قَلَّةٌ

S E N T . L X V .

الْخَلَافُ

N O T A E A D :

Non habent Latini (aut ego fallor) nomen quo
exprimant Arabicum رضفة quod significat, lapi-
dem tacti imponi solitum ad id calefaciendum. Mens
autem Adagii est: ab homine avaro quicquid haberis
potest, ut sit exiguum, sumendum esse.

LXVII. Qui præ pudore quod desiderat petere non
audet, id conséqui quoque ut plurimum non solet.

LXVIII. Vera nempe pœnitentia non est, quam
non sequitur vita emendatio, خلاف propriæ quidem
est contrarietas, repugnantia, sed hic sumitur pro
peccato, pœnitentiæ contrario.* At المناداة non est
idem quod فداء، sc. pœnitentia, sed compotatio

O o 3 tan-

L X I X.

Quicquid in manu
servi est , domini e-
jus est.

كُلُّمَا فِي يَدِ الْعَبْدِ

لِمَوْكِبَةٍ

L X X.

Sex proprietatibus
agnoscitur stultus :
Quod abs re irasca-
tur; quod loquatur in-
utilia; quod fidat cui-
libet; quod mutet u-
bi locus non est mu-
tationis; quod querat
quod ad se non atti-
net; & quod non dis-
cernat amicum suum
ab hoste suo.

جِسْتَهُ خَصَالٍ يَغْرِفُ
الْأَحْمَقُ بِالْقَضَبِ مِنْ غَيْرِ
شَيْءٍ فِي الْكَلَامِ فِي غَيْرِ
نَعْلَمٍ فِي النَّقْةِ فِي كُلِّ أَحَدٍ
فِي بَدْلَهُ جَعْبَرٌ مَوْضِعُ التَّبَدِيلِ
وَسَوْالَهُ عَنْ مَا لَا يَعْنِيهِ
فِي بَانَةِ مَا يَعْرِفُ صَدِيقَةُ
مِنْ حُمْدَةٍ

N O T A E A D S E N T . L X I X .

tantum. Itaque ad verbum fuerit, Optimum compotationis est paucitas contrarietatis: id est, in convivio, vel convivali seu amica consuetudine, optimum est adversum esse nemini.

LXIX. *Usurpari solet, cum quis se suaque omnia alii humaniter offert.*

LXX. In tertio membro, pro **بَذْلَهِ** legendum

بَذْلَهِ

الذبابة جبعة وطالبوه
كلاب ﴿

LXXXI.

Mundus cadaver
est, & petentes eum
canes sunt.

الغنى هو القنوع
ورأس المفترس
الخضوع ﴿

LXXXII.

Divitiae sunt, con-
tentum esse: præci-
puum autem pauper-
tatis, abjectum (*seu*
submissum) esse.

يهلك الناس في
خلالتبسي فضول المسال
وفضول الكلام ﴿

LXXXIII.

Duobus modis per-
eunt homines: Abun-
dantia opum; & A-
bundantia sermonis.

لَا تُعِدْ نفسك مِنَ الناسِ

LXXXIV.

Ne te hominibus

N O T A E A D S E N T. LXXII.
بِذلِك البذل ut sit, quod large donet, ubi
locus non est donationi.

LXXII. *Idem fere babes Centuria prima, Proverb.*

LXIV. sc. هُمُّ الْغَرْبُ الْخُضْرَاعُ وَخَيْرُ الْغَنِيِّ الْقَنْوَاعُ
Malum paupertatis est, abjectum (*seu* submissum)
esse: bonum vero divitiarum, esse contentum.

حالة, *Idem est quod* حَالٌ قَوْعَدٌ حَالٌ status, mo-
dus,

annumeres , quamdiu
ira te superat.

مَا دَامَ الْغَضَبُ عَالِيًّا
عَلَيْكَ فَإِنْ

L X X V . Contentus esto ,
quod Deus tibi im-
pertit ; : & eris dives.

إِقْرَأْ بِمَا قَسَمَ اللَّهُ
لَكَ تَكُونَ غَيْبًا

L X X VI . Abstinentia arbor
est , cujus radix est
Contentum esse , fru-
ctus vero Quies.

الْوَرْعُ شَجَرَةً أَصْلُهَا
الْفَقَاءُ وَثُمرُهَا الْرَّاحَةُ

L X X VII . Visitans in manu
est visitati.

الْزَائِرُ فِي قَبْضِ
الْمَزْوِينِ

N O T E A D S E N T . L X X V I I .
dus , conditio . * *Quin non aliter quam*
est legendum , non حَالَةٌ *est tantum*
matertera , حالٌ autem حَالٌ *differunt :*
quippe prius est status , posterius vero modus.

L X X V I I . *Amicus visitatus domi sua visitanti le-*
ges præscribit .

L X X V I I I . *Turpe est doctori , cum culpa redarguit*
*ipsum . * Verum يَحْتَارُ non notat reprehendere ; sed*
meditari technam : ut sensus sit , non est intelligens ,
qui dolum vel technam struit in quam ipse incidat .

Pro-

LXXXVIII.

لَبْسُ الْعَاقِلِ الَّذِي
يَحْتَالُ الْأَمْرَ فَبَعْدَ ذَلِكَ
يَقْعُدُ فِيهِ

Non est sapiens
qui negotium aliquod
reprehendit, postea
vero in id incidit.

LXXXIX.

جَمَلٌ بِمَوْضِعِ جَمَلٍ
يَنْبَرِكُ

Camelus in lo-
co cameli genu fle-
ctit.

LXXX.

الَّذِي بِالْوَصَائِلِ لَا
يَكْفُضُ صَائِلَ

Mundus est in suf-
ficientibus, non in a-
bundantibus.

LXXXI.

أَحْمَقُ مَنْ أَرْجَلَةً

Stultior Portulaca.

N O T A E A D S E N T . L X X I X .

*Proverbii hujus usus est, cum res undequaque simili-
limes inter se commutantur, aut similis succedit simili-*

LXXX. *Satis habet qui, quod sufficit, habet,
non quod abundat.*

LXXXI. *Hujus Adagii sola ratio, ni fallor, est,
quod alio nomine Portulaca حِمْقَاء id est Stulta (po-
tius بِغْلَةُ الْحِمْقَاء i. e. olus fatuum) vocetur: cuius
appellationis ratio mihi certe non liquet. Nam quod
Mustapha ait, eam ita dictam, quod non nisi in
fluente crescat, falsum est: crescit enim in hortis.*

Pp * Ab

LXXXII.

Frequens ad homines accessus adducit malum.

كثرة القرب إكي

الناس تجلب السوء

LXXXIII.

Visita raro, augebis amorem.

غير غبا شره حبا

LXXXIV.

Qui aliquid amat, frequenter ejus mentionem facit.

من أحب شيئاً أكثر
ذلك

LXXXV.

Demissio sui augmentum est nobilitatis, & complementum gratiae.

التواضع بريادة في
الشرف فيه تترشم
السمعة

LXXXVI.

Perfectio est in tribus rebus: quae sunt

الكمال في ثلاثة
أشباء العفة في السدين

N O T A E A D S E N T . LXXXIII.

* *Ab insipido sapore ac stupore sic portulaca dicitur: ita uti ἐῳ blitum μωρὸν λάχανον olus fatuum vocarunt Græci: ἐῳ adagio dici solet, blito despectior aut stultior, de homine socorde ἐῳ imutili, aut insulso ac fatuo.*

LXXXIII. Ut crebra nimis visitatio amorem minue-

فِي الصَّابَرِ عِنْدَ النَّوْلَيْبِ وَحَسْنَ
الْمُعِيشَةِ

Devotio in religione;
patientia in adversis;
& prudentia in vita.

L X X X V I I.

سُلْطَانٌ بِلَا عَنْدِ
كَنْهِيرٍ بِلَا مَاءِ

Imperator sine ju-
stitia est ut fluvius si-
ne aqua.

L X X X V I I I.

كَمَا الْبَدْنُ إِذَا هُنَّ سَقِيمٌ
لَا يَنْفَعُهُ الْطَّعَامُ كَذَا الْعُقْلُ
إِذَا خَلَقَهُ حَبَّ الْدَّرْبَى لَا
تَنْفَعُهُ الْمَوَاعِظُ

Ut corpori ægro-
to utilis non est ci-
bus: ita menti cap-
tæ amore mundi
non prosunt admoni-
tiones.

L X X X I X.

عَالِمٌ بِلَا عَمَلٍ
كَسْخَابٌ بِلَا مَطْرِبٍ

Doctus sine ope-
re, ut nubes est sine
pluvia.

N O T A E A D S E N T. LXXXVIII.
nuere, sic rarer augere solet. Usus proverbii est,
cum de rara amici visitatione quis reprehenditur.

LXXXVIII. Captæ] ad verbum, cum occlusit eam
amor mundi. * غَلَف legit vir doctiss. pro عَلَف A'li-
ka: hoc autem notat, inhærere animo, afficere ani-
mum; ♂ peculiariter de amore usurpari vox solet.

Qui patrem suum honorat, prolongantur dies ejus.

X C.

مَنْ وَقَرَ أَبَاهُ طَالَتْ
أَيَّامَهُ ♫

Dives sine liberalitate est ut arbor sine fructu.

X C I.

غَنِيٌّ بِلَا سَخَاءً
كَشْجِرٌ بِلَا ثَمَرَةً ♫

Pauper sine patientia est ut lampas sine oleo.

X C II.

فَقِيرٌ بِلَا صَبَرٍ كَعَنْدِهِ يَلِ
بِلَا مَرْيَتٍ ♫

Juvenis sine poenitentia est ut domus sine tecto.

X C III.

شَبَابٌ بِلَا تَوْبَةَ كَبَيْتٍ
بِلَا سَقْفٍ ♫

Mulier sine verecundia est ut cibus sine sale.

X C IV.

إِصْرَارٌ بِلَا حَبَّةً كَطَعَامٍ
بِلَا مَلْحٍ ♫

Dies unus viri docti præstat tota vita indocti.

X C V.

يَوْمٌ وَاحِدٌ لِلْعَالَمِ أَخْبَرَ مَنْ
الْحَبَّةَ كُلُّهَا لِلْجَاهِلِ ♫

NOTÆ AD SENT. XCVII.

Significat elegans hoc Adagium, charissimos esse parentibus suos liberos: at hos nihil mi-

SENTENTIARUM

nus

X C VI.

الظَّالِمُ مَيْتٌ وَلَنْ كَانَ
 فِي مَنَازِلِ الْأَحْبَاءِ
 فِي الْمُحْسِنِ حَيٌّ وَلَنْ كَانَ
 أَنْتَقَلْ إِلَيِّي مَنَازِلِ الْمُؤْمَنَاتِ

Improbus mortuus
 est, etiamsi in man-
 sionibus sit vivorum:
 at Probus vivus est, li-
 cet migraverit in man-
 siones mortuorum.

X C VII.

قَدِيبٌ عَلَيِّ آبَنِي وَقَدْبٌ
 آبَنِي عَلَيِّ حَجَرٌ

Cor meum super
 filio meo est: at cor
 filii mei super lapide.

X C VIII.

عَدُوكَ وَحَاسِدُكَ لَا
 تَنْظُهُرُ لَهُمْ عَدُوًّا نَكْ

Nec hosti tuo, nec
 invidenti tibi inimici-
 tias tuas manifesta. *lege عَدَاوَنَكَ

X C IX.

لَا تُقْبِرْ مُؤْمِنَةَ حَتَّى
 تَفْكِرَ فِي بَهْ

Ne aggredere ne-
 gotium aliquod donec
 id perpenderis.

لَا تَخَاطِبِ الْأَحْمَقَ
 وَلَا تَخَالَطْ فَإِنَّهُ
 مَا يَسْتَكِي

Ne colloquere cum
 stulto, nec commerci-
 um cum eo habe: quip-
 pe quem nihil pudet.

N O T A E A D S E N T . X C V I I I .

nus saepe quam parentes redamare.
 Inimicitias tuas] in alios, ut opinor.

F I N I S.

Pp 3

The Collodion's claim
against the manufacturer
and distributor of the
dope which caused the
burns will be heard.

E X C E R P T A
EX
ANTHOLOGIA
VETERUM POETARUM,
QUÆ INSCRIBITUR
HAMASA ABI TEMMAM.
EX MS. BIBLIOTH. ACADEM.
LUGD. BATAV.
EDIDIT ET NOTULIS AUXIT
ALBERTUS SCHULTENS.

قَسْمَانِ

قَرِيبٌ مُّبِينٌ أَنْبِيَفْ

أَنْ كَنْتُ مِنْ مَازَنْ كُمْ تَسْتَبِّعَ إِبْلِي
بَنْسَى الْلِّقْبَطَةِ مِنْ قَهْلِ بَنِ شَبَّابَانَا

N O T .

Historiam horum versiculorum præstruxisse juvabit ex اغام قاس من بنى شبابان علي مرجل Taurizio. من بلغى يقال له قريط بن انبيف فاخذوا له قاتي بنى مازن فركب معه ذئفر فساطردوا لبني شبابان مایة بعبرا ودفعوها الى قريط فقال قريط هذه الابيات يمدح بنى مازن ويهاجى قومه Incursarunt quidam ex Sjaibanitis in Virum quendam e Belanberitis, qui vocabatur Korait Ibn Onaiph; rapueruntque ei triginta camelos. Tum suppetias poposcit tribulos suos; sed non tulere. Accessit itaque ad Mazinitas, quorum evencta mox cum eo manus, centum camelos Sjeibanitis abegerunt; eosque ad Koraitum propulerunt. Tum Koritus hos dixit versiculos, laudans Mazinitas, & Satyrice gentem suam increpans.

Vers 1. قَسْتَبِّعَ est fut. 10. a patuit. Inde in 4. communis juris fecit; quod & in 10. obtinet. الاباحة والاستباحة اخذ الشيء Taurizius مباحا وكان الاصل فيه اظهار الشيء للمناظر لتناوله من شاء ومنه باح بسرة Spec-

DIXIT

KORAIT IBN ONAIPH.

i Si extitsem ex *Mazinitis*, non promiscui juris
fecissent camelos meos
Filii humi collectæ, e *Dulbo Filio Sjeibani*.

NOTÆ.

Species 4. & 10. notant rapere quid tanquam cūjusque arbitrio
permīssum: videturque *Origo istius usus sita in re oculis expo-*
nenda, ut eam capiat qui velit: *Dicitur etiam hinc, divulga-*
vit secretum ejus.

Ibid. **اللقطة** proprie humi collecta: forma fæm. part.
pass. Pabyl. In *Golio exponitur Vir vilissimus*, & sequioris or-
dinis. Fætus natusve mulieris. Utrumque, quasi humo recol-
lectum quid. Hic in fæmina vilioris, & servilis conditionis.
Ejus masc. **لقطة** est puer projectitus ignoto Patre & Matre,
qui de terra tollitur. Nempe Thema **لكن** **لقطة** est legit rem
humi abjectam, ut lapillos, spicas, alia. Inde **لقطة**, & **لقطة**
لقطة *spicilegium*; **لقطة** *spicæ* quæ falcem messoris effugiunt:
pulchre **لقطة** **ألمعدهن** *spicilegium aurifodinæ*, pro particulis au-
ri quæ in fodina reperiuntur. **لقطة** & **لقطة** item, quicquid
de humo legitur. Vides, unde pera **لقطة** dicta sit. Venu-
ste avium ingluviem **لقطة** **الجصا** *Collectricem glareæ vo-*
citant.

إِذَا لَقَامَ بِنَاضِرِيْ مَفْشِرُ خَشْنَ
عِنْدَ الْحَجَفِ بِظَهِيرَةِ إِنْ دُوْ كَوَافِيْ لَانَّا
كَفَمْ إِذَا الْشَّرْ أَبْدِيْ نَاجِدِيْ كَهْنَمْ
طَلَارِ وَإِلَكْبِيْ نَرَافَاتِ وَخَدَانَّا

N O T A.

Vf. 2. apud Gjeub. est الغضب والحمبة الـ حفـبـة ira, & fervor tuendi se. Enucleatus Tauriz. الغضـبـ في الشـيـ الذي يـجـبـ ان يـحـفـظـ ira ob rem quae incumbit servanda. Descendit ab حفـظـ affervavit. Inde in 3. specie حفـاظـ strenue propugnavit. Inde in 3. specie حفـاظـ Dies praelii, ubi jus cuique suum defensandum. Speciatim vocant Muhammedani, illum fervorem quo bella & ipsi sacra gerunt adversus nomen Christianum. Hinc Algezira titulo دار الحفـاظـ sedis belli sacri nobilitatur.

Ibid. گوئـتـ segnities, tarditas, languor, stultitia. Se- cundaria omnia, a maceratione, quae cernitur in لـوـاثـ massâ dependo macerata. Radix لـاثـ respondet Hebræorum چـدـ depuit, proprie convolvit. Redi ad Cons. 1. Harir. p. 38. Ab hac notione etiam comparat: الـلـوـٹـ est flaccidus, tardus greffu & lingua; fæm. گـوـئـتـ: nec non specie 8. التـنـاثـ est tardus fuit in opere: itemque confusum, pertur- batum, & involutum fuit negotium. Ad لـانـنـa teneatur, Eliph

- 2 Profecto surrexisse in auxilium mihi cœtus
asper
In defensionem juris, flaccidus ubi remolles-
cit.
- 3 Genus quod quum malum molares ipsis dentes
nudat,
Ad illud agminatim convolant, & seorsim.

N O T A E.

Elipt. metri causa appositum, pro لَّاْنَ lenis, mollis fuit. Si-
miles in هَانَ pro هَانَ levis fuit us. 4. recurret. Poëtice
etiam خَشْنُّ pro خَشْنُّ asperi elatum, quod est plur.
fr. خَشْنَّ a, أَخْشَنْ خَشْنُّ asper fuit.

Vf. 3. Insignis figura, *Malum molares monstrans*; in qua
sibi placent Poëtæ. Præmitto bonæ frugis notam ex *Tauri-
zio*. الناجذ ضرس التحلم وهو اقصي الاضراس.
وهي اربعة من كل جانب واحد من فوق
وواحد من اسفل تنبت من بعد ان يشب
الغلام وتسمى اضراس العقل ومن ثم قبل
 الرجل منكذا اذا احكمته التجارب قال
الشاعر ﴿

بَجَدَنِي مُدَافِرَةً اللَّشَقِينِ بِهِ

وقال بعضهم النواخذة الضواحك واحتاج
بحديث صلعم ضحكت حتى بدت ذواحذه
قال واقصي الاسنان لا يبديها الضحكت
والصحب

لَا يَسْأَلُونَ أَخْاهُمْ حِبْنَ يَسْنَدَ بْهُمْ
فِي الْتَّأْيِبَاتِ عَلَيْ مَا قَالَ بُرْهَانًا

N O T A.

والصحبيح الأول والحادي ث بيريد المبالغة
وان لم تبده النواجهه وابداء الشر نواجهه
مثل لشدة وصولته وذلك ان السبع اذا
صال او شد كشر عن انبابة فشبكة الشر
به بحال شدته ويقول الرجل لصاحبته
لاميتك ناجذى اذا اراد ان يتشدد عليه
ويقال عض على ناجذيه اذا صبر على الامر
*Molaris dens pubertatis vocatur, estque molarium
extremus. Hi quatuor, ab utroque latere unus superior, infe-
rior alter. Enascuntur, quum puer adolevit: & vocantur mo-
lares sapientiae: atque inde vir dente isto praeditus dicitur; quum
eum experimenta sapientem reddidere. Ita Poëta*

Dentem genuinum dedit mihi vicissitudo rerum.

Sunt qui dicant, signari dentes risores; probant ex traditione Pro-
phetæ; Risit ita ut γελασίαι apparuerint: nam, inquiunt, extremos
molares non nudat risus. Verius tamen prius: & Traditio illa sum-
num gradum intendit; et si genuini non prodeant. Nam vero Ma-
lum monstrare Genuinos, figuratum ad vehementiam & saevitiam
ejus notandam; scilicet fera quum saevit, aut incursat, destringit
dentes suos. Ei Malum assimilatur quum vehementius est. Dicit
quoque quis alteri; Enimvero monstrabo tibi Genuinos meos; quum
gestit infestius cum eo agere. Dicitur adhuc; momordit super Ge-
nuinis suis; quum aliquid patienter tolerat. Juvabit insigniora
quædam exempla subjunxit. Antara Ibn Sjeddad in Moallek.

ابدي نواجهه بغير تبسم

Monstravit genuinos suos, non sane renidendo.

Hoc est: Imiticum in modum rinxit; rictu ad aures velut re-
scis-

¶ Non poscunt Fratrem ipsorum, quum promtos
ciet
In calamitatibus, ut id quod dicit, probet.

N O T A.

scisso. Ex Hamas. infra producam ora mortium, quæ rideant, & quorum تھللت النواخذة renidescant Genuini. Hoc est, lato & laeto riſtu immineant. In Diw. Hud. pinguntur نواخذة عصل قواطع Genuini recurvi, scisfores, quos quis adversæ Fortuna reſtringat. Referatur ad id, quod sub II. specie نجدة habes apud Golium; fubatum expertumque reddidit; Fortuna cum part. مَنْجَدٌ fubatus rerum usu & experientia confirmatus: proprie molaribus genuinis offirmatus. Thema فحذ vebementer momordit impressis genuinis. Item roſit, carpit dente maledico. Hoc Horatio item est, Genuinum alicui infringere.

Ibid. Pro خرفة agmen, caterva, pecul. decem admodum hominum, etiam خرفة dageſſata media effertur. Radix الجمع والزيادة على خرف juxta Tauriz. notat congestionem & aggerationem rei; indeque deducit خرف فلان في حدیثة اذا كذب ille in sermone suo, pro mentitus est. Dubito: & a properando utrumque derivare malim: nam خروف est properanter ineedens, & velox camelus. Est etiam II. خرف agminatim fecit properare. & IV. خروف impulit ad properandum. Hoc a congeſtione ſtipata, خوف ſeſciv.

VJ. 4. Thema ذهب proprie uvere, uvescere, uvidule manare, per varias metonymias ſe diffundit. A fluxu uido ha-

bes notione *intransitiva*, quæ principe loco comparere in *Lexicis* debuisset, *Agilis promtusque fuit*; item *nobilis*, & *liberalis fuit ad officia præstanda*. Hinc نَدْبُ Agilis, *a-lacer promtus, liberalis, munificus*; de homine; de equo, *velox, acer, ultro in cursum effusus*. Habes, quem *Hebrei נָדֵב appellitarunt, Voluntarium, & in omnem munificentiam sponte effusum*. Potestate *transitiva etiam valet, impulit, incitavit ad aliquid, nempe liberali motu peragendum*; ita *Harir. Conf. 30. prohibuit Deus increpare poscentes وَنَدَبَ الَّذِي*

excitavit promte succurrere egenti. In Hist. Sarac. occurrit نَدْبُ الْجَبْوُش emisit in bellum copias. Eodem pertinet Glossa illa apud Golium, Vocavit eum ad rem aliquam. Ita enim Tauriz. ad h. l. يَقَالْ فَدْبَتْهُ لِلأَمْرِ فَانْتَدَبَ لَهُ وَرَجَلْ نَدَبْ يَنْتَدَبْ لِلأَمْرِ إِذَا نَدَبَ إِلَيْهَا وَيَقَالْ نَدَبْ لَكَذَا اي نصب ورشح للقبام Dicitur, Vocatio- vi eum ad res gerendas, & ille אַנְתָּדֵב Vocationi an-nuit: ac vir נָדֵב qui res promte suscipit, quum ad eas vocatur. Dicitur item, passive, Vocatus est ad hoc, quum rei ali-cui præficitur, eique administrandæ ut idoneus maxime adhibetur. In VIII, quæ est התנדב tres Glossas re-perias apud Golium. Annuit vocanti; i. e. promtum se ob-tulit, primo. Secundo, benigne rependit, & propicius fuit Deus: item promtum se prebuit. Tertio, leniter effluxit, seu exsudavit. Hoc posterius Originem oculis ingerit illum-que fluxum uvidum, quem supra posui: atque inde intelli-getur, quanta sit ubertas & ultro offerre, erogare, im-pendere se & sua. Hinc quoque pendet Glossa IV. spe-ciei, qua אַנְדֵב נֶפְשָׁה אַنְדֵב נֶفֶס exponitur, peric-u-lo exposuit animam suam: quasi erogavit, & im-pendit eam libe-ralius. Est verbum militare, Devotissimum, & extrema quæque subire paratum militem consignans. Talis exercitus insigni-te

te appellatus **עם נדבות** *populus sponte semet offerens, ergangens, impendens Messiae; Ps. 110: 3.* In his omnibus *Arabica cum Hebraicis intimam cognationem colere, atque Dialectos mutuam sibi lucem ferre, vel præfractissimus agnoscere cogatur.* Sed quid, quod idem hocce **ندب** etiam declaretur per, *deflevit mortuum, eique justis Encomiis parentavit;* Id longius utique discedit. Nempe si corticem spectes *Glossæ;* at si medullam inspectes, non displicebit, credo, *fluxit lacrymis, fluxit laudibus;* quod per *Uberavit* non incommode exprimas. Remotius adhuc **ندب cicatrix depressior, in cute apprens;** & ipsum verbum, *cicatricosum fuit dorsum.* Substitue *uvescens dorsum,* habebisque ipsam illam, quam eruimus, potestatem; speciali usu huc admotam. Nempe & *Uvidum, substillumque pro Cicatricoso apud Latinos venit:* nihilque in hac varietate *Glossematum,* quod non ex omni Lingua copiosiore ultro promanet, ac redundet.

Ibid. A **ناب supervenit per vices absolute in part. notat casum fortunæ; unde plur. fr. incurrensia per vices.** Plena phrasis dat **نواب الدھر vices incurantes Fortune.** Et **نایبات** in plural. sano frequenter. Junctim in *Diw. Hud.*

فلا نایبات الدھر يرجعون هالكـا
الـي أهـلـهـ والـدـھـرـ جـمـ النـوـابـ

Sane *vices Fortunæ non reduxerint mortuum*
[*Suam ad familiam, quantumvis Fortuna vicibus scatet,*
In *Hamas.* nostro]

كرام اذا ما النـايـباتـ تـنـوـبـ

Generosi, quum vices Fortunæ recursant.
In meliorem partem quoque se præbet; atque inde **خـبرـ نـايـباتـ** *copiosum, abundans bonum, designat: itemque in Camuso est دـوـلـةـ convercio latior fortunæ fe-*

لَا كُنْ قَوْمٌ يَقْرَأُونَ كَانُوا دُؤُوبِي عَدَدَهُ
لَكَبِسُوا مِنْ الظَّرِيرِ فِي شَنِيٍّ فَإِنْ هَانَ
يُجْزِئُونَ مِنْ ظُلْمٍ أَفْلَى الظُّلْمُ مَعْغُرَةً
وَمِنْ إِسْأَاءَةٍ أَهْلَى الْشَّوْءِ إِذْ هَانَ

N O T A.

felicitas. Hinc in VIII. Harir. Conf. 39. Tum effusa super eum dona largissima, que vultum votorum ejus renidentem rediderent; *وَانتَابَةُ الدُّخُلِ* cumulavit. Hinc plenius intelligas illud Ps. 62: 11. *כִּילְכִּילְנָה נָעַם* opulentia quum accrescat, atque accumulabitur letis identem vicibus: Item *תְּנוּבָה* quatenus proventum annuis vicibus recurrentem exprimit.

Ibid. بِرْهَان probatio evidens. Argumentum indubitatum: a quadrilatero quod est *أَقْلَمُ الْحَبَّةِ* stare fecit sive evicit demonstrationem. Est species auctior per Nun, *عَرْبَنْ*, a secuit, decidit. Ita arrham dedit; *فَعَلَنْ*, *عَلَنْ*: & *عَلَوْنَ* Titulo insignivit; a *عَلَى* altus fuit. Adisis institut. Aramæas. Sensum hujus versiculi illustrat alter hicce ex *Hamas*.

لَدَنْ أَسْتَسْجَدُوا لَمْ يَسْتَأْلُوا مِنْ دُعَاهِمْ
لَابِيَةُ حَرْبٍ أَوْ لَابِيَ مَكَانَ

Quum ad auxilium vocantur, non rogant illum qui eos ad vocat,

Quodnam ad bellum? aut quemnam ad locum?

Vf. 5. Particula, لَكَبِسْنَ, contracta haud dubie ex

۵ Ast gens mea, etiamsi numero polleat,

Nihil sunt omnino adversus malum, quantumvis
leve sit.

6 Rependunt injuriam injuste agentium condona-
tione,

Et maleficia malignorum beneficentia.

N O T A.

proper est *substantiva*; negans *rei existentiam*: unde *كُبْسَكْ* neutiquam tu: pro quo & *كَسْتَ* inclinatum, ac si verbum esset. Ad eam rationem & hic *كَبْسَوْا* non sunt illi. Phrasis, non sunt de malo in re ulla, valet, non sunt ullius ponderis, momenti, valoris, quoad malum ab aliquo depellendum.

Vf. 6. Verbum *جَرْ* ult. *Waw*, *جَرْ* proper est secuit, præcedit. Inde *pensavit*, *retribuit*, quasi *secta* ac *præcisa* portione. Valet quoque *satisfecit*; *suffecit*, eodem e fonte. Ultima *Hamzata* *جَرْ* partitus est, *distribuit*; & *جَزْ* pars *præsecta*, eandem *Originem* clare exerit, *partic.* proper *جَانِ* a priori, absolute frequentatur pro *Defensore ad omnia sufficiente*, & aliorum vices pensante. Ex usu illo explicandus *Pf. 71. 6. A ventre matris meæ* *تَنْتَنْ* tu sufficiens mibi ad omnia, omniumque vicem pensans.

Ibid. Rad. *غَفَرْ* *condonavit*, dat *غَفَرْ* pro condonatione, *venia*: iic dicta metonym. a *tegendo*, vel potius *linendo*, *illinendo*, *superlinendo*. Cernas vim istam in *Glossa*, apud

كَانَ رَبُّكَ لَمْ يَخْلُفْ لِخَشْبَتِهِ
سِوَاهِمٌ مِنْ جَمِيعِ النَّاسِ إِنْسَانًا فِي
مُكْبَثٍ إِي بِهِمْ قَوْمًا إِذَا رَكَبُوا
شَدَّوْا الْأَغْصَانَةَ قُرْسَاتًا وَرَكَبَانَا فِي

N O T A.

Golum, num. I. texit imbuitque canos tintura. Apud Hebreos נָפֶל eandem obtinuit notionem, indeque dictæ arbores oleosæ, quæ resinam fundunt linimentis. גְּפֵרִית sulfur eadem linimenti ansa appellatur.

Ibid. إِسَاءةً Malefacere : est infin. fæm. IV. speciei, a سَاءَ malus, corruptus, depravatus fuit. Item malo afficit: quod tamen potius احسن، contrarium احسن & beneficit. Derivatum شَوَّه Malum, malitia, vitium omne. Inde vir nequam. In Hamasa opponuntur حَلْ سَوْه vir nequam, & امرى الصدق Vir nequam, & امرى السوء justus & verax. Apud Hebr. ماٰ شَوَّه sunt Viri nequam: qui hoc versu اهل السوء nequitiæ dediti. Origo nec dum satis comperta.

Vf. 7. Aculeate dictum. Sensus hic. Adeo meticolosi sunt, ut soli ex omnibus mortalibus Deum metuere posse videantur. Prima frons laudem offerebat; inversa meticolositatem perstringit. خلق Creavit, proprio lævigavit, alibi jam illustratum. خشي timuit; metuit; abhorruit; ejusdem Originis cum altius difficiliusque spiritum duxit: asthma laboravit. Utrumque pendet metonymice ab حشا farcit,

7 Haud secus ac si Dominus tuus non creasset ad sui timorem

Ullum, præter illos, ex universis mortalibus, mortalem.

8 Quod utinam mihi pro illis gens foret, quæ ubi vehuntur,

Acrem invehunt impressionem, five equos sedent, five camelos.

N O T .

referit: & intransit: *fartus*, *tomento offertus fuit*. Ejus derivatum حشبة *fartura*. In VIII. احتشى est *constipatus* fuit, vel *semet indita fartura constipavit*. Ex hoc fonte חASH proprie sonat φιμέψης, quod ad *altum silentium gravissime translatum fuit*, quum velut *constipato* & *offarcto* ore obticetur; Conjunctione *Marc.* 4: 39. Σιάπα, πεφίμωσο. Obticesce, offercitor. Eadem figura *Pf.* 107: 29. יְחִישׁו גַּלְיָהֶם φιμέψης fluctus ejus.

فیبروی شنوا لاغامه. *Vf.* 8. Ad hunc v. *Tauriz.* اي فرقوها وقوله شدوا لاغامه اي شدوا لاغامه کقولک حملوا لاغامه و معنی قوله فرسانه ورکیانه يعنی انهم کانوا يقاتلون على الخبر والابل

Editur etiam quod est sparsim diffundunt direptionem.

Quod autem dicit شدوا incursant direptionem, positum est pro incursant direptioni: quemadmodum dicitur, incumbunt direptioni. Sequentia vocabula innunt, eos ex equis pugnare solitos & ex camelis. Nempe فرسان plur. fr. a eques; & راكب item plur. fr. a سessor camelii.

قہل

الـ زـمـانـيـهـ الـ زـمـانـيـهـ

فِي حَرْبِ الْبَلْمَوْن

صَفَحْتَنَا عَنْ بَنِي دُهْلٍ وَقَلَّنَا الْقَوْمُ إِخْرَانٌ

خَسْوَ، الْأَيَّامُ أَنْ يَرْجِعُنَّ قَوْمًا كَالَّذِي كَانُوا فِي

N O T E

Vj. 1. Ad صَفَّنَا condonavimus, ita Tauriz. الصفع العفن يقال اعْرَضْت عن هذَا الامر صفتة اذا تركتة ويقال ابدي لي صفتة اذا اهكنتني من ذفنه Radix hæc condonationem signat; ex phraſi, averti vultum ab hac re, quum eam missam facis. Dicitur etiam, monstravit mihi faciem suam expansam, quum me sui compotem facit. Habes duplex Etymon; alterum ab aversa facie, quum con-nivetur: alterum a facie expansa, quum indulgetur. Apud Golium nostrum reperies primum ab averso vultu: adjectis aliis notionibus, que implicant magnopere eos, qui ex ipsis fontibus bibere non possunt. Ut qui sub 2. Classe proponitur, transire jussit egitque præter puteum camelos. 3. Latiore parte gladii ac lamina percussit. 4. potentem repulit. 5. propinavit quicquid esset vini. 6. Composit manus. In II. Specie; صَفَّح latum fecit, in latum duxit, expanditque fer-
rum,

D I X I T

ALPHENDUS ZIMMANIUS,
IN BELLO BESSUSÆ.

- 1 Condonavimus delicta *Dsuhlitis*, diximusque,
gens est fraterna.
2 Efficient forte dies ut reddant se gentem, qua-
lis ante erant.

N O T A E.

rum, ut ensem, qui inde صَفْبَع & صَفْبَع prius
quoque est *Lapis latus* & *tenuis*: & صَفْبَع
Latior facies rei: *lamina*, *bractea*: *affer*; *tabula*. *Omnia*,
ut quisque nunc videt, ab *expansa* & *explanata* *superficie*;
qua manu superducta efficitur. *Est nostrum strycken* / *pla-*
nare. *Hinc omnes usus emanarunt*: ut ille 2. *planavit præ-*
ter puteum: 3. *planavit eum ense*: pro *percussit*: cui in-
hæret 4. *repulit eum*, *repercussit*. *A percutiendo quoque* 5.
سَقَاه ای شَرَاب كَان propinavit ei quicquid esset
vini, *idque more compotantium ingessit in faciem*. In *com-*
plosione manuum earumque *superficie collisa* nemo hæredit.
Ab hac *planata superficie* צְפִיחַת dicta *placenta*: *qua* &
apud *Latinos* a τλαξις, & τλακοεις, τλακοεισ; τλα-
κεισ, unde *platunt* *Antiquiores*, descendit. *Eadem Ori-*
go sororii תְּפִחָה, unde in *Sacris remansit* תְּפִחָה & תְּפִחָה *palm-*
illa, *manus plana* & *pansa*: itemque *palmus*, *mensura manus*
illius. *Hinc pulchre in Pibb.* Jes. 48: 13. *Dextra mea* תְּפִחָה
R r 3 plas

فَلَمَّا صَرَحَ الشَّرْ فَأَمْسَيَ وَهُنَّ عَرَبَانٌ

N O T A E.

Planavit cœlos, in latum & tenuem superficiem expandit, quod
est ipsum صَفَحَةً. Paulo aliter *Thren.* 2: 22. Quos طَفْحَاتٍ
plana manu leniter tractavi, & educavi: qui teneri, tenera
manu foti, *ibid.* v. 20. erant. עֲוָלִי טְפֵחַת. Apud Arabes
similiter III. species, est manu plana tractare,
permulcere. Denique מֶטְפָּחַת ex eodem hoc fonte adfert
pallam latam, late superflusam corpori, quasi dicas complana-
torium amictum: de quo Clar. Schroed. enucleate, & egre-
gie, in *Comm. de Vest. Mulier. Hebr. Cap.* 16. Necdum ma-
num de tabula. Discutienda nubecula; quam offundunt u-
sus verbi طَفْحَةً apud Golium enotati, 1. plenum ad
redundantiam fuit vas: plenus vino fuit ebrius: abundavit li-
beris mulier. 2. Replevit, ita ut liquor effluxerit. 3. Sustulit
Gossypium ventus. &c. &c. Congeries cæca, & cæcans,
qui ipsos fontes non salutant; neque attendunt esse *Glossas*
secundarias, ex una primaria dimanantes: quales sunt *Glos-*
sa Hesychianæ, & *Non. Marcelli de Verborum signif.* Te-
neatur modo *Belgicum strycken* / & omnia ultro applana-
buntur: ut quum de vase pleno dicimus stryckend vol: &
oberstrycken: doen oberstrycken. De windt gingh 'er mede
strycken. Wegstrycken &c. &c. Sic concordia claro in die
reluet.

Vf. 3. Excellens metaph. صَرَحَ الْشَّرْ meracum fuit
malum. Apud Golium nostrum reperies sub verbo صَرَح
I. Purus, sincerus fuit: II. Aperte exposuit dixitve: manife-
stam fecit rem: & intransit: duplicata potentia primæ, Manife-
stus, apertus, purus, sincerus, clarus fuit. Omnia a primario
meraci, quod in صَرَح cernitur, merum, & impermix-
tum.

3 At quum meracius factum est malum , extitit-
que planissime nudum;

N O T A E.

من اللبس الصريح وهي
الذى قد ذهب رغوة واذا ذهب الرغوة
فالمطلب عريان *Transsumtum a lacte mero , cuius*
spuma discussa. Hac autem demta , lac quoque nudum manet.
Prior firmo stat talo; posterius jacet. Odiosa foret repeti-
tio Nudi , post meracum , si nil aliud adferret. عريان
عرى , a عري نودس fuit , hic est γυμνη την κεφαλην in-
cedens: seque impudenter & nudato quasi capite inferens.
Sic اعرى و موي Nudum se intulit , est , flagitia palam patra-
vit. Ad figuram priorem in *Hamas* extat quoque hoc *Saadi*
Ibn Malichi; cuius nonnulla in *Monum*. *Vetus*. Arab. pro-
duxi.

كشافت لهم من ساق الحرب
فيبدا من الشجر الصراح

Denudavi ipsis crus ad bella substrictum;

Apparuitque de malo , meracissimum.

كأس الصراح poculum vini meracioris ; quod
hac in sede per frequens; Emblemate passim in sacris occur-
rente. Longe diversum tamen apud *Hebræos* fuisse dices
صرخ voiferari in *Lexicis*: & צריח arx , turris. Sed en
apud *Arabes* quoque
النضر وكل بناء عال Arx , & omnis excelsior structura: quin صرخ valde exclamavit : speciatim opem implorans: & اصرخ cum clamore
opem tulit. Utrumque in *Bibliis*, ubi bis tantum legitur, ea-
dem virtute. Zeph. I: 14. מִר צריח amare exclamitans ibi
Heros: quod est opem implorantis: ut ferentis *Jesaj. 42: 13.*
Dominus ut Heros exhibet , sicut vir bellator fuscitabit Zelum
flamm-

وَلَمْ يَبْقَ سَوْيِ الْعَدُوَانِ دَنَاهُمْ كَمَا دَنَوا

شَدَّدْنَا شَدَّةَ الْلَّيْلِ عَدَا وَاللَّيْلُ خَفْيَانٌ

N O T E

flammantem: יְרוּעָאַף יְצִירָה jubilabit, etiam opem cum clamore bellico præstabit. Bonæv. Est accessio lucis. Magis adhuc lucebit; si clamoris hujus intensioris Origo teneatur. Ea haud dubie a mero, meraciore, claro: quali clara & alta voce exclamare.

Vſ. 4. Proverbiale: دَنَاهُم appendimus illis &c. pro par
 pari retulimus; repensavimus ipsis vices nobis appensas. Est prim.
 plur. præt. a الـ med. je, in Golio, 1. Debitor, etiam,
 creditor evasit. 2. subegit sibi, coëgit, possedit. Rex & impera-
 tor fuit. Item se submisit. 3. Religionem amplexus fuit 4.
 Malo noxave affectus fuit. 5. Rependit, pensavit. 6. Judicavit,
 condemnavit. ۱۶ & ۱۷. Omnia ab appendendo. Ad hanc an-
 sam filum ultro sese evolvet. Tauriz. الـ دَنَةَنْ لِغَظَةَنْ

مشتركة في عدة معانٍ كالجرا والحساب وهو هنا الجرا وفي المثل *Vox* دين ^{كما} تدبر قد ين تدان *multas significationes amplectitur, inter quas compensatio & computatio, quae hic intenditur: ut in Proverbio est: prout appendis tibi rependetur.*

Vj. 5. **لِيْش لَبْت شَدَّد** incurvavit, infestavit: & **غَضْبَان** Leo convolutus ac compactus, alibi enucleata. **غَضْب** iratus, a **vehementius irasci**, hic speciatim designat famelicum, fame rabidum. Hoc, & repetitionis dignitatem, recludat Tauriz. **كَنِي مِن الْجَمِيع بِالْغَضْب** لانع

4 Neque quicquam restaret nisi injuria , appendimus ipsis prout appenderant.

5 Incursavimus in eos vehementia Leonis , qui quidem Leo rabidus.

N O T A E.

لأنه يصـحبـه وـكـرـرـ اللـبـثـ وـلـمـ يـاتـ
بـضـمـمـيـرـه تـفـخـيـمـاـ وـتـهـقـيـلـاـ وـهـمـ
يـفـعـلـونـ ذـلـكـ فـيـ اـسـمـاءـ الـاجـنـاسـ
وـالـاعـلامـ قـالـ عـدـيـ بـنـ نـبـيـدـ

لـأـمـرـيـ الـمـوـتـ يـسـبـقـ الـمـوـتـ شـيـءـ

نـعـصـ آـلـمـوـتـ ذـاـلـغـنـيـ وـالـعـقـبـرـاـ

Circumloquitur in ira famem , quoniam eam comitatur ira : &
Leonem repetiit , non utens pronomine relativo , ad granditatem
& terrorem : quod facere solent in nominibus appellativis , pro-
priisque . Ita Adi Ibn Zeid .

Non video Mortem , prævertat Mortem res ulla :

Conturbat Mors opulentum simul , & inopem .

Geminum in Hamas . illud Alaarasji .

المـوـتـ اـحـلـيـ عـنـدـنـاـ مـنـ الـعـسـلـ

نـحـنـ بـنـيـ الـمـوـتـ اـذـ الـمـوـتـ نـزـلـ

Mors apud nos melle dulcior .

Nos Filii Mortis ; quum Mors gravius incubat .

Item hoc Hodbae .

لـاـ اـتـمـنـيـ الشـرـ وـالـشـرـ تـارـكـيـ

وـلـكـنـ مـنـيـ اـحـمـلـ عـلـيـ الشـرـ اـمـكـبـ

Non opto malum , quum malum me missum facit :

Ast quum adigor ad malum , illud invehor .

بِضَرْبٍ فِيهِ تُوْهِبَنْ وَتَخْضِبَعَ فِي إِقْرَانْ ۖ
وَطَعْنَ كَفَمِ الْزِيقِ عَذَا وَالْزِيقِ مَلَانْ ۖ
وَبَعْضُ الْحَلْمِ عَنْدَ الْجَهْلِ لِلْذَّلَةِ إِذْعَانْ ۖ

N O T A.

Vf. 6. وهن توهبن inf. II. enervare; a enervis fuit: torpuit: flaccidus laxatus. تَخْضِبَعَ خضع submissus fuit: unde nonnulli, monente Tauriz. hic subjugationem accepere: vel submissionem sui. In Camuso idem est quod تَخْذِيْعَ concidere minutatim carnem. Adjectum يَتَمَّلَ ان يَكُونَ مِنْ الخبضة والخبيضة وهو اختلاط الصدوق في الحرب ومنه قوله

الضارب بن الههام تحت الخبضة فالاصمعي يقال للسباط خبضة ولا ادرى لمن الصوت هي اي من القطع Fieri potest ut sit a scutica, aut a strepitu confusus gladiorum & pugnae: unde nonnemo.

Qui percutiunt capita sub gladiorum strepitu. Asmaeus dicit, se nescire num scutica nomen traxerit a strepitu, an a conscissione. Omnino conscrissio & contruncatio hic tenenda. اقران infin. IV. a قرب ubi est prævaluit; nunc est الغلبة Victoria. Potiri hostium.

Vf. 7. Eadem hic repetitio gravis, ac decora, ۶ uter vino recondendo, saccus; quam supra habebamus v. ۵. A sacco placuit saccare, pro colare, percolare. His usibus auctum

6 Cum ictibus qui enervabant, qui contruncabant
qui reportabant victoriam.

7 Et confessione, ut orificio utris, qui effluit;
qui quidem uter distentus.

8 Nempe quædam mansuetudo apud insipientes,
est vilitati se capistrandum dare.

N O T A E.

Etum quoque יקק Hebr. Nec abit Glossema apud Gol. Rostrum in rostrum inserto aluit pullum avis: q. d. Colavit. Percolavit, eliquavit in os. Quin & quum ظرف exponitur, pudenter figuratum est, pro eliquavit fæces: quemadmodum a Latinis quoque percolare, & saccare, eodem traducta sunt. Origo sita in arctando: unde סק' catenæ, itemque ظען איזק, a themate forte ظرف איזק item artavit. ظען טען confessio, nunc notat plagam confodiente lancea inflictam. Ea ad genium gentis comparatur Orificio utris מלאן ملان repleti, distenti, a ملا repleri, oppleri, distendi, proprie: ut distenta ubera, tensus uter, tensus & turgens sacculus, apud Latinos غذا fluxit uter, sanguinem emisit vena, usurpatum quum fluxus ille fit دفعۃ بعد دفعۃ impetu alio post alium: vel abruptum; singultatim: qualia Poëtae singulantia vulnera. A Taurizio appositum aliud hocce.

ادا فسغذتهم كرت على بـ
بـ طعن مثل افواه الـ بـ

Quum confudit eos, denuo in eos irruit

Plaga assimili orificiis marsupiorum.

Hoc Hebraicis הַגִּר עַל יְדֵי חֲרֵב singultatim ebullire fecit confossum acie gladii: de quo in Libello de Defect. Hodiernis Ling. Hebr. fusius aetum.

Vf. 8. Acute; quin aculeate. Quædam mansuetudo est

وَفِي الشَّرِّ نَجَاهُ حِبْنَ لَا يَنْجِبُكَ إِحْسَانٌ

N O T A.

se submittere vilitati: se obsequentem dare contemptioni & vili-pendio. Apud Sapientes videlicet mansuetudo alicui & decus adstituit, & pondus. At insipientes, proprie leves, mobiles, omni aura circumacti, eo magis ferociunt, atque infoles-cunt, quo quis mansuetior: atque bonitatem non illudunt solum, sed & insultant. **أَجْهَلٌ** est plur. fr. ob levior, levissimus: quæ vis sub X. specie regnat: ubi Golius dedit, *Commovit ramum ventus.* Minus concinne sub ordinarunt Grammatici. Hoc inde factum, quod **أَجْهَلٌ** minus frequenter occursaret. Extat tamen, apud *Algazal.* aliosque: unde habeas modo illud من اجهلک ما اجهلک من انسان *Quam levissimus es mortalis?* Ad infin. 4. a دعنه *obsequens fuit teneatur,* metaph. esse desumptam a Camelō, qui sub capistro per nasum trajecto se obsequentissi-mum præbet seffori. Talis *Camelus* in *Diw. Hud.* **مَذْعَنٌ** vocatur. In *Camuso* extat وذر وذل *اقر واسرع في الطاعة وانقاد كذعن ونقاقة مذعنة من قادة سلسلة الرأس*

ورأيتهم

9 Estque in maleficio salus tum , quum haud servet te , benignum fuisse.

N O T A E.

وَلِيَتَّهُمْ فِي الظَّاعِنَةِ مَذَعَانِبِنَ اَيْ
مَتَّتَابِعِنَ Verbum in 4. est submisit se , & obsequens fuit , & confessus est subditum sese ; & properavit ad obedientiam , & passus fuit se duci ; quod etiam in 1. obtinet . Indeque Camelus ، مَذَعَانَةٌ ، catenæ capitis obsequentissima : atque hinc phrasis ; Vidisti illos in obedientia obsequentissimos ; tanquam sub Capistro nempe . Genus capistrandi reperias apud Golium sub خَزَامَةٍ perforavit narium isthmum , & trajecit annulum , eoque obsequentem reddidit camelum . Ejus derivatum حَرَامٌ & خَرَامٌ elt annulus ex pilis confectus , quo per narium imbricem trajecto capistratur jumentum . Hinc figureate , recipere خَرَامَ الْأَدَلْلَى Capistrum vilitatis abjectissimæ : apud Ispahan . Hist . Salad . Idem annulus appellatur بَرْدَةٌ pro بَرْدَةٍ vel بَرْدَةٍ ، de quo luculenter Cl . Golius noster sub جَرَامٍ ult . Waw , & Je , rasit , derafit : a radendo enim nomen traxit . Inde Harir . Cons . 6. تَغْتَادْ : جَرَامَ الْصَّفَارِ Circumducit eum capistrum summæ vilitatis . Ubi alia , quæ faciunt , subnotavi .

قِسْلَ

ابْنِ الْغَوْلِ الْمُطَهَّرِ وَيْ

وَدَتْ نَفْسِي وَمَا مَأْكَلَ كَتْ يَمِبِينِي
 فَوَارِسْ صَدَقَتْ فِي بِهِمْ ظَنَّوْنِي ﴿١﴾
 فَوَارِسْ لَا يَمْلِكُونَ آلَمَنَّا يَا
 إِذَا دَارَتْ رَحَّا آلَ حَرْبِ آلَ زَبُونِو ﴿٢﴾
 وَلَا يَجْزِرُونَ مِنْ حَسَنِ بِشَنِي ﴿٣﴾
 وَلَا يَجْزِرُونَ مِنْ غِلْظِ بِلَبِينِ ﴿٤﴾

N O T A E.

Vj. 1. Formula solemnis *Redimat anima mea illos; pro mibi mea vita cariores sunt; quippe pro quibus animam impensam velim.* Dicunt quoque انسی فداء لک *Ego quidem redemptio tua sum; latiore adhuc sensu; pro, omnes tuas miseras in me transmotas velim, te inde exento. Inde partic. pass. 2. مُفَدِّی *redemptus* venit pro capite honoratissimo, quod omnes vel sua vita a malis & miseriis cupiant liberari: cuique dicatur جعلت فدائک *constituar redemptio tua; pro te caput meum devovere paratus sum.**

Vj. 2. Mortes; a مَنْبَةً in plur. fr. Id proprie

D I X I T

ABU'L GOUL TOHAWIUS.

1 Redimat anima mea , & quicquid dextra possidet,

Equites ; de quibus veracissima mea opinio.

2 Equites ! quos non tædio coxerint Mortes ,

Quum mola volvitur belli contumacius collisi.

3 Quique non rependant pro bono malum :

Neque pro aspero lene rependant.

N O T A E.

prie sonat præseciam atque ita præfinitam portionem : Fatum ,
 τιμαρεύοντες : quod δέ τι μέρει : a cūjus μέμονες , ίμμοες ,
 etiam μέρες ac mors descendunt. مني secuit , dedit
 per metonymiam mox , certa quantitate , certoque modo , aut
 numero , definitivit. يسلوون tædio coxerint , a سل cineribus
 calidis , prunisve , supposuit coquendum panem , carnem. In-
 de ad tædium urens translatio facta. Allegoria subjuncta
 regnat inter Arabes : atque inde רח' mola , רח' apud Golium inter alia exponitur Campus pugnae : & , ag-
 men se invicem prementium. Accuratus Schol. Diw. Hud.
 مولا bellum est ejus

وَلَا تَبْكِي بَسَالَتَهُمْ فَإِنْ هُمْ مَا كُوا
بِالْحَزْبِ حِبْتَنَا بِغَدَةِ حِبْنِهِ
هُمْ مَنْتَعُوا حِمَى الْوَقَبَى
بِصَرِيبٍ يَوْمَ لَفَ بَنْسَنَ أَشْتَاتِ الْمَنْتُونَ

N O T A.

eius maxima moles. In Hamaj. nostro Samuel Ibn Adia.
فَانْ بَنْي الْدِيَانْ قَطْبُ الْقَوْمَهُمْ
قَدْوَنْ رِحَاهُمْ حَوْلَهُمْ وَتَحْوُلَهُمْ

*Nam sane Daijanitæ sunt polus suæ genti,
Cujus mola circa illos volvatur ac gyret.*

Creberimum quoque Epitheton **الزَّبُون** in prælio, quod
Cl. Gol. declarat, in quo homines ob multitudinem inter se col-
liduntur: item, malæ indolis camelus, percutiens mulgentem.
Hinc ansam arreptam docet Tauriz. شبهت الحرب
بالناقة الرذيلون فوصفت بصفتها وهي
comparatur præ-
lium camelio calcitratori, ejusque nota delineatur: quippe quæ
mulgentem pede suo feriat.

Vf. 4. Dignissima, quæ teneatur Origo vocis بسالة
strenuitas, sub strenuus fuit vi secundaria: nam
أصل البسال الحرام وذاك ان
الباسل ممتنع من قرنها كأنه محرم
عليه ان يناله بمكره prima notio est illicitum,
quia strenuus ab adversario intactus: tanquam interdictus ei, quem
malo attingat. Est ergo strenuitas veluti Sacro sancta, & inta-
cta.

4 Neque deteratur sirenuitas eorum, vel si torre-
antur,

In bello, vices post vices.

5 Illi defensarunt septum sacrum Wakbae,

Ictibus diversas Mortes conneclentibus.

N O T A.

ta. Ideo adhibitum **بَلَهْ بَلِي** deteri i. e. imminentia. delibera-
ri. violari. Porro insignita locutio, qua multum delectati Arabes صلا بالحرب tostus fuit prælio, pro magno animo susti-
nuit, & exaltavit, fervidissimas collisiones. Apud Gol. num.
6. sub صلا reperies, صلي النام incaluit ad ignem,
ejusque fervorem sustinuit. Hinc صلاة الحروب tosti præ-
liorum, pro titulo additur Strenuissimis bellatoribus apud
Poetas. Sub 8. Specie invenies quoque لا يصلي بنار، non facile certari cum eo potest: quod proprie, non torreatur
a'quis igne ejus. In Hamasa

أَوْقَدْ نَارًا لَهَا وَهَجَّ لَهُ مَصْنَاعِيْ غَبَرْ طَالِيلْ
Accendit ignem, cui ardor tosto haud sane benignus.

In Wakidio de Expugnatione Syriæ frequentissima hæc formula,
quum Heroës suos dilaudat. Aliquando torrei bello re-
missius est, mala ejus perpeti: prout in Alcoran: صلا النام
& صلا الجحيم torrei igne, gehenna: in Hamasa
iterum

كَبَسْ يَصْلِي نَارَ الْحَرَبْ جَانِبَهَا

Non semper torretur igne belli ejus inceptor.

Vf. 5. Magnifice; ictus diversas mortes conneclentes. Apud
Tacitum, omnes mortuum imagines. Intellige aliis crania fis-

Tt fa,

قَنْكِبَ وَعَنْتَهُمْ دَرَأَ الْأَعْدَادِيَّ
 وَدَائِرَ وَبِالْجَنَّوْنِ مِسْنَ الْجَنَّوْنِ
 وَلَا يَرْتَهُونَ أَكْتَافَ الْأَهْمَقِيَّةِ
 إِذْ حَلَّوا وَلَا مَرْفَضَ الْأَلْهَدَوْنِ

N O T A E.

fa, aliis *capita præscissa*, aliis *jugula*, vel *pectora hausta*: atque ita porro. **مَوْلَفُ الْفَلَّا**, cuius pri-maria vis in *copula*, & *connexu arctiore*. Hinc omnia enata, quæ tam *Hebræi*, quam *Arabes*, & *Aramæi*, suo qui-que ore, & more, admiserunt, cum divergio quodam Dia-lectorum manente uno fonte, uno Linguae corpore.

Vf. 6. نَكَبْ avertit. In II. pro repulit, refutavit, a نَكَبْ deflexit. دَرْعَةِ impulsus, & quidem cum impetu, a دَرَأْ pepulit, impulit cum nisu, curvamine. أَعْدَادِيَّ a عَدَدِيَّ hostis; unde أَعْدَادِيَّ hostes; indeque plurali altero عَدُوِّيَّ أَعْدَادِيَّ. Thema عَدِيَّ incurrit, infestavit. fana-runt, est pret. III. remedio concinnavit, restauravitque rem, a دَوِيَّ agrotavit: q. d. tractavit ægrotum. جَنَّوْن furor a جَنِّ جَنْ texit; quasi obnubilatio mentis, & obscuratio. مَلَنَةِ Thren. 3. 65. Potest etiam a جَنِّ genius; dæmon derivari, ut sit obseffio dæmonis. Δαιμονίας. Ad phrasin tot-tam Tauriz. اي دَائِرَ وَالشَّرْ بِالشَّرِّ كَمَا قَالُوا الْحَدِيدَ بِالْحَدِيدَ يَغْلِبُ وَالْجَنُونَ هَنَا مِثْلَ وَمَعْنَاهُ

6 Sic refutarunt a fese impetum hostium,

Et furore persanarunt furorem.

7 Illi haud pascant conseptas quietulæ oras,

Ubi resederunt, neque pacis hortulos.

N O T A

وَسَعْنَاهُ الْلَّاجِحُ فِي الشَّرِّ وَرَكْوبُ السَّرَّاسِ
Est tantumdem ac malum malo medicari: prout dicitur, ferro
rum ferro fulcatur. Furore figurate positum, pro immittere se
profundius in malum, atque caput suum obstinatius sequi.

Vf. 7. Illustres figuræ. هُنَيْدَةٌ in Lexico non com-
paret. Est diminut. ab هُونَى levior, in compar. fæm.
a masc. هُنَقُونَ, Thematis levis ac facilis fuit. Notat
fortunam commodiorem, q. d. commodiusculam. Venuste,
pascere septa, vel conseptas oras commodiusculæ: pro, quieti
& otio se tradere; atque tanquam molli in gramine recubare.
Eadem venustate adjectum, neque hortulos pacis;
plur. fr. a هُنَيْدَةٌ hortus florifer: pratum amœnum. In alia
معناه اذهم من عزتهم وجرائهم لا يرعون السنواحي السنوي اباحثها
المسالمة ووطائفها المهاذنة ولكن السنواحي المذاهبات
sensus est eos præ fortitudine & audacia non depascere tractus,
quos pacificatio fecit promiscuos, & quos calcare permittunt inducæ: sed tantum tractus interdictos ac defensos. Mihi totus
hicce versiculus videtur esse مثل Allegorica figura, se-
cundum lineolas quas supra duxi.

قـال

جعفر بن علبة الهاشمي

اَللّهُفَيْ بِقُرْيَيْ سَخْبَلْ حِبَنْ اَجْكَبَنْ
عَلَكْبَنَا اَلْوَلَيَا وَالْعَدْدَى اَلْمَبَاسَلْ ۝

فَقَالُوا كَنَا نَنْتَانْ لَا بُدَّ مِنْهُمَا
صُدُورْ يَمْسَاجْ اَشْرَعَتْ اَنْ سَلَاسَلْ ۝

N O T A.

Vf. I. *tumultum cierent*: in præt. 4. a جلب اجلبت *traxit*; & *tractim rasit*: unde **חָלֵב** *tonfor* in *Hebræo*. Sæpe, ut σύρειν, adfert trahere συγχέσθαι, turbam & tumultum concitare: vel ex omni parte cum tumultu confluere. Eadem potestas in IV. obtinet. Legitur etiam **لحليت** *undique cum strepitu confluxit*; ab **حَلْب** *mulxit*, *emulxit*: unde **חָלֵב** *adeps*, *succosa pinguitudo*, quæ *emulgetur*, dimanarunt. **ولبة** *turbæ muliebres*; in plur. fr. a **حَلْسٌ** & **بَرْدَعَةٌ** *quod ex panno coactili insternitur jumento*, ut *mollius incubant clitelæ*: atque ipsæ *clitelæ*: وهي هنا **كتابية** عن النساء لـ **عن** **الضعفاء** *الذين لا غناء عندهم وشدة* **والرخي** *الخواли بالولبة لاذها برخوة منتفجة* *Hæ autem num figuram sustinent mulierum*; vel **debilium**, quibus nulla sui defensio: comparant autem mollem & flaccidum tali pulvillo *clitellario*; quoniam *mollis est* & *turgidulus*.

المباسل

D I X I T

GIAFAR IBN OLBA HARITHIUS.

1 O vah! in *Korra Sebbal*; quum tumultum cierent

Super nos turbæ mulierum, hostisque simul strenuus.

2 Dixeruntque illi, duplex fertur conditio inevitabilis;

Pectora hastarum protensa, aut catenæ.

N O T A E.

المباسل **strenuus**; est part. III. a بأسـل quod est, circumivit bostem latus ejus captans. Origo ad præcedens carmen indicata.

Vf. 2. Notabilis forma شـنـتـان *duæ*; ex *Dialecto* pro vulgatiore بـنـتـان, omisso eliph servili: plane ad *Hebraicum* שـנـתـا, unde شـتـيـם sine ulla dubitatione contractum. Ita بـنـتـان pro شـنـتـان *duæ filiæ*; monente Tauriz. effertur. *Due*, præcissim; pro, duplex vobis *conditio* offeratur. *Due*, præcissim; pro, duplex vobis *conditio* offeratur. *pectora*, in *haftis*, in *gladiis*, designant anteriores partes a medio ad mucronem usque. Audacissime *Harith* Ibn Helza in *Moallek*.

جـابـدـيـةـ مـمـاحـ صـدـورـهـنـ الـقـضـاءـ

In manibus eorum *haftæ*, quorum pectora Mortes. اشـرـعـتـ protensa sunt; in præt. pass. IV. a شـرـعـ tetendit, protendit longius. Hinc fentias, quid شـرـعـ valeat *Lev. 21: 18. & 22: 23.* Inde omnes notiones apud Cl. Golium defluxere: ut legem tultit Deus; id est tetendit, & quidem ut esset شـرـعـ via tensa, recta, regia. Item penetravit in

فَقُلْنَا كَهْمٌ تَلْكِمْ إِذَا بَغْدَةَ كَرَّةَ
 تَعْدِي صَرْعَيْ دَوْهَةَ مُتَحَادِلْ فَ
 وَكْمَ نَدِيْ إِنْ جَضْنَا مِنْ الْمَوْتِ جِبْرَةَ
 كَمْ الْعَمْرَ بَاقِيْ قَالْمَدِيْ مُتَنَطِّلْ فَ

N O T A E.

publicam viam: quasi tetendit per viam regiam. Iterum, extulit in altum. Nec non, ingressus fuit in aquam animal, quasi protenso collo perrexit: indeque, ingressus fuit negotium, &c. &c. Hinc reliqua clarescent.

Vf. 3. Rariusculum illud تلکم hæc vestra, hæc vobis; nempe ut a simplici pronom. تـ hæc, conformatum قـ لـكـ hæcce tibi; & تـ لـكـ hæcce tibi quasi قـ لـكـ. Ita etiam cum adv. plur. admissum تـ لـكـ hæcce vobis; coactus ex تـ لـكـ. Reperio etiam in *Hamas*. قـ لـكـ hæc tibi cuius *Dimin.* قـ لـكـ. Apud *Haririum* extat hic vobis, & ذـ لـكـ hic vobis. Minutula suppellex, quæ Grammaticæ plenius instruendæ necessaria. *Hoc vobis*, abruptim quoque: nempe ut vel pectora hastarum a nobis recipiatis; in prælioque occumbatis; vel ut in catenas compingamini. تـ عـادـيـنـ relinquat, destituat; in fut. III. a غـادـيـنـ fefellit; item retromansit a grege. Sic *Ezaj. 40: 26.* Nullus retro relicitus: & *Ezaj. 59: 15.* Fuitque veritas נـעـרـתـ retro relicta. Figuram percipies ex غـادـيـنـ Retro manens & a pastore derelicta ovis. Sunt & alii usus apud *Hebræos*, & *Arabes*, ad quorum concordiam Ori-

3 Nos vero: hoc vobis fuerit post collisionem

Quæ relinquat stratos ad surgendum flaccidos.

4 Nescimus nempe, si nunc mortem declinaverimus;

Quam diu mansura vita, & meta proroganda sit.

N O T E.

Origo desideratur. **חדל** خَذَلٌ مُتَخَذِّلٌ Part. VI. a **flacidus**, *debilisque fuit. Frustratus fuit. In sexta spec. destituerunt se invicem mutua ope præ flacciditate; quasi conflaccuerunt inter se.* **نَوْعٌ** *assurrectio, actio verbi surrexit cum labore; surgere annis est. Item, pressit, deppressit onus, ut surgi non possit. Concidit gravius onustus: &, cruda fuit vel semicocta caro: præsertim med. Je. Habes נָגָד crudum, & חַנּוֹת cruditas animi exulcerati. Hanas item נָגָד particulam hortandi; agedum, quod ab assurgendo commode derivatur: vel potius a primaria virtute vigoris tensi, quam huic Radici subjectam fuisse suspicor. Et tamen, adhuc quidem, suspicio; de qua ampliandum*

mihi sumo. **صَرْعَةٌ** prostrati; a sing. **صَرْعٍ**. Ea forma, ut omnia pluralia fracta, quæ difficillimam partem constituunt Ling. Arabicæ, proprie sonat prostrationem, collective positam pro stratis. Ita caritas pro caris: & necessitudo pro necessariis &c. A sternendo sub **צְרֻעָה** صَرْعٍ, vel potius gravius feriendo, nomen invenit **צְרוּפָה** lepra percussus; apud Arabes etiam Epilepsia istus. In Arabicо pro, ad consurgendum flaccidos, ad verbum extat, quorum assurrectio conflaccescens.

Vf. 4. **فَدْرٌ** scimus, per Apocopen pro **فَدْرٍ** propter

إِذَا مَا إِبْتَدَرْنَا مَسْأَرَقًا فَرَجَّتْ أَنَّا
بِأَيِّمَانِنَا دِبْضُ جَلَّتْهَا الْصَّبَاقِيلُ ﴿٤﴾

N O T A.

negativam præcedentem neutiquam: fut. i. a دری *scivit;*
notione secundaria a discriminando capillos: ut apud Latinos
quoque discriminare capillos pectine, & materias judicio.
in præt. i. a حاض *deflexit, hic valet declinav-*
rimus & effugerimus. At quum derivatum حبض *per*
contractionem ex حبض *, exponitur incessus fastuo-*
sus, est quasi flexuosus: nam fastuosi multum sese flectunt
in incessu.

V. 5. ازق مَسْأَرَقَ ptoprie locus arctus. ab coarctatus,
pressusque fuit. Hinc ad prælii campum opportuna transitio facta.
Harib. Ibn Hessjam, de die prælii Bedrensis, in Hamaf. nostro

شَمَاءَتْ مِيقَحَ الْمَوْتِ فِي الْمَاءِزِقِ ﴿٥﴾

Olfactavi odorem Mortis in Campo prælii.
præt. i. a فرج fidit; laxavit; discussit; deter-
fit anxietatem ac mœorem. Usu proprio Alcor. sur. 77: 9.
quum cœlum diffissum fuerit. Im-
proprio Hariri Conf. 33. الذي هـ يفـّرج الـّوـم الـّذـي هـ
*diffindet curam, quæ eum tabefaciebat: i. e. discutiet, deter-
gebit. In Hamaf. simillimum hinc*

ونـركـبـ الـكـرـ، اـهـبـانـاـ فـبـفـرجـةـ
ـعـنـاـ الـحـفـاظـ وـاسـبـافـ قـوـاتـبـنـاـ ﴿٦﴾

Nempe nonnunquam molestem quid adigimur, sed findit illud
A nobis indignatio, ensesque nobis comites.

5 Quum vero arctum in prælium rueremus, spa-
tia laxarunt nobis
Micantes in dextris nostris *gladii*, quos polito-
res terserant.

N O T E.

Vides proprietatem verbi *a findendo ad discussionem mali trans-*
missam observari. Idem & hic cernere est: in arcta colli-
sione pugnae fissa, i. e. *laxata gladiis*, & *discussa*. ببض
Plur. fr. ab اببض *albus*, ex albedine micans. בז; unde
ovum. Item בז: *byffus*, a candore. Plena phrasis est ביצה
gladii ex albedine micantes. Creber usus
effecit, ut absolute *micantes*, pro *gladiis* ponи queant. Sæ-
pe & Galeas signat. صباقل poliones; est plur. fr. a
صباقل *politor*; ex specie *Pajbel* ح lavigavit, in
nitorem perpolivit. Venuste Poëta in *Hanias*.

النفر الببض كانوا هم صباقل
يسمون المرقع أخذل صها الصباقل

*Homines candidissimi, ac si forent Laminæ
In die prælii, quas politura nitidavit.*

ثُمَّ أَخْذَ فِي قَفْسَبِرْ صَقْلَ بَهَ الْأَنْهَانْ وَاسْتَفْرَغَ
Tum occœpit explicare ea, quibus ingenia expoliret,
manicasque simul exhaustiret; i. e. crumenas: Aliter cons. 27.
صَقْلَ الْخَاطِرْ cor nitide expolivit: i. e. hilaravit
detersa rubigine mœroris. Non injuncta translatione etiam
venit, pro dedolare fuste, delumbare aliquem: ut لَهْ لَهْ lavi-
gare apud Græcos. cernis unde צְקָלָן gluma, folliculus gra-
ni, nomen traxerit. جلت 3. fœm. præt. kal a جلي
nitidavit, velo detracō fecit nitere, revelavit, & in cla-
ra luce posuit.

لَهُمْ صَدْرٌ سَبْفِي يَقْمَ بَطْحَاءَ سَخْبَلٍ
وَلِي مِنْتَ مَا ضَمَّتْ عَالِبَةَ الْأَنْسَامِلَ فَ

N O T A.

Vj. 6. Ad Vers. 2. Illustratum jam pectus Gladii. Ejusdem capulus circumscribitur per id quod constringant inde artius digiti. צַמֵּס pectus, circumplexus. Constringere plexu quodam & nexu. Apprime quadrat in manum digitorum plexu firmiore stringentem. Illustrabit satis nobilem sensum idem Poëta, cuius & hi versus mox in Hamasa subnexi

لَا يَكُ شَفْ أَلْفَمَاءَ إِلَّا أَبْنَ حَرَّةَ
يَرَى خَمَرَاتَ الْمَوْتِ تَمَ يَرْوَرَهَا فَ
تَفَاسِهُمْ أَسْبَابَنَا شَرَ قَشْمَةَ
فَغَبَنَا غَوَاشِبَهَا وَفِبَهُمْ صَدْرَهَا فَ

لَا يَكُ شَفْ أَلْفَمَاءَ إِلَّا أَبْنَ حَرَّةَ
يَرَى خَمَرَاتَ الْمَوْتِ تَمَ يَرْوَرَهَا فَ
تَفَاسِهُمْ أَسْبَابَنَا شَرَ قَشْمَةَ
فَغَبَنَا غَوَاشِبَهَا وَفِبَهُمْ صَدْرَهَا فَ

6 Pro illis mucro gladii mei, die vallis Sebhal;
At pro me quod constrinxerant digiti, i. e.
Capulus.

N O T A.

Non discutit molem mali nisi nobilissimus quisque,

Qui cernit gurgites mortis, deinde visitat illos.

Partiti fuimus illis gladios nostros pessima partitione.

In nostra enim parte capuli, in illorum fuere mucrones.

غاشبنة المثبف اوـة
مـما يـلـبـكـ وـصـدـرـهـ الـذـيـ يـضـرـبـ بـهـ
ايـ فـيـنـاـ مـقـابـضـهـ وـفـيـهـ مـضـارـبـهـ
*Tegumentum gladii, capulus tibi proximus; & pectus ejus,
id quo feritur. Sensus hic. Nostram portionem faciunt partes
qua manu retinentur; illorum autem, partes quibus vulnera
infliguntur.*

وـيـنـاـ مـعـاـ مـعـنـاـ بـهـ
N. 2. لـجـيـرـ لـفـقـ، لـقـلـعـنـدـ دـيـسـلـونـهـ
پـتـ اـنـیـلـیـ نـیـلـجـ، اـنـیـلـیـ نـیـلـیـ اـنـیـلـیـ لـیـ نـیـلـیـ
انـیـلـیـ مـیـلـیـ اـنـیـلـیـ، اـنـیـلـیـ لـیـ مـیـلـیـ، سـیـلـیـ اـنـیـلـیـ لـیـ مـیـلـیـ
گـلـیـلـیـ اـنـیـلـیـ، اـنـیـلـیـ لـیـ مـیـلـیـ؛ اـنـیـلـیـ لـیـ مـیـلـیـ
کـلـیـلـیـ اـنـیـلـیـ، اـنـیـلـیـ لـیـ مـیـلـیـ؛ اـنـیـلـیـ لـیـ مـیـلـیـ
کـلـیـلـیـ اـنـیـلـیـ، اـنـیـلـیـ لـیـ مـیـلـیـ؛ اـنـیـلـیـ لـیـ مـیـلـیـ
کـلـیـلـیـ اـنـیـلـیـ، اـنـیـلـیـ لـیـ مـیـلـیـ؛ اـنـیـلـیـ لـیـ مـیـلـیـ

وقال ايضًا
جُنْدِي فَرِنْتُر الْكَارْثِي
وهُوَ مَاسِور بِمَكَّةٍ

هُوَ أَيْ مَعَ الْرَّكْبِ الْبَمَانِبِنِ مَضْعُدٌ
جَنِيبٌ وَجَنْمَانِي بِمَكَّةٍ مَوْثِقٌ
عَجِيبٌ لِمَسْرَاهَا وَأَنِي تَخَالَصْتُ
إِلَيْيَ قَبَابِ الْسِّجْنِ دُونِي مَغْلُقٌ

N O T A E.

Vj. 1. Pulchre جنِيب qui a latere ducitur, equus, camelus, παθόργη jugalis, hic transfertur ad affectum; qui catervæ proficiscentium amicorum se addit comitem, iisque a latere velut adhærescit. رَكْب est vectura. هوی affectus vastior הַזֹּה. In صعد ascendit, צער est nifus scandendi.

Vj. 2. Fingit Poëta, illam catervam, quæ Femam petebat camelis inventa, ac speciatim amicam cum iis iter nocturnum ingressam, se oculis ejus obtulisse, atque adeo in carcerem ad eum intrasse. سري iter nocturnum; itemque imago vel species ejus de nocte oblata; phantasia: a projectus est noctu: prominuit proprie, ac promicuit. A prominendo est سري princeps שָׁרֵךְ pro prominentis, &

DIXIT QUOQUE
GIAFAR HARITIUS,

IN CARCEREM CONDITUS MECCÆ.

1 Affectus meus cum cæterva Jemaniensi adscendit.

Jugalis, quum corpus Meccæ sit vincitum.

2 Adstupui nocturnam ejus speciem, qui clara accesserit

Ad me, quum janua carceris super me clausa foret.

N O T A.

generositate eminens: & اسری vel excellētissimus apud Harir. Conf. 29. hoc ipso usu signa iore sacri Codicis:

اطا الاحرار مسولدا و سراهم سودنا

Nitidissimus candidorum nativitate, & excellētissimus principali dignitate. A سري plur. fr. سری principes passim sonat. Ea forma proprie substantiva est fæmin. notans excellentiam, eminentiam, quam pro viris excellētissimis, & eminentissimis collective frequentare cœperunt; indeque plur. fracti vim induit. Exquisite positum sequens تخلصت depurata est, in præt. 5. a خلص purus, merus fuit, חלץ. Depurata est ad me, valet hic, clara specie ad me accessit. Nec omitenda notio, quam exerit خلص in II. purum & sincereum amorem præstitat: unde خلص amicus sincerus; cum

الْمَتْ فَلَحِبَّتْ تَسْ قَامَتْ قَوْدَعَتْ
فَلَمَّا تَوَّتْ كَادَتْ الْتَّفَسْ تَرْهَفَ بِ

N O T A.

plur. fr. خلصان. Utrumque substantivum est, signans sinceritatem; quod nunc singulariter venit, pro amico sincerissimo; nunc collective, pro amicis sincerissimis; atque tunc in Grammatica vocatur plurale fractum. Ita necessitudo, nunc unum, nunc plures necessarios amplectitur, pro serie. Particula دون sub; dicitur contrariam quoque vim exerere supra. Scilicet videtur nonnunquam istam ideam excitare; ut hic: sed videtur tantum: quum enim illud infra saepe valeat *citra*, inferatque notionem, qua quid concipitur non attin gere, sed *citra stare*, eleganter *citra me* nunc valet, *inter me*, & *illam*, janua carceris intersepiente. Ita in formula، ذلک خرت القتاد *intercedit* *destrictio* *tragacanthae*: i. e. illud *adspirari* nequit sine summa molestia. **غلف** part. pass. IV. a *claustus*, pessulo, obice, vecte. Origo sita in *appangendo*, unde diversæ metonymiae subsumuntur, ut apud Gol. num. II. *procul abiit* & *profectus fuit* per terram. **غلف في الأرض** q. d. *appactus terræ obhaesit*. Et num. IV. *obstrictum cessit creditori pignus*: i. e. *appactum fuit*. Gravi metaph. **غلف بهذه** *appactum haesit pignus ejus*, apud Harir. est, *obiit*, *fato functus est*. Iterum num. V. *Molestia animi, & tædio laboravit*: quasi, *adhæsit appactus*. Denique VI. *nimio onere sauciatum fuit dorsum, intertrigine appactum nempe* Hoc ad arborem translatum VII. *suggessit vermiculationem appactam*. Eadem potentia primigenia regnat sub **علق** *in alios tropos se diffundens*. Ut num. I. II. *Suspensus adhaesit*. *Impactus fuit*. ubi ite-

3 Appropinquavit illa salutavitque, surrexit dein.
valedixitque:

Quumque avertisset se, prope fuit anima ut ex-
spiraret.

N O T A E.

iterum variæ metaphore: inter quas appæcta fuit hirudo, que
hinc Salomoni עליקה. At num. III. concepit; gravida fuit
mulier. Respicitur appæctio fœtus. Postremo Num. IV. cœ-
pit, instituit facere: est, appæctus fuit rei, in eamque de-
ditus. Eadem Origo verbi הואל apud Hebr. quin & طفف
sub quo repieres apud Gol. geminam Glossem. 1.
Cœpit, instituit facere, quod continuare ad finem vellet: 2.
Affixus fuit loco, in eoque affiduus. Habes appæctum, quod
principe loco collocandum. Linguæ dignitas, constantia,
ubertas, per hanc Originem sub fororiis Radicibus reflorescit.

Vj. 3. A لم prope fuit, accessit. In IV. الله est se admo-
vit propius. In حبّت præter. II. ab حيٰ, viget il-
lud solenne ن vivat, in salutatione, fausta comprecione.
وَدَعَ valedixit; proprie commendavit velut depositum. كاد
prope fuit; tantum non fecit. Est secundarium thematis med.
Je & Waw; quod est excussit scintillas ex igniario silice, vel
ligno. Cernas in derivato بـ excusso ignis apud Go-
lium: inde *fraus*, *dolus*, *stratagema*, *bellum*: *omnis machina-*
tio mali. *Calamitas*. Hinc genuinam vim reddidi ἀπαξ λεγο-
μένων in בֵּיד in *Jobo*. Ex hoc fomite significationes omnes e-
micuere. 1. *Dolum struxit*, quasi excussit scintillas. 2. concin-
navit, tractavit rem. Metaphora in bonum emissâ. 3. كاد
النفقة liberaliter se vitamque impendit, eam velut excu-
tiens, cum nisu. Alio flexu, animam egit. Honeste 4. & 5.
in

فَلَا فَخْسِبِي أَنْتِي تَخْشَغْتُ بَعْدَ كُمْ
لِشَيْءٍ وَلَا أَنْتِي مِنْ آنَّهُ مَوْتٌ أَفَرَقْ

N O T A.

in *menstruo*, *vomituque*, *excussis*. Denique 6. *prope fuit*; quasi
in *nisu*, in *conatu vehementiore*: ut hic. Ita in *Diw. Hud.*

كَمْ أَفْقَ مِنْ الْوَجْدِ حَتَّى كَادَتِ النَّفْسُ تَخْرُجُ هَيْ

Non emersi ex mærore, sic ut tantum non exierit anima.
Clarius adhuc *Ibid.*

كَدْتُ بِالنَّفْسِ أَنْتَشَرْ

Prope fui ut animam præfocatus singultarem.

Ad postremum مَرْهُقٌ mira *Glossarum* congeries. *Abivit.*
expiravit. *periit*, *evanuit*. *Vanus* & *frustra fuit*. *Repletum*
fuit medulla os. *Præteriit* scopum sagitta. *Præcessit*, *præver-*
tit equus. Hæc vertiginem offundunt iis, qui ex *Lexicis*
ufum, *geniumque*, *Lingue aucupantur*. *Nocti caliginosæ*
dies succedit, & *grata lux*, si exhibuero *Originem lubrici*
motus: qui nobis glippen. *Inde abire*; de eo qui *celeri* pede
aufertur, nec non perire, evanescere. *Inde expirare*, in ani-
ma. *Inde frustra esse falli*. *fallere*: in sagitta, non ferire sco-
pum. At in equo, est *celeri* cursu *præverti*. Denique in osse
medulloso facile jam recognoscis pingue illud *lubricum*, unde
& مَرْهُوقٌ dictus *præpinguis*, obesus; quasi dicas *lubricum*
& *lævem præ obesitate*. Reliqua jam ultro se dabunt. *Origi-*
nem quam promo cernas in hocce *Diw. Hud.*

كَهَادِي حَوَافِرُهَا جَنْدَلًا مَرْوَاهِقَ

Factant unguia earum silices lubricos.

Nec non in المَعْزَاءِ lubrici silices soli glareusi:
&

4 Ne tamen existimes me obnoxium post vos factum,

Ulli rei, neque me mortis metu infractum.

N O T A.

& **مَرْدِي الزَّوْاهِقَ** *incusso silicum lubricorum*. Nihil horum extra fontes invenias: sentias etiam quid distent æra lupinis ex loco *Alcoran. sur. 17: 83.* Dic; advenit **الْحَقُّ** وَنَهْقُ الْبَاطِلِ أَنَّ الْبَاطِلَ كَانَ مَرْهُوقًا & lubricat vanitas: utique vanitas est lubricissimum quid. Substinet evanescit, & est vanissimum quid; omne pondus sententiæ in fumum abierit. Item *Surat. 21: 18.* *Imo vero feriemus vanitatem veritate, quæ cerebrum ei comminuet;* & فَإِذَا هُنَّ نَرَاهُقَ ecce illa vanitas lubrico lapsu corruet: subde denuo evanescet; male peribit; rem habebis, non colorem lucidissimum, quo pingitur vanitas contusa iictibus veritatis, suo velut in sanguine lubricans, lapsans, corruiens. Jucundissime & hic, anima ferme expirasset; imo vero, lubricasset, lubrico impetu mibi elapsa fuisset. Et nos nostrum glippen eadem configuratione augemus.

Vf. 4. Occurrit suspicio, quæ incessere potuisset, ac si tædio carceris, aut metu mortis, tantopere concussum fuisset. Nil, inquit, minus. Nulli post vos, vobis amissis, humili me feci, obnoxiumve, تَخَشَّعْتَ, in præt. V. a **خَشْعَ** humili fuit. Oculos vocemque demisit. Dejectus & depresso fuit. Docte Tauriz. **الْخَشْعُ** في الْبَصَرِ والصوت كـالخضوع في الـبـدن ويقال اختشع ولأن اذا طاطأ رأسه مرآةـها بـبصره Radix hæc venit in visu voceque dejectis: ut cognata خـضـع in corpore toto. In VIII. usurpatur, quem quis dejecto capite visum in terram defigit. Grave etiam ver-

وَلَا أَنِي نَفْسِي يَرْدَهْ بَهْ سَا وَعِبَدْهْ مْ
وَلَا أَنِي بِالْمَشِي فِي الْقَبْدِ أَخْرَقْ فَ
وَلِكَنْ عَرْتَنِي مِنْ هَوَائِي صَبَّابَةَ
كَمَا كُنْتُ الْقَيْ مِنْكِ إِذْ أَنَا مَطْلُقْ فَ

N O T A.

bum فرق fut. i. a פְּרָק fregit; *divulgit*; &c.
num. 5. apud Golium, פְּרָק فִּرְק intransitiva forma, pa-
vuit, quasi *fractus*, *infractus* fuit. Non incognitus quoque
Hebreis usus.

V. 5. In idem animosius adhuc instatur. يَرْدَهْ يَ
est fut. VIII. a لَهْ quaffit arborem ventus; quod apud Golium
in media turba aliarum significationum, pro primario inter-
nosci non potest. In VIII. tantum exponitur, levipendit; sed
hoc secundarium, a quaffit, & tanquam leve ac vile diffavit.
Hic valet concusfit, ut apud Auctores passim. In Diw. Hud.
يَرْدَهْ يَ passive usurpatum pro cursu veloci concussus fuit.

Notetur quoque لَهْ exponi spiravit ventus, elevavit, &
extulit rem vapor. Habes quassationem rei levissimæ, quam
vel vapor in altum efferat. Hinc subnatum in passivo, super-
bire, gloriabundum ferri, & efferri. Quod autem alia Glossa
declaretur, nituit oculis, pulcraque visa fuit res; per singu-
larem tropum tantudem est ac oculum ferit, atque specie
pulcra concusfit veluti. Ocliferia sic Latinis olim dicta cense-
bat i πάνω Lipsius. Hoc non discutio. Hinc subnatum illud,
quod

5 Non sane quod animam mihi concutiant eorum minaciæ;

Neque quod in catena ambulem impatientior.

6 Sed incessit me de amore tui effusior impetus,

Quales de te experiebar; quum solutus existem.

N O T A.

quod principem locum occupat in Lexico Goliano; *Flavere ac rubore caput dactylus*: & *fructum maturescens ostendit palma*: quasi dicas *feriit oculos grata specie*. Apud Latinos quoque *oculos quatere*, est eos *specie jucunda commovere*. Consonant suavissime, quæ discrepare majorem in modum videbantur. Concordant item sub ^{هـ}*maturescere incipientis dactyli color*: & ipse *dactylus talis*. *Pulcritudo & elegancia vultus*. *Flos. Gloria*: item *superbia. typbus. vanitus*; *mendacium*: quæ jam *Harmonia sua omnium oculos ultro feriunt*, secundum diversos adspectus, quos aperui in *jactatione*. Novissimum ^{آخر} *compar. & superlat. infert*, a ^{خرف} *laceravit*. Item *secundario usu, asperum & intractabilem se præbuit*. Inde ^{خرف} *est asperitas, durities mentis*: seu potius, Cl. Gol. notante, *inertia, & remittente ad آخر* *iners*, qui nihil novit perficere. Sed utrumque obtinuit ex gemino usu verbi, quod dat *laceravit*, pro *iners fuit*, *corrupt opus*: & pro *vehemens fuit*, *asperitate sua omnia dilacerans*. Ita heic loci a Tauriz. exponitur ^{الرقيق} قلب *parum commodus, difficilis, intractabilis*.

Vf. 6. Concluditur, *impatientiam hanc, & impotentiam*,

عره عري ex vehementissimo amore ortam fuisse. A nudus fuit, عرءا & عرءا nudam aream designant. Hinc subsumtum, supervenit & accessit velut nudo ac patenti. Specialius, de febri: unde passive عري paroxysmo febrili, ejusve tremore correptus fuit. Opportunissimum ergo illud عرتني velut nudum invasit me, sive simplicem tenet vim, sive auctiorem illam ex paroxysmo febrili; quam hic captatam suspicor. Sed quid suspicari me dico, quod dubio vacat ex carm. seq. vs. 2. صبابة amoris desiderium & ardor apud Golium, a صبت amore percitus fuit: proprie

قـال

ابـي الـعـطـا الـسـنـدـي

ذـكـرـكـ وـالـخـطـيـ يـخـطـرـ يـبـتـئـنـا
وـقـدـ نـهـلـتـ مـنـنـا الـمـثـقـفـةـ الـشـفـرـ

N O T A.

V. i. זכר memor fuit: a primario acrem esse. Unde & זכר masculus. Ita Gladius ذكر acie praeditus. Ad memoriam per insignem metonymiam applicari coepit, ansa desumpta ab acrimonia, & recenti vigore; & quidem speciatim odoris. Recens memoria viget, spirat, halat. Contra oblivione marcescunt idea, sensimque veluti exspirant ac delentur. Frequentatur quoque ذكر ut pro laudatione, fama, existimatione, nobilitate. In quibus item facile ag-

est effusio, effusus impetus; & quidem per declive. صبب
 aqua effusa. صبّتْ effusa aqua: itemque amore percitus ac
 flagrans. Ad proprietatem, in amorem effusus quasi per de-
 clive. طلاق est part. pass. IV. à طلاق laxavit,
 & laxatus fuit. Inde omnes notiones pendent ut, lar-
 gitus est: soluto & hilari vultu fuit. Temperatus & saluber
 fuit dies. quasi laxus & remissus. Iterum partus dolori-
 bus affecta fuit mulier, id est laxata & soluta. Item re-
 pudiateda fuit. Denique longius abiit, veluti dimissus. Ex
 eodem fonte טלק apud Aramæos est, abjicere, projice-
 re; quasi laxare.

D I X I T

ABU'L ATAJUS ASSINDIUS.

I Memor tui sum, quum hastæ inter nos intre-
 mant

Atque bibant e nobis directæ illæ fuscæ.

N O T A.

agnoscas odorem fragrantissimum nominis. Cum allusione ad
 hanc certissimam Originem in Diw. Hud. pulcre Moattel.

فَأَبْنَى لَنَا رِيحَ الْكَلَاءِ وَنَكَرَهَ

Et remeavimus cum aura victoriae & acri ejus odore.
 Eadem biga vocum occurrit Hos. 14: 7. 8. פָּרַ aura ei ut
 Libano: & זְכָרוֹ & odor ejus fragrans, sicut vini Libani.
 Vides fragrantiam odoris, proprie & improprie sese exerere,

فَوَاللَّهِ مَا أَنْدَرَ يَوْمَيْنِي أَكْسَى دَافِقَ
أَدَاءً عَرَادِيٍّ مِنْ حَبَابِكَ أَمْ سِخْرَةً

N O T A.

cum admirabili dignitate. Hinc plura sagax observator deducet, suisque sedibus reponet.

Ibid. خَطْرٌ *hafta*. Sic dicta vel ab appellativo خَطْرٌ

linea, ut a recto tenore nomen sit ductum: vel a proprio nomine loci in *Jemama*, vel portu in *Bahrein*, unde *hafta* illae ex *India* afferuntur. Non usurpatur nisi in genere laudatissimo. يَخْطَرُ fut. I. a خَطْرٌ *vibravit*: usu transit. & intransit: vernacule *drillen*. Inde jucunda phrasι خَطْرٌ الْدَهْرِ خَطْرَانَةً *Fortuna ludum suum lusit*: sive ictum suum inflixit: proprie *vibravit vibrationem suam*. Exponitur etiam خَطْرٌ *incertam subivit aleam*: indeque, periculo extiove se exposuit: & alio flexu, *Vendidit rem quam in potestate non haberet*: Ab alea incerta videlicet. Elegans quoque locutio خَطْرٌ بِبَالِي *subiit mentem meam res*: proprie *vibravit in corde*: qua ansa خَاطِرٌ part. præs. est cogitatio cor movens: & ipsum cor, cum plur. خَواطِرٌ: unde plena phrasι *Ibn Doreid*, خَواطِرُ الْقَلْبِ *vibramina cordis*. Illud خَاطِرٌ appositissime adhibitum in Versione Arab. Gen. 6: 5. & 8: 21. pro יְצָרָה ad perpetuam vibrationem cordis & cupiditatis simul se extendens. Diverso aspectu خَاطِرٌ Med. Damm. valet in dignitate, existimatione, gratia fuit: ubi jam vibravit est emicuit & eminuit. Etiam pro superbire usurpatur: vel a vacillante gressu, & vibratione manuum; vel a vibratione & jactatione caude. Unde Satyricum illud in *Hamasa*.

اتَّخَطَرُ

3 *Enimvero, per Deum! nescio, & profecto verax sum,
Num morbus me incessat ex amore tui, an
fascinum.*

N O T E.

لَا تَخْطُرْ لِلَاشْرَافِ يَا قَرْدَ حَذِيمْ
وَهَلْ يَسْتَعِدُ الْقَرْدَ لِلَاخْطُرَانْ ؟
لَبِيْ قَصْرُ الْأَذْنَابِ أَنْ تَخْطُرْ وَابْهَانْ
وَلَقِمَ الْقَرْدَ بَكَلْ مَكَانْ ؟

An vibras caudam ad gloriandum o simia Hidjamita?

Et num simia vibrandaæ caudæ disposita est?

Abnuit brevitas caudarum, ut eas convibretis;

Dedecusque simiae omnibus notum est locis.

Eodem tendit & hoc in *Hamas*.

هُمْ الْجَبَلُ الْأَعْلَى إِذَا تَنَاهَكُرْ
مَلُوكُ الْرِّجَالِ أَنْ تَخْطُرْ الْبَرْزَلْ ؟

Illi cacumina summa sunt, quum concertant de gloria

Reges virorum; aut caudas convibrant Cameli.

Finem facio in usu VIII. speciei ubi اخْتَطَرْ mantile contortum vibrare infligendi ergo: quod ludi genus est, inde appellatum. Nemo, credo, nunc ambiget, quin *Hebreum חַטֵּר* eandem vibrandi tenuerit potentiam, atque inde *חַטָּר* *virgam* nomen invenisse.

Ibid. فَهَلْ potavit; proprie bilit prima vice: ut عَلَى secunda vice sitim sedavit. Duo verba, quæ ad gladios & hastas amant transferri, quum multum sanguinis fundunt, atque altiora vulnera infligunt. Exempla pleno modio adducta Tom. I. Orig. atque Themata נְדָל ac عَلَى simul illustrata. ئَقْفَ الْمَنْقَفَةَ est part. pass. II. a نَقْفَ rectam reddidit hastam distortam: quasi rigidavit. Ab eadem rigidat penetrantia reliquæ omnes notiones descendunt; quæ ultero se

فَإِنْ كَانَ سِحْرًا فَأَعْذِرْنِي يَنْبِي عَلَيَ الْهَوَى
فَإِنْ كَانَ دَاءً كَبْرَهُ فَكَلِمْكَ الْعَذْنَرْ

N O T A.

se cuivis dabunt. Hebr. הַלְּקָה hinc lumen scenerari in Comm.
ad Job. submonui. [—] fuscæ, hastæ; videlicet, Epi-
theto pro re ipsa posito. Est plur. fr. ab [—] fusco co-
lore præditus: ut verbum [—] est fuscus, olivaster, mu-
stelino colore fuit. Grandifone Amru Ibn Keltum in Moallek.

دَطَائِنْ مَا تَرَاهِي الْصَّفَقَ عَنَّا
وَنَضَرَ بِالسَّبَّ وَفِ إِذَا نَشَقَنَا
بِسْمِرْ مِنْ الْقَنَا الْخَطَّيِ لَدْنَ
دَوَالَ آقِ بِبِضِ يَغْتَلِبَنَا
ذَشَقَ بِهَا تُرْقَوْسَ الْقَنْفِمْ شَفَّا
وَنَحْلِبَهَا الْرِقَابَ فَتَخْتَلِبَنَا

Con-

3 Quod si fascinum sit? excuses me de amore;
Sin fuerit alius morbus; tu⁹ tu mihi excusan-
da es.

N O T A E.

*Configimus in acie, sic ut laxentur ordines,
Et verberamus gladiis, quum invadimur;
Fuscis hastarum Indicarum, lentis,
Flaccidis, micantibusque qui immineant ensibus.
His capita diffundimus populi quam certissime:
Iisdemque pabulum largimur colla, quibus pascant se.*

Ille color fuscus gradum tenet secundarium; quemadmodum
& reliquæ notiones, multum primo obtutu diversæ: noctu, الصلوة تسمى اللوصايا في
vesperive, pecul. lucente lung, confabulatus est. Item clavis con-
fixus fuit: ut in II. clavis confixit, compeditique: unde in versio-
ne Arabica Chrysosth. انفسنا
precatio clavis figit præcepta in mentibus nostris.
Respondet τῷ ἡλεῖν: ut ἡλεῖται & μέσημερ μέσημερ
clavis ferreus. Videntur omnia pendere ἐπὶ φείασιν,
φείασιν horrere, horripilare. Inde سُرْسَرْ tenebrae noctis:
præsertim luna sublustrī. Hoc peperit mox confabulationem
nocturnam sub Luna. Inde etiam fuscedo, sive color fuscus.
Sic suam in stirpem omnia coalescunt; atque Tertulliani
verbo, coadolescunt.

قـال

سـعـد بـن نـاـشـب الـمـازـنـي

سـأـلـتـهـ مـعـتـدـلـيـ الـغـارـ جـالـبـاـ
 عـكـيـ قـضـاءـ الـلـهـ مـاـ كـانـ جـالـبـاـ
 وـأـهـلـ عـمـ دـارـيـ وـأـجـعـلـ هـذـهـاـ
 لـعـرـضـيـ مـنـ بـنـيـ الـمـذـمـمـةـ حـاجـبـاـ
 فـيـضـقـرـ فـيـ عـبـنـيـ تـلـادـيـ إـذـاـ أـنـشـتـ
 يـمـبـنـيـ بـاـدـرـاـيـ الـذـيـ كـنـتـ طـالـبـاـ

N O T A.

Vf. 1. Quum vindicem sanguinis se præstitisset Noster hicce, adversus Bilalitas; hi domum ejus diruerunt. Hæc clavis versiculorum. Sentitur confessim quid sit, maculam eluere gladio; quamdiu enim sanguis propinqui vindicatus non esset, turpissima nota inhærebat vindici sanguinis, totique a deo familie, quin genti. جـالـبـاـ trabat licet, mira syntaxi, in qua Ellipsis regnat, est enim accusat. partic. qui absolute id efficit, quod ablative. absolutus apud Latinos: trabente super me decreto Numinis quicquid trabens sit. Observari velim in transitu ansam, qua لـ ما quicquid, involvere cœpit dirissimos & fatalissimos casuum. Sic haud dubie expli-

D I X I T

SAAD IBN NASJIB MAZINIUS.

1 Sane eluam de me maculam Gladio, trahat *liget*

Super me fatum Numinis, quicquid traxerit.

2 Et obliviscar meam domum; faciamque ut eius ruina

Famam meam a reliquo vituperio intersepiat.

3 Nempe parvi sunt in oculo meo opes avitæ,
ubi se applicat

Dextra mihi mea ad talionem assequendam,
quam persequor.

N O T A E.

plicandum illud Prov. 9:13. בְּלֹא יָדַעַת מֵהֶן non curat quicquid:
quod tandem cumque. Similiter Job. 13:13. יַעֲבֹר עַל מֵהֶן trans-
seat super me quod tandem cumque. Subest *Aposiopesis*.

Vsi. 2. Gravis figura, infra quam sedit versio. Nempe
حَاجِبٌ est apparitor *Aulicus*, aulæo principum *adstitutus*; quasi dicas *seclusorem*. Hac persona pulcre convestit nunc *ruinas domus sua*; quas sibi attraxerit, quod fidum & firmum vindicem *sanguinis* gessisset. Hæ ergo *ruinæ Famam*, & *splendidam existimationem* viri generosi, ab *accessu* *vituperii* omnis in *perpetuum* nunc defensare dicuntur: quin *Appari-*

فَسَأْنَ تَهْدِمْ وَبِالْسَّفَدِيْ دَارِيْ فَائِنَهَا
 تَرَاثُ كَرِيمٍ لَا يَبَالِي الْمَعْوَاقِبَا
 أَخِي عَمَرَاتٍ لَا يَرِيدُ عَلَى الْمَذِي
 يَهُمْ بِهِ مِنْ مُفْظِعِ الْأَمْرِ صَاحِبَا
 إِذَا هَمْ لَا تَسْرِدْ عَزِيزَةَ هَمَّةَ
 وَلَمْ يَأْتِ مَا يَأْتِي مِنْ الْأَمْرِ هَائِبَا

N O T A E.
 toris obtinere munus, in nova Gloriæ intaminata domo,
 quam sibi veluti exstruxerat.

Vf. 4. Ut versu præced. ostendit se Divitias, opesque vetustas,
 longe postponere Gloriæ, quæ ex fortibus factis & depulsiōne
 ignominie redundat; ita nunc insinuat, se domo diruta, ac
 solo æquata, nihil tamen hæreditatis avitæ perdidisse; quum
 gloriam Domus sue integrum illibatamque conservet. Enim-
 vero, inquit, perfide dirutum rovistis meam domum; nec ta-
 men hæreditatem gloriæ Domus illius diruere valuistis: quippe
 quæ supra fortunæ casus sit erecta. هـ diruit, evertit, de-
 struxit; proprie complanavit, æquavit solo. Vides natalia
 מִשְׁרָת Hæreditas; ad الدُّم scabelli pedum. قَلَاد Vernacula, domi nata, & inveterata
 opulentia, ad ولد. De his latius in clavi Dialect.
 curat; in fut. III. a بلی trivit & tritus
 fuit. Inde sub ista specie invaluit, attrivit se cura, solicitu-
 dē-

4 Quod si dirueritis perfidia domum meam, at illa

Hæreditas generosi, haud curantis vices rerum:

5 Fratris gurgitum; qui haud poscat in iis

Quæ suscipit de arduis negotiorum, socium.

6 Quum curandum quid suscepit, non retunditur
acies curæ ejus,

Neque aggreditur, quicquid aggreditur rei, ti-
midus.

N O T A.

دَنْيَةٌ وَاقِبٌ *Vices rerum*; est plur. fr. a عَاقِبَةٌ عَاقِبٌ finis & exitus rei: עַקְבָּה עַקְבָּה pone venit. succedit; cal-
cem tenuit.

Vf. 5. Formula solemnis, *Frater gurgitum*; pro gurgiti-
bus periculorum se immergere suetus. q. d. cui pericula velu-
ti familiaria, domestica, cognata. Adi Comm. ad Job. item-
que ad Prov. ubi plura. سُقْبَةٌ سُقْبَةٌ Suscipit curare: cura sollici-
ta versat in animo: ab هَمَّةٍ هَمَّةٍ Tabescere, intabescere
rei: itemque Tabefacere. Illustratum Tom. I. Origin. Inde
عَلْقَمٌ Part. IV. absolute frequentatur pro gravi, & ar-
duo negotio: quod cura maceret, ac tabefaciat. فَطَاعٌ
part. IV. gravis & horrenda res: q. d. onere frangens, sau-
cians. Thema فَطَاعٌ Grave & invicem fuit negotium; ab
infringendo & elidendo: quod & فَضْعٌ ac فَصْعَدٌ. Con-
venit يَعْزِيزٌ sauciavit, vulneravit, infregit.

فَبِمَا لَرَأَيْمُ رَشَحْتُ وَبِمَا مَفَدَّهُ
إِلَيْكُمُ الْمَوْتُ خَوَاضِعًا إِلَيْهِ الْكَنْسَابِيَّةُ
إِذَا هُمْ أَلْقَيْتُمْ بَيْنَ عَبْنَتَبَيْهِ عَزْمَةً
وَذَكَرَ عَنْ ذِكْرِ الْعَوَاقِبِ جَانِبَاتٍ
وَكُمْ يَسْتَشَرُ فِي أَمْرِهِ عَبْرَ نَفْسِهِ
وَكُمْ يَرْضَى إِلَّا فَائِمُ الْسَّبِيلِ صَاحِبَاتٍ

N O T E.

Vſ. 7. **مُشَحّةٌ** *imbuīte: foveate; educate. est imper. II. a maduit, sudavit. Inde بشی لا يرشح له non descendit, non sudat ei vel re minima; . e. ne guttulam quidem enlargitur. In II. apud Golium reperias, bene administravit opes: &, exigua paulatim quantitate propinata suctioni assuefecit pullum mater: nec non, educavit formavitque a teneris aliquam rem. Hæc ita concilieſ. **السائل** *ma-
descere fecit opes: scil. non exaruerunt sub manu ejus, sed lætius efflauerunt. Item, Madescere fecit pullum mater: im-
buit palatum succo titillante. Hinc subsumtum, educavit for-
mativitque a teneris, plane ut imbuere: unde Tacit: honestis
sermonibus aures imperatoris imbuere, Item imbuere ani-
mum disciplinis &c. Eodem figura. **المرشح** *للسلطنة imbutus principati: apud Harir.* **المرشح****

لaser عاپة

- 7 At vos *Razamidæ* imbuite in me Antecessorem
Ad mortem , qui se immergit ad eam medias
in Legiones.
- 8 Quum hoc agit , scopum inter oculos sibi defi-
git;
Atque a fatalium cogitatione latus avertit.
- 9 Neque consulit in negotio suo quemquam nisi
semet ,
Neque acquiescit ulli , nisi capulo gladii , fo-
cio.

N O T A E.

الرعاية *imbutus præfecturæ* sive *pasturæ populorum*.

Vj. 8. اذ اهتم *quum hoc agit.* *Quum* aliquid curandum suscepit : ut supra. *القى عزم* *conjicit firmum propositum suum inter oculos.* *Hunc unicum* sibi *scopum præfigit.* *جرا* *applicuit animum.* *operam dedit.* *propositum habuit.* *Item adjuravit:* nec non *incantavit:* omnia ab *adstringendo:* unde *عزمية* *Vj. 6.* erat *applicata & adstricta acies mentis.* Alias *incantamentum;* amuletum designat: quo quid *adstringitur.*

Vj. 9. *رسالة* *consulit.* *Est fut.* *X.* per *Apocopen,* pro *رسالة* *بستشبر* propter part. *negandi,* cum *vehementia;* *minime consuluerit.* Radix *لسان* *eliquavit mel.* *Inde in X.* *consilium petiit;* metaph. a *melle* perillustri.

قـالـ

تـابـطـ شـرـ

إِذَا الْمَرْأَةُ لَمْ يَخْتَلِفْ وَكَذَّ جَدَّ جَدَّ
أَضَاعَ وَقَاسَى أَهْرَارَهُ وَهُنَّ مُدْبِرُهُ

N O T A.

Celebratissimus inter Arabes Poëta hicce, manu & ore
ثابت بن جابر juxta promitus. Ejus verum nomen Thabit Giabiri F. Sophiani N. Phahmita. Ei
cognomentum inditum Taabbata Sjerran, id est, *sub axilla
gestat malum;* لانه ذات يوم اخذ سكينا
تحت ابطه وخرج فقبل لامه ابن هاشم
 فقالت لا ادمي تابط شرها
sub axillam condito exierit: atque interrogata mater, quorsum?
responderit, nescio sane: *malum sub axillam condidit.* Occasio
ان تابط شرها
كان يشتغل عسلا من جبل ليس له
غبار طريق فأخذ عليه لحبشان ذلك
الموضع وخبروه النزول على حكمهم ان
البقاء نفسه عن الموضع الذي ظنوا انه لا
يسلم منه فصب العسل الذي كان معه
علي الصفا ثم عمدا الي السرقة فمشده علي
صدره، ثم لم ينزل ينزل حتى جاء مسلم بما
الي اسفل الجبل وذهب من موضعه الذي
وقع

D I X I T

TAABBATA SJERRAN.

Si vir versutum non agat, quum serium quid
ingruit;
Male perit, & intractabile tractat, terga usque
versurum.

N O T A E.

وَقْعُ فَبَّةٍ بِبَنْجَةٍ مَسْبَرَةٍ نَلَانَةٍ أَيَامٍ
Solebat Taabbeta Sjerran mel colligere e monte cui nil nisi unus trames. Illum ei locum occlusere Libjanitæ: atque optionem ei fecere, vel dedendi se arbitrio eorum, vel abjiciendi sese inde, unde non putabant eum salvum posse abire. Ibi tum ille mel, quod secum habebat, super petram effudit; atque utrem cepit, eumque pectori suo circumligavit: non cessavitque lubricare, usque dum salvus perveniret ad imum montis. Inter locum autem in quem delapsus fuit, & inter illos, interstitium erat trium dierum. Merebatur sane talis casus, pro more gentis, versiculos hisce nobilitari; atque in notitiam & admirationem feculorum dimitti.

Vf. 1. **يَكْتَلُ** versutum agit. Est 3. fut. VIII. ab **حَالٍ** spicere, vertere. verti; torqueri: versare & verjari. Inde omnes notiones verbi potentissimi, & magnis canalibus longe lateque diffusi, manarunt. Apud Golium 1. præterit annus. vertit. 2. annum vertentem extitit. 3. intercessit quid inter duo vel distinuit; quasi avertit. 4. vafer fuit. technas struxit. a versando sese, & versutia. 5. vi polluit. potens fuit validusque; quasi versatus in rebus. 5. mota fuit & vacillavit res: versa & versatilis. 6. Versus mutatusque fuit. migravit de loco in locum. &c. &c. Reliqui numeri facile hinc

deducentur. Undecimus in arcu distento ex Gjeubar. excerpti
meretur, quod Proverbiū Vetus inde lucem sit fæneratu-
ر حالت القوس واستحالات اي انقلبت
عن حالها التي غمز عليها وحصل في
قبابها اعوجاج قال اي ذي يبس
وحللت كالحول القوس طلت وعطيت
ثلاثا واعبي عجسها وظاهرها
يقول تغيرت هذه المرأة كالقوس التي
اصابها الطبل فنديت وزرع عنها الوتير
فبراغ عجسها واعوج *In arcu I. & X. spec. adhi-
betur pro inverti ab æquabili extensione, super quam signatus
est, incidente in dimensionem distorsione.* Hinc Abu Djowaib.

*Inversa est, ut invertitur arcus, qui madescit, laxaturque;
Jam triennum, fatiscente manubrio ac dorso.*

Hoc dicit: immutatam esse mulierem illam instar arcus, qui ro-
re commaduit, nervo ejus relaxato; & manubrio ejus deflexo
ac distorto. Vides quid sit in Proverbiali dicto Ps. 78: 57.
كشت رمیہ *arcus dolose relaxatus, atque inversus: sed redea-
tur in viam. Cum 4. signif. conspirat VIII. species* احتساب *omnem
strophas versare, cuius infinit. machinationem, bonam, malam complectitur. Etiam med.*
جود *حَبْلٌ* est virtus, vis, strenuitas agendi; δύναμις
ad omnia sese versans, inque omnibus versatissima، *حَبْلةٌ*
machinatio, techna, stropha: *أَحْبَلٌ* versutior, sagacior;
versatissimus in omnibus. Quantum hinc luminis accedere
queat ad themata & חול, eorumque diversissimos u-
fus, alibi exequar. Nunc fontes aperuisse, & limpidiores
reddidisse, fatis fuerit.

Ibid.

Ibid. Venusta phrasis ~~s~~ \rightarrow ~~s~~ \rightarrow seria & severa res e-
jus agitur: quum quid periculose plenum aleæ ingruit. Non
comparat in Léxico. In Hamas. nostro Ogjail Seloulius.

اذا جدد عثرة السجدة ارضاك جده
وذى بساطل ان شبنت الشهائى بساطله

Quum serius est ad seria, placeat tibi serium ejus:

Et jocari si lubeat, oblectet te jocus ejus.

Radix جَدْ in Origine secuit, insecurit. Hæc num. 4. 5. demum apud Gol. prostat. Hinc جَدْ acies secans, proprie, indeque studium, labor, sedulitas, seria & severa intentio nervorum: unde in Gol. num. 2. diligentia & studio usus fuit, nervos intendit: quod est جَدْ الامْرُ se-
cante vi egit aliquid. Alio adspectu جَدْ الامْرُ secat res,
quæ severa & gravis incumbit, atque negotium facebit: &
جَدْ molestia secans. Ea vis hic obtinet. Quod autem exponatur quoque Magnus fuit dignitate, divitiis, & atrię-
xis; nil aliud quam secante acie polluit. At جَدْ novus, in veste, ac tela, est quasi resectus modo pannus, oppo-
sus trito. Unde phrasis جَدْ بَابُ جَدْ بَابُ vestes recens re-
sectæ a textore. Hæc constantiam Linguae, ac concordiam
cum جَدْ satis fanciunt.

Ibid. اضیاع præt. IV. a ضایع periit; unde existit perire fecit. dilapidavit: ut in Alcoran: لا يضيّع Deus non facit perire mercedem credentium. Sed hic absolute ponitur, valetque semet, vel rem suam dilapidat: sive ut Tauriz. malebat وجاد امره قسّاسی invenit rem suam male pereuntem. قسّاسی præt. III. a קשָׁה durus fuit, notat obduravit se: itemque rem duram tractavit. مسدود part. act. IV. vel est retrocedens ipse; vel, quod malim, retrocedens & tergum Zz 2 ver-

وَلَا كُنْ أَخْوَى الْحَرَمِ الَّذِي أَبْسَنَ فَانِزَلَ
بِهِ الْحَكْمَ بِإِلَّا وَهُوَ لِلْقَضِيدِ مُبْصَرٌ
فَذَاكَ قَرِيبَعُ الْدَّهْرِ مَا حَاسَ حَوْلَ
إِذَا سَدَ مِنْتَهَى مَتْبِعِرَ جَاسَ مَنْتِبِرٌ

N O T A.

vertens negotium : quod in pejus identidem retro sublabatur.

Vf. 2. لَخْي الْحَرَم Frater firmæ substrictionis : i. e. firmi propositi. Notissimus jam Arabismus. للقصيد قصيدة & nervose dictum. مُبْصَر est directa intentio, vel petitio necem minantis. مَبْصَر part. IV. est asie persecans, quasi, a بَصَر secuit; unde secante acie penetravit subsumtum metonymice. In IV. بَصَر secare fecit, est rectam & penetrantem aciem tetendit. Eam esse amplitudinem phraseos, quam expressi, discas ex simillimo hocce Rabiæ in Hamas.

وَاللَّهُ ذِي حَنْقَ عَكَيْ كَاتِمًا
تَغْلِي عَدَادٌ صَدِيرٌ فِي مِرْجَلٍ
أَوْجَبْتَهُ عَنِّي فَأَبْصَرَ قَضَدَهُ
وَكَيْتَهُ فَوْقَ الْنَّوَاطِرِ مِنْ عَلِيٍّ

2 At pectore substrictus is , in quem nil descendit
derit

Negotii, quin rectam in directum aciem tene-
derit.

3 Atque is quidem seculi Heros , quoad vixerit,
versutissimus;

Cujus altera nare obstructa , altera mox rebul-
liat.

N O T A E.

*Sæpe adversarium plenum iræ adversus me , haud secus
Atque si odium pectoris ejus in abeno bulliret ;
Repulsavi eum a me , & rectam in directum ejus istum
aciem tetendi :*

Et cauterio eum inussi supra oculos desuper.

V. 3. Magna figura قریع الدهر Heros seculi ; de qua Philologi Arabum non idem sciscunt. Tauriz. قریع الدهر يختتم وجہ بن یحییٰ
ان یکون فی معنی مختتم الدهر
من قرعته ای اخترتہ بقرعیتی یحییٰ و
ان یکون من قرعه الدهر بن وايبة
حتیٰ جرب و تبصیر و هذین الوجه بن
فعیل بهمعنی مفعول ولا یمتنع
ان یکون المراد فتح الدهر یکون
فی هذا الوجه فعیل بهمعنی فاعل
لان الفحول یقزع النقاۃ وما تقدم
Phrasis recipit duas facies. Licet exponas, Electus
seculi, a signif. eligendi in sortem, quæ est in Radice. Licet
etiam a signif. pulsavit eum Fortuna adversis, ut expertus &
Zz 3 pro-

מִפְעָל pro פַעַל providus redderetur. Utroque adspectu erit פַעַל Nec abhorret ut intendatur Admissarius Camelus seculi; quo adspectu pro פַעַל part. præf. erit positum: nam Admissarius pulsat femellam. Priora, pulchrius habent. Ita quidem princeps ille Criticus. Mihi posterius unice verum: nam Admissarius pro principe genio Arabiae congruentissimum. In Camuso speciatim Admissarii Poëtarum vocati dicuntur الفالبيون في الهجاء من هاجاهم وكذلك من اذا عارض شاعرًا فحول الشعراء افضل علىه Victores in carmine satyrico, itemque in reliqua Poësi, quicumque supra adversarium excellit. Eadem figurazione Admissarios Eruditorum appellat Algazal. qui fœundi robore ingenii reliquis præcellant. Etiam Admissarii belli pro strenuissimis bellatoribus veniunt. Non erat ergo cur ab Admissario seculi resiliret Tauriz. cuius nunc judicio longe prætulerim Teblevium ad Conf. 6. Harir. القریع من الابل المختار لفحة وهى قریع دهره اي واحدة Ita vocatur quod electus sit ad admisuram, indeque Admissarius seculi sui, est ejusdem unicus Heros.

Ibid. حَوْلَ versutissimus. Est derivatum speciei II. verbi حَالَ vertit: de quo Vf. I. Unde multum verit, versavit; versatilem se fecit. Ex ejus passivo descendit forma nostra, ut versatus quoque ex passivo oriundum. Dextre comicus.

Versutior es quam rota figuraris.

لُسُسُ ex Ancipiti. Junctim dici amat حَوْلَ versutus versatilis: qui & versipellis.

Ibid. Figuratus sermo, cuius partem tantum pandit Tauriz. قوله اذا سد منخر مثل لام كروب المضيق

المحض بق عليه واصل الممنخر في الانف
من النحير وهو مهـ الانفس ونـ خرـتا
الانف خرقـاه يقول لافتـنانـه في الجـبل
لا يوـخذ عـلـيـه طـرـيـف الا وـنـفـذ في اـخـر

*Quod dicit; quum obstruitur naris, allegoria est in eum qui merore opprimitur & coarctatur. Est autem מנהר foramen nasi, ita dictum a נחר' intensione flatus, sive roncho; נחרתא אלאנף ronchissiones ambo nasi, sunt duo ejus foramina. Vult dicere; propter divergia stropharum suarum, non posse sibi obstrui viam, quin ex alia evadat. Hoc certissime intenditur; sed eximius commentator ansam allegoriam non tenuit, utique non palpandam prebuit; quia non tenuerat ejus fundamentum in Camelō admissario. Eo quidem nihil ferocius. Huic si, ad ferociam comprimentam, obstruantur foramen unum nasi ronchissantis, mox alterum eo vehementius effervescit & rebullit. Sentis, quorsum collineat Taabbera Sjerran. Comparaverat se Admissario ferocissimo. Huic unum foramen narium veluti obstructum fuerat, quum montis clementior via ipsi esset praeclusa ab hostibus. At mox vehementius rebullit alterum, quum viam sibi inviam aperuit: atque abruptissima petrarum sibi quasi substravit. Ansa Allegoriam porrecta per Metaphoram, qua نـفـ Nasus, itemque foramen nasi; & مـنـخـرـم fissura nasi; prominentias montium, & extremitates, figurant. Optime Tauriz. alio in loco, quod hic opportune locasset قد سمو منقطع اـنـفـ الجـبل مـنـخـرـم تـشـبـهـا بـالـانـفـ
الاخـرـم وـقـالـ قـوـمـ المـنـخـرـم طـرـيـفـ فيـ الجـبلـ
appellitarunt praeruptum nasi montis, ejus narem fissam, similitudine sumta ab eo cui narium diffusus imbrex; sunt etiam qui dicant, fissuram naris notare quamcumque in monte viam. Est etiam ubi obstruere nares ronchissantes simplificius*

أَفْوَلُ لِلْخَبَّابِ وَقَدْ صَفِرْتَ لَهُمْ
وَطَابِي وَيَوْمِي صَبِّقَ الْجَحْرِ مَغْوِرٌ

N O T A.

cius veniat, pro alicujus feroce spiritus retundere, ac domare: In Diw. Hud.

إِنْ تَبْدِ تَبْجِدَعْ مَنْخِرِيَّكَ بِمُدِيَّةٍ
مَشْرُشَرَةٌ حَرَثِيَّ رَمْبَضَ حَسَامَهَا

*Quod si prodieris, mutilabere nares cultro
Minutim truncante, fervido, cui mucro acutissimus.*

Vf. 4. Nova Allegoria; de qua ita Tauriz. قوله قد صفرت لهم وطابي يحيتهمل وجههما ييجوز ان يكون المعنون قد خلا قلبي من ودهم وييجوز ان اشرفت نفسى على الهلالك ويكون هذا من قوله ه ولو ادركتناه صفر الوطاب ه وييجوز ان يسرىد بالوطاب جسمة اي كاد تفارقه الروح وييجوز ان يكون الاشارة الي ظروف العسل التي صبها Quod ait, vacuatus erat illis uter meus, admittit diversas facies. Fieri potest ut sit sensus; quum jam cor meum vacuum esset a more illorum. Potest etiam ut sit, quum jam anima mea existio proxima foret: ut in illo:

Quod si assequamur eum, evacuabitur uter.

Potest item, ut intendat per utrem corpus; q. d. ferme receperat

4 Dixi *Libjanitis*; vacuato jam illis utre meo:
Quumque dies meus angustus latibuli, nudum
latus præbens.

N O T A.

rat inde spiritus. Potest denique, ut innuantur loculi mellis, quos effuderat. Prius frigidum & ineptum: posterius simplicissimum videri posset ex Historia præmissa. Quæ in medio posita, parum aut nihil differunt: atque apprime quadrant: me autem abant illi exitio proximum, & mox animam evacuaturum e corpore. Huc collineat Camus صفتر وطابه اي مسات ان قتل uter ejus, mortuus est, vel occisus est. Usurpatur nempe vel de propria morte, vel de violenta. Posterius obtinet in versu Amrolkisi, ejus enim est, quem laudavit Tauriz. Is adspectus hinc abesse nequit: & tamen uter mellis nimis magnam habet partem hac in re, quam ut ex oculis queat dimitti. Nodum sic solvi posse, censeo. Decreverat jam Nostrus, obstructa sibi via, quid facturus esset: eumque in finem utrem mellis evacuarat in rupem. Eo viso exclamasse videntur Libjanitæ, viri utrem esse vacuatum; hoc est, nil reliquum ei, quam ut pessima nece interiret. Hunc duplicem conspectum utris vacuati venuste complexus Poëta, hostibus triumphum jam canentibus insultat; atque vanissima ista gaudia deludit. Signanter hunc in sensum. Dicebam Libjanitis &c. nempe ferociam eorum retundens.

Ibid. Succinit interpretationi huic, quod adjungatur, Et dies meus arctus latibuli. سرخ foramen; caverna; a سرخ profundius in cavum sidere. و سرخ part. IV. a سرخ cæcus fuit: unde سرخ apertum præbuit latus, & petendi copiam fecit, præda. Istud apertum & simul cæcum latus appellatur سرخ. Hæc alia occasione latius. Nunc A a a de-

هَمَّا خَطَّتَا إِمَّا إِسْلَامٌ وَمَسْنَةً
 فِي إِمَّا دَمٌ وَالْقَتْلُ بِالْخَرِّ أَجَدَرَ
 وَأُخْرَى أَصَادِي الْتَّفْسِ عَنْهَا فِي إِنْهَا
 كَمْ فِرَدَ حَزْمٍ إِنْ فَعَلْتَ وَمَضَدَرَ
 فَرَشْتَ لَهَا صَدْرِي فَرَزَّلَ عَنِ الْصَّفَا
 بِهِ جَوْهَرٌ عَنْبَلَ وَمَنْتَنَ مَكْحَصَرَ

N O T A.

desino in observatione utili, moris esse apud Poëtas, ut *dies* attribuant, quod *homini* competit. Ita *يَوْم مِرْصَدِ* *inſidians*; in *Hamaf.* & *يَوْم مِنْ الْلَّهِي هَاضِبِ* *Dies præ lufione ſtreperus*: in *Diw. Hud.* quod genus infinitum.

Vſ. 5. Hæc semet jam explanant. **خطة** *Linea* ſæpe conditionem *præscriptam* affert. **خطتا** *sine Regimine*, pro **خطتان**, in *Duali*; ob verſum. **منة** *exprobratio* *beneficii*; a **من secuit**. Ait *duas tantum conditiones sibi ferri ab hostibus, vel captivitatem cum exprobatione beneficii in ignavorem: vel sanguinem i. e. cædem, ni se dediderit.* Illudit eorum improbae ſpei, atque adeo *insultantibus* *viciſſim insultat*. Huc tendit nobile illud. *At cædes ingenuo congruenior.* **اجدى** *Compar.* a **جدى** *dignus, conveniens fuit.* Ejus part. **جدىس** *dignus, aptus: item, locus muro cinctus: ſep-*

5 Duæ conditiones: aut captivitas & opprobrium:

Aut sanguis. Et cædes ingenuo congruentior.

6 Sed aliud est, de qua animam blande alloquor,
Animosissimum suscipienti, si fecero, & exequenti.

7 Expandi ad illud pectus meum, & lubricavit
de petra nitida
Thorax torto robore, & lumbus gracilitate
constrictus.

N O T A.

Septum ۶۶. Hæc per Originem facile coalescunt.

Vf. 6. Elusis Hostium conditionibus, tertiam promit, quam sibi dixerat; ut semet nempe de *aversa rupe lubricante lapsu demitteret, super pectora*. De hoc audacissimo facinore scite ait se *animam suam blande compellasse*. Hoc valet صادی i.fut. III. a صدی incantavit, delenivit. Ejus دلچی blandiciis circumvenit: innuit se arduum hocce molimen a sua ipsius anima velut *e blanditum esse*; eamque tanquam potenti quodam fascino Heroismi circumvenisse. Vocabula دوون descensus in aquatorium; & صدی adscensus ex eo sibi recinunt. Prius frequentatur in *suscipiendo* ineundisque gravioribus periculis: posterius in *iisdem exequendis & evincendis*. حزم *substrictio pectoris*; & firmum animosumque propositum: ab حزم *cingulo substrinxit*.

Vf. 7. Animose enunciatum, *Expandi ad illud pectus meum*. Duplex potentia, propria & improoria. Nempe expandere pe-

فَخَالَطَ سَهْلَ الْأَرْضِ لَمْ يَكُنْ كَدْحَ الْصَّفَا
بِهِ كَدْحَةً وَالسَّمُوتُ خَرْيَانٌ يَنْظَمُ

N O T A.

ctus ad magna ausa, est, ea magnanimitter aggregi: ut contrabere pectus, est ea refugere ac reformidare. Ad arduum hocce molimen etiam pectus suum expandit noster Heros, quum illud utre vacuo substrictum petrae glaberrimae commisit; ut eo subnixus, lubrico & leni lapsu semet de ea demitteret. Posteriori unice attendens Tauriz. prius plane prætervidit; quod tamen vel maxime intentum. Quin si alterutrum misfum facere deberem, posterius dimitterem: quum id per sequentia satis exprimatur. جَوْجَى pectus, thorax speciatim avis, vel navis, prominens videlicet, ac potentum. بَهْ in eo vel cum eo, redit ad صَدْرِي pectus meum. Hoc prima fronte impedit. Expandi ad illud facinus pectus meum, & lubricavit in eo de petra nitida pectus tortum: Vix stribagine liberari posse videtur. Ea nulla erit, si prius صَدْرِي pectus meum tantum sub figura accipias. Illud enim pectus internum, & magnanimum, sustinebat veluti ac dirigebat pectus externum جَوْجَى. Ergo صَدْرِي pectus in صَدْرِي pectore lubricabat, istamque firmitatem exerebat. عَبْلَ torso; contorsio funis, itemque tori: unde mox crassis brachiis praeditus, torosus. Ad pectoris magnanimi صَدْرِي, in audacissimum facinus sese expandentis, iussa capessenda, opus erat جَوْجَى عَبْلِ thorace torto, & toroso; itemque مَخْتَنْ مَخْتَنْ lumbo gracili, gracilitate constricto: est part. pass. II. a خَصْر læsus fuit a frigore in extremis corporis membris. Valde friguit riguitque dies. Est gemina glos-

§ Et immiscuit se velut molli terreno, non lanante petra

Laniationem; Morsque id attonita inspectabat.

N O T A E.

glossa, cuius proprietas *constrictus fuit*, unde & reliquæ notiones pendent. Jam omnia splendent: atque istud admirabilem parit effectum; non tam *cum eo sonans*, quam *in eo*; i. e. *in ejus virtute*, *firmitate*, *constantia* flecti & vinci nescia.

Vf. 8. Eadem animositate continuatum قل لخ
& comperit, vel expertum est, illud pectus meum expansum tanto molimini, non duritiem asperrimam petræ nitidæ, sed قل الارض mollitiem planam terræ. Hoc vult. Effect fortitudo invicta pectoris interni, ut asperrima petra mihi evaderet terrenum molle; per quod meo commodo, sine vulnere, sine dolore, descenderim. Exquisite positum قل خالط præt. III. a خل miscuit, commiscuit. Inde in Pobel existit immiscuit se rebus, hominibusque, commercium habuit; expertus fuit familiarius. μισθεδ. θημισθεδ. Innuit, se familiarius velut commercium cum petra contraxisse; eamque sibi remollitam. Huc fertur, Neque لصاف petra nitens, præ asperitate, & duricie, حلق laniavit, momordit, fœdavit, in illo, حلق laniationem. Non refero ad pectus externum, sive thoracem, qui quantumvis munitus utre, & melis lubricitate sublevatus, aliquid experiri debuit vexationis & doloris; sed ad صدر pectus internum, & invictum illud, quod nullo dolore se infringi patiebatur. Nullam scarificationem in corpore factam, quod vult Tauriz. a vero abhorret. De verbo حلق idem rectius monet, adhiberi in morsu dentium, & lapidis contusione, quæ necdum laniationem

وَبَأْتُ إِلَيْ فَهْمٍ وَكُنْ أَكَنْ آيَبْـا
وَكُنْ مِشْلَهَا قَارِقَتْهَا وَهِيَ تَضْفِرْـة

N O T A E.

faciat, excoriationemve; quamvis supra scarificationem sit. Apud Golium habes, fœdavit unguibus, scalpit, num. 3. 4. at num. 1. 2. studium & laborem adhibuit. Victimum quæsivit suis. Hæc sequi debuissent, nam a scalpendo, conscalpendo, corradendo fluxerunt. Alcor. sur. 84: 6. O homo كادح انك ای ربک کدحا فهلاقبه Utique tu conscapens ad Dominum tuum sculpturam, quam experturus es. i. e. corradens tibi thesaurum vel boni vel mali operis. Commentatores Alcorani ad captum vulgi id explanant per كاسب کسب acquirens acquisitionem; nec de metaph. insigni quicquam commonent. Talibus Glossis contexta Glossaria corticem Linguæ offerunt, nucleus pandere non possunt. Tauriz. ipse certe rationem significationis hujus ignorasse videtur; quum ita defungitur والکادح ایضاً الکسب etiam acquisitionem notat eadem radix, adductoque id Alcorani loco firmans, cum Glossa كاسب کسب acquirens acquisitionem. Ne mire. Nec Scholiaſtæ Græci, nec eorum collectores, exscriptoresque, Hesychius, Suidas &c. ubique medullam Linguæ

9 Sic reversus sum ad *Phahmitas*; quum non viderer reversurus.

Quot autem similia unde *Victor* discessi, fremente leto.

N O T A.

gustarunt: multo minus eam gustandam præbuerunt. In cortice ferme ab omnibus obhærescit.

Ibd. Audacissimum Epinicium: & *Mors attonita spectabat*. Thema خری est pudore confundi; itemque, vilem & abjectum esse; in afflictione vel dedecore jacere. Hæc secundaria, a configendo ducta. Addubitat Tauriz. sit ne pudore confusa *Mors*, an vilis facta, an afflita. Omnia amplectaris licet, & *Mors attonita*, vel jam, pro Origine, confixa, ad omnia ista se extendit, quippe quæ se exarmatam, debellatam, triumphatam senserit a nostro Heroë. Admirabile Schema, *Mors triumphum de se inspectare coacta*.

Vf. 9. Gloriatur, se victorem remeasse ad Tribules, & Lares domesticos, *Morte ringente*: quin complures a se duatos de *Morte triumphos*, qui huic eventui non concedant. צפָר صְפָר proprio torcit: inde sibilavit torta voce. Heic loci sibilo dolorem testatus est: infremuit, victa videlicet & triumphata *Mors*. Ita jam rectissime Tauriz. submonens esse, qui وهي تصفّر & illa sibilabat, retulerint ad Tribum viri, dolentem de ejus absentia: nec non, qui ad Libjanitas, plorantes ejus evasionem. Nempe pauci magnos sensus suspicere, nedum suscipere & sustinere possunt.

قال

أبى الكببر الهمذانى

وَلَقْدْ سَرِيَتْ عَكِي الظَّلَامِ بِمِقْشِ
جَلْدِ مِنْ الْفِتْنَابِنِ كَبِيرٌ مُشْقَلٌ

N O T E.

كان سبب قول أبى الكببر هذه الأبيات انه تزوج ام تابط شرفا فخاف منه فقال لامة ويبحك قد مرابني امر هذا الغلام قالت فاحتفل عليه حتى تقتله فقال له ذات يوم هل لك ان تغزى فقال ذلك من امرري ثم مضيا في غزاته مما ويقول أبى الكببر له كل ليلة اختر لي نصفي الليل شببت تحرس فيه وانام وتنام النصف الآخر واحرس فكان أبى الكببر ينام الى نصف الليل ويحرسه تابط شرفا فانا نام تابط شرفا نام أبى الكببر ايضا لا يحرس شيئا فلما كان في الليلة الرابعة ظن ان النعاس قد غلب الغلام وقال الان يستشقى ذو ما وتمكنتني فيه الغرصة واخذ حصاة فخذف بها نقام

ABU 'L KEBYR HUDEILITA.






1 Et sene perrexi super tenebris cum intrepido,
Robusto juvenum, neutiquam torpido.

NOTE.

فَقَامَ الْفَلَامْ كَانَهُ كَعْبَ فَقَالَ مَا
هَذِهِ الْوَجْهَةُ قَالَ لَا ادْرِي فَقَامَ تَابِطَ
شَرَا وَعَسْ وَطَافَ وَلَمْ يَرْ شَبَّا فَعَادَ فَنَامَ
فَلَمَّا ظَنَ أَذْنَهُ قَدْ اسْتَنْقَلَ أَخْذَ حَصْبَّةَ
أَصْغَرَ مِنْ قَبْكَ فَحَذَفَ بِهَا فَقَامَ
كَقَبَامَهُ الْأَوَّلَ فَقَالَ مَا هَذِهِ الَّذِي اسْمَعَ
قَالَ وَاللَّهِ لَا ادْرِي قَدْ سَمِعْتُ كَمَا سَمِعْتُ
مَا ادْرِي مَا هُوَ فَقَامَ فَطَافَ فَعَسْ وَلَمْ
يَرْ شَبَّا وَرَجَعَ إِلَيْهِ فَقَالَ يَا هَذَا أَنِي
قَدْ أَنْكَرْتُ أَمْرَكَ وَاللَّهِ لَبَّنْ عَدْتُ اسْمَعَ
شَبَّا مِنْ هَذَا لَا قَتَلْنِكَ فَخَافَ مِنْهُ أَبْنَى
الْكَبِيرَ جَدًا وَقَالَ بِهِ الْأَبْيَاتُ الَّتِي مَضَتْ

Ratio qua ducitus Abulkebyr hos dixit versiculos, est, quod quum matrem Taabbeta Sjerran domum duxisset, eum metueret. Dixitque Matri ejus, vae tibi! sollicitum me habet negotium adolescentis hujus. Ibi illa, machinare ei necem. Dixit proinde ei quodam die, estne tibi animus in expeditionem ire? ille, placet, inquit, res. Quam in expeditionem deinde perrexissem, dixit ei Abul-

kebyr, omni nocte eligas, qua dimidia parte excubare velis, ut ego dormiam; & altera parte tu dormias, atque ego excubem. Et Abulkebyr quidem ad mediam noctem dormiebat, excubias a gente Taabbeta Sjerran; at quum dormiret Taabbeta Sjerran, obdormiscebat quoque Abulkebyr, neque vel tantillum vigilabat. Quum autem quarta jam foret nox, existimabat somnolentiam prævalitaram adolescenti, dixitque, nunc quidem somno prægravabitur, atque dabit sese mihi in eum occasio: capiens deinde calculum, eum projecit. At adolescens mox adstare instar cubi, atque rogare, quis ille strepitus? Respondit, nescio. Tum Taabbeta Sjerran circumiens & lustrans omnia, nec quicquam deprendens, reddidit se somno. Alter autem quum opinaretur, eum nunc saltem degravatum fore somno, lapillum cepit minorrem altero, eumque projecit. At ille mox priore in statu adstare, rogareque quid hoc, quod audio? Vitricus, per Deum! inquit, haud scio. Audivi quod & tu audivisti. Quum autem de novo omnia lustrasset, & circuisset, nihilque deprendisset, rediens dixit ei; Heus Tu! profecto suspectum habeo negotium tuum; per Deum! si denuo audiero tale quicquam, occidam te. Tunc Abulkebyr sibi metuens de eo, versiculos dixit qui præcessere.

Vf. 1. Pergere super tenebris eleganter dictum, pro, densissimis etiam tenebris non deterreri ab itinere nocturno prosequendo; sed eas veluti superscandere. , qui &, ex specie pehalhal, , apud Golium est, strenuus admodum & intrepidus, in audacia constans, quem ab animi proposito nihil retrahat. Radix , inter alia exponitur, Noctu properanter lignatus est, non respiciens quæ amputaret: item, promiscue ingessit insalubria juxta ac salubria. Hæc secundaria sunt a  & , in quibus residet obscuritas confusa vel compacta: inde metonymice applicari coepit ad vehementiam cæco velut impetu ruentis, atque vesana qua-

quadam audacia graffantis. Ita in Diw. Hud. **غواشم** va-
cantur camelī, quæ **تفشم الطير** vesano impetu
ruunt, vel indomita ferocia, feruntur per viam. Vides, quam
apposite Taabbeta Sjerran appelletur **مششم**. De forma
hac erudite Tauriz. **انما الرجل عدوه لافعل**
قبل مفعول ناري مارب ومرجم
وإذا كان المفعلن عاده له **قبل**
مفعول مثقل مرجل مفخول قال
ابن رياش **المفشم الذي يفشم**
الامور ويختلطها من غيسر تهيز
Quum quis instrumentum est Actiois, adhibetur forma,
ut in bellicosus; **مرغم** vehemens in conficiendis hostibus.
At quum Actio ei in habitum versa, dicitur **مفعول**,
ut in **معور** pugnator, excursator. Author est Abu Rijaschus,
vocabulum nostrum signare eum qui irruit in negotia, iisque se
immiscet circa ullum discrimen. Utilis observatio. quæ vivum
usum Linguae in talibus præbet introspiciendum.

Ibid. Ad **كبير** quatenus negantis particula est, ver-
bulo teneatur, quum dicitur **كبير** insi-
piens, id proprie sonare diversitas sapientis, i. e. longe alius
quam sapiens. Ita hic **كبير** longe alius quam
gravatus; in part. pass. II. a **شكل ثقل** appendit, pon-
deravit. Per non gravatum intelligit Tauriz. quem nemo gra-
vatur, quem omnes ament. Malim referre ad habitum cor-
poris animique, minime gravatum ignavia, ac torpore: ut
num. 4. apud Golium reperitur segnis, tardus fuit, tor-
puit.

مِنْ حَمَلَنْ بِهِ وَهُنَّ عَوَادَ
حَبَكَ الْنِطَاقِ فَشَتَّ غَيْرَ مَهَابِلَ ﴿

N O T A E.

Vf. 2. Verecunde non minus, quam profunde, hæc figurata sunt. Explanabit Tauriz. حکی عن ام تابط شر از آنها قالت فبـه آنـه والـله شـبـطـان لا هـم مـذ کـان صـبـیـا بشـیـا الا فـعـلـة ولـقد حـمـلت بـه فـی لـبـلـة ظـلـمـاء وـان ذـطـافـی لـمـشـدـون وـمـعـنـی الـبـیـت آـنـه مـن الـفـتـیـان الـذـیـن حـمـلت اـمـاتـهـم وـهـنـ غـبـر مـسـتـعـدـات لـلـفـرـاش Narratur de matre Taabbeta Sjerran, eam dixisse de eo, profecto Satanas est; nunquam quicquam suscepit inde a puerō, quin efficerit: & sane concepi eum in nocte obscurissima, subligaculo meo firmius adstricto. Sensus autem versiculi est, eum esse ex adolescentibus, quos Matres eorum conceperint neutiquam paratæ thoro geniali. Postremum hocce phrasι حـبـکـ عـوـادـهـنـاطـاقـ renodatæ plexus subligaculi honeste convelatum. renodantes est plur. fr. a عـاـقـدـهـنـاطـاقـ part. præf. fæm. a عـدـکـ عـقـدـنـاطـاقـ nodavit. plexus, est plur. fr. ab حـبـکـ حـبـکـ خـبـکـ plexuit; חـבـکـ ut pro קـחـקـ risit, ex Dialecto exstitit ضـبـکـ.

Ibid. شبـتـ شـبـتـ adolevit. Est notio metonymica a propria & primaria, arsit, exarsit. Idem Hebræis fuit;indeque Hof. 8: 6. cremia: & שְׁבֵב flagrantia. Ab ardore flagranti subsumta alacritas adolescentiæ, quæ vocatur

2 Ex iis quos utero gessere, quæ renodare solent
Lora subligaculi; qui adolevit minime turgidus.

N O T A.

تُرْ شَبَابٌ & شَبَّ: ut adolescens forma part. pres.
شَبَّ. Struitur quoque transitive شَبَّ النَّارِ accen-
dit ignem, شَبَّ الْحَرَبَ accedit bellum. In Diw.
Hud. Poëtria

شَبَّتْ هَذِبَلْ وَقَهْمَ بَبَنْهَةَ اَمَّةَ
مَّا ان قَبَوْخَ وَمَا ان يَرْتَدَ صَالْبَهَةَ

Accenderunt Hudeilitæ & Phahmitæ inter se caminum
Non restinguendum; & quo qui torretur, haud redierit.
Nil crebrius. Venuste Abu Tsachrus, Hudeilita;
العنبر شَبَّ ذَمَشْقَةَ الْخَمْرِ
Ambarum accedit odorem vi-
ni. Venustius adhuc apud Tauriz. ad Hamas. لَهَبَهَةَ
أَيْ سَوَادَ شَعْرَهَا فَرِغَةَ
أَظَاهَرَ h. e. niger crinis virginis
enitere facit albedinem faciei ejus. Huc pertinet illud Glo-
ssema apud Golium: num. 2. Vivacitate & gratia colorem accen-
dit. Grandisone Malich. Ibn Chalid. in Diw. Hud. de Leone
شَبَّوْيِ اَظَافَرَةَ accensus unguis suos. Haec salivam
movere possunt; quibus hoc in genere sapit palatum.

Ibid. Trifariam, vel quadrisariam, exponitur حَبَلْ
part. pass. II. in Golio 1. amissus morte filius. ab حَبَلْ
nempe, quatenus valet, orba mansit mater. 2. Carnosus &
facie turgens: ab حَبَلْ multa ac cumulata gravavit caro.

وَمُبَرِّئٌ مِنْ كُلِّ حَبَّةٍ حَبْضَةٍ
وَفَسَادٌ مُرْضِعٌ وَدَاءٌ مُفْصِلٌ

N O T A E.

Inde & 3. *congesta carne præditus*. Denique 4. *Devotus diris*, ^{وَ}
maledictus. Mediæ *Glossæ* coherent; prima & quarta valde
 dissident. Quintam adjecit *Tauriz*.
 نَكَرْ بَعْضَهُمْ
 ان المَهْبَلُ الْمَعْتَنِيُّ الَّذِي لَا يَتَمَاسُكُ
 فَإِنْ صَحَّ ذَلِكَ فَكَانَهُ مِنْ الْأَسْرَاعِ
 يَقْتَالُ جَمْلَ هَبْلَ أَيْ سَرِيعٍ
 Ajunt nonnulli מהבל significare vesanum, qui non sit compos mentis. Hoc
 si verum, videtur a festinatione ductum: dicitur enim Camelus
 הַבֵּל, i. e. festinus. Mihi quidem pro serie nil aptius visum,
 quam quod num. 2. & 3. comparet. Idem sciscit Gjeubar.
 hunc ipsum versum citans, ad notiones istas adstruendas.
 Adjecit & speciem IV. eadem potestate, citata traditione
 Ajeschæ, uxoris Muhammedis
 يَهْبَلَهُنَّ الْأَسْرَاعُ أَيْ يَرْهَلُهُنَّ الْأَسْرَاعُ
 Mulieres isto die Resurrectionis non יְהִלָּהוּ caro; hoc est
 non turgore inflabit eas pinguitudo. Locus est quantivis pre-
 tii, qui Originem pandit verbi הַבֵּל هַבֵּל non solum pro
 Arabicæ Dialecto, ut ejus ope, quæ pugnare videbantur,
 in concordiam gratianque redeant, sed etiam pro Hebræa:
 ubi vanescere, & vanitas: ab inflatione turgida
 emanarunt. Cl. Cocc. ex usu Thalmud. jam adduxerat pro-
 prietatem halitus, & vaporis; indeque vanitatem deduxerat.
 Non displicebit proin Harmonia jucunde nunc resflorescens,
 qua هَبْل deprenditur primariam vim possedisse inflatio-
 nis, & vaporationis, e flatu oriunda. Hinc in II. هَبْلَهُنَّ
 الْأَسْرَاعُ

3 Quique nitidatus ab omni residuo menstrui;

Et corruptela lactantis, morboque tabifico.

N O T A.

اللَّحْم itemque in IV. اهْبَل, est turgore inflavit, gravavitque eum caro: & part. pass. مَهْبِل turgidus: in I. item هَبْلَتْهُ امْهَمْهَهْ تَكَلَّتْهُ orbata fuit eo per mortem. Est insignis Glossa; quæ & in هَبْول turgens, turgore anhelans recurrit, de matre شَكَوْل liberis orbata: nec non in VIII. apud Phiruzabad. in Camus اهْنَتْبَلْ عَلَيْهِ تَكَلَّل وَلَدَهُ اتَّكَلْ Turfit, vel turgidus anhelavit, super filio suo; est, eo orbatus fuit. Alio flexu sub eadem specie ibidem اهْتَبَل لَاهْلَهْ تَكَسَّبْ كَهْبَل

وَتَهْبَل Turfit anhelus pro familia sua, est victimum comparavit ei, quod & in II. & V. obtinet. Ita nos ژوئن. Iterum اهْنَتْبَل الصَّبَد Anhelavit venationem: est, anhelus eam captavit. Inde الْكَاسَبْ الْمَكْتَالْ والصَّبَاد Anhelator usurpatur pro eo qui victimi conquirendo omnia machinatur: itemque venator. Belgice, een ژوئر. Agmen claudat, atque omnia adstringat, hæc Glossa Camusi: اهْتَبَل كَذْبْ كَشْبَرْ آهَاتْبَل valet, mentitus est multum; quasi cum inflatione turfit; meras vanitates proslavit. Hoc Job. 27: 12. est, חַבֵּל הַבְּלْ vanescere vanitatem.

Vj. 3. Insignite مُبَرَّعٌ مِّنْ nitidatus a labe; in part. pass. II. proprie exasciatus, sub ascia quasi nitere factus. Ex hoc

حَبَّاتٌ دِّيَةٌ فِي أَبْلَكَةٍ مَّرْزِيَّوَدَةٍ كَرْهَةٌ
وَعَقْدَ نَسْطَاقَهَا أَكْنَ يَخْكَلٌ ﴿

N O T A E.

hoc usū emicuit metonymia בְּרֵיאָה pro pingui, opimo: ut apud Latinos nitidus quoque, de pingui: & nitere est pinguescere. Apud Arabes pulchre بَرَّا مِن الْمُرْض nituit a morbo, (quasi exasciatus,) i. e. planissime convaluit: persanatus fuit: itemque بَرَّا مِن الْعَبَّوبِ وَالْدَّيْوَن nituit a vitiis aut debitis: pro, ab iis purus & intactus fuit: vel &, iisdem se exsolvit & exemit. Eadem potestas Thematis בְּרֵא ult. Waw & Je: asciavit, exasciavit ad nitorem usque, præsecando; radendo, perpoliendo; quicquid rude supererat. Ejus part. pahyl. בְּרֵי apud Cl. Golium est, præcisus, asciatus: item, liberatus a criminè vel debito; insons: quod tamen ad בְּרֵא ult. Aleph potius pertinere monet. Non perspiciebat nempe rationem metaphoræ, qua asciatus pro insonte usurpari cœpit. Utriusque Radicis eandem Originem fancit quoque excellentior illa metonymia, qua asciare frequentatum pro creare, & manu artifice fabricare. Hæc virtus utrobique obtinet, ultima Aleph tamen potissimum ditionem sibi istam vindicante: quemadmodum ultimæ Waw vel Jod altera præcidendi & exasciandi magis attributa. In Sacro codice בְּרֵא pro præcidere, præcidendo asciare, ac dedolare tria, quatuor, loca occupat omni dubitationi exempta Jos. 17: 15. 18. Ezech. 21: 19. vel 24. itemque 23: 47. quæ nunc tantum indico ad Harmoniam: alibi ea, cum reliquis usibus insignitis, & nitorem ac polituram rasilem exerentibus, pleno ac justo in lumine collocaturus.

Ibid.

4 Conceperat eum nocte quam monstri quid terruerat:

نodusque subligaculi ejus haud erat solutus.

N O T A.

Ibid. مُعْضِلٌ part. IV. a عضل *implexus*, *intortus* fuit; usurpatur in omni negotio molesto, gravi, ineluctabili; ac speciatim jam in morbo tabifico, qui infantes corrupto lacte nutritos inficit, ac immedicabili contagione implicat & distorquet. Eodem collineat Varians Lectio مُغَبِّلٌ part. IV. a غال med. Je, infantem lactavit grava mater, vel nutrix: unde مُغَبِّلٌ quæ lactans confuescit viro. Quanta hinc pestis in infantes redundet, meum non est docere. Si ista Lectio obtineat, syntaxis mutanda, vertendumque, a morbo lactantis gravidæ: quem talis mater, vel nutrix, per viscera & medullas lactentis diffundit. Res eodem redit.

Vf. 4. Mirifice enunciatum, in nocte مُنْزِفٌ وَدَوْدَةٌ conterrita; & externata: i. e. in qua magnum aliquod malum, ac monstrum extiterat; unde terror omnibus incussus. Audi Tau-

رزوْدُ الذعر ولما كانت الرزوْد في البلة جعله لها واكثراً ما ينسحب الفعل الي الوقت فپوقي به على انه

فأعلى Vox med. Eliph signat terrorem attonantem: quod autem terror ille extiterit in Nocte, eum ipsi Nocti attribuit: saepissime enim Actio additur temporis; idque enunciatur ac si esset ipsum Agens. Vel & patiens, si sit passiva potestas,

C c c

ut

فَأَتَتْ بِهِ حُوشَ الْفَوَادِ مَبَطِّنًا
 شَهْدًا إِذَا مَا نَامَ لَبْلَ الْهَوْجَلِ ﴿
 فَإِذَا نَبَدَتْ كَهْ لَلْكَصَاءَ رَأَيْتَ
 يُنْزِي لِرْوَقَعَتِهَا طَمْورَ الْأَخْبَلِ ﴾

N O T A E.

ut hic: est enim *partic. pass.* a زاد Hamzata media, per-
terrefecit. Proprie fecit effervescente cum tumore. Hæc est Nox-
illa ظلماء tenebrisissima, de qua ad *Vſ.* 2. ubi etiam
reliqua, quæ hic verecunde innuuntur, enodata.

Vſ. 5. Notetur idiotismus, انت بـ *venit cum eo*, i. e.
adduxit, produxit eum, pro partu edidit. אַתְּ *venire,*
proprie tendere. Quod nox flac-
 cidi, inertis, ignavi, dicatur *dormitare*; eodem colore figu-
 ratum est, quem *Vſ.* præced. vidimus. Tauriz.
 وقوله نام *لبل الـهـوـجـلـ جـعـلـ الـغـعـلـ لـلـبـلـ لـسـوقـوـعـةـ*
 فـبـهـ ايـ نـامـ الـهـوـجـلـ فـيـ لـبـلـ

Quod dicit, dormitat Nox flaccidi, in eo attribuit Actionem No-
 xii, quia in eam incidit. Sensus est, dormitat flaccidus in nocte-
 sua. Est Genus Poëtis familiarissimum, quod Enallagen vo-
 citant. Ea semper interiorem quandam vel vim, vel gra-
 tiā, spirat. Dormitat ipsa Nox, cum Dormitatore, quæ to-
 ta, quanta quanta, desertitur, & profundo sopore mergitur
 ac mergit simul. Consimiliter *Vſ.* 4. Nox attonita est, quæ
 tota a terroribus occupata, obfessa, oppressa. Geminum ger-
 manum est illud Æneid. 8: 94.

Olli remigio noctemque diemque fatigant.

Id

5 Ediditque eum acrem cordis, gracilem ventre,

Pervigilem, ubi dormit nox flaccidi.

6 Ei si lapillum projeceris, cernas eum

Exilire ad lapsum illius saltu pici yridis.

N O T A E.

Id est, non intermissō remigio occupant, & consumunt, ita ut nox & dies isto labore quasi fatigari videantur. Similiter de venatoribus acerrimis:

— — — silvasque fatigant.

Non sane pro semet fatigant in silvis; nec silvas pro feras: sed tam acri venatione silvas quatunt; ut ipsae quasi fatiscant, atque delassentur. Ad hanc vehementiam, quam Enallage sic dicta captare solet, etiam reduci velim, quod Carmine praeced. Vf. 4. annotatum.

Vf. 6. Quid respiciatur in *lapillo projecto*, Historia præmissa declarat. حصى *calculus*; a masc. حصى *numerus*, *multitudo*; & *glarea*, *calculus*; apud *Golium*: sed facile apparet a *calculo* per metonymiam ductum *numerum*, ut a *glarea* *multitudinem*. Radix حصى in *Golio* exponitur *vestigium impressum*, signavit. Item *lapillis* abundavit terra: valuit intelligentia. In IV. حصى *numeravit*; *scripsit*, *ordinavit*; *comprehendit*; *scivit*; *potuit*. Mira congeries; quam digerens, adhibita *calculatione* quæ ad omnia ista se porrigit. حصى *intelligentia prædictus*; *proprie*, qui pollet *calculo*. Inde compar. أحصى *pollentior calculo*, *Alcor. Sur. 18: 11.* Sic omnia lucent. *Origo est secuit, incidit, הַחְזָה*: quæ

فَإِذَا يَهْبَتْ مِنْ الْمُنَامِ رَأَيْتَهُ
كَرْتُوبٍ كَعْبَ الْسَّاقِ كَبْسَ بِزْمَلِ
مَا إِنْ يَمْسِشُ أَلْأَرْضَ إِلَّا مَنْتَهَى
مِنْهُ وَحْرَفُ الْسَّاقِ طَسِيَ الْمُخْمَلِ

N O T A.

vis etiam sub حصا ult. *Waw.* primaria: quemadmodum خصي eandem planius exerit. ذرا saliit, exiliit; expersus fuit saliendo. Apud Hebreos نזה in sanguine respersu frequentatur. Idem apud Arabes obtinuisse, patet ex Glossa 6, in *Golio*; נזה אלدم ذري الدم effuxit sparsum sanguis. Sequens وقعة fragor, sive flictus; a flixit, deflixit cum fragore. Inde הוקיע nativam virtutem recuperat.

Vf. 7. Proverbiale quid præfert, erectum stare instar tali curvis. رتوب est firmitas stabilis, & immota. Hæc talum vel maxime suffulciat necesse est. Apud Latinos quoque Proverbii quid redolet firmus & infirmus talus. Eodem collineat لبس بزمـل non est in claudicatore; pro minime claudicator. In Lexicis exponitur pusillanimis, ignavus, languens; لـتـزـمـلـة بـتـقـبـة quod se involvat veste sua. Ita etiam Tauriz. heic loci: ex potestate quæ in II. & V. regnat. Ego ex I. claudicavit malui: quamvis alterum illud satis quoque opportunum.

Vf. 8. Pleonasmus particulæ ان, de qua ita Tauriz. ان تـرـيد لـتـوـكـبـد النـفـي وـيـبـطـلـ particula ان redundat ad adstringendam negationem; ejusque o-

- 7 Eundem e somno expergitum cernere sit,
Erectum stare instar tali cruris, qui minime
claudicet.
- 8 Nil nempe tangit terram, de cubante, nisi hu-
merus;
Extremitasque cruris plicam *tangit* balthei.

N O T A.

تِسْوَى. Sic لَمَّا انْرَأَيْنَا Non vidimus, pro مَا رَأَيْنَا.
 Sunt qui انْ, si alias, subinde negare existiment; ut in Al-
 corani illo، انَ الْكَافِرُونَ لَا فِي غَرْوٍ non sunt im-
 pii nisi in delusione. Et vera Syntaxis adfert, si impii, nisi in
 delusione. Est Apostolus animata jurejurando: ut دَعْنَ Ps.
 89: 36. si Davidi mentiar. Crebrum in Alcor. ut Sur. 10: 67.
 انْ يَتَبَعُونَ لَا الظَّنُونَ وَانْ هُمْ لَا يَخْرُصُونَ
 si sequuntur nisi opinationem; & si illi quicquam, nisi men-
 tiuntur. Et mox Ibid. Vj. 73.
 انْ اجْرِي لَا عَلَيِ اللَّهِ si merces mea, nisi super Deo. Alia ratio in nostro hocce
 pleonasmo, in quo انْ habet vim asseverativam, ut sit non
 sane. Exempla passim obvia. Sensus versiculi hicce, ex-
 planatore Tauriz. لَمَّا اذْنَامْ لَا يَنْتَبِسْسْ
 عَلَيِ الارضِ وَلَا يَتَمْكِنْ مِنْ مُنْتَهِيَةِ
 بَاعِضِيَاهِ كَاهْنَاهَا حَتَّى لَا يَكُانْ
 يَتَشَمَّسْ مِنْ عِنْدِ الْاَذْنَاءِ Eum, quum
 dormitat, non exporrigere se super terra; neque ei omnia sua
 membra committere; sic, ut non valeret continuo succinctus
 adstare, ubi experactus foret.

وَإِنَّا مَرَّ بِنَتْ بِهِ الْفَجَاجَ رَأَيْتَ نَدَةَ
يَهُوَيْ مَخَارِمَهَا هَوِيَ الْأَجْدَلِ
وَإِذَا فَطَرَتْ إِلَيْيَ أَسْرَرَةَ وَجْهِ
بَرَقْتَ كَبَرْقَ الْعَارِضَ الْمُتَنَاهِلِ
صَغَبَ الْكَبِيرَةَ لَا يُرَامُ جَنَادِيَةَ
مَاضِيَ الْعَزِيمَةَ كَالْحَسَامِ الْمِقْصَلِ

N O T A.

Vf. 9. Exquisita phrasis, يرمي السفاجاج jecit, jaculatus est fissuras montium; pro eas penetravit instar teli. Non absimile, quod in ضرب percussit admisere. Inde pulchre ضرب في الأرض est eandem peragrare. مُخَارِم prominentiae sive supercilia praeerupta montium: a حرم, quod a disrupt futuram. abrupt. praeerupt. חרם. Inde in VIII. חרם est funditus extirpavit: internecione delevit. Ea Origo ♫ anathematis; quod tamen sub حرم isto quidem usu, potissimum sedem fixit. هوي delapsus fuit ex alto; in prædamque irruit aquila. Primaria virtus sidere. Inde omnia largo fluxu descenderunt. אנדרל Ajndl accipiter, quasi intortior nervis, viribusque.

Vf. 10. أسمرة lineæ, lineamenta: in plur. fr. a سر li-

9 Cum eodem si quatias fissuras montium, cernas
eum

Sidere in prominentias eorundem impetu Aqui-
læ.

10 Quod si ad lineas vultus ejus respicias,

Fulgorant, fulgore nubis cum tonitru reniden-
tis.

11 Indomitus vehementiæ, haud appetatur ejus la-
tus:

Secans propositi, ut Gladius politissimus.

N O T A E.

lineæ in vola manus ac fronte. Eadem سرکش, & أَسْرِكَش, & أَسْلَكَش, quæ in Libro Jobi شُرُورِيم. A عَرْض vibravit, in part. præf. عَارِض absolute invaluit pro transversa nube. هلل هَلَلَ est part. V. ab splen-
duit; unde in V. reniduit vultus; resplenduit fulgurans nubes; Exultavit, jubilavit. החהָלֶל. Sensus hic est; eum & formo-
sum fuisse, & formidolosum.

Vj. 11. Vox حَرْبَكَ apud Golium est bellum, ejusve
vehementia & calamitas. Radix est حَرْبَكَ abhorruit, dete-
status est: unde forma part. pabyl sonat horrendum; dete-
standum. Hinc ad calamitates atrociores, & bella speciatim
applicari cœpit. Inde حَرْبَكَ يَوْمَ dies belli ve-
hementioris, in Hamasa nostro: & حَرْبَكَ ابْنَ فِيلُوس. Fi-
lius belli horrendi: pro ei affuetus, ac si ex eo natus esset. Inde pos-

يَخْمِي الْصّحَابَ إِذَا تَكَ وَنَفَظَ بَمَةً
فِي إِذَا هُمْ نَزَلُوا فَمَأْوِي الْقَبْلِ

N O T A.

posset, indomitus vehementiae bellicae. Sed est alius usus opportunior, quem in *Camuso* enotatum reperio, quo
 كَرِيدَةٌ Vehementia alicujus speciatim valere dicitur
 بَادِرَةٌ الْتَّهِي تَكَرِيدَةٌ مَنْهَى
 acrem ejus impetum, quem horreas. Hoc intendi nunc, ex
Historiola horum versuum elucet. In eundem sensum sub-
 neftitur, haud appetatur latus ejus. جَنَابٌ latus, ora,
 area domus, atrium; limen; angulus tractusque: figurate fre-
 quentatur, diciturque قَنْيَنْ جَنَابٌ *invaluit*
 latus ejus: pro dignitas ejus increvit. Habes formulam *A-*
bulphar. *Hist. Dynast.* p. 298. 551. 552. Apud *Arabsjad.* in




12 Defensat socios, quum grave quid increpuit;
 Quumque diversantur, tum Hospitium est egen-
 tibus.

N O T E.

Vit. Tim. **امتناع** **جنابا** *inaccessus lateris*: i. e.
formidolosa majestate præditus. In Hist. Salad. per Ispahanens.
اللواحدون قاطفين جنبا *accedentes ad eum, carpebant fructum Lateris ejus*, i. e. ho-
 norifici ejus Liminis, Atriive.

Vf. 12. **پرسنی** *defensat ignito impetu, a* **חמה**
candescere; ignitum esse. Inde mænia **חומות** *dicta*.
عظمه *magnum, grave, atrox quid: a* **عظمه**
עמם. Postremum **עמל** *est plur. fr. a* **ענייל** *pauper, egenus. Radix* **עמל** *med. Je, eguit, indiguit.*



فَسَالَ

تَبَادَلَ طَشَّرَا

إِنِّي كَمْهُدٌ مِّنْ شَنَّاءِ فَقَاصِدٌ بِهِ
لَذَّيْنِ عَمِ الْحِدْقِ شَمْسٌ مَّبِينِ مَالِكٍ ۖ

أَهْرَزٌ بِهِ فِي ذَدِي الْحَكِي عَطْفَةٌ
كَمَا هَرَزٌ عِطْفِي بِسَائِلِهِ جَسَانٌ الْأَوَارِكِ ۖ

فَلِبَلْ الْأَنْشَكَى لِأَمْهُمْ يَصْبِيَ
كَبِيرُ الْهَوَى شَتَّيُ الْنَّوَى فَالْمَسَالِكِ ۖ

N O T A.

Vf. 1. Elegans figura sub part. IV. مُهْدِي pro مُهْدَى, هَدِي ab הַדָּה tetendit, duxit, speciatim deduxit sponsam. Ei comparat carmen hocce suum. *Præpos.* ل est Emphatica. شَنَاء Encomium, Laus; a شَنَى duplicavit شَنَاه. Constructio subtilior, deducens de laudatione mea sponsam: pro hocce meum Encomium, tanquam sponsam.

Vf. 2. Signata phrasis هَرَزٌ عَطْفَةٌ quatere latus aliquis; pro, exhilarare ad exultationem usque. Quum concilium, vel conciliabulum gentis, hic memorat, respicitur ad vetustum morem Arabum, in conciliabulis carmina sua recitare solitis, ut per ora hominum volitarent, atque ad memo-

D I X I T
TAABBETA SJERRAN.

1 Evidem deduco sponsam landis meæ, & tendo cum ea,

Ad patruelem sincerum *Sjums Ibn Malici.*

2 Qua exultare eum faciam gentis in concilio,

Prout exultare me fecit camelis *Aracam* pascen-
tibus.

3 Parcus ille conquestionis ad gravissimum quod-
que, quod feriat.

Multa volvens molimina, diversasque vias emo-
liens.

N O T A E.

moriām posteritatis propagarentur. هَبَّاتْ *Præstantissimi*
cameli, speciatim *albi*. Quod dicatur esse *sing.* & *plur.* nil
aliud, quam sëpe *collectivam* subesse potestatem; prout omnia
pluralia fracta in *Origine* sunt *singularia*, quibus vis *collectiva*
per usum constantem subjuncta. اوْرَكْ *Aracam* carpentes,
est plur. fr. a part. *præf.* آرَكْ & آرَكَة ab نَرْكِ frondem
vel fructus arboris *Arac*, vulgo *Pilou*, pastus fuit *camelus*. Sic
dicta ea a *lentore*: nam نَرْكِ لَرْنَهْ est *lentescere*, *lentum* esse.

Vf. 3. قَسْطَنْتَنْيَة pro قَسْطَنْتَنْيَة *conquestio*, est
D d d 2 in-

يَظْلَلُ بِمَمْوَةٍ وَقَيْمَسِي بِغَبَرَهَا
جَحِبَّشَا وَيَعْرَفُونَ الْمَهَالِكَ

N O T A.

infin. V. a شَكَّا questus fuit, lamentando exposuit statum suum Deo. Doluit & exposuit morbum. Sunt notiones secundariæ, a compunctione ductæ. قلب الشكّي paucus conquestionis, pro plane non conquerens. Sic Tauriz.

يَقُولُ أَنَّهُ صَبَوْرٌ لَا يَشْكُّ مَا نَزَلَ
بِهِ إِلَيْهِ أَحَدٌ وَاسْتَعْمَلَ لَفْظَ الْقَلْبِ
لَنْفِي الْكَلْلِ وَهَذَا كَمَا يَقُولُ فَلَانَ
قَلْبُ الْأَكْتَرَاثِ بِقَوْعِيدَ فَلَانَ إِنْ لَا
يَكْتَرِتَ innuit eum esse patientissimum, qui omnino queratur nemini de iis quæ ipsi eveniant. Usurpat vocabulum pauci ad plenam negationem: quemadmodum dici solet, ille parum curat minas hujus; pro non curat. Exempla nonnulla apposuisse juvabit; præter ea, quæ jam ad Nawabig. subjici p. 168. قلب قدي العينين paucus festucæ oculorum: i. e. nullo omnino vitio præditus, e cuius oculo ne festucam quidem eximere queas. Clarius adhuc & plenius Ibn Doreid.

وَالنَّاسُ لَمَّا مَوْتُ خَلَا يَلْسُونُ
وَقَلَّمَا يَبْقَى عَلَيْهِ السَّسَسُ الْخَلَا

*Hominesque Morti pabulum sunt, quos delingat;
Et paucum est, quod superstite linctui, pabulum.*

Vides plane nullum designari: notabisque illud

pa-